

a few/એ ડ્યુ/ઓછા, ઓછી
a little/એ લિટલ/ઓછું
ab initio/અબ ઈનિશ્યો/પ્રારંભ-મૂળથી
aback/અબેક/પાછળ
abandon/અબેન્ડન/ત્યાજવું, ત્યાગવું
abase/અબેઇઝ/માનભંગ કરવું
abash/અબેશ/શરમાવું, માનભંગ થવું
abashed/અબેશ્ડ/શરમિંદુ
abate/અબેઇટ/ઘટાડો થવો
abattoir/એબટવાં/કતલખાનું
abbreviate/અબ્રિવિએઇટ/સંક્ષિપ્ત/ટૂંકુ બનાવવું
abdicate/એબડિકેટ/પદ-હોદ્દો ત્યાગવો
abduct/અબ્ડક્ટ/અપહરણ કરવું
aberrant/અબેરન્ટ/વિકૃત, રેઢિયાળ
aberration/અબરેશન/વિચલન, વિકૃતી
abet/અબેટ/ગુન્હામાં સાગ્રીત થવું
abeyance/અબેઅન્સ/મોકૂફી, સ્થગિતતા
abhor/અબહોર/અતિ તિરસ્કાર કરવો
abide by/અબાઇડ બાય/ને વળગી રહેવું
abiding/અબાઇડિંગ/શાશ્વત, પ્રબળ, કાયમ
ability/અબિલિટી/શક્તિ, આવડત, સક્ષમતા
abirritant/એબઇરિટન્ટ/પ્રશામક/સંતાપહારી
abject/એબ્જેક્ટ/હીન, નીચ, હલકટ
abjure/એબજ્યુર/ત્યાગ કરવો, ખંડન કરવું
ablation/અબ્લેઇશન/અંગછેદ/ખડકનું ધોવાણ
ablaze/અબ્લેઇઝ/પ્રજ્વલિત, બળતું, સળગતું
able/એઇબલ/શક્તિમાન, સમર્થ
ablutions/અબ્લુશન/પ્રાતઃક્રિયા, સ્નાન
abnegation/અબ્નેગેશન/સ્વઇન્કાર
abnormal/એબનોર્મલ/અસામાન્ય, વિકૃત
aboard/અબોર્ડ/વિમાન-જહાજ પર
abode/અબોર્ડ/રહેઠાણ, નિવાસ
abolish/અબોલિશ/નાબૂદ કરવું
abolition/અબોલિશન/નાબૂદી
abominable/અબોમિનેબલ/થિકકારપાત્ર
abominate/અબોમિનેટ/થિકકારવું
aboriginal/અબરીજનલ/મૂળ રહેવાસી
aborigine/અબરિજિન/મૂળ રહેવાસી
abort/અબોર્ટ/વ્યર્થ-નકામું બનાવવું
abortion/અબોર્શન/ગર્ભપાત
abortive/અબોર્ટિવ/વ્યર્થ, નિષ્ફળ
aboulia/અબુલિઆ/ઇચ્છાશક્તિનો અભાવ
abound/અબાઉન્ડ/પુષ્કળ હોવું
about/અબાઉટ/ના વિશે/આમતેમ/અંદાજે
above/અબવ/ઉપર
abracadabra/અબ્રેકેડેબ્રા/જાદુમંતર, બકવાસ
abrasion/અબ્રેઝન/ઉઝરડાં
abrasive/અબ્રેઝિવ/દૂભાવતું વર્તન
abreast/અબ્રેસ્ટ/સાથે સાથે રહેવું
abridge/અબ્રિજ/સંક્ષિપ્ત-ટૂંકુ કરવું

abroad/અબ્રોડ/વિદેશ, પરદેશ
abrogate/એબ્રોગેટ/નાબૂદ-રદ કરવું
abrogation/એબ્રોગેશન/નાબૂદી, રદ
abrupt/અબ્રપ્ટ/ઓચિતાનું, એકાએક
abscess/અબસેસ/ગૂમડું
abscond/અબસ્કોન્ડ/નાસતા ફરવું
absence/અબ્સેન્સ/ગેરહાજરી
absent/અબ્સન્ટ/ગેરહાજર
absentee/અબ્સન્ટી/ગેરહાજર રહેનાર
absolute/અબ્સલૂટ/આપબુદ, સ્પષ્ટ, નિરંકુશ/અંતિમ
absolution/અબ્સલૂશન/મુક્તિ, છુટકારો
absolve/અબઝોલ્વ/દોષ-પાપ મુક્ત કરવું
absorb/અબ્ઝોર્બ/શોષવું, સમાવવું, તલ્લીન થવું
abstain from/અબસ્ટેઇન ફ્રોમ/થી દૂર રહેવું
abstemious/અબસ્ટીમિઅસ/મિતાહારી/સંયમી
abstention/અબસ્ટેન્શન/દુરી, પરહેજ
abstinence/અબસ્ટિનન્સ/પરેજ, સંયમ
abstract/એબસ્ટ્રેક્ટ/ઉતારો, અમૂર્ત, સાર
abstruse/અબ્સ્ટ્રુઝ/જટિલ, ગૂંચવાડાભર્યું
absurd/અબ્સર્ડ/નિરર્થક/હાસ્યાસ્પદ, અર્થહીન
abundant/એબન્ડન્ટ/વિપુલ, પુષ્કળ
abuse/અબ્યુઝ/અપશબ્દ, ભાંડવું, દુરુપયોગ
abusive/અબ્યુસિવ/નિંદાત્મક, બિભત્સ
abut/અબટ/જોડવું, નજીક લાવવું
abuzz/અબઝ/ઘોંઘાટ, કોલાહલ
abysmal/અબિઝમ્બલ/અંધકારમય, અતિ ઊંડું
abyss/અબીસ/પાતાળ, ગર્તા
academic/અકેડેમિક/શૈક્ષણિક, શાસ્ત્રીય
acarpous/અકારપ્સ/વંધ્ય, ફળરહિત
accede/અકસીડ/સંમત, સામેલ થવું
accelerate/અકસેલેરેઇટ/વેગ આપવો
accent/એકસન્ટ/ઉચ્ચારણ, ભાર ઢેવો
accentuate/અકસેન્ટ્યુએટ/ભારપૂર્વક જણાવવું
accept/અકસેપ્ટ/સ્વિકારવું
acceptance/અકસેપ્ટન્સ/સ્વીકૃતિ
access/એકસેસ/માર્ગ, પહોંચ, પ્રવેશ
accessary/અકસેસરિ/મળતિયો
accessible/અકસેસિબલ/પહોંચમાં/સુગમ/સુલભ
accession/એકસેશન/જોડાણ/પ્રાપ્તિ/રાજ્યારોહણ
accessory/અકસેસરિ/સહાયક/સંલગ્ન સામગ્રી
accident/અકસિડન્ટ/અકસ્માત
acclaim/અકલેઇમ/તાળીઓથી વધાવવું
acclimate/અક્લામેઇટ/હવામાન માફક થવું
acclimatize/અક્લામાટેઇઝ/હવામાન માફક થવું
acclivity/અક્લિવિટિ/ઢાળ
accolade/અકલેઇડ/વખાણ, કદર
accommodate/અકોમોડેઇટ/સમાવવું
accommodation/અકોમોડેશન/સ્થાન-સગવડ, જોગવાઈ
accompaniment/અકમ્પનિમન્ટ/સંગત, સાથ
accompany/અકમ્પનિ/સાથે જવું

accomplice/અકમ્પ્લિસ/મળતિયો, દોષભાગી
accomplish/અકમ્પ્લિશ/સિદ્ધિ કરવું
accomplishment/અકમ્પ્લિશ્મન્ટ/સંગત, સાથ
accord/અકોર્ડ/સમજૂતી, કરાર, સંપ, સુમેળ
according to/અકોર્ડિંગ ટુ/તે પ્રમાણે
accost/અકોસ્ટ/જઈને વાત કરવી
account for-ખુલાસો કરવો
account/અકાઉન્ટ/હિસાબ, વર્ણન
accountability/અકાઉન્ટબિલિટિ/જવાબદારી
accoutre/અકૂટર/ સાધન સજ કરવું
accoutrements/અકૂટરમન્ટ/સાધન, સરંજામ
accredited/અક્રેડિટેડ/અધિકૃત, માન્ય
accretion/અક્રિશન/ કુદરતી વૃદ્ધિ-વધારો
accrue/અક્રુ/સંગ્રહ-જમા થવું, વધવું
accumulate/અક્યુમ્યુલેટ/સંચય-સંગ્રહ કરવો-થવો
accuracy/અક્યુરસી/ચોકકસાઈ, ચિવટ
accurate/અક્યુરેઈટ/ચોકકસ
accusation/અક્યુઝેશન/આરોપ, આક્ષેપ
accusative/અક્યુઝેટિવ/આરોપ મૂકવું
accuse of/અક્યુઝ/નો આરોપ મુકવો
accused/અક્યુઝડ/આરોપી
accustom/અકસ્ટમ/ટેવાઈ જવું
ace/એઈસ/એકકો, અવ્વલ, શ્રેષ્ઠ
acerbity/એર્સિબિટિ/તેજાબીપણું
acetic/એસિટિક/એક તેજાબનો પ્રકાર
acharnement/અચાર્નમન્ટ/લોહીની તરસ
ache/એઈક/દુઃખવું, દુખાવો
achieve(ment)/અ /
achieve/અચીવ/પ્રાપ્ત કરવું, સિદ્ધિ મેળવવી
achievement/અચીવમન્ટ/સિદ્ધિ
Achilles'heel/અકિલીઝહિલ/નબળી કડી
acid/એસિડ/તેજાબ
acidity/એસિડિટિ/અમ્લપિત્ત
acid-test/એસિડ ટેસ્ટ/અગ્નિપરીક્ષા
acidulous/એસિડ્યુલસ/તેજાબી
acknowledge(ment)/અ /
acknowledge/અકનોલિજ/સ્વીકારવું
acknowledgement/અકનોલિજમન્ટ/સ્વીકૃતિ
acme/એકમિ/શિખર, પરાકાષ્ઠા, ટોચ
acolyte/એકોલાયટ/મદદનીશ, શિખાઉ
acoustics/અકુસ્ટિક્સ/ઘ્વનિવિજ્ઞાન
acquaint(ance)/અ /
acquaint/અકવેઈન્ટ/થી પરિચિત થવું
acquaintance/અકવેન્ટન્સ/ઓળખાણ, પરિચય
acquest/અકવેસ્ટ/ઉપાર્જિત મિલકત
acquestrian/અકવેસ્ટ્રિઅન/ઘોડેસવારી
acquiesce/અકવાએસ/સહમતી-મંજૂર કરવું
acquire/અકવાયર/મેળવવું, સંપાદન કરવું
acquisition/એકિવઝિશન/પ્રાપ્તિ, સંપાદન
acquit/અકવિટ/નિર્દોષ છુટકારો થવો

acquittal/અકિવટલ/નિર્દોષ છુટકારો
acid/અકરિડ/આકરું, તમતમતું
acrimonious/એક્રિમોનિઅસ/સખત/ઉગ્ર/કઠોર
acrimony/એક્રિમનિ/ઉગ્રતા, સખતાઈ, કઠોરતા
acrobatic/એક્રોબેટિક/મલ્લકુસ્તીનો ખેલ
acronym/એકોનિમ/સંક્ષિપ્તશબ્દઆદ્યાક્ષર **AIDS**
across/અ /
across/અક્રોસ/સામે, પેલે પાર
act on (or upon)-ની પર પ્રતિભાવ આપવો
act out-નકકર બનાવવું
act up-દુર્વ્યવહાર કરવો
act(ive)/અ /
act/અક્ટ/કાર્યરત થવું/અભિનય/કાયદો/કાર્ય/અંક
acting/અક્ટ/કાર્યકારી/અભિનય/પગલાં લઈને
action/અકશન/કાર્ય, પગલાં, અભિનય
activate/અક્ટિવેટ/સક્રિય બનાવવું/પ્રવૃત કરવું
active/અક્ટિવ/સક્રિય, કાયરત
activist/અક્ટિવિસ્ટ/કાર્યકર, આંદોલનકારી
activity/અ /
actual/અક્યુઅલ/વાસ્તવિક
actuarial/અક્યુઅરિઅલ/વીમા ને લગતું
actuary/અક્યુઅરિ/વીમો વગેરે
actuate/અક્યુએઈટ/ગતિ આપવી
acuity/અક્યુટિ/તીવ્રતા, સખતાઈ
acumen/અક્યુમન/કુશાગ્ર નિર્ણય શક્તિ
acute/અક્યુટ/તીવ્ર, અતિ, સખત
AD (Anno Domini) ઈસવી સન
ad hoc/અડ-હોક/તદર્થ, કામચલાઉ
ad lib/અડ-લિબ/મનમાં આવે તે, તૈયારી વિના
ad valorem/અડ વૈલોરમ/મૂલ્યાનુસાર
adage/અડેજ/કહેવત, લોકોક્તિ
adamant/અડમન્ટ/સુષુપ્ત, અડગ, મંદ
adapt/અડપ્ટ/અનુકૂળ આવવું,
adaptation/અડપ્ટેશન/અવતરણ/અનુકૂલન
add in-માં ઉમેરવું
add on-જોડવું
add up to-સરવાળો થવો
add up-ઉમેરવું
add(ition)/અ /
add/અડ/ઉમેરવું
addendum/અડેન્ડમ/ઉમેરો, વધારો
addict/અડિક્ટ/બંધાણી, વ્યસની
addicted/અડિક્ટ/બંધાણી, વ્યસની
addiction/અડિક્ટ/બંધાણ, વ્યસન
additional/અડિશનલ/વધારાનું, અધિક
addle/અડલ/મુંઝવું, ગોટા કરવાં
address/અડ્રેસ/સંબોધન કરવું, સરનામું
adept/અડેપ્ટ/કુશળ
adequate/અડિકવેઈટ/પૂરતું, પર્યાપ્ત, યોગ્ય
adhere to/એધર ટુ/ને વળગી રહેવું

adherence/અધરન્સ/પાલન, અનુસરણ
adherent/અધરન્ટ/ને વળગી રહેતું
adhocism/અડહોકિઝમ/કામચલાઉપણું
adieu/અડ્યુ/અલવિદા, વિદાય
adjacent/અજેસન્ટ/પાસેનું, સંલગ્ન
adjective/એજેક્ટિવ/વિશેષણ
adjoin/અજોઈન/પાસેનું, સંલગ્ન
adjourn/અઝર્ન/મોકૂફ રાખવું
adjournment/અઝર્નમન્ટ/મોકૂફી
adjudicator/અજ્યુકેટર/લવાદ, નિર્ણાયક
adjunct/અજન્ક્ટ/વધારાનું, સહાયક
adjuration/અજ્યુરેશન/આગ્રહભરી વિનંતી-આહ્વાહન
adjure/અજ્યુઅર/આગ્રહભરી વિનંતી કરવી
adjust/અજસ્ટ/સરખું કરવું
adjustment/અજસ્ટમન્ટ/ગોઠવણ, સુમેળ
adjutant/અજટન્ટ/લશ્કરી અમલદાર, સહાયક
administrate/એડમિનિસ્ટ્રેટ/વહિવટ કરવો
administrative/એડમિનિસ્ટ્રેટિવ/વહિવટી
admirable/એડમિરબલ/વખાણવા લાયક
admire/અડમાયર/વખાણવું
admissible/અડમિસિબલ/સ્વીકાર્ય
admission/અડમિશન/પ્રવેશ, કબૂલાત
admit to-એકરાર કરવો
admit(tance)/અ /
admit/અડમિટ/સ્વીકારવું, દાખલ કરવું, કબૂલવું
admonish/અડમોનિશ/દપકો આપવો
ado/અડ્ડુ/લપન છપન, લપ, દેકારો, ઘાંધલ
adolescent/અડોલેસન્ટ/સગીર, તરૂણ
adopt/અડોપ્ટ/દત્તક લેવું, અપનાવવું, ઉતારો કરવો
adoption/અડોપ્શન/સ્વીકાર, દત્તક
adorable/અડોરેબલ/પૂજ્ય, સન્માનીય
adoration/અડોરેશન/સ્તુતિ, ભક્તિ
adore/અડોર/ભિરદાવવું, ભજવું
adorn/અડોર્ન/શણગારવું, સજાવટ કરવી
adrenaline/અડ્રેનેલિન/ઉશ્કેરાટ જન્ય રસાયણ
adroit/અડ્રોઈટ/નિપુણ, કુશળ
adroitness/અડ્રોઈટ/નિપુણતા, કુશળતા
adulation/અડ્યુલેશન/વખાણ, ખુશામત
adult/અડલ્ટ/પુખ્ત, પાકટ
adulterate/અડલ્ટરેટ/ભેળસેળ કરવી
adulterated/અડલ્ટરેટડ/ભેળસેળયુક્ત
adulteration/અડલ્ટરેશન/ભેળસેળ, સેળભેળ
adultery/અડલ્ટરિ/વ્યભિચાર, ઈનાબવું
advance/અડવાન્સ/આગોતરું, અગ્રીમ, આગળ વધવું
advanced/અડવાન્સ/મૂબ આગળ, અગ્રીમ
advantage/અડવાન્ટેઈજ/ફાયદો, લાભ
advent/અડવેન્ટ/આગમન, પ્રવેશ
adventure/અડવેનચર/જોખમ, સાહસ
adverb/અડવર્બ/ક્રિયા વિશેષણ
adversary/અડવર્સરિ/હરીફ, પ્રતિસ્પર્ધી

adverse/અડવર્સ/વિરુદ્ધનું
adversity/અડવર્સિટિ/મુસીબત, તકલીફ
advertise/એડવર્ટાઈઝ/જાહેરાત કરવી
advice (n)/એડવાઈસ/સલાહ
advisable/એડવાઈઝબલ/સલાહભર્યું
advise (v)/અડવાઈઝ/સલાહ આપવી
advocacy/અડવોકસિ/વકીલાત, હિમાયત
aegis/એઈજિસ/રક્ષણ, છત્ર
aeon/ઈઅન/લાંબો સમય-ગાળો
aerial/એરિઅલ/હવાઈ, એરિઅલ (રેડિયો)
aerodynamics/એરોડાયનેમિક્સ/વાયુગતિ શાસ્ત્ર
aesthetic/ઈસ્થેટિક/સુંદર, મજાનું, કલાત્મક
aesthetics/ઈસ્થેટિક્સ/સૌંદર્યશાસ્ત્ર
affability/અફેબિલિટિ/મેત્રીપૂર્ણતા
affable/અફેબલ/મળતાવડું, મિલનસાર
affair/અફેઅર/બાબત, પ્રણય-સંબંધ, લફરું
affect/અફેક્ટ/અસર કરવી
affected/અફેક્ટેડ/અસરગ્રસ્ત
affectionate/અફેક્શનેઈટ/પ્રેમાળ, માયાળુ
affidavit/અફિડેવિટ/સોગંદનામું
affiliate/અફિલિએઈટ/ની સાથે જોડવું
affiliation/અફિલિએશન/જોડાણ, સંલગ્નતા
affinity/અફિનિટિ/લગાવ, મોહ, ચાહત
affirmation/અફર્મેશન/હકાર, મંજૂરી
affirmative/અફર્મટિવ/હકારાત્મક
affix/અફિક્સ/ચોટાડવું
afflict/અફલિક્ટ/કોપ વર્તાવવો
affliction/અફલિક્શન/પીડા, સંકટ
affluence/અફલુઅન્સ/ સમૃદ્ધિ, સંપન્નતા
affluent/અફલુઅન્ટ/સમૃદ્ધ, સંપન્ન
afford/અફોર્ડ/પોસાવું, પૂરું પાડવું
affordable/અફોર્ડબલ/પોસાય તેવું
affront/અફ્રન્ટ/પુલ્લું અપમાન
aficionado/અફિસિનાડો/પ્રેમી, ચાહક
afoot/અફુટ/હાથ વેંતમાં
afraid of/અફ્રેઈડ-ઓફ/થી ડરતું
after/આફ્ટર/પછી, પશ્ચાદ, પાછળ
aftermath/આફ્ટરમાથ/પરિણામ
afternoon/આફ્ટર /
afterward(s)/અ /
afterwards/આફ્ટરવર્ડ્સ/પાછળથી, પછી
again/અગેઈન/ફરીવાર
against/અગેઈન્ટ/વિરુદ્ધ, ની સામે
agape/અગેઈપ/ઘાંધુ, ભયભીત
agate/એગટ/અકીક
age/એઈજ/યુગ, ઉંમર, કાળ, જુનું થવું
agenda/એજન્ડા/કાર્યસૂચિ, કામકાજની યાદી
agent/એજન્ટ/દલાલ, આડતિયો, જાસૂસ
agglomeration/અગ્લોમેરેશન/સમૂહ, શંભુમેળો
aggrandise/અગ્રાન્ડાઈઝ/વધારો કરવો

aggravate/અગ્રેવેટ/કાબુ બહાર જવું, વણસવું
aggregate/અગ્રીગેટ/કુલ, એકંદરે
aggressive/અગ્રેસિવ/આક્રમક
aggrieve/અગ્રીવ/વેદના, દુઃખ ભોગવવું
aghost/અઘાસ્ટ/ભયભીત
agile/એજાઇલ/ચપળ, તરવરાટ વાળું
agility/એજિલિટિ/ચપળતા
agitate/એજિટેઇટ/ઉશ્કેરાવું, ધુજવું
agitated/એજિટેટેડ/ઉશ્કેરાયેલું, આવેશમય
agitation/એજિટેઇશન/આંદોલન, ઉશ્કેરાટ
agnostic/એગ્નોસ્ટિક/અજ્ઞેયવાદી, સંશયવાદી
ago/અગો/પહેલાં
agog/અગોગ/ઉત્કંઠીત
agonise/એગોનાઇઝ/દુઃખ-પીડા કરવી
agony/એગનિ/વ્યથા, યાતના
agrarian/એગ્રીરિઅન/ખેતીપ્રધાન
agree about-
agree on-સંમત થવું
agree to-સ્વીકારવું
agree with-ની સાથે સહમત થવું
agree(ment)/અ /
agree/અગ્રી/સંમત થવું
agreement/અગ્રીમન્ટ/કરાર, સમજૂતી
ahead/અહેડ/આગળ, મોખરે
aid/એઇડ/સહાય, મદદ
aide/એઇડ/સહાયક, મદદનીશ
ailment/એઇલમન્ટ/બિમારી, રોગ
aim/એઇમ/ઘ્યેય, નિશાન, લક્ષ્ય સાધવું
air/એઅર/હવા
airborne/એરબોર્ન/હવામાં, આકાશમાં
aircraft/અ /
airforce/અ /
airport/અ /
airs/એઅર્સ/, દંભ, અભિમાન
aisle/આઇલ/બેઠકો વચ્ચે ચાલવાનો માર્ગ
aits/એઇટ્સ/નાનો ટાપુ(નદીનો)
akimbo/અકિમ્બો/કમરે હાથ રાખેલું
ala carte/આલા-કાર્ટ/અલગ અલગ વાનગી
alacrity/એલેક્રિટિ/તત્પરતા, હોંશ, તૈયારી
alarm/અલાર્મ/ચેતવણી, ચિંતા, ભય
alarming/અલાર્મિંગ/ભયજનક, ચિંતાજનક
albeit/ઓલબીટ/તેમ છતાં
albino/એલ્બિનો/કોઢવાળું
album/એલ્બમ/તસવીર-ગીત સંગ્રહ
alchemist/એલ્કેમિસ્ટ/કીમિયાગર
alchemy/એલ્કેમિ/કીમિયો
alcohol/એલ્કોહોલ/દારૂ
alcoholic/આલ્કોલિક/દારૂયુક્ત, દારૂડિયો
alcove/આલ્કોવ/સુંદર સ્થળ-ખુણો
alert/અલર્ટ/ચેતવણી, સાવધ, સર્તક-કરવું

alertness/અલર્ટ/સાવચેતી, સાવધાની
alfresco/અલફ્રેસ્કો/પુલ્લી હવામાં
algae/એલજી-ગી/શેવાળ, લીલ
algamate/અમ્લેગમેઇટ/ભેળવવું
alias/એલીઅસ/ઉર્ફે, ઉપનામ
alibi/એલિબાઇ/અન્યત્ર હાજરીનું બહાનું
alien/એલિઅન/વિદેશી, પારકું, પરબ્રહ્મનું
alienate/એલિઅનેઇટ/વિમુખ થવું, દૂર જવું
alignment/અલાઇનમન્ટ/સમાંતર, હરોળમા
alike/અ /
alimentary/અલિમેન્ટ્રી/પોષક, સત્વવાળું
alimony/એલિમનિ/ભરણપોષણ/ખાધાખોરાકી
alive/અલાઇવ/જીવિત, હયાત
all/ઓલ/બધાં, બધું, સર્વ
allay/એલેઇ/હળવું કરવું, ઘટાડવું
allege/અલેજ/આક્ષેપ-આરોપ મુકવો
alleged/અલેજ્ડ/તથાકથિત, આક્ષેપ કર્યો
allegedly/અલેજ્ડલિ/કહેવા પ્રમાણે
allegiance/અલીજન્સ/વફાદારી
allegorical/એલેગોરિકલ/રૂપાત્મક, ભાવનાત્મક
allegory/એલિગરિ/રૂપક, ભાવદર્શક કૃતિ
allergic/એલર્જિક/સુગવાળું
alleviate/અલિવિએટ/રાહત-છુટકારો અપાવવો
alleviation/અલિવિએશન/રાહત, છુટકારો
alley/એલી/સાંકડી ગલી
alliance/અલાયન્સ/જોડાણ, યુતી, મોરચો, વફાદારી
allies/અલાઇઝ/સાથીઓ, મિત્રો
alliteration/અલિટરેશન/વર્ણાનુપ્રાસ અલંકાર
allocate/અલોકેટ/ફાળવવું, સોંપવું
allocation/અલોકેશન/ફાળવણી, સોંપણી
allot/અલોટ/ફાળવવું, સોંપવું
allotted/અલોટેડ/ફાળવાયેલું, સોંપાયેલું
allow for-ગણતરી રાખવી
allow out-જવાની છુટ આપવી
allow/અલાઉ/છુટ આપવી
allowance/અલાઉન્સ/છૂટ, ભથ્થું
alloy/અલોય/મિશ્ર ધાતુ
allude/અલ્યુડ/ઉલ્લેખ કરવો
allure/અલ્યુર/લલચાવવું
allusion/અલ્યુઝન/ઉલ્લેખ, સંકેત
alluvial/અલ્યુવિઅલ/કાંપવાળુ
ally/એલાઇ/મિત્ર-રાષ્ટ્ર
alma mater/આલ્મા મેટર/માતૃસંસ્થા
almanac/એલ્મનૅક/પંચાંગ, તારીખિયું
Almighty/ઓલમાઇટી/સર્વશક્તિમાન, ઈશ્વર
almost/અલ્મોસ્ટ/લગભગ
alms/આમ્સ/ભીખ, દાન
aloft/અલોફ્ટ/ઉપરથી લટકતું
alone/અલોન/એકલું
along/અલોંગ/સાથે

alongside/અલોંગસાઈડ/બાજુમાં, પડખે
aloof/અલૂફ/અટલું, અતડું
aloud/અલાઉડ/મોટેથી, ઊંચા અવાજે
alpha to omega/આલ્ફા ટુ ઓમેગા/એ ટુ ઝેડ
alphabet/એલ્ફાબેટ/મૂળાક્ષર
already/ઓલ્ડેરી/કયારનુંય
also/ઓલ્સો/પણ
altar/ઓલ્ટાર/યજ્ઞવેદી
alter ego/ઓલ્ટર ઈગો/આત્મરૂપ
alter/ઓલ્ટર/ફેરવવું, બદલવું
alteration/ઓલ્ટરેશન/ફેરફાર
altercate/ઓલ્ટરકેટ/બોલાચાલી-તકરાર કરવી
altercation/ઓલ્ટરકેશન/બોલાચાલી, તકરાર
alternate/ઓલ્ટરનેટ/વારાફરતી, એકાંતરે
alternative/ઓલ્ટરનટિવ/વૈકલ્પિક, અવેજ
although/ઓલ્થોઉ/છતાં પણ
altitude/ઓલ્ટિટ્યુડ/ઊંચાઈ
altogether/ઓલ્ટુગેથર/સંપૂર્ણરીતે
altruistic/ઓલ્ટ્રુઈસ્ટિક/પરોપકારી, માનવતાવાદી
alumni/અલ્યુમનિ/ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ
always/ઓલ્વઈઝ/હંમેશા
amalgamate/અમેલગમેટ/મિશ્રણ કરવું
amass/અમેસ/ભેગું કરવું
amateur/અમેટર/શિખાઉ, શોખથી કરનાર
amaze/અમેઈઝ/સ્તબ્ધ-આશ્ચર્યચકિત કરવું
amazingly/અમેઈઝિંગલિ/આશ્ચર્યજનક રીતે
Amazon/અમેઝોન/પડછંદ સ્ત્રી
ambassador/અમ્બેસેડર/રાજદૂત, એલચી
amber/અમ્બર/પીળી બત્તી
ambiance/અમ્બિઅન્સ/પરિસર, વાતાવરણ, માહોલ
ambidextrous/અમ્બિડેક્સ્ટરસ/બન્ને હાથે કુશળ
ambience/અમ્બિઅન્સ/પરિસર, વાતાવરણ, માહોલ
ambiguous/અમ્બિગ્યુઅસ/સંદિગ્ધ, અસ્પષ્ટ
ambit/અમ્બિટ/ધેરાવો, હદ, સીમા
ambitious/અમ્બિશિઅસ/મહત્વાકાંક્ષી
ambivalence/અમ્બિવેલન્સ/દિશાવૃત્તિ
amble/અમ્બલ/ ઘોડાની રેવાલ ચાલ
ambrosia/અમ્બ્રોઝિઆ/અમૃત, દેવનું પીણું
ambulatory/અમ્બ્યુલેટરિ/રખડતું, પ્રવાસ કરતું
ambush/અમ્બુશ/ઓચિંતો છાપો મારવો
ameliorate/એમિલિઓરેટ/ઉન્નતિ-ઉત્કર્ષ કરવે
amelioration/એમિલિઓરેશન/ઉન્નતિ, ઉત્કર્ષ
amen/આમેન/તથાસ્તુ
amenable/અમેનેબલ/આજ્ઞાથીન, કહ્યાગરું
amend(ment)/અ /
amend/અમેન્ડ/સુધારવું (કાયદો)
amendment/અમેન્ડમન્ટ/કાયદામાં સુધારો
amenities/એમનિટિઝ/સુખસગવડો
amiable/એમિએબલ/મિલનસાર, મજાનું
amicable/એમિકેઈબલ/મૈત્રીપૂર્ણ

amid(amidst)/અમિડ/ની વચ્ચે
amiss/અમિસ/ખોટું
amity/એમિટિ/દોસ્તી, મૈત્રી, ભાઈબંધી
ammo(ammunition)દારૂગોળો
ammunition/અમ્યુનિશન/દારૂગોળો
amnesia/એમનેઝિઆ/વિસ્મૃતિ, સ્મૃતિલોપ
amnesty/એમનેટિ/કુલમાફી, સર્વમુક્તિ
amock(ચસેબં)/એમક/બેકાબૂ
among/અમન્ગ/ની વચ્ચે
amongst/અમન્ગસ્ટ/ની વચ્ચે
amoral/અમોરલ/બ્રષ્ટ, અનૈતિક
amorous/એમરસ/કામુક
amorphous/અમોર્ફસ/આકાર વિનાનો ગઢો
amortization/અમોર્ટાઈઝેશન/ઋણ માફી
amount/અમાઉન્ટ/રકમ, ની બરાબર હોવું
amphibian/એમફિબિઅન/ઉભચર પ્રાણી
amphitheater/એમ્ફિથિએટર/લંબગોળ નાટ્યગૃહ
ample/એમ્પલ/પુષ્કળ, મબલખ
amplify/એમ્પ્લિફાય/વિસ્તારવું, મોટું કરવું
amputate/એમ્પ્યુટેટ/અંગવિચ્છેદન કરવું
amputation/એમ્પ્યુટેશન/અંગવિચ્છેદન
amulet/એમ્યુલેટ/માદળિયું
amuse(ment)/અ /
amuse/અમ્યુઝ/મનોરંજન કરવું
anachronism/અનેક્રોનિઝમ/કાલદોષ
anaemia/એનેમિઆ/પાંડુરોગ, રક્તક્ષય
anagram/એનેગ્રામ/શબ્દરમત
analgesic/એનાલ્જિસ્ટિક/સંવેદનહારક
analogous/એનેલોગસ/સામ્યતા વાળું
analogue/એનેલોગ/સંગણક, સામ્ય
analogy/એનેલજી/સરખામણી
analysis/એનેલિસિસ/પૃથક્કરણ, વિશ્લેષણ
anarchist/એનાર્કિ/અંધાધૂંધી, અરાજકતા
anarchy/એનાર્કિ/અંધાધૂંધી, અરાજકતા
anathema/એનથેમા/શ્રાપ, ઘુણાસ્પદ વાત
anathematize/એનથેમેટાઈઝ/શ્રાપ-ગાળો દેવી
anatomical/એનટોમિકલ/શરીર રચનાનું
ancestor/એન્સેસ્ટર/પૂર્વજ, વડવાઓ
anchor/એન્કર/લંગર, ટેકો, પ્રસ્તુતકર્તા
ancient/એન્સિઅન્ટ/પુરાતન, પૌરાણિક
ancillary/એન્સિલરી/સંલગ્ન, પેટા
anecdote/એનેકડોટ/નાની વાત, પ્રસંગ
anemia/એનિમિઆ/રક્તક્ષિણતા
anemic/એનેમિક/કૃપણ, રક્તક્ષીણ
anesthetic/એનેસ્થેટિક/સંવેદનાહારક
angel/એઈન્જલ/દેવદૂત
angelic/એન્જલિક/દેવદૂત જેવું
anger/એન્ગર/ગુસ્સો
angle for-મેળવવા કોશિષ કરવી
angle/એન્ગલ/ખૂણો

angry/अंग्रि/गुस्से
angst/अंगस्ट/असलामती-गुन्धानो भाव
anguish/अंग्विश/मनोवेदना-व्यथा
angular/अंग्युलर/भुझावाणुं
animadvert/अंमिअडवर्ट/टिका, निंदा
animal/अंनिमल/पशु, ज्ञानवर
animate/अंनिमेईट/ज्वंत, सज्व
animated/अंनिमेईट/ज्वंत, जुरसावाणुं
animation/अंनिमेईशन/ज्वंतीकरण (चित्र)
animosity/अंनिमोसिटी/दुश्मनावट
animus/अंनिमस/अंतस, वेरभाव-प्रकृति, स्वभाव
annals/अंनल/इतिहास, वृत्तांत
anneal/अंनिअल/शफ्त बनावणुं
annex/अंनेक्ष/जोडणुं, भालसा करणुं
annihilate/अंनिहिलेट/सर्वनाश नोतरवो
annihilation/अंनिहिलेशन/सर्वनाश
anniversary/अंनिवर्सरि/वर्षगांठ
annotate/अंनोटेईट/नोंध उमेरवी
announce(ment)/अ /
announce/अनाउन्स/जाहेर करणुं
annoy/अनॉय/नाराज करणुं
annoyance/अनॉयअन्स/त्रास, पजवणी, नाराजगी
annual/अंन्युल/वार्षिक
annuity/अंन्युटी/वर्षासन
annul/अंनल/व्यर्थ बनावणुं
anodyne/अंनडिन/निर्दोष-बिनडानीकारक
anoint/अंनोईंट/ओपडणुं, निमणुं
anomalous/अंनोमलस/अनियमित, विलक्षण
anomaly/अंनोमलि/विसंवादीता
anon/अ /
anonymity/अंनोनिमिटी/अज्ञातपणुं, अज्ञातवास
anonymous/अंनोनिमस/ननामुं, अनामी
anorexia nervosa वजन वधवाना डरथी ओछुं भावुं
anorexia/अंनोरेडिअ/भूषण
another/अनदर/भीणुं
answer for-जवादार बनणुं
answer to-जवाबदारी थवी
answer/अन्सर/जवाब-आपवो
ant/अ /
antagonise/अंनटगोनाईज/दुश्मनी पेदा करवी
antagonism/अंनटगोनिजम/दुश्मनी, विरोध
antagonistic/अ /
antagonistic/अंनटगोनिस्टिक/दुश्मनावट ल्युं, वेरीलुं
Antarctic/अंनटार्कटिक/दक्षिण ध्रुव प्रदेशणुं
antecede/अंन्टिसीड/पूर्वव्यक्त थणुं
antecedent/अंन्टिसीड/पूर्ववर्ती, आगणुं
antecedents/अंन्टिसीड/पूर्वइतिहास
ante-date/अंन्टीडेट/पडेलांनी तारीख
antediluvian/अंन्टीडिल्युविअन/सर्जन समयणुं पुर
antenna/अंन्टेना/तरंगसंवाहक

anthem/अंन्धम/स्तुतिगान, राष्ट्रगीत
anthropoid
anthropologist
anthropology/अंन्थ्रोपोलज/मनुष्य विज्ञान
antibody/अंन्टिबॉडी/प्रतिकारक तत्वो, दवा
anticipatory/अंन्टिसिपेटरि/आगोतणुं, अपेक्षित
anticlimax/अंन्टिक्लिअक्स/अधोःसीमा
antidote/अंन्टिडोट/विषणुं मारण, प्रतिविष
antipathy/अंन्टिपथी/अप्राण्य, सूग
antiquated/अंन्टिक्वेटेड/जुर्रित, प्राचीन
antique/अंन्टिक/जुनुं, अलभ्य, प्राचीन
antiquity/अंन्टिक्वीटी/भूतकाल
anti-septic/अंन्टिसेप्टिक/सडा-निरोधक
anti-social/अंन्टिसोशियल/असामाजिक
antithesis/अंन्टिथीसिस/तद्दन विरोधी वात
antonym/अंन्टोनिम/विड्वधार्थी शब्द
anvil/अंन्विल/अेरण
anxiety/अंक्झाईटी/चिंता, व्याधी, उत्तेजन
anxious/अंक्क्षियस/चिंतातुर, उत्तेजित
any/अनी/कोई, गमे ते
anyhow/अ /
anyone/अ /
anyplace/अ /
anything/अ /
anywhere/अ /
apache/अपेच/गुंडो, बटमाश
apanage (appanage) कुंदरती वारसो
apart (ment)/अ /
apart/अपार्ट/जुदुं
apartheid/अपारथेट/रंगभेद
apathetic/अपथेटिक/उपेक्षा सेवणुं/अनुत्साही
apathy/अपथि/भावशून्यता
ape/अपे/वांदरो, नकल करवी
aperture/अपेच/प
apex/अपेक्ष/शिखर, टोय
aphasia/अफेझिआ/भाषाविकार
aphorism/अफोरिजम/कडेवत, सुत्र
aphrodisiac/अफ्रोडिसिअक/कामातेजेक
apiary/अपियरि/पक्षीघर
aping/अपिंग/वांदरवेडा, नकलपोरी
aplomb/अप्लोम्ब/आत्मश्रद्धा, स्थिर मनोभाव
apocalyptic/अपोकलिप्टिक/साक्षात्कारमय
apocryphal/अपोक्रिफल/उपजावी काहेलुं
apogee/अपोजि/श्रेष्ठ काल, ब्रमणकक्षानुं अंत बिंदु
apologetic/अपोलोजेटिक/माफी मागणुं
apologise for-ने माटे माफी मागवी
apologise to-नी माफी मागवी
apologise/अपोलोजाईज/माफी मागवी
apologue/अपोलोग/बोधवार्ता
apology/अ /

apoplectic/અપોપ્લેક્ટિક/લાલચોળ, મનોરોગી
apoplexy/અપોપ્લેક્સિ/બેભાન અવસ્થા
apostasy/અપોસ્ટેસિ/સ્વધર્મ-પક્ષ ત્યાગ
apostate/અપોસ્ટેટ/ધર્મત્યાગ કરવો
apostle/અપોસ્ટલ/યશસ્વી ધર્મપ્રચારક
apostrophe/અપોસ્ટ્રોફિ/પષ્ટીવિભ. 'નું ચિન્હ
apothecary /અપોથેકરિ/દવા-દારૂ બનાવનાર
apothegm/એપથેમ/સૂત્ર
apotheosis/એપથીઓસિસ/ દેવતાગણ
appall/અપોલ/આઘાત આપવો
appalling/અપોલિંગ/આઘાતજનક, ખતરનાક
apparently
apparatchiks/અપૅરાશીકસ/સામ્યવાદી અમલદાર
apparatus/અ /
apparel/અપૅરલ/કપડાં
apparent/અપૅરન્ટ/દેખીતું, સ્પષ્ટ
apparently/અ /
apparition/અપૅરિશન/આભાસ, ભૂત
appeal/અપીલ/અપીલ કરવી
appear/અપીઅર/દેખાવું, હાજર થવું
appearance/અપીઅરન્સ/દેખાવ
appease/અપીઝ/શાંત પાડવું, શમન કરવું
appeasement/અપીઝમન્ટ/સંતુષ્ટીકરણ
appellation
append/અપેન્ડ/જોડવું, ઉમેરવું
appetite/અપિટાઈટ/ભૂખ, ખાવાની રૂચિ
applaud/અપ્લોઉડ/તાળીઓથી વધાવવું
applause/અપ્લોઉઝ/તાળીઓથી વધામણી
apple/અપલ/સફરજન
applecart/અપલકાર્ટ/
appliance/અપ્લાયન્સ/ઉપકરણ, સાધન
applicable/અપ્લિકેઈબલ/લાગુ થઈ શકે તેવું
application/અપ્લિકેશન/અરજી, ઉપયોગ
apply/અપ્લાય/અરજી કરવી, લાગુ કરવું
appoint/અપોઈન્ટ/નિમવું
appointment/અપોઈન્ટમન્ટ/નિમણૂક, મુલાકાત
opposite/અપોઝિટ/યોગ્ય, અનુરૂપ
opposition/અપોઝીશન/યોગ્યતા
appraisal/અપ્રાઈઝલ/મૂલ્યાંકન
appraise/અપ્રાઈઝ/ક્યાસ, તાગ મેળવી વાકેફ કરવું
appreciable/અપ્રિસિએબલ/વખાણપાત્ર
appreciate/અપ્રીસિએટ/રસદર્શન-કદર કરવી
appreciation/અપ્રીસિએશન/રસદર્શન, કદર, મૂલ્ય
apprehend/અપ્રિહૅન્ડ/ધરપકડ કરવી
apprehension/અપ્રીહૅન્સન/ડર, શંકાહોવી, ધરપકડ
apprehensive/અપ્રીહૅન્સીવ/
apprentice/અપ્રેન્ટિસ/તાલીમી, શિખાઉ
apprise/અપ્રાઈઝ/જાણ કરવી, વાકેફ કરવું
approach/અપ્રોચ/અભિગમ, માર્ગ/પહોંચ
approbation

appropriate/અપ્રોપ્રિએટ/
appropriation/અપ્રોપ્રિએશન/કબ્જો, યોગ્યતા
approval/અપ્રૂવલ/માન્યતા, મંજૂરી
approve/અપ્રૂવ/માન્ય રાખવું
approximate/અપ્રોક્સિમેટ/અંદાજીત, લગભગ
appurtenance/અપર્ટિનન્સ/માર્ગ-પ્રવેશ હકક
apropos/અપ્રોપસ/ના અનુસંધાને-બાબતે
apshagum
apt/અ /
apt/અપ્ટ/યોગ્ય
aptitude/અપ્ટિટ્યુડ/વલણ, અભિરુચિ
aqua/અક્વા/પાણી
aquiline/અક્વાલાઈન/ગરૂડ જેવું
arable/અરબલ/ખેતીલાયક
arbiter/આર્બિટર/લવાદ, પંચ
arbitrarily/આર્બિટ્રરિ/મનસ્વી રીતે
arbitrary/આર્બિટ્રરિ/મનસ્વી
arbitrate/આર્બિટ્રેટ/પતાવટ કરવી
arbitration/આર્બિટ્રેશન/લવાદ, પંચ
arboretum/આર્બોરેટમ/વનસ્પતિ સંશોધન ઉદ્યાન
arc/આર્ક/તણખો
arcade/આર્કેડ/બે-બાજુએ દુકાનો વાળો માર્ગ
arcane/આર્કેઈન/રહસ્યમય, ગૂઢ
arch/આર્ચ/કમાન, ધનુષાકાર
archaeology/આર્કિઓલજી/ પુરાતત્વવિજ્ઞાન
archaic/આર્કએઈક/લુપ્ત (શબ્દો)
archer/આર્ચર/બાણાવળી
archery/આર્ચરિ/બાણવિદ્યા
archetype/આર્ચટાઈપ/નમુનો, અસલ
archipelago/આર્કિપિલેગો/ટાપુઓનો સમૂહ
architect/આર્કિટેક્ટ/શિલ્પસ્થાપત્યકાર
archives/આર્કાઈવ્ઝ/દફતર ભંડાર
Arctic/આર્કટિક્ટ/ઉત્તરધ્રુવનું
ardent/આર્ડન્ટ/અતિ ઉત્સાહી
ardour/આર્ડર/ખંત, ઉત્સાહ
arduous/આર્ડસ/સખત, પરિશ્રમી, આકરૂ
area/અરિઆ/વિસ્તાર, વિભાગ
arena/અરિના/પટ, પાંજરું, યુધ્ધભૂમિ, અખાડો
argosy/આરગસિ/મોટું જહાજ
argot/આરગટ/વિશિષ્ટ ભાષા
argue away-અદૃશ્ય કરવું
argue for/against-વ્યાજબી ઠેરવવું
argue out-નિવેડો લાવવો
argue/આર્ગ્યુ/દલીલ કરવી
argument/અ /
aria
arid/અરિડ/સુકોપ્રદેશ, રણ જેવું
arise/અરાઈઝ/ઉભું થવું, ઉદ્ભવવું
aristocracy/અરિસ્ટોક્રસિ/ઉમરાવપણું, ઉચ્ચવર્ગ
aristocratic/અરિસ્ટોક્રેટિક/ઉમરાવ, ઉચ્ચવર્ગનું

ark/આર્ક/રક્ષણ, આશ્રય, હોડી
arm(y)/અ /
arm/આર્મ/હાથ, હથિયાર
armada/આર્મડા/નોંકા કાફલો
armament/આર્મામેન્ટ/શસ્ત્રીકરણ, શસ્ત્ર સરંજામ
armour/આર્મર/બખતર, કવચ
army/આર્મી/લશ્કર, સેના
aroma/અરોમા/સુગંધ, પુશ્બુ
aromatic/અરોમેટિક/સુગંધી, પુશ્બુદાર
around/અરાઉન્ડ/આસપાસ
arouse/અરાઉઝ/જાગૃત કરવું
arrack
arraign/અરેઈન/આરોપ ઘડવો
arrange(ment)/અ /
arrange/અરેન્જ/વ્યવસ્થા કરવી
array/અરે/વ્યૂહરચના, પોષાક
arrears/અરિઅર્સ/ચડત લેણું
arrest/અરેસ્ટ/ઘરપકડ કરવી
arrival/અરાઈવલ/આગમન
arrive at-
arrive in-
arrive/અરાઈવ/આવી પહોંચવું
arrogance/અરોગન્સ/ઉઘ્ધતાઈ, ધમંડ
arrogant/અરોગન્ટ/ઉઘ્ધત, ધમંડી, તોછડું
arrow/અરો/તીર
arroyo/અરોયો/જળમાર્ગ
arsenal/આર્સનેલ/શસ્ત્રાગાર
arson/આર્સન/આગજની, આગ ચાંપવી
art(istic)/અ /
art/આર્ટ/કલા
artefacts/આર્ટફેક્ટ/કલાકૃતિઓ
artery/આર્ટરી/ઘોરી નસ
artful/આર્ટફુલ/કાવત્રાખોર, લુચ્ચું
article/આર્ટિકલ/કલમ, અનુચ્છેદ, લેખ, વસ્તુ
articulate/આર્ટિક્યુલેટ/હાવભાવસભર ભાષા
artifacts/આર્ટફેક્ટ/
artifice/આર્ટિફાઈસ/નકલી વર્તન, કુશળતા
artificial/આર્ટિફિશલ/કૃત્રિમ, આભાસી
artillery/આર્ટિલરી/તોપદળ
artisan/આર્ટિઝન/કલા-કારીગર
artist/આર્ટિસ્ટ/કલાકાર
artiste/આર્ટિસ્ટ/મનોરંજન કલાકાર
artistic/આર્ટિસ્ટિક/કલાત્મક
artless
as if/અઝ-ઈફ/જાણે કે, જેમકે
as/અઝ/ની જેમ, કારણ કે
ascend/અસેન્ડ/ચડવું
ascendancy/અસેન્ડન્સિ/સતારોહણ,
ascent/અસેન્ટ/ઉદય, ચઢાણ
ascertain/અસર્ટન/ખાત્રી કરવી, પાકકું કરવું

ascetic/અસેટિક/તપસ્વી, સંતપુરુષ
asceticism/અસેટિસિઝમ/તપમાર્ગ
ascribe/અસ્ક્રાઈબ/સમર્થન આપવું
aseptic/અસેપ્ટિક/જંતુમુક્ત, અશકત
ash/અશ/રાખ
ashamed/અશૈઈમ્ડ/શરમીદુ
ashen/અશન/લાકડાનું
ashes/અશીઝ/રાખ, અસ્થિ
aside/અસાઈડ/ભાજુમાં, પડખે
asinine/અસિનાઈન/ગદર્બલક્ષણ
ask after-પ્રણામ પાઠવવા
ask around-પૂછપરછ કરવી
ask back-આમંત્રણ આપવું
ask for-
ask in- આમંત્રણ આપવું
ask out-મુલાકાત માગવી
ask up- આમંત્રણ આપવું
ask/આસ્ક/પૂછવું, માગણી કરવી
askance/આસ્કન્સ/શંકા
askew/અસ્ક્યુ/લાઈનદોરી બહાર
asleep/અસ્લીપ/સુતેલું, સુસુપ્ત
aspect/અસ્પેક્ટ/પાસું, લક્ષણ
asperity/અસ્પેરિટિ/સખ્તાઈ, કડકાઈ
aspersions/અસ્પર્ઝન/નિંદા, લાંછન
asphalt/આસ્ફાલ્ટ/ડામર
aspirant/અસ્પિરાન્ટ/આશાસ્પદ, મહત્વકાંક્ષી
aspiration/અસ્પિરેશન/અરમાન, મહત્વકાંક્ષા
aspire/અસ્પાયર/અરમાન, મહત્વકાંક્ષા હોવી
ass/અસ/મુર્ખ, ગધ્યા
assail/અસેઈલ/આક્રમણ, સખત ટીકા
assailant/અસેલન્ટ/હુમલાખોર
assassin/અસેસિન/હત્યારું, ખૂની
assassination/અસેસિનેશન/હત્યા, ખૂન
assault/અસૉલ્ટ/હુમલો
assay/અસે/પ્રયત્ન-કરવો
assemble/અસેમ્બલ/ભેગા થવું
assembly/અસેમ્બલી/સભા, મેળાવડો
assent/અસેન્ટ/સંમતિ, મંજૂરી
assert/અસર્ટ/કથન-વિધાન કરવું
assertion/અસર્શન/હુંકાર, દાવો, પ્રતિજ્ઞા
assertive/અસર્ટિવ/સ્વમતાપ્રહી, વિધેયાત્મક
assess/અસેસ/મૂલ્યાંકન, આકારણી કરવી
assessment/અસેસમેન્ટ/મૂલ્યાંકન, આકારણી
asset/અસેટ/મિલકત, સંપત્તિ
assiduous/અસિડ્યુસ/ઉદ્યમી, ખંતીલું
assign/અસાઈન/વિધિસર સોંપવું
assimilate/અસિમિલેટ/આત્મસાતકરવું
assist(ance)/અ /
associate/અસોસિએટ/જોડાવું, લાગુ પાડવું
association/અસોસીએશન/મંડળ, જોડાણ

assortment/અસોર્ટમન્ટ/મિશ્રણ
assuage/અસ્યુએજ/શાંત પાડવું
assume/અઝ્યુમ/હાથમાં લેવું, ધારવું
assumption/અઝમ્પ્શન/માન્યતા, ધારણા
assurance/અસ્યોરન્સ/વીમો, ખાતરી, હેયાધારણ
assure/અસ્યોર/ખાતરી આપવી
assuring/અસ્યોર/ખાતરી આપવી
ast/કોઉસ્ટ/કિનારો, કાંઠો
asteroid/અસ્ટ્રોઈડ/આકાશી પદાર્થના ટુકડા
astigmatism/અસ્ટિમોટિઝમ/આંખોની ઝાંખપ
astonish/અસ્ટોનિશ/આશ્ચર્યચકિત કરવું-થવું
astound/અસ્ટાઉન્ડ/આશ્ચર્યચકિત કરવું-થવું
astral/અસ્ટ્રલ/તારાઓનું-ને લગતું
astray/અસ્ટ્રે/અવળેમાર્ગે, ભટકી ગયેલું
astringent/અસ્ટ્રિન્જન્ટ/સખત, આકરું
astronaut/અસ્ટ્રોનોટ/અવકાશયાત્રી
astronomical/અસ્ટ્રોનોમિકલ/અતિ વિરાટ, મોટું
astronomy/અસ્ટ્રોનોમી/ખગોળવિજ્ઞાન
astute/અસ્ટ્યુટ/કુશાલ બુદ્ધિવાળું
asunder/અસન્ડર/છુટું, વેગળું
asylum/અસાયલમ/પાગલખાનું, આશ્રય
asymmetric/અસિમેટ્રિક/ખરબચડું, અસમતળ
at all/એટ ઓલ/બિલકુલ, જરા પણ
at bay/અટ બે/છેતું-દૂર રાખવું
at large/એટ લાર્જ/ભાગેડું, ફરાર (કાયદાથી)
at the helms/એટ ધ હેલ્સ/સુકાન પદે
atavism/એટાવિઝમ/પૂર્વજોલક્ષી વલણ
atavistic/એટાવિસ્ટિક/પૂર્વજોલક્ષી
atheist/અથેઈસ્ટિ/નાસ્તિક
atheistic/અથેઈસ્ટિક/નાસ્તિકતાવાદી
athletic/અથલેટિક/ખેલકુદનું
atom(ic)/અ /
atom/અટમ/અણુ
atone/અટોન/પ્રશ્ચાતાપ કરવો
atrabilious/અટ્રાબિલસ/ગમગીન, ચિડીયું
atrocious/અટ્રોશિઅસ/જુલમી, અત્યાચારી
atrocious/અટ્રોસિટિ/જુલમ, અત્યાચાર
atrophy/અટ્રોફિ/શરીરનું સુકાવાનો રોગ
attaché/અટેચિ/ રાજદુત
attachment/અટેચમન્ટ/જોડાણ. લગાવ, મોહ
attack/અટેક/હુમલો, ચડાઈ
attain/અટેઈન/મેળવવું, પ્રાપ્ત કરવું
attainment/અટેઈનમન્ટ/સિધ્ધી, પ્રાપ્તી
attempt/અટેમ્પ્ટ/પ્રયત્ન-કોશિષ-પ્રયત્ન કરવો
attend to/અટેન્ડ ટુ/-વહિવટ કરવો
attend(ance)/અ /
attend/અટેન્ડ/હાજર રહેવું, ધ્યાન આપવું
attenuate/અટેન્યુએટ/પાતળું બનાવવું
attest/અટેસ્ટ/પ્રમાણિત કરવું, અધિકૃતકરવું
attestation/અટેસ્ટેશન/સાખ, દસ્કત, ખરાઈ

attire/અટાયર/કપડાં, વસ્ત્રો
attitude/એટિટ્યુડ/વલણ, લક્ષણ
attract/અટ્રેક્ટ/આકર્ષવું
attraction/અટ્રેક્શન/આકર્ષણ
attractive/અટ્રેક્ટિવ/આકર્ષક, મોહક
attribute/અટ્રિબ્યુટ/ગુણ, લક્ષણ
attrition/અટ્રિશન/ઘર્ષણ, પશ્ચાતાપ
atypical/અટિપિકલ/અસામાન્ય
au revoir/ઓરેવાર/અલવિદા, આવજો
auction off-હરાજ કરી નાખવી
audacious/ઓડેસિઅસ/હિમ્મતવાન, બહાદુર
audacity/ઓડેસિટિ/હિમ્મત, બહાદુરી
audible/ઓડિબલ/સંભળાય તેવું
audit/ઓડિટ/હિસાબ તપાસણી
auditorium/ઓડિટોરિયમ/સભાગૃહ
augment/ઓટ/ કાંઈપણ
augment/ઓગમેન્ટ/વધારવું,
augmentation/ઓગમેન્ટેશન/વધારો
augur/ઓગર/ભવિષ્ય ભાખવું
augury/ઓગર/અગમ સંકેત
augment/ઓગસ્ટ/ઉમદા, પવિત્ર, પુજ્ય, ઓગસ્ટ માસ
augment/આન્ટ/કાકી, મામી, માસી, ફઈ
augment/ઔરા/સુવાસ, તેજ, પ્રભાવલય
augment/ઓઉરલ/કાનનું
augment/ઓરિઓલ/તેજોવલય
augment/ઓરોરલ/તેજોમય, પરોઢ
augment/ઓસ્પીસીસ/કૃપા, આશ્રય, શુકન, ઉપક્રમ
augment/ઓસ્પિસશ/શુભ, શુકનવંતુ, માંગલીક
augment/ઓસ્ટીઅર/કઠોર, સખત, કડક
augment/ઓસ્ટેરિટિ/કઠોરતા, સખ્તાઈ
augment/ઓથેન્ટિક/સત્તાવાહી, પ્રમાણીત
augment/ઓથેન્ટિકેટ/પ્રમાણિત કરવું
augment/ઓથેન્ટિસિટિ/વિશ્વનિયતા, અસલિયત
author(ity)/અ /
author/ઓથર/લેખક, પુસ્કર્તા
authorise/ઓથોરાઈઝ/સત્તા-અધિકાર આપવો
authoritarian/ઓથોરિટરિઅન/સત્તા ભોગવનાર
authoritative/ઓથોરિટિવ/સત્તાવાહી, સત્તાવાર
authority/ઓથોરિટિ/સત્તા, અધિકાર, વિશ્વાસપાત્ર
authorship/ઓથરશિપ/લેખકત્વ
autistic/ઓટિસ્ટિક/સતત ભ્રમણામાં જીવવું
autobiography/ઓઉટોબાયોગ્રાફિ/આત્મકથા
autocracy/ઓટોક્રસિ/આપખુદ, નિરંકુશ શાસન
autocrat/ઓટોક્રેટ/આપખુદ, સરમુખ્યતાર
autocratic/ઓટોક્રેટિક/આપખુદ શાસક
automat/ઓટોમેટ/સ્વયંચાલિત વિક્રિયંત્ર
automation/ઓટોમેશન/યાંત્રીકરણ
automaton/ઓટોમેટન/યાંત્રમાનવ, રોબોટ
automobile/અ /
automobile/ઓટોમોબાઈલ/વાહન

autonomous/ઑટોનોમસ/સ્વાયત્ત
autopsy/ઑટોપ્સિ/શબપરીક્ષણ
autumn/ઑટમ/પાનખર
auxiliary/ઑગ્ઝીલિઅરિ/સહાયકારી
auxilium/ઑકઝિલિયમ/સાધ્વીઓનો મઠ
avail of/અવેઈલ ઓવ/નો લાભ લેવો
avail(able)/અ /
available/અવેઈલેબલ/પ્રાપ્ય, ઉપલબ્ધ
avalanche/એવલાંશ/હિમપ્રપાત
avant garde/એવાંગાર્ડ/ પ્રણેતા, અગ્રીમ
avarice/ઑવરિસ/લોભ, લાલસા
avaricious/ઑવરિશસ/લોભી
avenge/ઑવેન્જ/બદલો લેવો
avenue/ઑવેન્યુ/વૃક્ષમાર્ગ, રાજમાર્ગ
aver/ઑવર/પ્રતિપાદિત કરવું
average out at-સરેરાસ થવી
average out-સરેરાસ ગણવી
average/એવરિજ/સરેરાશ, સામાન્ય
averse/ઑવર્સ/અનિચ્છુક, અણગમા વાળું
aversion/ઑવર્સન/અણગમો, સુગ
avert/ઑવર્ટ/નિવારવું, ટાળવું
aviary/ઑવિઅરિ/પક્ષીઘર
aviation/ઑવિએશન/ઉડ્ડયન(વિમાન)
avid/ઑવિડ/ઉત્સુક, આતુર
avionics/ઑવિઓનિક્સ/ઉડ્ડયનવિજ્ઞાન
avocation/અવૉકેઈશન/શોખ, વ્યવસાય
avoid/અવૉઈડ/ટાળવું, ઉપેક્ષા કરવી
avow/અવાઉ/બેધડક કહેવું
avuncular/અવન્ક્યુલર/કાકા-મામા જેવું
await/અવેઈટ/રાહ જોવી
awake/અવેઈક/જાગવું
awaken/અવેઈકન/જાગાડવું
award/અવૉર્ડ/સુકાદો, ઈલકાબ
aware of/અવૉર ઓવ/થી માહિતગાર
awareness/અવૉરનેસ/માહિતી
away/અવેઈ/દુર
awe/ઑ/ધાક, આદરચુકત, ભય
awesome/ઑસમ/ભયાનક, ખતરનાક
awe-struck/ઑસ્ટ્રક/ભયગ્રસ્ત, ચકિત
awful/ઑફલ/પ્રચંડ, ડરામણું, ખતરનાક
awkward/અ /
awkward/ઑકવર્ડ/કઠંગું, બેડોળ
awl/ઑલ/આરી
awry/ઑરિ/ખોટી રીતે
axe/ઑક્સ/કૂહાડી-મારવી, કાપ મૂકવો
axiom/ઑકિઝઅમ/પ્રસ્થાપિત કહેવત
azure/અઝ્યુર/વાદળી રંગનું
babble away/on-બબડાટ કરવો
babble/બબલ/બકબક, કાલુકાલું બોલવું
baby/બેઈબિ/બાળક, છોકરી(ગીત)

bachchanal/બૅકાનલ/વરણાગીચું, મુક્તાચારી
back burner/બૅકબર્નર/અવગણના થતું
back down-શરણે થવું
back on to-નુ પછવાડું હોવું
back out/બૅક-આઉટ/પીછેહઠ કરવી
back out-પીછેહઠ કરવી, ગાડી પાછી લેવી
back up-પાછળ લેવું
back(ground)/બ /
back/બૅક/પીઠ, પાછળ, ટેકો આપવો
back-bite/બૅક બાઈટ/ચુગલી, નિંદા કરવી
back-bone/બૅકબોન/આધારસ્તંભ, કરોડરજ્જુ
back-fire/બૅકફાયર/ઊલટું પરિણામ આવવું
backlash/બૅકલૅશ/હિંસક પ્રતિક્રિયા
backlog/બૅકલૉગ/ભરાવો, બાકી જથ્થો
backsliding/બૅકલૉગ/પીછેહઠ કરતું, ઓસરતું
backtrack/બૅકટ્રેક/પીછેહઠ-કરવી
backward/બૅકવર્ડ/પછાત
backwater/બૅકવૉટર/બંધિયાર-પાણી, ખાડી
bacteria/બૅક્ટેરિયા/જીવાણુઓ
bad blood/બૅડબ્લડ/વૈમનસ્ય, અંટશ
bad/બૅડ/ખરાબ
badger/બૅજર/ત્રાસ આપવો, ધોરખોદ પ્રાણી
badinage/બૅડિનાજ/મજાક, મશકરી
baffle/બૅફલ/ગૂંચવાવું, મુંજવવું
bag/બૅગ/ઝોળી, થેલી કબ્જે કરવું, પ્રાપ્તકરવું
baggage/બૅગ્ગ/સામાન
bail out/બેઈલ આઉટ/જામીન પર છોડવું
bail/બેઈલ/જામીન, ક્રિકેટ ના ચકલા
bailed/બેઈલ્ડ/જામીન આપ્યા
bait/બેઈટ/પ્રલોભન, લાલચ, છટકું
bake/બેઈક/શેકવું
balance out-બરોબરી કરવી
balance/બૅલેન્સ/સમતોલન/સિલક
balcony/બાલ્કની/ઝરૂખો
bald/બૅલ્ડ/ટાલિયું
balderdash/બૅલ્ડરડૅશ/અર્થહીન, બકવાસ
bale out-કુદી પડવું(હવાઈ જહાજ)
bale/બેઈલ/કાપડની ગાંસડી, તાકો
baleful/બેઈલફુલ/દુષ્ટ, વિનાશક
balk/બૅક/અડચણ, વિઘ્ન
ball/બૅલ/દડો, ગોળ છરો
ballad/બૅલ્ડ/ભાવપ્રધાન ગીત
ballet/બેલે/સંગીત-નૃત્ય નાટિકા
ballistic/બૅલિસ્ટિક/પ્રભેપાસ્ત્રનું
balloon/બલૂન/ફૂગો, હવાઈ ગોળો
ballot/બૅલટ/મતદાન, મતપત્રક
ballyhoo/બૅલિહૂ/ખોટી-ભ્રામક જાહેરાત
balm/બામ/દર્દશામક મલમ
bam/બૅમ/ઠગવું, છેતરવું
bamboo/બૅમ્બૂ/વાંસ

bamboozle/બંબૂઝલ/બનાવટ, મજાક કરવી
ban/બંન/નિષેધ-મનાઈ કરવી, પ્રતિબંધ
banal/બંનલ/તુચ્છ, નકામું
banality/બંનેલિટ/નિરસતા, તુચ્છતા
banana/બનાના/કેળું
band together-એકઠા કરવું
band/બંન્ડ/વાજું, પટ્ટો
bandit/બંન્ડિટ/ઘાડપાડુ, લુંટારો
bandwagon/બંન્ડવેગન/ચાલુ ગાડીએ
bandy about/around-વારંવાર ઉપયોગ કરવો
bane/બેઈન/ઘાતક ઝેર, નાશ કરવો
baneful/બેઈનફુલ/વિનાશક, પીડાકારક
bang/બેન્ગ/ધમાકો, વિસ્ફોટ, અથડાવું
banish/બેનિશ/દેશનિકાલ કરવો
bank (up) on-ની પર આધાર રાખવો
bank on/બેન્ક/ની પર આધાર રાખવો
bank/બેન્ક/બેંક, કાંઠો, કિનારો
bankrupt/બેન્કરપ્ટ/દેવાળિયું, નાદાર, કડકો
bankruptcy/બેન્કરપ્સી/નાદારી, દેવાળું
banner/બેનર/ઝંડો, નેજો, વાવટો
banquet/બેન્કવેટ/ભોજન સમારંભ
banter/બેન્ટર/મજકરી, મજાક
bantering/બેન્ટરિંગ/હાસ્યવિનોદ-મજાક કરવું
baptise/બેપ્ટાઈઝ/નામ પાડવું (ખ્રિસ્તી સંસ્કાર)
bar/બાર/લાટો, દારૂનું પીંદું, વકીલ મંડળ નકારવું
barb/બાર્બ/કાંટો-આંકડો
barbarism/બાર્બરિઝમ/જંગાલિયત, કૂરતા
barbarous/બાર્બરસ/કુર, જંગલી
barbed/બાર્બેડ/કાંટાવાળું
bard/બાર્ડ/ભાટ, રાજકવિ
bare/બેઅર/ખુલ્લું કરવું, નગ્ન, અલ્પ
barefaced/બેઅરફેઈસ્ડ/ખુલ્લા-ચોખ્ખા ચહેરો
barely/બેઅરલિ/ભાગ્યેજ
bargain for-આશા રાખવી
bargain/બાર્ગેઈન/સસ્તો સોદો, કરાર
barge/બાર્જ/ધસી જવું, માલવાહક નૌકા
bark/બાર્ક/ઝાડની છાલ, ભસવું
barmy/બાર્મિ/ચક્કમ
barn/બાર્ન/કોઠાર
baron/બેરન/ઘનાઢય વેપારી
baroque/બેરોક/સજાવટ, શણગારેલું
barrack/બેરેક/સૈનિક નિવાસ, હુરિયોબોલાવવો
barrage/બેરેજ/ડેમ, તોપમારો, તડાપીટ
barrel/બેરલ/નાળચું, પીપ
barren/બેરન/વેરાન, ઉજ્જડ, સૂમસામ
barricade/બેરિકેઈડ/આડશ, અવરોધ, નાકાબંધી
barrier/બેરીઅર/અંતરાય, દિવાલ, વાડ
barring/બેરિંગ/સિવાય, બાદ કરતાં
barrister/બેરિસ્ટર/વકીલ(વડી અદાલત)
barter/બાર્ટર/વિનિમય, અદલાબદલી

barterer/બાર્ટરર/વિનિમય, અદલાબદલી કરનાર
basal/બેઈઝલ/પાયાનું, મૂળભૂત, મૂળ પ્રકૃતિ
base/બેઈઝ/પાયો, થાણું, હલકટ, નીચ
bash about-ફટકારવું, નુકશાન કરવું
bash on-ચાલું રાખવું
bash/બેશ/ફટકો, માર મારવો
bashful/બેશફુલ/શરમાળ, બીકણ
basic/બેઈઝીક/પાયાનું, મૂળભૂત
basis/બેઈસીસ/પાયો, આધાર, મુખ્યતત્વ
bask/બેસ્ક/તડકો ખાવો, રાચવું
basket/બાસ્કેટ/ટોકરી, સુંડલો
bastard/બાસ્ટર્ડ/વણસંકર, અનૌરસ બાળક
bastion/બેસ્ટિઅન/લશ્કરી સંરક્ષણ, કિલ્લો
bat/બેટ/ક્રિકેટનું બેટ-રમવું, ચામાચિડીયું
batch/બેચ/જુથ, ઘાણવો, લૉટ
bate/બેટેડ/ઘટાડવું, રોકી રાખવું
bath/બાથ/સ્નાન
bathe/બેઈથ/નહાવું
bathos/બેથસ/હલકી સાહિત્ય રચના
baton/બેટન/બડીકો, દંડો
battalion/બેટલિઅન/પલ્ટન(ભુમી સેના)
batter/બેટર/ઘોકાવવું, ઝડવું
battery/બેટરિ/તોપખાનું, મારપીટ
battle on-મુશ્કેલીમાં ચાલુ રાખવું
battle/બેટલ/ સંઘર્ષ કરવો લડાઈ, મારામારી
battle-line/બેટલ લાઈન/યુધ્ધરેખા
bauble/બૉબલ/તકલાદી
bulb/બુલ્બ/અવરોધવું, અચકાવું
bawdy/બૉડિ/બીભત્સ વાત
bawl out-ચીસ પાડવી, ઠપકો દેવો
bay/બેચ/ઉપસાગર, આખાત
bayonet/બેયોનેટ/બંદુક સાથે જડવું સંગીન
bazaar/બઝાર/હાટ, બજાર
bazooka/બઝૂકા/રોકેટ છોડવાનું સાધન
be/બી/થવું, હોવું, અસ્તિત્વ હોવું
beach/બીચ/દરિયાકાંઠો
beacon/બીકન/માર્ગદર્શક પીળી બત્તી, કિરણ
bead/બીડ/મણકો, પારા
beak/બીક/ચાંચ
beam/બીમ/કિરણ, ચમક
beaming/બીમ/ કિરણ, ચમકવાળું
bean/બીન/કઠોળ
bear down-ધકકો મારવો
bear out-ટેકો દેવો
bear the brunt આઘાત સહેવો
bear up-ચલાવ્યે રાખવું
bear with-ચલાવી લેવું
bear(up)on-ને લેવાદેવા હોવા
bear/બેઅર/જન્મ આપવો, રીંછ, સહન કરવું
bearable/બેરેબલ/સહન થઈ શકે તેવું

beard/બીઅર્ડ/દાઢી
bearer/બેરર/હોદ્દેદાર, ધારણકરનાર
bearing/બેરિંગ/વર્તન, અંગસ્થિતિ
bearish/બેરિશ/તેજીલક્ષી (શંર)
beast/બીસ્ટ/પશુ, જાનવર
beat back-મારી હટાવવું
beat down-પટકાવવું, પછડાવું
beat off-મારી હટાવવું
beat out-ઓલવી નાખવું
beat up-હુમલો કરવો
beat/બીટ/મારવું, મહાત કરવું ઘબકારો, તાલ
beatific/બીટિફિક/કૃપાનિધાન
beatitude/બીટિટ્યુડ/કૃપા, આર્શિવાદ
beatnik/બીટનિક/રૂઢી ભીન્નયુવાન
beau/બો/વરણાગિયો, છેલછબીલો
beauteous/બ્યુટીઅસ/સુંદર
beautiful/બ્યુટિફુલ/સુંદર, લાવણ્યમય
beautitude/બ્યુટિટ્યુડ/ધન્યતા
beauty/બ્યુટી/સુંદરતા/લાવણ્ય
beaver away-સખત મહેનત કરવી
because/બીકોઝ/કારણ કે
beckon/બેકન/ઈશારાથી બોલાવવું
become/બિકમ/થવું, બનવું
bed/બેડ/પટ, પથારી
bedeck/બીડેક/સજાવટ કરવી
bedizen/બેડિઝન/ભભકાદાર વસ્ત્રો પહેરવા
bedlam/બેડલેમ/અવ્યવસ્થા, પાગલખાનું
bedraggle/બિડ્રેગલ/સંપૂર્ણ રીતે ભીનું કરવું
bedrock/બેડરોક/નકકર ખડક-પાયો
bee/બી/માખી
beef up/બીફ-અપ/સર્તક, મજબૂત બનાવવું
beef/બીફ/ગાયનું માંસ
bee-hive/બીહાઈવ/મધપૂડો
beeline/બીલાઈન/સીધી લાઈન
beer/બિઅર/બીઅર
befitting/બિફિટિંગ/યોગ્ય
before/બિફોર/ના થી પહેલાં
beforehand/બિફોરહૅન્ડ/અગાઉથી
befuddled/બિફુડલ/મૂઝાયેલું, ઘાંધુ, છાકટું
beg/બેગ/માગવું, આજીજી કરવી
beget/બિગેટ/પેદાકરવું, કારણ બનવું
begin/બિગીન/શરૂકરવું
begrimed/બિગ્રીમ/કાદવથી ખરડાવું
begudge/બિગ્રજ/આપતા ખંચકાવું
beguile/બિગાઈલ/ભ્રમમાં નાખવું, છેતરવું
behalf/બિહાફ/ની બદલીમાં
behave/બીહેઈવ/વર્તવું
behaviour/બીહેવિઅર/વર્તન
behead/બીહેડ/શિરછેદ કરવો
behemoth/બિહમોથ/ખખડધજ, વિરાટ

behest/બીહેસ્ટ/આજ્ઞા, હુકમ, વચન
behind/બિહાઈન્ડ/ની પાછળ
behold/બીહોલ્ડ/જોવું, નિરખવું
beholden/બીહોલ્ડન/નું દેવાદાર
behoove/બીહૂવ/જરૂરી, લાયક, યોગ્ય
belabour/બિલેબર/ઝૂડવું, પીટવું
belated/બીલેઈટેડ/વિલંબ-ઢીલ થયેલ
belch/બેલ્ચ/ઓડકાર ખાવો
beleaguered/બિલીગર્ડ/ઘેરાએલું, ગ્રસ્ત
belie/બીલાય/જૂઠું પાડવું, બોલવું
belief/બિલીફ/માન્યતા
believe in-માં વિશ્વાસ કરવો-માનવું
believe/બિલીવ/માનવું
belittle/બિલિટલ/હલકું પાડવું, ઉતારી પાડવું
bell/બેલ/ઘંટડી, ટોકરી, ઘંટ
bellicose/બેલિકોસ/ઝઘડાખોર
belligerence/બેલિગરન્સ/યુધ્ધારૂઠ, હડાયકપણું
belligerent
bellows/બિલોઝ/ધમણ
belly/બે /
belong in-
belong on-
belong to/બિલોંગ ટુ/ના વતની-માલિકીનું હોવું
below/બીલોઉ/નીચે
belt out-મોટેથી ગાવું કે વગાડવું
belt up-ચૂપ થવું
belt/બેલ્ટ/પટો, પટ્ટી
bemoan/બીમોન/બેદ-દુઃખ વ્યક્ત કરવું
bemused/બિમ્યુઝડ/તલ્લીન, મુઝવણમાં
bench/બેન્ચ/પાટલી
benchmark/બેન્ચમાર્ક/માનદંડ, કસોટી
bend/બેન્ડ/વાળવું, વળવું
beneath/બિનીથ/નીચે
benediction/બેનિડિકશન/કૃપા, દયા
benefactor/બેનિફક્ટર/દાતા, આશ્રયઆપનાર
beneficent/બેનિફિશન્ટ/પરોપકારી
beneficial/બેનિફિશ્યલ/લાભ-ફાયદાકારક
beneficiary/બેનિફિશ્યરિ/લાભાર્થી
benefit/બેનિફિટ/લાભ, ફાયદો
benevolence/બેનિવોલન્સ/દયા, ભલાઈ
benevolent/બેનિવોલન્ટ/દયાળુ, પરોપકારી
benign/બિનાઈન/દયાળુ, કૃપાળુ
benison/બેનિસન/આર્શિવાદ, ઓચિતો લાભ, કૃપા
bent on/બેન્ટ ઓન/કૃતનિશ્ચયી, વળેલું
bequeath/બિકવીથ/વારસામાં આપવું
bequest/બિકવેસ્ટ/વારસાગત(વસ્તુ)
berate/બિરેઈટ/ઓછી કિમત આંકવી
bereaved/બિરીવ્ડ/નોઘારું, ના વિનાનું
bereavement/બિરીવમન્ટ/નોઘારાપણું
bereft/બિરેફ્ટ/થી વિહોણું

berry/બેરી/બોર, નાનાં ફળ
berserk/બર્સર્ક/ઝનૂની, જંગલી
berth/બર્થ/સ્થાન, સૂવાનું પાટિયું, નિમણુંક
beseech/બીસીચ/આજીજી-કાલાવાલાં કરવા
beset/બીસેટ/ઘેરાઈ જવું, હુમલો થવો
beside/બિસાઈડ/બાજુમાં
besides/બિસાઈડ્સ/તદ્ ઉપરાંત
besiege/બિસીજ/ઘેરો ઘાલવો, મોરચો માંડવો
besmear/બિસ્મીઅર/ચોપડવું
besmirch/બિસ્મર્ચ/ગંદુ કરવું, ડાઘા કરવાં
bespectacled/બિસ્પેટેકલ્ડ/ચશ્માવાળું
best/બેસ્ટ/સર્વશ્રેષ્ઠ, સર્વોત્તમ
bestial/બિસ્ટીઅલ/પશુ જેવું
bestow/બિસ્ટો/અર્પણ કરવું
bet/બેટ/શરત લગાડવી
bete noire/બેટનૂવાર/અણગમતું
betray/બિટ્રે/દગો દેવો
 betroth/બિટ્રોથ/સગાઈ કરવી
 betrothal/બિટ્રોથલ/સગાઈ
 better/બ /
 between/બિટવીન/બે ની વચ્ચે
 beverage/બિવેજ/પીણું
 bevy/બિવિ/ટોળું, મંડળી
 beware/બિવૅર/સાવધ થવું
 bewilder/બિવિલ્ડર/ગુંચવણમાં નાખવું
 bewitched/બિવિચ્ડ/ મેલી વિદ્યાવાળું
 beyond/બિયોન્ડ/થી આગળ
 biannual/બાઈએન્યુઅલ/વર્ષમાં બે વાર
 bias/બાયસ/પક્ષપાત, ભેદભાવ
 bib/બિબ/દારૂ ઢીંચવો, લાળિયું
 biblical/બિબ્લિકલ/બાઈબલ ને લગતું
 bibliography/બિબ્લીઓગ્રાફી/સંદર્ભ સૂચી
 bicameral/બાયકેમેરલ/બે ગૃહો વાળું
 biceps/બાયસેપ/દ્વિ પાંખીયુ
 bicker/બિક/ઝઘડો-કજિયો કરવો
 bickering/બિકરિંગ/ઝઘડો, કજિયો
 bicycle/બાયસિકલ/સાયકલ
 bid/બિડ/અભિવાદન-હુકમ કરવું, કોશિષ, બોલી (હરરાજી)
 biennial/બાયએનિયલ/દ્વિવાર્ષિક
 bier/બિઅર/નનામી, ઠાઠડી
 biff/બિફ/ફટકો, તમાચો
 bifocal/બાયફોકલ/દ્વિકેન્દ્રી (ચશ્મા)
 bifurcate/બાયફરકેઈટ/બે ફાંટા કરવા
 big/બિગ/મોટું
 bigamy/બાયગેમી/દ્વિપત્ની પ્રથા
 bigot/બિગોટ/ધર્મધ
 bigotry/બિગોટ્રી/ધર્મધતા
 bigwig/બિગવિગ/બેરખાં, મોટામાથાં
 bijou jewel
 bike/બાઈક/સાયકલ

bilateral/બાયલેટરલ/દ્વિપક્ષી
 bilingual/બાયલિંગ્યુઅલ/દ્વિભાષી
 bilious
 bill/બિલ્ક/ ઠગ, ઘુતારો
 bill/બિલ/પાવતી, ખરડો
 billet doux/બિલેડુ/પ્રેમપત્ર
 billous
 billow/બિલો/પાણીના મોજા જેવું
 bimbo/બિમ્બો/લટકા-મટકા વાળી સ્ત્રી
 bimonthly/બ /
 bin/બિન/કચરાપેટી
 binary/બાયનરિ/દ્વિઅંકી
 bind over-કાયદેસર રીતે ચેતવવું
 bind/બાઈન્ડ/બાંધવું
 bing/બિન્ગ/છાકટું, અતિરેક, શરાબની મહેફિલ
 binoculars/બીનોક્યુલર્સ/બે કાય વાળું દૂરબીન
 biodegradable/બાયોડિગ્રેડેબલ/સડીને નાશ પામતું
 biographical/બાયોગ્રાફિકલ/જીવનચરિત્રનું
 biography/બાયોગ્રાફી/જીવનચરિત્ર
 biopsy/બાયોપ્સિ/કોષપરીક્ષણ
 biped/બાયપેડ/બે પગું
 bird/બર્ડ/પક્ષી
 birth/બર્થ/જન્મ
 biscuit/બિસ્કીટ/બિસ્કીટ
 bisect/બાયસેક્ટ/બે ભાગ પાડવા
 bistro/બિસ્તરો/સસ્તું નાસ્તાગૃહ
 bit/બીટ/થોડું, કરડ્યું/પાનું(ઘાતુ)
 bitch/બિચ/કૂતરી
 bite/બાઈટ/ખટકવું, કરડવું, બચકું ભરવું
 bitter/બિટર/કડવું, સખત
 bitterness/બિટરનેસ/કડવાસ, સખત
 bitumen/બિટ્યુમન/શિલાજીત
 bivouac/બિવુઅક/કામચલાઉ રહેઠાણ
 bizarre/બિઝાર/વિચિત્ર, ભયપ્રેરક, બિહામણું
 blab/બ્લેબ/છુપી વાત બકી નાખવી
 black out-બેભાન થવું, અંધારપટ
 black/બ્લેક/કાળું
 blacken/બ્લેકન/કાળું કરવું
 blacklist/બ્લેકલિસ્ટ/સજાપાત્ર યાદી
 blade/બ્લેડ/ધાર, પતરી, પાંખ
 blame/બ્લેમ/દોષ-દેવો
 blanch
 bland
 blandishment
 blank/બ્લેન્ક/કોરૂ, ખાલી જગ્યા
 blarney/બ્લેર્ની/ખુશામત
 blasé/બ્લાઝ/બેફામ, બેફિકર
 blasphemous/બ્લાસફેમસ/ધર્મધ,
 blasphemy/બ્લાસફેમી/ઈશ્વર નિંદા, ધર્મધતા
 blast off-છોડવું(રોકેટ)
 blast/બ્લાસ્ટ/ધમાકો, ભડાકો ઘડાકો, સખત ટીકા કરવી

blatant/બ્લૅટન્ટ/બેશરમ
blaze away-ગોળી વરસાવવી
blaze/બ્લેઈઝ/ક્રોધ, આગ, ભડકો, ચોમેર ફેલાવું
blazon/બ્લેઝન/આગવું
bleak/બ્લીક/વેરાન, ઉજ્જડ, અંધકારમય
bleed/બ્લીડ/રક્તસ્ત્રાવ થવો
blemish/બ્લેમિશ/ખામી, ત્રુટિ, કલંક
blend/બ્લેન્ડ/મિશ્રણ કરવું, ભેળવવું
bless/બ્લેસ/આર્શિવાદ આપવા
blew/બ્લ્યુ/ફૂંક મારી, ફૂંકાવું
blighted
blighter/બ્લાઈટર/સરેવું, ઉપદ્રવકારક
blind/બ્લાઈન્ડ/આંધળું
blink at-અવગણવું
blink away-અદૃશ્ય કરી દેવું
blink/બ્લિન્ક/ઝબકવું, પલકારા થવા
blinkers/બ્લીન્કર્સ/આંખો ના પરદા(ધોડા)
blister/બ્લિસ્ટર/ફોલ્લાં
blithe/બ્લાઈઠ/આનંદવિભોર, મોજીલું
blitz/બ્લિટ્ઝ/વિનાશક હુમલો
blitzkrieg/બ્લીટ્ઝક્રીગ/હુમલો, સપાટો
bloat
bloated
bloc/બ્લોક/મિશ્ર, મોરચો
block in-અટકાવવું
block off-આડચ ઊભી કરવી
block up-ડાટો લાગવો
block/બ્લોક/કમરો, રોકવું, ખંડ, ભાગ અવરોધવું
blockade/બ્લોકેઈડ/નાકાબંધી
block-buster/બ્લોકબસ્ટર/ધૂમ મચાવનાર
blockhead/બ્લોકહેડ/અણધડ, જડભરત, ભોટ
bloke/બ્લોક/જણ, વ્યક્તિ
blonde/બ્લોન્ડ/સોનેરી વાળ(ગોરી સ્ત્રી)
blood/બ્લડ/લોહી, રક્ત
blood-letting/બ્લડલેટિંગ/લોહીયાળ, રક્તપાત
bloody/બ્લડી/લોહિયાળ, ફૂર, દુષ્ટ, ખૂનખાર
bloom/બ્લૂમ/ખીલવું, વસંત આવવી
bloomer/બ્લૂમર/છબરડો, ગોટો
blooper/બ્લૂપર/છબરડો, ગોટો
blossom out-ઉભરવું
blossom/બ્લોઝમ/ફુલો બેસવાં, યુવાની
blot out-ભૂંસી નાખવું
blot/બ્લોટ/ડાઘ, કલંક, ચૂસવું
blouse/બ્લાઉઝ/પોલડું
blow in-નાશ થવો
blow off-ઉડી જવું(હવા)
blow out/બ્લો-આઉટ/ફૂંકી મારવું, ઓલવાઈ જવું
blow over-નીચે પડવું, અંત આવવો
blow up-ધમાકો થવો, મોટું કરવું
blow/બ્લો/ધા, જટકો, ફટકો, ફુંકાવું

blowhard/બ્લોહાર્ડ/બડાઈખોર
blow-up/બ્લો-અપ/મોટું ચિત્ર, મોટું બનાવવું
bludgeon/બ્લડ્જન/લાકડી થી ફટકારવું
blue/બ્લુ/વાદળી રંગ
blue-chip/બ્લુચીપ/શાખપાત્ર, સધ્ધર
blue-eyed/બ્લુઆઈડ/લાડકો-માનીતો
blue-print
bluff out-છટકી જવું(ચાલાકી)
bluff/બ્લફ/પોકળ ધમકી
blunder/બ્લંડર/છબરડો, ગોટો
blunderbuss/બ્લંડરબસ/જુનવાણી બંદુક
blunt/બ્લન્ટ/બૂટું, તોછડું, નકામું બનાવવું
blur/બ્લર/ડાઘ, ઝાંખુ થવું
blurb/બ્લર્બ/પુસ્તક વિષે નોંધ-પરિચય
blurred/બ્લર્ડ/ઝાંખું, ધૂંધળું
blurt/બ્લર્ટ/ભરડવું (ભાષા)
blush/બ્લશ/શરમાવું
bluster/બ્લસ્ટર/ભપકાદાર કે પોકળ
boar/બોર/જંગલી ડુકકર(શિંગડા વાળું)
board in/up-અટકાવવું
board/બોર્ડ/મંડળ, પાટિયું, આરોહણ કરવુંચઢવું
boast/બોઉસ્ટ/બડાઈ હાંકવી
boat/બોટ/હોડી, નૌકા
bob/બોબ/ઝોલાખાવાં
bobby/બોબી/લંડનનો પોલીસ
bobitise/બોબિટાઈઝ/ગુપ્તાંગ વિચ્છેદકરવો
bode/બોડ/
body/બોડી/શરીર, સંસ્થા, મૃતદેહ
body-politic/બોડીપોલિટિક/રાષ્ટ્ર
boffin/બોફિન/સંશોધક-વૈજ્ઞાનિક
bog down/બોગડાઉન/પટકાવું, કાઢવમાં ખૂંસી જવું
bogey/બોગી/ટ્રેઈનનો ડબ્બો
boggle/બોગલ/મુંઝવવું, પટકાઈ પડવું
bogie/બોગી/
bogus/બોગસ/બનાવટી, દંભી
bohemian/બોહેમીઅન/અવધૂત, મુકતાચારી
boil down to-ની બરાબર હોવું
boil up-ગરમ કરવું
boil/બોઈલ/ઉકળવું, ગૂમડું
boisterous/બોઈસ્ટરસ/ઘોંઘાટિયું, ખડખડાટ
bold/બોલ્ડ/બહાદુર
bollywood/બોલિવુડ/ફિલ્મી જગત
bolster/બોલ્સ્ટર/ટિકો આપવો
bolt down-નીચે પટકાવું
bolt/બોલ્ટ/વણ્ટવું, સાંકળ દેવી, દોટ મૂકવી
bomb/બોમ/બોમ્બ
bombard/બોમ્બાર્ડ/બોમ-તોપમારો કરવો
bombardment/બોમ્બાર્ડમન્ટ/બોમ-તોપમારો
bombast આડંબરી ભાષા વાપરવી
bombastic/બોમ્બાસ્ટિક/આડંબરી ભાષા

bon mot/બોનમોટ/ચતુર-રમુજી વક્તવ્ય
bon vivant/બો વિવાં/ખાઉધરૂ
bon voyage/બોવવાયેજ/મંગલ યાત્રા
bonafide/બોનાફાઈડ/પ્રમાણિત, સાચું, ખરું
bonafides/બોનાફાઈડ્ઝ/સચ્ચાઈ, શુદ્ધ દાનત
bonanza/બોનાન્ઝા/વિપુલ ખજાનો-ઈનામ
bonbon/બોનબોન/લોલીપોપ (મીઠાઈ)
bond/બોન્ડ/કરાર, બંધન, મર્યાદા, જોડાણ
bondage/બોન્ડિજ/બંધન, ગુલામી
bonded/બોન્ડ્ઝ/બંધિવાન, બંધાયેલું
bone up on-અભ્યાસ કરવો
bone/બોન/હાડકું
boner/બોનર/મુખામી ભરેલી ભૂલ, છબરડો
bongo/બોન્ગો/ઢોલક વગેરે
bonhomie/બોનમી/ખુશહાલી
bonkers/બોન્કર્ઝ/નરાધમ ગાંડુ
bonny/બોની/તંદુરસ્ત, સુંદર
bonsai/બોન્સાઈ/લઘુસ્વરૂપે મોટુંઝાડ
bony/બોનિ/સુકલકડી
bonzer/બોન્ઝર/મજાનો માણસ
boob/બૂબ/મુખામી ભરેલી ભૂલ, છબરડો
booby trap/બૂબિટ્રેપ/ફસાવવાની યુક્તિ
booby/બૂબિ/મૂર્ખ, અણધડ
boogie-woogie/બૂગીવૂગી/સંગીત-નૃત્ય
book in-આગમનની નોંધ કરવી
book out-વિદાયની નોંધ કરવી
book up-આરક્ષણ કરવું
book/બુક/ચોપડી, ઘરપકડ થવી, નોંધાવવું
boom/બૂમ/તેજી, ગર્જના, માંગ
boomerang/બૂમરૅંગ/કરનાર માથે આવી પડવું
boon/બૂન/વરદાન
boorish/બૂરિશ/અણધડ, ગમાર
boost/બૂસ્ટ/જુસ્સો-મૂલ્ય વધારવું, વધારો
boot up-ફ્લોપી ધી ચાલુ કરવું (કમ્પ્યુ)
boot/બૂટ/જોડું, ગાડીની ડેકી
booth/બૂથ/રાવટી, કુટિર
bootlegger/બૂટલેગર/દારૂ ની હેરાફેરી કરનાર
bootless/બૂટલેસ/નિરર્થક, વ્યર્થ
booty/બૂટી/લૂંટ નો માલ
booze/બૂઝ/દારૂ-ઢીંચવો
border/બોર્ડર/સિમા, હદ, કિનારી
bore/બોર/કાણું પાડવું, કંટાળો આવવો
boredom/બોરડમ/કંટાળો
born/બોર્ન/જન્મેલું
borne/બોર્ન/ધારણ-ઉચકાયેલું
borrow from-પાસેથી ઉછીનું લેવું
borrow/બોરો/ઉછીનું લેવું
bosh/બૉશ/બકવાસ
bosom/બૂઝમ/છાતી, જીગર
boss around/બૉસ અરાઉન્ડ/કાંકા ફોજદારી કરવી

boss/બૉસ/સરદાર, શેઠ, સાહેબ, વડો, ઉપસેલો ભાગ
botch/બૉચ/ખરાબ રીતે કરવું, બગાડવું
both/બોથ/બન્ને
bother/બોધર/ફિકર, ચિંતા, તકલીફ
bottle up-અંદર દબાવી રાખવી (લાગણી)
bottle/બોટલ/શીશી
bottleneck/બૉટલનેક/ભીંસ-સંકડાશ થવી
bottom out-તળિયે પહોંચવું
bottom/બોટમ/તળિયું
bough/બાઉઝાડની ડાળી
bought/બૉટ/ખરીદ્યું
bouillon
boulder/બોલ્ડર/ગડબો, ખડકનો ટુકડો
bounce/બાઉન્સ/તરાપ, ઉછળવું, પાછું ફરવું
bound for/બાઉન્ડ ફૉર/ની તરફ જતું
bound/બાઉન્ડ/બંધાયેલું, દોટ મૂકવી
boundaries/બાઉન્ડરીઝ/સીમાઓ, મર્યાદાઓ
boundless
bountiful/બાઉન્ટિફુલ/પુષ્કળતા, વિપુલતા
bounty/બાઉન્ટિ/પુષ્કળ, વિપુલ
bouquet/બુકે/ગુલદસ્તો
bourgeois/બૂર્જવા/મધ્યમવર્ગ, જનતા
bourse/બોર્સ/નાણાંબજાર
bout/બાઉટ/ઊભરો, હુમલો
boutique/બુટિક/નાની દુકાન (ફેશન)
bovine/બોવિન/જડ, મંદ
bow out-ઝૂકી જવું, શરણે થવું
bow/બોઉ/નમન કરવું, ધનુષ
bowdlerise/બોઉલ્ડરાઈઝ/વાંધાજનક શબ્દો રદ્દકરવા
bowel/બૉવલ/હોજરી, આંતરડા
bowels/બ /
bowl out-હરાવી દેવું
bowl over-પછાડવું
bowl/બોલ/વાટકો, કટોરી, દડો ફેંકવો
box in-ઘેરી લેવું
box/બોક્ષ/મૂકકો, પેટી, ચોકકું
boy/બૉય/છોકરો
boycott/બૉયકૉટ/બહિષ્કાર કરવો
bozo/બોઝો/મૂર્ખ, અકકલમકું
bra/કોબ્રા/ઝેરી સાપ
brace/બ્રેઈસ/સજ્જ થવું-કરવું
brag/બ્રૅગ/બડાઈ-ડંકાશ મારવી
braggadocio/બ્રૅગડૉશિઓ/બડાઈખોર
brain/બ્રેઈન/મગજ
brain-child/બ્રેઈનચાઈલ્ડ/મગજની પેદાશ, માનસ પુત્ર
brain-storming/બ્રેઈનસ્ટોર્મિંગ/ગરમ વિચાર વિમર્શ
brake/બ્રેક/રોક, અવરોધક
brakes/બ /
branch off-ફંટાવવું
branch out-વૈવિધ્યકરણ કરવું

branch/બ્રાન્ચ/શાખા, ડાળી
brand/બ્રાન્ડ/છાપ, ડામ
branding/બ્રેન્ડિંગ/ડામ, છાપ મારવી
brandish/બ્રેન્ડિશ/ફેરવતું, વિંઝતું
brash/બ્રેશ/દુરાગ્રહી, ઉદ્ધત
brass/બ્રાસ/પીત્તળ
brassy/બ્રાસિ/પિત્તળનું, બેશરમ
bratpack/બ્રેટપેક/વંદેલ-ઉદ્ધત છોકરું
bravado/બ્રેવાડો/ડંકાશ, બહાદુરીનો દેખાવ
brave out/બ્રેવ આઉટ/સામનો કરવો, પડકારવું
brave/બ્રેવ/બહાદુર, શૂરવીર, પડકાર ઝીલવો
brawn/બ્રૉન/સ્નાયુ, બાંધો
brawny/બ્રૉનિ/સશક્ત, સ્નાયુબદ્ધ
bray/બ્રે/ગધેડાનું ભીકવું
brazen out-
brazen/બ્રેઝન/બેશરમ
breach/બ્રીચ/ભંગ, ભંગાણ, તીરાડ
bread/બ્રેડ/પાંઉરોટી
breadth/બ્રેથ/પહોળાઈ
break away-છટકવું, છૂટું પડવું
break down/બ્રેક ડાઉન/તુટી પડવું, ખરાબ થઈ જવું
break down-બગડી જવું (ગાડી)
break in/બ /
break into/બ્રેક ઇન્ટુ/જબરદસ્તી ઘુસવું
break into-ઘર ફોડી કરવી (ઘુસવું)
break in-અવરોધવું
break off-છૂટું પડવું
break out/બ /
break out/બ્રેકઆઉટ/ફાટી નિકળવું
break the ice/બ્રેક ધિ આઈસ/વાત-પહેલ કરવી
break up-ટુકડા થવાં
break/બ્રેક/તુટવું, ભાંગવું, વિરામ
breakfast/બ /
break-through/બ્રેક થ્રુ/નોંધપાત્ર પ્રગતિ
breast/બ્રેસ્ટ/છાતી, સ્તન
breath/બ્રેથ/સ્વાસ
breathe/બ /
breathe/બ્રીથ/સ્વાસ લેવો
breather/બ્રીથર/થોડોક વિરામ-આરામ, રાહત
breech/બ્રીચ/
breed/બ્રીડ/ઉછેરવું, જાત, ઓલાદ
breeze/બ્રીઝ/હવાની લહેર
brevice/બ્રિવિટિ/સંક્ષિપ્તતા, ટૂંકાણ
brew/બ્રુ/ઉકળવું, દારૂ ગાળવો
brewery/બ્રુઅરિ/દારૂની ભઠી
brewing up/બ્રુઈંગ અપ/ઉકળવું
bribe/બ્રાઈબ/લાંચ, રૂશવત, કટકી, તોડ
brick/બ્રિક/ઈંટ
bridal/બ્રાઈડલ/દુલ્હનનું
bride/બ્રાઈડ/દુલ્હન

bridge/બ્રિજ/સેતુ, પુલ, નાળું, જોડવું
bridle/બ્રિડલ/ચાબૂક, કોરડો
brief/બ્રિફ/ટૂંકું, સંક્ષિપ્ત
brigade/બ્રિગેડ/લશ્કરી દળ-ટુકડી
bright/બ્રાઈટ/ચળકતું, તેજસ્વી
brilliant/બ્રિલિઅન્ટ/તેજસ્વી, ચળકતું, હોંશિયાર
brim/બ્રિમ/ધાર, કાંઠો
brimming/બ્રિમ/
brimstone/બ્રીમસ્ટોન/ગંધક
brindled
bring about/બ્રિંગ/થવા દેવું, કરવું
bring about-કરવું
bring around/બ /
bring back-
bring down-
bring in/બ /
bring off/બ /
bring on-
bring out/બ /
bring round/બ /
bring round-વું
bring to book/બ્રિંગ/કાયદેસર પગલા લેવાં
bring up/બ્રિંગ/ઉછેરવું, કેળવવું, મોટું કરવું
bring/બ્રિંગ/લાવવું
brink/બ્રિંક/ધાર, કિનાર
brinkmanship ધર્ષણ ટાળવા સલામતી સ્થાપવી
brisk/બ્રિસ્ક/ઝડપી, ફટાફટ
bristling/બ્રિસલિંગ/કડક ઉભું રહેતું
brittle/બ્રિટલ/બટકણું
broach/બ્રોચ/ઓજાર
broad/બ્રોડ/પહોળું
broadcast/બ્રોડકાસ્ટ/પ્રસારણ કરવું
broaden/બ્રોડન/પહોળું કરવું
broadminded/બ્રોડમાઈન્ડિડ/મોટા મનનું
brocade/બ્રોકેડ/રેશમ-ઝરીકામ
brochure/બ્રોચર/માહિતી પુસ્તિકા
broke/બ્રોક/કડકો, દેવાળિયો, નિર્ધન
broker/બ્રોકર/દલાલ, વચચેટિયો, મધ્યસ્થી કરવી
broolly/બ્રોલિ/છત્રી
bronze/બ્રોન્ઝ/કાંસાનું
brooch/બ્રુચ/બિલ્લો-બકલ પિન
brood/બ્રુડ/મનન કરવું વિચારવું
brook/બ્રુક/ઝરણું, સહન કરવું, ચલાવી લેવું
brooking/બ્રુકિંગ/સહનશક્તિ
broom/બ /
broom/બ્રૂમ/સાવરણી
brothel/બ્રોથેલ/વેશ્યાગૃહ
brother/બ્રધર/ભાઈ, સાથી
brouhaha/બ્રુહાહા/દિકારો, ગોકીરો, ધમાલ
brow/બ્રાઉ/બમ્મર

browbeat/બ્રાઉબીટ/દબડાવવું, ધમકાવવું
brown off-વું
brown/બ્રાઉન/ભુરું
browse/બ્રાઉઝ/ફાંફાં મારવા, શોધવું
bruise/બ્રુઈઝ/ઉઝરડાં
bruit/બ્રુઈટ/અફવા ફેલાવવી
brunch/બ્રંચ/લંચ-નાસ્તો સાથે
brunette/બ્રુનેટ/ભુરા વાળ વાળી ગોરી સ્ત્રી
brunt/બ્રન્ટ/આઘાત, ફટકો, ઘા
brush aside-વું
brush up-તાજું કરવું
brush/બ્રશ/પીંછી
brusque/બ્રસ્ક/તોછડું
brutal/બ્રુટલ/ઘાતકી, ક્રૂર
brutality/બ્રુટલિટી/બર્બરતા, જંગાલિયત
brutally/બ્રુટલિ/ક્રૂરતા પુર્વક
brute/બ્રુટ/પશુ સમાન, જંગલી
bubble/બબલ/પરપોટો
buccaneer/બુકાનીઅર/ચાંચિયો
buck up-ઉતાવળ કરવી
buck/બક/કાળિયાર, પૈસા
bucket down-ઘોઘમાર વરસવું
bucket/બ /
buckle down/to-વું
buckle/બકલ/પટ્ટો બાંધવો, સજ્જ થવું
bucks/બકસ/ડોલર, પૈસા
bucolic/બ્યુકોલિક/ગોવાળોનું, ગ્રામ્ય
bud/બડ/કળી, ખીલતું, ઉગવું
buddy/બડિ/દોસ્ત, યાર, મિત્ર, ભાઈબંધ
budget/બજ/ખસવું, ચલિત થવું
buff/બફ/ચમકાવવું, મખમલ, ઉત્સાહી માણસ
buffalo/બફલો/ભેંસ
buffer/બફર/આંચકા રોધક, તટસ્થ
buffoon/બફૂન/વિદૂષક, ડાગલો
buffoonery/બફૂનરિ/વિદૂષકવેડા,
bug/બગ/માંકડ, જાસૂસી કરવી, ખોટકો, ભૂલ
bugaboo/બગ્બૂ/ત્રાસ, હાઉ
bugbear/બગબેર/હાઉ, માથાના દુઃખાવારૂપ
bugger/બગર/અશિષ્ટ ઉદ્દગાર
build on-વું
build up-વું
build/બિલ્ડ/ચણવું
bulb/બ /
bulb/બલ્બ/ગોળો
bulge/બલ્જ/ઉપસવું, ફૂલાવું
bulk/બલ્ક/જથ્થો
bulky/બલ્કિ/કદાવર, તોતિંગ, મોટા કદનું
bull/બુલ/આખલો
bulldoze/બુલડોઝ/ધમકાવવું
bullet/બુલેટ/બંદૂકની ગોળી

bulletin/બુલેટિન/અહેવાલ, પત્રિકા
bullion/બુલીઅન/સોના કે ચાંદી ની લગડી
bullish/બુલિશ/તેજનું વલણ (શેર બજાર)
bull-shit/બુલશિટ/બકવાશ, કચરો, વ્યર્થ વસ્તુ
bully/બુલિ/ગુંડો, દાદો, દાદાગીરી કરવી
bulwark/બુલવર્ક/રક્ષણાત્મક આડસ
bum/બમ/રખડેલ, બદમાશ
bump into-વું
bump off-વું
bump up-વું
bump/બમ્પ/રોદો
bumptious
bun/બન/પાંઉ
bunch/બંચ/ઝુમખું
bundle off-વું
bundle/બંડલ/થોકડી, પોટલું
bung up-વું
bung/બંગ/ડાટો મારવો
bungle/બંગલ/લોચો મારવો, બગાડવું
bunk/બંક/ગાપચી મારવી, ઘતિંગ
bunker/બંકર/ભોંયરૂ
bunkum/બન્કમ/બકવાસ, ફાલતું
buoy/બોય/તરતી નિશાની
buoyancy/બોયઅન્સિ/ઊંચાઈ, તેજ, ચમક, ઉછાળો
buoyant/બોયઅન્ટ/તરતું રહેતું, ચમકતું ન્સિ
burden/બર્ડન/બોજો
bureaucracy/બ્યુરોક્રસિ/ અમલદારશાહી
bureaucrat/બ્યુરોક્રેટ/ સરકારી અમલદાર
burgeon/બર્જન/ઝડપથી વધવું
burglar/બર્ગલર/ઘરફડુ
burglary/બર્ગલરિ/ઘરફોડી
burial/બેરિઅલ/દફનવિધિ
burlesque/બર્લેસ્ક/પ્રહર્સન, ઠહામશકરી નાટક
burly/બર્લી/કદાવર
burn down-વું
burn out-વું
burn up-વું
burn/બર્ન/સળગવું
burnish/બર્નિશ/ઘસીને ચમકાવવું
burrow/બરો/ભોણ, દર માં ભરાઈ રહેવું
burst into-વું
burst out-વું
burst/બર્સ્ટ/ફાટવું
bury the hatchet ઝગડો ખતમ કરવો
bury/બેરી/દફન કરવું
bus/બસ/બસ
bush/બુશ/છોડ
business/બિઝનેસ/ઘંઘો, વ્યવસાય
busk/બસ્ક/શેરીમાં ગાવું ફરવું
buss/બસ/

bust/બસ્ટ/છાતી, અર્ધપ્રતિમા,
bust/બસ્ટ/ભુકકા બોલાવવા, દેવાળિયું, નિષ્ફળ
busted/બસ્ટેડ/પર્દાફાસ કર્યો
bustle/બસલ/ધમાલ, દોડ ધામ
bustling/બસલિંગ/ધમધમતું
busy/બિઝી/વ્યસ્ત, રોકાયેલું
busybody/બિઝીબોડી/ડખલદેનાર, નડતરરૂપ
but for/બટ ફોર/ના વિના
but/બટ/પણ
butcher/બુચર/ખાટકી, કસાઈ
butt in-વું
butt/બટ/ઢૂંઢૂં, શિંગડુ મારવું, કુંદો, નિશાન
butter/બટર/માખણ
button/બ /
button/બટન/બટન
buttness//થાંભલો, ટેકો દેવો
buxom/બકઝમ/રૂષ્ટપુષ્ટ
buy into-વું
buy off-વું
buy out-વું
buy up-વું
buy/બાય/ખરીદવું
buzz off-વું
buzz/બઝ/ધરેરાટી, ઘોંઘાટ
buzz-word/બઝવર્ડ/પ્રચલિત સુત્ર
by/બાય/દ્વારા, બાજુમાં, વડે
bye/બાય/આવજો
by-election/બાયઈલેક્શન/પેટાચૂંટણી
by-gone/બાયગોન/વિતી ગયેલ
by-law/બાયલો/પેટા કાયદો
bypassizable
by-product/બાયપ્રોડક્ટ/આડપેદાશ
by-stander/બાયસ્ટેન્ડર/મૂક પ્રેક્ષક
byte/બાઈટ/કમ્પ્યુટર મેમરીનું ઘટક
byword/બાયવર્ડ/દાખલારૂપ, કહેવત
cab/કેબ/ટેક્સી
cabal/કેબલ/કાવતરૂં, કાવતરાખોર ટોળકી
cabbage/કેબેજ/કોબી
cabinet/કેબિનેટ/મંત્રીમંડળ, ખાના વાળી પેટી
cable/કેબલ/તાર, દોરડું
cache/કેશ/છુપો ભંડાર-જથ્થો
cack-handed/કેકહેન્ડેડ/અણધડ માણસ
cackle/કેકલ/બતકનો અવાજ
cacophonous/કેકોફોનસ/બેસૂરો અવાજ
cacophony
cad/કેડ/હલકટ માણસ
cadaver
cadaverous/કેડવરસ/મડદા જેવું
cadence/કેડન્સ/તાલ, ટેકો, લય
cadet/કેડેટ/લશ્કરી તાલિમાર્થી

cadge
cadmium/કેડમિયમ/સોનામાં સાંધવાની ધાતુ
cadre/કેડર/શ્રેણી, માળખું, કક્ષા
cafe/કેફે/અલ્પાહાર ગૃહ
cage/કેજ/પાંજરૂ
cagey/કેજી/સાવધ
caginess/કેજી/સાવધાની
cajole/કજોલ/પટાવવું, ફોસલાવવું
cake/કેક/કેક
cakewalk/કેકવૉક/સરળ-પોચું કાર્ય
calabash/કેલબેશ/કમંડલુ
calamity/કેલેમિટી/આફત, સંકટ
calculus/કેલ્ક્યુલસ/પથરી-છારી થવી
calculate/કેલ્ક્યુલેટ/ગણતરી કરવી
calendar/કેલેન્ડર/પંચાગ, રોજનીશી, ટીપણું
calf/કાફ/વાછરડું
caliber
calibrate/કેલિબ્રેટ/માપાંકન કરવું
calibre/કેલિબર/બુધ્ધિ, બંદુકનીનળી નું માપ
call (up) on-વું
call at/કૉલ ઍટ/સ્થળ ની મુલાકાત લેવી
call back-વું
call for/કૉલ ફૉર/હાકલ કરવી, અપીલ કરવી
call forth/ક /
call forth/કૉલફૉર્થ/
call in/કૉલઈન/પાછું બોલાવવું
call off/ક /
call off/કૉલઍફ/પાછું ખેંચવું
call on/કૉલઍન/મુલાકાત લેવી
call out-વું
call up-વું
call/કૉલ/બોલાવવું, હાકલ
calligraphy
callous/કેલસ/રીઠું, સંવેદનાવિહીન, બેશરમ
callow/કેલો/કાચું, બિનઅનુભવી
callshots/કૉલશૉટસ/ની બોલબાલા હોવી
calm down-વું
calm/કામ/શાંત, સ્વસ્થ, શાંતિનો કાળ
calmp down
calorie/કેલરિ/
calorific
calumny/કેલ્યુમ્ની/નિંદા, આળ, લાંછન
calypso
camaraderie/કેમરૉડરિ/બિરાદરી
came/કેઈમ/આવ્યો
camel/કેમલ/ગિંટ
cameo/કેમિઓ/ટૂંકો અભિનય
camera/કેમેરા/કેમેરા
camouflage/કેમોફલાજ/છલાવરણ
camp/કેમ્પ/મુકામ, પડાવ, છાવણી
campaign/કેમ્પેઈન/રુંબેશ, પ્રચાર-અભિયાન

camphor/કંખર/કપૂર
canard/કંનાડ/અકવા, ખોટી વાત
cancel/ક /
cancel/કંસલ/રદ કરવું
candid/કંનડિડ/નિખાલસ, પ્રમાણિક
candidature/કંનડિડ/ઉમેદવારી
candle/કંન્ડલ/મિશબતી
candor
candour/કંન્ડર/નિખાલસતા, પ્રમાણિકતા
candy/કંન્ડિ/મીઠાઈ, ખાંડની મિઠાઈ
cane/ક /
cane/કંઈન/વાંસ, નેતર, ફટકારવું
canine/કંનાઈન/રાક્ષસી દાંત, કૂતરા સંબંધી
canker/કંન્કર/
cannibal/કંનીબલ/માનવભક્ષી
cannon/કંનન/તોપ
canny/કંની/શઠ, ચાલક, ગણત્રીબાજ
canon/કંનન/માપદંડ, સિધ્ધાંત, નિયમ
canonisation
canopy/કંનપી/ચંદરવો, છત, આકાશ
cant/કંન્કટ/દંભ, ઢોંગ, ઢાળ, ખાસ ભાષા
cantankerous
cantata
canter/કંન્કટર/ઘોડાની ચાલ
canto
canvas/કંનવસ/જાડું કાપડ
canvass/કંનવાસ/પ્રચાર કરવો
cap/કંપ/ટોપી
capability/કંપેબિલિટી/શક્તિ, સામર્થ્ય
capable/કંપેબલ/સમર્થ
capacious/કંપેશિઅસ/ક્ષમતા, મોકળાશ વાળું
capacity/કંપેસિટિ/સંપ્રહશક્તિ, ક્ષમતા, હેસિયત
cap-a-pie
capillary
capital/કેપિટલ/મૂડી, ભંડોળ, રાજધાની, મોટું
capitalise/કેપિટલાઈઝ/લાભ ખાટવો
capitalist/કેપિટલિસ્ટ/મૂડીવાદી
capitulate/કેપિટ્યુલેઈટ/
caprice/કેપ્રિસ/તરંગ
capricious/કેપ્રિશસ/તરંગી
capsize/કેપસાઈઝ/પાણીમાં ઊંધું વળવું
captain/કેપ્ટન/કપ્તાન, નાવિક
captaincy/કેપ્ટન/કપ્તાનપદ
caption/કેપ્શન/મથાળું, લખાણ, લેખ
captious
captivate/કેપ્ટિવેઈટ/મંત્રમુગ્ધ કરવું
captive/કેપ્ટિવ/બંદિવાન, ગુલામ
captivity/કેપ્ટિવિટી/બંધન, કેદ
capture/કેપ્ચર/જીતી લેવું, ઝડપવું
car/ક /
carafe

carapace
carat/ક /
carat/કરેટ/(ચથિ)શુદ્ધતા આંક(સોનાચાંદી)
caravan/ક /
caravan/કરેવાન/કારવાં, વણજાર
carcass/કરેકસ/પ્રાણીનું હાડપિંજર
carcinogenic
carcinoma/કાર્સિનોમા/કિન્સર
card/કાર્ડ/પત્તું, પુંડું, પીંજવું
cardiac/કાર્ડિયાક/હૃદયનું
cardinal/કાર્ડિનલ/મૂળભૂત, પાયાનું
cardiology/કાર્ડિયોલજી/હૃદય વિજ્ઞાન
care about-
care for/ક /
care for-વું
care(ful-less)/ક /
care/કર/દરકાર, સાવચેતી
careen/કરીન/નમાવવું, ઝુકાવવું
career/કરીઅઃ/કારકિર્દી, વ્યવસાય
care-free/કર ફ્રી/બિનધાસ્ત, બેફિકર, મોજીવું
careful
caress/કરેસ/પંપાળવું
caretaker/કરેટર/કર/રખેવાળ
cargo/કાર્ગો/વિમાન-જહાજ માં મોકલાતો માલ
caricature
carillon
carnage/કાર્નિજ/કત્લેઆમ, નરસંહાર
carnal/કાર્નલ/દુન્યવી, શારીરિક
carnival/કાર્નિવલ/ઉત્સવ, ઉજાણી મેળો
carnivorous/કાર્નિવરસ/માંસભક્ષી
carousal
carouse/કરાઉઝ/દારૂની મહેફીલ
carping
carriage/ક /
carrier/કરિઅર/વાહક, ઉચકનાર, લઈ જનાર
carriion
carry away-વું
carry forward-વું
carry off જબરદસ્તી ઉઠાવી જવું
carry off/ક /
carry off-વું
carry on/ક /
carry on/કરિ ઓન/આગળ ધપાવવું
carry out/ક /
carry out/કરિ આઉટ/અમલ કરવો
carry through પાર પાડવું
carry through/ક /
carry/ક /
carry/કરી/ઉચકવું
cart/ક /
cart/કાર્ટ/ગાડું

carte blanche/કાર્ટબ્લાંશ/પીળો પરવાનો
cartel/કારટેલ/માલ ઉત્પાદકો નો સંઘ
cartographer/કાર્ટોગ્રાફર/નકશાકાર
carton/કાર્ટન/ખોખું, પેટી
cartoon/કાર્ટૂન/વ્યંગચિત્ર
carve out-વું
carve up-વું
carve/ક /
carve/કાર્વ/કોતરવું
cascade/કાસ્કેઇડ/પાણીનો ધોધ
cascading
case/ક /
case/કેઈસ/મુકદ્દમો, બાબત, ઘટના, પેટી
cash in on
cash in on/ક /
cash in-વું
cash/ક /
cash/કેશ/રોકડ, નકદ, નાણું
casino/કસિનો/જુગારખાનું
cassette/ક /
cassette/કસેટ/કેસેટ
cast away-વું
cast back-વું
cast off-વું
cast on-વું
cast/ક /
cast/કાસ્ટ/ઢાળવું, પાત્રવરણી, રેડવું, ફેંકવું
caste/ક /
caste/કાસ્ટ/જાતિ, જાતિ, વર્ગ
caster/ક /
castigate/કાસ્ટિગેટ/નો ઊધડો લેવો, ઝાટકવું
castigation
castle/ક /
castle/કાસલ/કિલ્લો
castor/કાસ્ટર/નાનું પૈડું, એરંડા
castrate/કાસ્ટ્રેટ/ખરી કરવી
casual/કેઝ્યુઅલ/આકસ્મિક, પ્રાસંગિક,
casualty/કેઝ્યુઆલટિ/મૃત્યુઆંક, ખુવારી
casuist/કેઝ્યુઈસ્ટ/વિતંડાવાદી
cat/ક /
cat/કેટ/બિલાડી
cataclysm/કેટાકલિઝમ/ઉથલપાથલ, વિનાશ
catalogue/કેટલોગ/સૂચિપત્ર
catalyst/કેટાલિસ્ટ/ઉદ્દીપક
catapult/કેટાપલ્ટ/જોરથી ઉપર ફેંકવું, ગોફણ
cataract/કેટરેક્ટ/જળધોધ, આંખનો મોતિયો
catarrh/કેટાર્રહ/શરદી, સળેખમ
catastrophe/કેટસ્ટ્રોફિ/ઉત્પાત, વિનાશ
catch at-વું
catch on/ક /

catch on-વું
catch out-વું
catch up-વું
catch/ક /
catch/કેચ/પકડવું, ઝીલવું
catch-22 વિરોધાભાષી પરિસ્થિતિ
catche/કેશ/છુપાવેલો જથ્થો
catechism
categorical/કેટેગોરિકલ/સ્પષ્ટ, નિરપવાદ
cater to/કેટર ટુ/પ્રબંધ કરવો, પુરું પાડવું
catharsis/કેથાસિસ/વિરોચન, ચિત્તશુદ્ધિ
cathartic
catholic કેથલિક/ઉદારતા વાળું, ખ્રિસ્તી ધર્મનું
cattle/કેટલ/પશુ, ઢોર
caucus/કોકસ/ચંડાળ ચોકડી, સંઘ
caught/ક /
caught/કેટ/પકડવું
caulk
causal/કૉઝલ/કારણદર્શક
cause celebre/કૉઝસેલિબર/ચકચારી મુકદ્દમો
cause/ક /
cause/કૉઝ/કારણ, નિમિત્ત બનવું
caustic
cauterise/કૉટેરાઈઝ/ડામ દેવો, બાળી નાખવું
caution/ક /
caution/કૉશન/ચેતવણી
cautious/કૉશસ/સાવચેત
cavalcade
cavalier/કેવેલિઅર/અશ્વદળ સૈનિક
cavalry/કેવેલરી/અશ્વદળ
cave in/કેઈવ ઈન/ધસી પડવું
cave in-વું
cave/ક /
cave/કેઈવ/ગુફા
caveat emptor ખરીદનાર સાવધાન
caveat/કેવિઅંટ/તાકીદ, ચેતવણી (કોર્ટ)
cavil/કેવિલ/વાંધા વચકા કાઢવા
cavort/કેવૉર્ટ/હડી કાઢવી, દોટ મૂકવી
cease/ક /
cease/સીજ/અટકવું
cease-fire/ક /
cease-fire/સીજફાયર/યુધ્ધવિરામ
cede/સીડ/આપી દેવું, છોડી દેવું
ceiling/ક /
ceiling/સીલિંગ/છત
celebrate/ક /
celebrate/સેલેબ્રેઈટ/ઉજવવું
celebrated
celebrity/સિલીબ્રિટિ/વિખ્યાત માણસ
celerity/સેલેરિટિ/ત્વરા, ઝડપ
celestial/સેલેશિઅલ/અલૌકિક, દેવી

celibacy/सेलिबसी/ब्रह्मचर्य
celibate
cell/क /
cell/सेल/कोष, कोटरी
cellar/क /
cellar/सेलर/भोंयरु
celluloid/सेल्युलोईड/कचकुंडू, फ़िल्मनी पट्टी
cement/क /
cement/सीमेंट/मजबूत करवुं
cemetery/सीमेंट्री/कब्रस्तान
cenotaph/सेनोटॉफ़/मृत्युलेख
ensor/सेन्सर/विचार-व्यवहार नियंत्रण
ensorious
censure//कपको
ensus/सेन्सस/वस्ती गणतरी
cent/क /
centaur/सेन्टॉर/किन्नर, नराश्व
centaure
centenary/सेन्टेनरि/शताब्दी, १०० वर्ष
centigrade
centimetre/क /
central/क /
central/सेन्ट्रल/केन्द्रिय
centre on-वुं
centre/क /
centre/सेन्टर/केन्द्र
centrifugal
centrifuge/सेन्ट्रिफ़्युज/केन्द्रत्यागी बण
centripetal
centurion
century/क /
century/सेनच्युरी/शतक
cerebral
erebration
eremonious
eremony/क /
eremony/सेरीमनी/औपचारिक विधी
certain/क /
certain/सर्टन/थोककस, निश्चित
certainly/क /
certify/सर्टिफ़ाय/प्रमाणित करवुं
cessation/सेसेशन/विराम, अंत
cession
cess-pool/सेसपूल/भाण-कूवो
chafe
chaff
chaffing
chagrin/शॉगरिन/भानभंग, अपमानित
chagrine
chain up-वुं
chain/चेईन/सांकण

chain/क /
chair(man-person)/क /
chair/चेअर/भुरसी
chalice
chalk up-वुं
chalk/चोक/चाक, भडी
chalk/क /
challenge/चैलेंज/पडकारवुं
challenge/क /
chameleon/कमीलियन/कांथीडो
champagne/शेम्पेईन/फ़ांसनी दारु
champion himayati
chance on-वुं
chance/चान्स/तक-उत्पीथवी
chance/क /
chandelier/शैंडलीयर/लुम्भर
change down-वुं
change over-वुं
change up-वुं
change/चेईनज/बदलावुं
change/क /
channel/चेनल/जणमार्ग, पट्टी, नडेर
chant/चान्ट/भजन गावुं, मंत्र बोलवो
chaos/क /
chaos/कईओस/अंधाधुंधी, अराजकता
chaotic
chap/चैप/व्यक्त, जण
chap/क /
character(istics)/क /
character/कैरैकटर/चारित्र्य
characterise/कैरैकटराईज/लक्षण, चरित्र देभाडवुं
characteristic/कैरैकटरिस्टिक/लक्षण, आगवुं
charade/शराड/बकवास, उभाणुं
charcoal/चारकोल/कोलसो
charcoal/क /
charge/चारज/आरोप, कब्जो, वसुलवुं, डल्लो करवो
charge/क /
chargesheet/चारजशीट/आरोपनामुं
chariot
charisma/करिजमा/प्रभाव, देन
charitable/चैरिटेबल/धर्मादानुं, धार्मिक
charity/क /
charlatan/शार्लटन/लेभाणु, धूतारो
charm/चारम/मंत्र, मोडकता, कामण
charm/क /
charmer
charming/चारमिर्ग/मोडक, कामण करवुं
charred/चारड/भाक थई गयेवुं
chart/चारट/नकशा, दोरवुं
chart/क /
charter/चारटर्/भतपत्र, सनड, डकक, भाडे करवुं

chary	cheque /ચેક/બેંકનો શાખપત્ર, ચેક
chase up-વું	cheque/ક /
chase /ચેઈઝ/પીછો કરવો	chequered ચડતી પડતી, ચોકડા વાળું
chase/ક /	cherish હૃદયમાં સંઘરવું, માણવું, પોષવું
chasm /કઝમ/ખાઈ, ખીણ	cherubic
chassis	chess /ચેસ/શતરંજ
chaste /ચેઈઝ/પવિત્ર, શુદ્ધ	chess/ક /
chasten	chest /ચેસ્ટ/પેટી, છાતી
chastened	chest/ક /
chastise /ચેસ્ટાઈઝ/પવિત્ર બનાવવું	chestnuts
chastity /ચેસ્ટિટી/પવિત્રતા, શુદ્ધતા, કૌમાર્ય	chevron /શેવરોન/v આકારની રેન્કપટ્ટી
chat up-વું	chew on-વું
chat /ચેટ/વાત વાતો કરવી	chew over-વું
chat/ક /	chew up-વું
chattel /ચેટલ/માલમતા, મિલકત	chew /ચ્યૂ/ચાવવું
chatter /ચેટર/બોલબોલ કરવું	chew/ક /
chatting /ચેટિંગ/વાતચીત કરવું	chic /શિક/ફાંકડું, આકર્ષક, મોહક
chauffeur /શોકર/ધંધાદારી કારચાલક	chicanery /શિકેનરી/કાવાદાવા, કપટ
chauvinism /શૉવિનિઝમ/અતિ-દેશપ્રેમ, સ્ત્રીનો પૂર્વગ્રહ	chick(en)/ક /
chauvinist	chicken out -પાછું હઠવું
chauvinistic /શૉવિનિસ્ટિક/કટ્ટર દેશપ્રેમી, સ્ત્રી-પૂર્વગ્રહી	chicken /ચિકન/મુર્ગીનું બચ્ચું
cheap /ચીપ/સસ્તું, હલકું	chide /ચાઈડ/કપકો આપવો
cheap/ક /	chief /ચીફ/મુખ્ય, મુખી, પ્રમુખ
cheat on-વું	chief/ક /
cheat /ચીટ/છેતરવું, ધુતારો, ઠગ	chilblain /ચિલ્બલેન/ફોલ્લો, વાઢિયો
cheat/ક /	child(hood)/ક /
check in/ક /	child /ચાઈલ્ડ/બાળક
check in -હોટેલ માં આવવું	childish /ચાઈલ્ડિશ/બાલિશ
check on/ક /	childish/ક /
check out - હોટેલ માંથી જવું	children/ક /
check out/ક /	chill/ક /
check through-વું	chill /ચિલ/ઠંડી, થીજી જવું, હળવાશ થી લેવું
check /ચેક/તપાસવું	chime /ચાઈમ/ઘડિયાળના ટકોરા ડંકા
check/ક /	chime/ક /
checkerred	chimera /કાઈમિઅર:/તૂત, આભાસ
cheek /ચીક/ગાલ	chimerical /કાઈમેરિકલ/નિરર્થક, ખોટું
cheek/ક /	chimney/ક /
cheeky /ચીકિ/તોછડું, ઉદ્ધત	chin/ક /
cheer on-વું	chin /ચિન/હડપચી
cheer up-વું	chip in /ચિપઈન/વચમાં બોલવું-રોકવું
cheer(ful)/ક /	chip in-વું
cheer /ચીઅર/આનંદનો ઉદ્ગાર	chip off-વું
cheered	chip/ક /
cheese /ચીઝ/ચીઝ	chip /ચિપ/કરચ, છોડિયું, કાતરી, પતરી
cheese/ક /	chirp /ચર્પ/પક્ષીનો કલરવ
chef /ચેફ/રસોઈયો	chisel /ચિઝલ/ઘડવું, કોતરવું, ટાંકણું
chef-d'oeuvre /શેઈદવરા/શ્રેષ્ઠકૃતિ	chivalrous /શિવલરસ/વીરતાપૂર્ણ
chemical/ક /	chocolate /ચોકલેઈટ/ચોકલેટ
chemical /કેમિકલ/રાસાયણિક	chocolate/ક /
chemistry/ક /	choice /ચોઈસ/પસંદગી
chemistry /કેમિસ્ટ્રી/રાસાયણશાસ્ત્ર	

choice/ક /
choir/કવાયર/ગાયકવુંદ
choke back-વું
choke up-વું
choke/ચોક/ગુંગળાવવું
choke/ક /
cholera/કોલેરા/કોગળિયું, કોલેરા
choleric
cholesterol/કોલેસ્ટ્રોલ/કોષોનું સ્ટેરોઇડ
choose/ચૂઝ/પસંદ કરવું
choose/ક /
chop/ચોપ/કાપી નાખવું, નાબુદી
chop/ક /
chopper/ચોપર/હેલિકોપ્ટર, મોટો છરો
choppy/ચોપી/
chord/કોર્ડ/ક /
chord/કોર્ડ/સ્વર, મેળ, દોરડું
chore/ચોર/ઘરકામ(રોજીંદુ)
choreography
chorus/કોરસ/સમુદ્ગાન
chronic/ક્રોનિક/લાંબી માંદગી
chronicle/ક્રોનિકલ/તવારીખ, ઇતિહાસ
chronology/ક્રોનોલજી/સમયપત્રક, કાળક્રમ
chubby/ચબી/ગાલગટીયા વાળું, રૂષ્ટપુષ્ટ
chuck in/up-વું
chuck/ચક/ /
chuckle/ચકલ/મોઢું દાબીને હસવું
chug along-વું
chum/ચમ/લંગોટિયો મિત્ર, ગોઠિયો
chum/ક /
chunk/ચંક/ભાગ, કકડો
church/ચર્ચ/દિવળ
church/ક /
churlish જંગલી, અણઘડ
churn out/ચર્ન/આઉટ/જથ્થાબંધ ઉત્પાદન કરવું
churn/ચર્ન/વલોવવું મંથન કરવું, જેરવું
chute/ચૂટ/
chute/ક /
chutzpah/ચુટપા/બેશરમ ભરી હિમ્મત
ciao/ચાઉ/આવો, આવજો
cicada/સિકાડા/તમરાં(જીવડું)
cigarette/ક /
cinch/સિન્ચ/સહેલી-નિશ્ચિત વાત
cinder/સિન્ડર/ચિનગારી
cinema/ક /
cinema/સિનેમા/ચલચિત્ર
cipher/સીફર/શૂન્ય
circa/સીરકા/ની તારીખ પહેલાનું
circle/ક /
circle/સર્કલ/ગોળ, મંડળ, ચક્ર

circlet
circuiting
circuitous
circular/ક /
circular/સર્ક્યુલર/ગોળ, પરિપત્ર
circulation/સર્ક્યુલેશન/ફેલાવો, પરિભ્રમણ
circumcise/સર્કમસાઈઝ/સુન્નત કરવી
circumlocution
circumscribe
circumspect/સર્કમસ્પેક્ટ/સાવચેતીપૂર્વક વર્તન
circumstantial/સર્કમસ્ટેન્શિયલ/સાંયોગિક
circumvent/સર્કમવેન્ટ/છેતરવું, ટાળવું
circus/ક /
circus/સરકસ/સરકસ
cissy/સિસિ/ડરપોક
cistern/સિસ્ટર્ન/પાણીની ટાંકી
citadel/સીટડેલ/કિલ્લો, સત્તાનું કેન્દ્ર
citation
cite/ક /
cite/સાઈટ/અવતરણ ટાંકવું, ઉલ્લેખ કરવો
citizen/ક /
citizen/સિટિઝન/નાગરિક
city/ક /
city/સિટિ/શહેર
civic/ક /
civic/સિવિક/નાગરીક, નગરનું, શહેરી
civil code
civil(isation)/ક /
civil/સિવિલ/નાગરિક-બાબત
civilise/સિવિલાઈઝ/સુસંસ્કૃત બનાવવું
civilised
civvy/સિવિ/નાગરિક
clabber/ક્લેબર/
clad/ક્લેડ/વસ્ત્રોમાં સજ્જ
claim/ક્લેઈમ/દાવો, ભોગ લેવો
claim/ક /
clairvoyance/ક્લેરવોયન્સ/ભવિષ્ય ભાખનાર
clairvoyant
clam up-વું
clamber
clamorous/ક્લેમરસ/ઘોંઘાટ, દેકારાવાળું
clamour
clamp down on-વું
clamp down/ક્લેમ્પ ડાઉન/તુટી પડવું
clamp down-વું
clamp/ક્લેમ્પ/પકડ માટે નો ચાપડો
clan/ક્લેન/વંશ, કુળ
clandestine/ક્લેન્ડસ્ટીન/ગુપ્ત, છુપું
clanger/ક્લેન્ગર/ગોટાળો, ગંભીર ભૂલ
clangor
clap/ક /

clap/કલેપ/તાળીઓ પાડવી

clapper

claptrap/કલેપટ્રેપ/બકવાસ,નિરર્થક વાત

claque/કલેક/ભાડૂતી તાલી પાડવા વાળા,**chamcha**

clarification/કલેરિફિકેશન/સ્પષ્ટતા, ખુલાસો, ચોખવટ

clarion/કલેરિઓન/હાકલ

clarity/કલેરિટિ/સ્પષ્ટતા, શુદ્ધતા

clash/ક /

clash/કલેશ/અથડામણ, ટકકર, મારામારી

clasp/કલેસ્પ/પકડી, રાખવું

clasp/ક /

class/કલાસ/વર્ગ, કક્ષા

class/ક /

classical/કલેસિકલ/શાસ્ત્રીય, શૈક્ષણિક

classified/ક /

classified/કલાસિફાઈડ/વર્ગીકૃત, તારવેલું

clause/ક /

clause/કલોઝ/ઉપવાક્ય, પેટા કલમ

claustrophobia

clavicle

claw/ક /

claw/કલૌ/પંજો (પ્રાણીનો)

clay/ક /

clay/કલેઈ/માટી

clean out-વું

clean up-વું

clean(se)/ક /

clean/કલીન/ચોખ્ખું

clean-chit/કલીનચિટ/દોષમુક્તિ

cleans/કલીઝ/સ્વચ્છ/સફાયો કરવો

clear away-વું

clear off-વું

clear the deck સજ્જ થવું

clear up/ક /

clear up-વું

clear/કલીઅર/સ્પષ્ટ/મંજુર-મુક્ત કરવું

clear/ક /

cleavage/કલીવેજ/ફાટ, ચીરો

cleave

cleft

clemency/કલેમન્સિ/દયા, કૃપા, માફી

clench/કલેચ/ખૂંચવી લેવો

clench/ક /

clergy/કર્લજી/પાદરી મંડળ

clergyman/કર્લજીમન/પાદરી

clerk/કલર્ક/કારકુન

clerk/ક /

clever at

clever/કલેવર/હોશિયાર

clever/ક /

cliam/કલાઈમ/માગણી કરવી

clichés/કલિશે/ચવાઈ ગયેલા શબ્દો

click/ક /

click/કલિક/કટ અવાજ, ફોટો લેવો, સફળ થવું

clientele/કલાયન્ટલ/ઘરાકી

cliff/કલિફ/ભેખડ ઊભો ખડક, કરાડ

cliff/ક /

climactic પરાકાષ્ટાનું

climate/ક /

climate/કલાઈમેટ/આબોહવા, વાતાવરણ

climatic/કલાઈમેટિક/આબોહવાનું,

climax/કલાઈમેક્સ/પરાકાષ્ટા

climb down-વું

climb/કલાઈમ/ઉપર ચઢવું

climb/ક /

clime/કલાઈમ/પ્રદેશ, આબોહવા

clinch/કલિન્ચ/ખૂંચવી લેવું

clines

cling/કલિંગ/ચોટી જવું

cling/ક /

clink/કલિન્ક/ખણખણાટ જેઈલ

clinker/કલિન્કર/ગડબો, શ્રેષ્ઠ, ઉત્તમ વસ્તુ

clip/કલીપ/પિન, કાપી નાખવું

clip/ક /

clique/કલિક/નાની ટોળકી

cloak/કલોક/ડગલો, છુપાવવું

lobber/કલોબર/ફટકારવું, સખત ટીકા કરવી

clock in-વું

clock off-વું

clock up-વું

clock/કલોક/ઘડિયાળ

clock/ક /

clog/કલોગ/નાડતર, રૂંધાવું, બંધ થવું

cloister

cloning

close down-વું

close in-વું

close up-વું

close/કલોસ/નિકટ, બંધ કરવું, નજીક

close/ક /

closet

closure/કલોઝર/બંધી, અંત, સંકેલો

clot/કલોટ/ગંઠાવું (લોહી)

cloth(es)/ક /

cloth/કલોથ/કાપડ

cloud up-વું

cloud(y)/ક /

cloud/કલાઉડ/વાદળું

clout/કલાઉટ/તમાચો મારવો, સાંઠગાંઠ

clover/કલોવર/

clown/ક /

clown/કલાઉન/ડાગલો
cloying
club together-વું
club/કલબ/ફૂલીનું પાનું, ગાંઠ
club/ક /
clubbed
clue/કલૂ/પગેલું, કડી, સગડ, સુરાગ સંકેત,
cluster/કલસ્ટર/ઝૂમખું
clutch/કલચ/પકડવું
clutch/ક /
coach/કોચ/ટ્રેઈનનો ડબ્બો, તાલીમશિક્ષક
coagulate
coal/કોલ/કોલસો
coalesce સાથે વધવું
coalition/કોઅલીશન/મિશ્ર, મોરચો
coarse/કોર્સ/જાડું, બરછટ
coat/કોઉટ/થર, પ્રાણીની ચામડી, ડગલો
coax/કોક્ષ/પટાવવું, ફોસલાવવું
cobble/કોબ/થાગડ થીગડ કરવું
cock/કોક/મરઘો
cockney/કોકનિ/ખાસ લંડન શહેરનું (ભાષા)
cockpit/કોકપિટ/વિમાનચાલકની કેબિન
cod/કોડ/મશકરી, માછલી ની જાત
coda/કોડા/અંતિમચરણ
coddle/કોડલ/પંપાળવું
code(d)/ક /
code/કોઉડ/સંજ્ઞા
coded/કોડિડ/સાંકેતિક, સંજ્ઞાવાળું, ગુપ્ત
codicil/કોડિસિલ/વસિયતનામાની પુરવણી
codify
co-efficient/કોએફિસિઅન્ટ/ગુણાંક (અર્થશાસ્ત્ર)
coerce/કોઅર્સ/જબરદસ્તી કરવી
coercion/કોઅર્સન/ધાક, ધમકી
coercive/કોઅર્સિવ/જબરદસ્તી પૂર્વકનું
coeval/કોઈવલ/સમકાલીન, સમસામયિક
coffee/ક /
coffee/કોફી/કોફી
coffers/કોફર્સ/તેજોરી, ભંડોળ, પેટી
coffin/કોફીન/શબપેટી
cog
cogent/કોજન્ટ/સબળ, નક્કર, પ્રતીતિકર
cogitate/કોજિટેટ/ગંભીર વિચાર કરવો
cognac/કોન્નેક/ફ્રેંચ બ્રાન્ડી
cognate
cognitive
cognizance/કોગ્નીઝન્સ/જાણકારી, ધ્યાન
cognoscente/કોગ્નીસન્ટ/જાણકાર, જ્ઞાની
cognoscenti/કોગ્નીસન્ટિ/કલાપારખું
cohere
coherence/કોહેરન્સ/સુસંગતા, સુમેળ
cohesion

cohort/કોહોર્ટ/કરવા પ્રેરવું
coiffeur/કોઈફ્યુર/હૈરડેસર
coiffure
coign/કોઈન/દૃશ્ય સ્થાન
coil/કોઈલ/ગૂંચળું-વળવું
coin/ક /
coin/કોઈન/સિકકો, નવો શબ્દ રચવો
coincide/કોઈનસાઈડ/સાથેસાથે બનવું
co-incidence/કોઈન્સિડન્સ/યોગાનુયોગ/જોગસંજોગ
coincident
coir/કવાયર/કાથી
coition/કોઈશન/સંભોગ
coke/કોક/કોલસો
colander
cold/ક /
cold/કોલ્ડ/ઠંડું, ઠંડી, ટાઢ, શરદી
collaborate
collaboration/કલાબોરેશન/સહયોગ
collage/કોલાજ/દિવાલકૃતિ (પદાર્થ-વસ્તુ)
collapse/કલેપ્સ/તૂટીપડવું
collar/કોલર/કોલર
collate/કોલેટ/
collateral/કોલેટરલ/મિલકત સબંધી
collation
colleague/કોલીગ/સહકાર્યકર, કાર્યબંધુ
collect up-વું
collect(ion)/ક /
collect/કલેક્ટ/એકઠું કરવું, જમા થવું
collective/કલેક્ટિવ/સામૂહિક
college/ક /
college/કલિજ/મહાવિદ્યાલય
collide/કલાઈડ/સામ-સામે અથડાવું
colliery/કોલીઅરી/ખનીજ ખાણ
collision/કલિઝન/અથડામણ, ટકકર, ટકરાવ
colloquial/કલોકિઅલ/બોલચાલનું
colloquy
collude/કોલ્યુડ/કાવાદાવા કરવા
collusion/કોલ્યુઝન/કપટ, કાવાદાવા
colonial/કલોનિઅલ/વસાહતી
colossal/કલોઝલ/વિરાટ, પ્રચંડ, ભયંકર
colossus
colour(ful)/ક /
colour/કલર/રંગ-કરવો
column/કોલમ/કટાર (છાપાંની)સ્તંભ, કતાર
coma/ક /
coma/કોમા/બેભાન અવસ્થા બેભાન
comatose
comb through-વું
comb/ક /
comb/કોમ/દાંતિયો
combat/કોમ્બટ/લડાઈ, સામનો કરવો

combatant/કોમ્બૅટન્ટ/લડવૈયો
combative/કોમ્બૅટિવ/લડાયક, કજિયાખોર
combination/ક /
combination/કોમ્બિનેશન/મિશ્રણ, સંયોજન
combine/ક /
combine/કમ્બાઈન/મિશ્રણ કરવું
combing ગુન્હેગારો નીસફાઈ કરવી
combustible/કમ્બુસ્ટિબલ/સળગી ઉઠે તેવું
come across મળવું, પરિચય હોવો
come across with-વું
come across/ક /
come along-વું
come apart-વું
come at-વું
come away-વું
come back-વું
come by-વું
come down on-વું
come down with-વું
come down-વું
come forward-વું
come in for/ક /
come in for-વું
come in on-વું
come in-વું
come into-વું
come off/ક /
come off-વું
come of-વું
come on-વું
come out with-વું
come out-વું
come over-વું
come round/ક /
come round-વું
come through-વું
come to-વું
come up against-વું
come up to-વું
come up with-વું
come up-વું
come what may જે થવું હોય તે થાય
come/ક /
come/કમ/આવવું
comely/કોમલિ/જાજરમાન, ભવ્ય
comestible
comet/કોમિટ/ધૂમકેતુ
comeuppance
comfort(able)/ક /
comfort/કમફર્ટ/સુખ, ચૈન, આશ્વાસન

comfortable/કમફર્ટઈબલ/આરામદાયક
comical/કોમિકલ/રમૂજી
comity/કોમિટિ/સૌજન્ય, શિષ્ટતા, વિવેક
comma/ક /
comma/કોમા/બેભાન અવસ્થા
command/ક /
command/કમાન્ડ/હુકમ, તાબામાં
commandeer
commando/કમાન્ડો/વિશિષ્ટ તાલીમી સૈનિક
commemorate/કોમેમોરેટ/સ્મૃતિ ઉત્સવ કરવો
commemorative
commence/કમેન્સ/શરૂ કરવું
commendable/કમેન્ડેબલ/વખાણવાલાયક
commensurate/કમેન્સ્યુરેઈટ/ને અનુરૂપ
comment(ary)/ક /
comment/કોમેન્ટ/ટીકા-ટીપ્પણ કરવી
commercial/કર્મશયલ/વ્યાપારીક
commercialise/કર્મશયલાઈઝ/વ્યાપારીકરણ કરવું
commiserate સહાનુભૂતી હોવી
commit(ment)/ક /
commitment/કમિટમન્ટ/વચનબધ્ધતા
committed/કમિટેડ/સમર્પિત, વચનબધ્ધ
committee/ક /
committee/કમિટી/સમિતી
commodious/કમોડિઅસ/મોકળાશ વાળું
commodity/કોમોડિટિ/ચીજવસ્તુ, ખાદ્યપદાર્થ
common/ક /
common/કોમન/સામાન્ય
commotion/કમોશન/કોલાહલ, ધાંધલ, ઉત્પાત
communal/કમ્યુનલ/કોમી, કોમનું
commune/કમ્યુન/કુટુંબ જૂથ
communicate/ક /
communicate/કમ્યુનિકેઈટ/સંદેશ
communication/ક /
communiqué/કમ્યુનિકે/જાહેર યાદી
communist/કમ્યુનિસ્ટ/સામ્યવાદી
commute/કોમ્યુટ/આવ-જા કરવી
commuters/કોમ્યુટર્સ/
compact/કોમ્પક્ટ/કરાર, સંક્ષિપ્ત, ટુંકું
companion/ક /
company/ક /
company/કમ્પની/સંગત, પેઢી
compare/કમ્પેઅર/સરખાવવું
compare/ક /
comparison/ક /
comparison/કમ્પેરિઝન/સરખામણી
compartment/કમ્પાર્ટમન્ટ/ખાનુ, વિભાગ
compassion/કમ્પેશન/દયા, કૃપા
compassionate/કમ્પેશનેટ/દયાળુ, કૃપાળુ
compatible/કમ્પેટિબલ/સુસંગત, બંધ બેસતું

compeer/કોમ્પિઅર/બરોબરીયો, સાથી
compel/કમ્પેલ/ફરજ પાડવી
compelling
compendium/કોમ્પિડિયમ/સંક્ષેપ, સાર
compensate/ક /
compensate/કોમ્પેન્સેટ/વળતર ચૂકવવું
compensation/કોમ્પેન્સેશન/વળતર(નુકશાની)
compensatory
compere/કમ્પીઅર/સુત્રધાર
compete/ક /
compete/કમ્પીટ/સ્પર્ધા-હરીફાઈ કરવી
competent/કમ્પીટન્ટ/સક્ષમ, અધિકૃત
competition/ક /
competition/કમ્પિટીશન/સ્પર્ધા
competitive/કમ્પીટિટીવ/સ્પર્ધાત્મક
competitor/ક /
competitor/કમ્પીટિટર/હરીફ, સ્પર્ધક
compilation
compile/કમ્પાઈલ/સંગ્રહ-સંકલન કરવું
complacent/કમ્પ્લેસન્ટ/સંતુષ્ટ
complain(t)/ક /
complain/કમ્પલેઈન/ફરિયાદ કરવી
complainant/કમ્પલેઈનન્ટ/ફરિયાદી
complaisant
complement/કોમ્પલિમન્ટ/પૂરક બનવું(નામ-ક્રિયા)
complementary/કોમ્પલિમેન્ટરિ/પૂરક (વિશેષણ)
complete/ક /
complete/કમ્પ્લીટ/પૂર્ણ, પુરું કરવું
completely/ક /
complex/ક /
complex/કોમ્પ્લેક્ષ/અટપટું, મિશ્ર
complex/કોમ્પ્લેક્ષ/સંકુલ, અટપટું, મનોગ્રંથી
complexity/કોમ્પ્લેક્ષિટિ/જટીલતા, આંટીઘૂંટી
compliance/કોમ્પલાયન્સ/અધિનતા, ના અનુસાર
compliant
complicate(d)/ક /
complicate/કોમ્પલિકેટ/ગૂંચવવું
complicated/કોમ્પ્લીકેટેડ/ગૂઢ, અટપટું
complicity/કોમ્પ્લીસિટિ/ગૂઢ, અટપટું
compliment/કોમ્પલિમન્ટ/શુભેચ્છા, અભિનંદન
complimentary/કોમ્પલિમેન્ટરિ/શુભેચ્છારૂપ
comply with/કમ્પલાય/અનુસરવું-માન્ય કરવું
comport
compose/ક /
compose/કમ્પોઝ/રચવું, ગોઠવવું
composite/કોમ્પઝીટ/સંયુક્ત
composure
compound/ક /
compound/કમ્પાઉન્ડ/મિશ્રણ કરવું, પટાંગણ
comprehend/કમ્પ્રીહેન્ડ/સમજવું, ગ્રહણ કરવું
comprehensive/કોમ્પ્રીહેન્સિવ/સર્વગ્રાહી

compress/કમ્પ્રેસ/ઠંસી ને ભરવું
comprise/કમ્પ્રાઈઝ/નું બનેલું હોવું
compromise/કમ્પ્રોમાઈઝ/સુલેહ, સમાધાન
compulsion/કમ્પલ્ઝન/મજબૂરી, જબરદસ્તી
compulsive/કોમ્પલ્ઝિવ/જબરદસ્તી વાળું
compulsory/કમ્પલ્સરી/ફરજિયાત
compulsory/ક /
compunction/કમ્પંક્શન/રંજ, ખટકો
compute
computer/ક /
computer/કમ્પ્યુટર/સંગણકયંત્ર
computernik
con/ક /
con/કોન/છેતરવું
concatenate
concatenated
concatenating
concave
conceal/ક /
conceal/કન્સીલ/છુપાવવું
concede/કન્સીડ/મંજૂર કરવું, સ્વીકારવું
conceit/કન્સીટ/મિથ્યાભિમાન, અહંકાર
conceited/કન્સીટેડ/ગર્વિષ્ટ, અહંકારી
conceive/કન્સીવ/ધારવું, ગર્ભધારણ કરવો
concentrate/ક /
concentrate/કોન્સન્ટ્રેટ/એકાગ્ર થવું
concentration//એકાગ્રતા, જમાવટ
concentric
concept/કોન્સન્ટ્રેશન/પરિકલ્પના
conception
conceptual/કનસેપ્ટ્યુઅલ/કલ્પનાત્મક
concern/ક /
concern/કન્સર્ન/લેવાદેવા/ચિંતા/બાબત/નિસ્બત/પેઢી
concert/ક /
concert/કોન્સર્ટ/સંગીત-જલસો, એકમત
concerted
concession
conch/કોન્ચ/શંખ
conciliation/કન્સિલિએશન/સમાધાન, મેળ, સુલેહ
conciliatory/કન્સિલિએટરી/સમાધાનકારી
concise/કન્સાઈઝ/સંક્ષિપ્ત
conclave
conclude/કન્કલુડ/નિષ્કર્ષ કાઢવો, સમાપ્ત કરવું
conclusion/કન્કલુઝન/નિષ્કર્ષ, સમાપ્તી
conclusive
concoct
concoction
concoction/કોન્કોકશન/સંમિશ્રણ, ઉપજાવેલું
concomitant
concord/કોન્કોર્ડ/સુમેળ, એકરાગ
concrete/કોન્ક્રિટ/નકકર, વાસ્તવિક

concubine/કન્ક્યુબાઈન/રખાત
concupiscent/કન્ક્યુપિશન્ટ/કામુક
concur/કન્કર/સંમતિ લેવી
concurrency/કન્કરન્સ/સંમતિ, મંજૂરી
concurrent
condemn/કન્ડેમ્ન/વખોડવું, દોષીત ઠરાવવું
condemnation/કન્ડેમ્નેશન/તિરસ્કાર, શ્રાપ
condescend/કન્ડેન્શન્ડ/નીચે ઉતરવું (વર્તનમાં)
condign/કન્ડાઈન/યોગ્ય બદલો-સજા
condiments
condition/ક /
condition/કન્ડિશન/પરિસ્થિતિ, શરત, અનુકૂળ કરવું
conditional/કન્ડિશનલ/શરતી
condole
condole/કન્ડોલ/આશ્વાસન આપવું
condolence/કોન્ડોલન્સ/શોક સંદેશ, દિલાસો
condominium/કોન્ડોમિનિયમ/સંયુક્ત સત્તા
condone
condone/કન્ડોન/માફ કરવું
conducive
conducive/કન્ડ્યુસિવ/પ્રેરક, પોષક
conduct/ક /
conduct/કન્ડક્ટ/સંચાલન કરવું, વર્તન
conduit/કન્ડિટ/નહેર, નળ
cone/ક /
cone/કોન/શંકુ, દેવદાર, ચીડ
confabulation/કોનફેબ્યુલેશન/અંગત વાતચિત
confer(ence)/ક /
confer/કોન્ફર/બક્ષવું, વિચાર વિમર્શ કરવો
confess(ion)/ક /
confess/કન્ફેસ/એકરાર-કબૂલાત કરવી
confidant/કોનફિડન્સ/વિશ્વાસુ માણસ
confide(nce)/ક /
confide/કન્ફાઈડ/વિશ્વાસ મૂકવો
confidence/કોન્ફિડન્સ/વિશ્વાસ, શ્રદ્ધા
confident/ક /
confident/કોન્ફિડન્ટ/આત્મવિશ્વાસુ
confidential/કોન્ફિડેન્શલ/ખાનગી, ગોપનીય
configured
confine/ક /
confine/કન્ફાઈન/મર્યાદામાં રાખવું, કેદ કરવું
confines
confirm(ation)/ક /
confirmation/કોન્ફિરમેન્ટ/પુષ્ટિ, સમર્થન
confirmed/કન્ફર્મ્ડ/આધારભૂત, પ્રમાણિત
confiscate/કોન્ફિસ્કેટ/જપ્ત કરવું
conflagration/કોન્ફિગરેશન/દાવાનળ, આગ
conflict/ક /
conflict/કોન્ફલિક્ટ/લડાઈ, અથડામણ, સંઘર્ષ
confluence/કોન્ફ્લુઅન્સ/ત્રિવેણી સંગમ
conform/ક /

conformity
confound
confound/કન્ફાઉન્ડ/ગૂંચવવું
confront
confront/કન્ફ્રન્ટ/સામનો કરવો
confuse/ક /
confuse/કન્ફ્યુઝ/મુંઝાવું
confusion/કન્ફ્યુઝન/મુંઝવણ, ગોટાળો
congeal/કન્જીલ/થીજવું
congenial/કન્જીનીઅલ/અનુકૂળ
congenital/કોન્જીનેટલ/જન્મજાત
congested/કન્જેસ્ટેડ/ગીચ, ભરાવો થયેલ
conglomeration/કોન્ગલોમેરેશન/જમાવ, ભરાવો
congratulate on/for-
congratulate/ક /
congratulate/કોંગ્રેચ્યુલેઈટ/અભિનંદન આપવા
congregate/કોન્ગ્રીગેઈટ/ઘર્મસભા માટે મળવું
congregation/કોન્ગ્રીગેશન/ઘર્મસભા
congruence
conifer
conjecture/કોન્જેકચર/અનુમાન, અટકળ
conjugal/કોન્જુગલ/દાંપત્ય, લગ્નસંબંધ
conjunction
conjure/કોન્જ્યુર/હાથ ચાલાકી કરવી (જાદુ)
conk
conk out-વું
connect(ion)/ક /
connect/કનેક્ટ/જોડવું
connivance
connive at/કન્નાઈવ એટ/આંખમિચામણાં કરવા
connoisseur/કોનોસર/કલામર્મજ
connotation/કોનોટેઈશન/અર્થ
connubial
conquer/કોન્કર/જીતી લેવું
conquest/કોન્કવેસ્ટ/વિજય, જીત
consanguinity
conscience/ક /
conscience/કોન્સિઅન્સ/અંતરાત્મા
conscientious/કોન્સિએન્શસ/સંનિષ્ઠ
conscious/ક /
conscious/કોન્સશ/સભાન, સ્વસ્થ
conscript
consecrate/કોન્સેક્રેઈટ/પવિત્ર બનાવવું
consecutive/કોન્સિક્યુટિવ/આનુક્રમિક
consensus/કોન્સેન્સ/સર્વસંમતિ, સર્વાનુમતિ
consent/કન્સેન્ટ/સંમતિ, મંજૂરી
consequence/કોન્સિકવન્સ/પરિણામ, મહત્ત્વ
consequential
conservancy/કોન્ઝર્વન્સ/સફાઈ, સ્વચ્છતા
conservative/કોન્ઝર્વેટિવ/રૂઢિચુસ્ત
conservatory

conserve/કોંઝર્વ/જાળવણી-બચત કરવી

consider(ate)/ક /

consider/કંસિડર/ધ્યાનમાં લેવું

considerate/કંસિડરેઈટ/વિવેકપૂર્ણ, વિચારશીલ

consign/કનસાઈન/સોંપવું, માલ મોકલવો, હવાલે કરવું

consignee/કન્સાઈની/માલ લેનાર

consignor/કન્સાઈનર/માલ મોકલનાર

consist/ક /

consist/કંસિસ્ટ/નું બનેલું હોવું

consistency

consistent સ્થિર, એકરૂપ, એકધારું

consolation આશ્વાસન, શાંતવના

console

consolidate મજબૂત કરવું, એકત્ર કરવું

consonance

consonant/ક /

consonant/કોન્સોનન્ટ/વ્યંજન

consort

consortium સંયુક્ત પેઢી

conspicuous/કોન્સપિક્યુઅસ/દેખીતું

conspiracy/કોન્સપિરસી/કાવતરું, ષડયંત્ર

conspire/કોન્સપાયર/કાવતરું-ષડયંત્ર ઘડવું

constant/ક /

constant/કોન્સ્ટન્ટ/સતત, સ્થિર

constellation

consternation/કોન્સ્ટરનેશન/ચિંતા, આઘાત

constituency/કન્સિટ્યુઅન્સિ/મતવિસ્તાર

constituent

constitution/ક /

constitution/કન્સ્ટિટ્યુશન/બંધારણ, બાંધો

constraint/ક /

constraint/કન્સ્ટ્રેઈન્ટ/સંયમ, નિગ્રહ

constraints

construct/ક /

constructive/કન્સ્ટ્રક્ટિવ/રચનાત્મક

construe/ક /

construed/કોન્સ્ટ્ર્યુલેટ/રાજદ્વારી પ્રતિનિધિ

consult/ક /

consult/કનસલ્ટ/સલાહ લેવી

consultant

consume/ક /

consumer/કન્સ્યુમર/ગ્રાહક, ઉપભોક્તા

consummate/ક /

contact/કોન્ટેક્ટ/સંપર્ક

contagion

contagious/ક /

contain/ક /

contain/કન્ટેઈન/કાબુમાં રાખવું, ધરાવવું

container/ક /

contaminate

contaminated/ક /

contamination

contemplate/ક /

contemporary/કન્ટેમ્પરરી/સમકાલીન

contempt/ક /

contemptible/કન્ટેમ્પટીબલ/ઘૃણાજનક

contemptuous/ક /

contemptuous/કન્ટેમ્યુઅસ/ધિક્કારપૂર્ણ

contend

contender/ક /

content/ક /

contention/કન્ટેન્શન/વિવાદ, દલીલ

contentious

contest/ક /

contest/કન્ટેસ્ટ/સ્પર્ધા, હરીફાઈ

context/ક /

contiguity

contiguous

continence

continent/ક /

contingency/કન્ટીજન્સિ/આકસ્મિક

contingent/ક /

continual/કન્ટીન્યુઅલ/અવિરત, ત્રુટક-ત્રુટક

continue/ક /

continue/કન્ટીન્યુઅલ/ચાલુ રાખવું

continuous/ક /

continuous/કન્ટીન્યુઅસ/વણથંભ્યું, સતત

contortions

contour/ક /

contraband/કોન્ટ્રાબેન્ડ/પ્રતિબંધિત માલ-વસ્તુ

contraceptive/ક /

contract/કોન્ટ્રેક્ટ/કરાર, સંકોચાવું

contradict/ક /

contradict/કોન્ટ્રાડિક્ટ/વિરોધનું, વિસંગત થવું

contradictory/ક /

contrary/કોન્ટ્રરી/ઉલ્ટાનું, વિસંગત, વિરોધી

contrast/ક /

contrast/કોન્ટ્રાસ્ટ/વિરોધાભાષ, વિસંગતતા

contravene/ક /

contretemps/ક /

contribute/ક /

contribute/કોન્ટ્રીબ્યુટ/કાળો-યોગદાન આપવું

contrite/ક /

contrive/કોન્ટ્રાઈવ/પસ્તાવો કરનારું

contrived

control/ક /

control/કંટ્રોલ/નિયંત્રણ, કાબૂ

controversial/ક /

controversy/કોન્ટ્રોવર્સી/વિવાદાસ્પદ

controvert

contumacious

contume/ક /

contusion**conundrum**/કોન્ડ્યુનડ્રમ/કોયડો, ઉખાણું**convene**/કન્વીન/સભા બોલાવવી**convenient**/ક /**convenient**/કન્વીનિયન્ટ/અનુકૂળ**convenor****convent**/કોન્વેન્ટ/સાધવીઓ નો મઠ**convention****conventional****converge**/કોન્વર્જ/કેન્દ્ર તરફ ગતિકરવી**conversant**/કોન્વર્સન્ટ/સુપરિચિત, જાણકાર**conversation**/ક /**conversation**/કન્વર્સેશન/વાતચિત**converse**/કન્વર્સ/વાતચિત કરવી**conversion**/કન્વર્ઝન/રૂપાંતર, ધર્માંતર**convert****convertible**/કન્વર્ટિબલ/રૂપાંતરીય**convex****convey**/કન્વે/પાઠવવું, મોકલવું**conveyance****convict**/ક /**convict**/કન્વીકટ/સજાકરવી, કેદી**conviction**/કન્વીકશન/પ્રતિતિ, દુઢ માન્યતા, સજા**convince**/ક /**convince**/કન્વિન્સ/ખાતરી કરાવવી**convivial**/કન્વાયવલ/મોજીલું, આનંદી**convocation**/કન્વોકેશન/પદવીદાન સમારંભ**convoke****convoluted****convoy****convoy**/કોન્વોય/વળાવીઆઓ નો કાફલો**convulse**/કન્વલ્ઝ/આંચકી-તાણ આવવું**convulsion**/કન્વલ્ઝન/આંચકી, તાણ**cook**/ક /**cook**/કુક/રસોઈ કરનાર, રાંધવું**cool down**/કૂલ ડાઉન/ઠંડુ પડવું-પાડવું**cool the heels**/કૂલ ધ હીલ્સ/રાહ જોવી**cool**/ક /**cool**/કૂલ/શિતળ, ઠંડું, મોજ**cooped****co-operate**/ક /**cooperate**/કોઓપરેટ/સહકાર આપવો**co-operative**/ક /**co-ordination**/કોઓર્ડિનેશન/સમન્વય, સંકલન**cop**/કોપ/પોલીસમેન, સિપાઈ**cope with**/કોઉપ વિથ/ને પહોંચી વળવું**cope**/ક /**copious**/કોપીઅસ/વિપુલ, અનેક**copped****copper**/ક /**copper**/કોપર/તાંબુ**copy**/ક /**copy**/કોપી/નકલ**coquetry**/કોકેટ્રી/સ્ત્રી ના નખરાં**coquette****cord**/ક /**cord**/કોર્ડ/દોરડું, તાર**cordial**/કોર્ડિઅલ/સાલસ, એખલાસ**cordons**/કોર્ડન/ઘેરો-ઘેરવું (સલામતી)**corduroy**/કોર્ડરોય/સુતરાઉ, મખમલ**core**/કોર/કેન્દ્ર, સાર, ગર્ભ**cork**/ક /**cork**/કોર્ક/શીશીનું ઢાંકણું, ભુચ**corn**/ક /**corn**/કોર્ન/મકાઈ**corner**/ક /**corner**/કોર્નર/ખુણો**corner-stone****cornice****cornucopia**/કોર્નુકોપિઆ/અક્ષયપાત્ર**corollary****corona**/કોરોના/ચંદ્રનું તેજોવલય**coronation**/કોરોનેશન/રાજ્યાભિષેક**coronet**/કોરોનેટ/નાનો મુગટ**corporate**/કોર્પોરેટ/અનેક જુથોનું નિગમ**corporeal**/કોર્પોરીઅલ/ભૌતિક, શારીરિક**corps**/ક /**corps**/કોર/લશકરી દળ, ટુકડી, દસ્તો**corpse**/ક /**corpse**/કોર્પ્સ/મડદું, લાશ, શબ**corpulent****corpus**/કોર્પસ/લખાણ નો સંગ્રહ**correct(ion)**/ક /**correct**/કરેક્ટ/સાચું**correlate**/ક /**correlation****correspond(ence)**/ક /**correspondence**/કોરસ્પોન્ડન્સ/પત્રવ્યવહાર**corroborate****corroboration**/કોરોબોરેશન/પરિપુષ્ટિ, સર્મથન**corrode**/કોરોડ/કાટ-સડો લાગવો**corronary****corrosion**/કોરોઝન/કટાવું, સડો**corrosive****corrugated****corrupt**/ક /**corrupt**/કરપ્ટ/બ્રષ્ટ, લાંચિયું**corset**/કોરસેટ/કંચુકી**cortege**/કોર્ટેજ/સ્મશાનયાત્રા**cosines****cosmetic**/કોસ્મેટિક/સૌંદર્ય ને લગતું**cosmic**/કોસ્મિક/બ્રહ્માંડનું

cosmopolitan/કોસ્મોપોલિટન/વિશ્વનાગરિક, પચરંગી

cosmos/કોસ્મોસ/બ્રહ્માંડ, વિશ્વ

cosp/કોસ્પ/

cosset/કોસેટ/પંખાળવું

cost(ly)/ક /

cost/કોસ્ટ/કિમત, મુલ્ય

costly

costume/કોસચ્યૂમ/વિશિષ્ટ પોષાક

cosy

cot/ક /

cot/કોટ/ખાટલો, પલંગ

coterie/કોટેરી/ચુનંદા ગોઠિયાઓ

cottage

cotton on-વું

cotton/ક /

cotton/કોટન/રૂ, સુતર

couch/ક /

couch/કાઉચ/

cough up/કફ અપ/પરાણે પૈસા કઢાવવા

cough/ક /

cough/કફ/ઉઘરસ ખાવી, ખાંસવું

could/ક /

could/કુડ/શકયા ભૂ. કા.

council/ક /

council/કાઉન્સિલ/સમિતિ

counsel/કોન્સલ/સલાહ આપવી

count in-વું

count on-વું

count out/ક /

count out-વું

count up-વું

count/ક /

count/કાઉન્ટ/ગણવું, આધાર રાખવો

countdown/કાઉન્ટડાઉન/ધડીઓ ગણાવી

countenance/કાઉન્ટિનન્સ/ચહેરો

counter productive ઉલટી અસર

counter/કાઉન્ટર/થડો, સામનો કરવો

counterfeit/કાઉન્ટરફિટ/જાલી, નકલી, ઢોંગ

countermand/કાઉન્ટરમેન્ડ/રદ કરવું

counterpart/કાઉન્ટરપાર્ટ/સમોવડિયો, પ્રતિરૂપ

country(side)/ક /

country/કન્ટ્રી/દેશ, દેશી, ગ્રામ્ય

coup/કૂ/બળવો(રાજકીય)સફળ ચાલ

couple

couple/ક /

courage/ક /

courage/કરિજ/હિમત, બહાદુરી

courageous/કરિજઅસાહિમતવાન, બહાદુર

courier/કૂરીઅર/દૂત, સંદેશવાહક

course/ક /

course/કોર્સ/માર્ગ, રસ્તો, અભ્યાસ, ખાણું

court(eous)/ક /

court/કોર્ટ/સંવનન કરવું, મેદાન, ન્યાયાલય

courteous/કર્ટીઅસ/સૌજન્યશીલ

courtesy/કર્ટસી/સૌજન્ય, વિનયશિલતા

courtier/કોર્ટિયર/દરબારીઓ, જી હજુરીઆ

court-martial/કોર્ટમાર્શલ/લશ્કરી અદાલત

courtship/કોર્ટશિપ/પ્રેમાઆલાપ, સંવનન

cous cous

cousin/ક /

cousin/કઝન/પિતરાઈ

covenant/કોવેનાન્ટ/કરાર, બોલી

cover/ક /

cover/કવર/ઢાંકવું, છાવરવું, ઢાંકવું

coverage/કવરેજ/વ્યાપ, આવરણ, સમાવેશ

covert

cover-up/કવરઅપ/ઢાંકપિછોડો

coveted/કોવેટેડ/ઈચ્છીત, ઝંખનાનું

covetous/કોવેટસ/લાલચુ

cow down/કાઉડાઉન/

cow/ક /

cow/કાઉ/ગાય

coward(ly)/ક /

coward/કાવર્ડ/ડરપોક, બાયલું

cowardice

cower

coy/કોય/શરમાળ, નમ્રતા નો ડોળ

cozen/કોઝન/ફોસલાવવું, છેતરવું

crabbed

crack down on-વું

crack down-વું

crack up-વું

crack/ક્રક/તિરાડ, ભડાકો, ફડાકો

crack/ક /

crackdown/ક્રકડાઉન/છાપો મારવો, તુટી પડવું

cradle/ક્રડલ/પારણું, ધોડિયું

craft/ક્રાફ્ટ/કૌશલ્ય

craft/ક /

crafted/ક્રાફ્ટેડ/

crafty/ક્રાફ્ટિ/લુચ્ચું

cram/ક્રમ/ગોખવું, ઠાંસવું

cram/ક /

cramp/ક્રમ્પ/મચકોડ

cramp/ક /

cranky/ક્રેકિ/ચકમ, તરંગી

crap/ક્રપ/કચરો, બકવાસ

crash into-

crash out

crash/ક્રશ/તુટી પડવું કડાકો

crash/ક /

crass/ક્રસ/જડ, અજ્ઞાની અને મહામૂર્ખ

crate/કેઈટ/ખોખું
crate/ક /
crater/કેઈટર/ખાડો
crave/કેઈવ/ઝંખવું, તલપાપડ થવું
craven/કેઈવન/બાયવું, હલકટ
crawl/ક્રોલ/ઘૂંટણિયે ચાલવું
crawl/ક /
craze/કેઈઝ/ધિલછા
craze/ક /
crazy/કેઈઝી/ધૂની, પાગલ
crazy/ક /
creak/ક્રીક/
cream off-વું
cream/ક્રીમ/મલાઈ
cream/ક /
crease/ક્રીઝ/કરચલી, સળ
crease/ક /
create/ક્રીએઈટ/સર્જવું, ઉભું કરવું
create/ક /
creation
creative/ક્રીએટિવ/સર્જનાત્મક, રચનાત્મક
creature/ક્રીચર/પ્રાણી
creature/ક /
creche
credence/ક્રેડન્સ/ભરોસો, વિશ્વાસ
credentials/ક્રેડેન્શિઅલ/ઓળખપત્ર
credibility/ક્રેડિબિલિટી/વિશ્વનિયતા
credible/ક્રેડિબલ/માની શકાય તેવું
credit/ક્રેડિટ/શાખ, જમા, આબરૂ
creditable/ક્રેડિટેબલ/પ્રશંસાપાત્ર
credo/ક્રેડો/માન્યતા, સિધ્ધાંત
credulity
credulous/ક્રેડ્યુલસ/ભોળવાઈ જાય તેવું
creed/ક્રીડ/પંથ, ધર્મ
creek/ક /
creep/ક્રીપ/પેટે ચાલવું
creep/ક /
cremate/ક્રીમેઈટ/અંતિમવિધિ કરવી
cremation/ક્રીમેશન/અંતિમવિધિ
crematorium/ક્રીમેટોરિઅમ/સ્મશાન
crescendo
crescent/ક્રીસેન્ટ/બિજ નો ચંદ્રમા
crestfallen/ક્રેસ્ટફોલન/ઝંખવાણું, નિરાશ
crevice/ક્રેવિસ/
crew/ક્રૂ/ચાલકગણ(વિમાન)
crew/ક /
crib/ક /
crib/ક્રિબ/
cribb
cribbing/ક્રિબિંગ/
cribbling/ક્રિબિલિંગ/

cricket/ક /
cricket/ક્રિકેટ/ક્રિકેટ રમત, તમરું
crime/ક્રાઈમ/ગુન્હો
crime/ક /
criminal/ક /
criminal/ક્રિમિનલ/ગુન્હાખોર, અપરાધી
cringe/ક્રિન્જ/ટૂંટિયા વાળવા, સંકોચાવું
crink
crinkle/ક્રિન્કલ/
cripple/ક્રિપ્પલ/પાંગળું બનાવવું
crisis/ક્રાઈસિસ/કટોકટી, ગંભીરસ્થિતિ
crisp(py)/ક /
crisp/ક્રિસ્પ/(બોર્જેઅ) કરકરું, કડકડતું
criss-cross/ક્રિસક્રોસ/કરચલીઓ
criteria/ક્રાઈટેરિઆ/માપદંડ(બ.વ.)
criterion/ક્રાઈટેરિઅન/માપદંડ(એ.વ.)
critical/ક /
critical/ક્રિટિકલ/ગંભીર, ટીકાત્મક, નાજુક
criticise/ક /
criticise/ક્રિટિસાઈઝ/ટીકા-વિવેચન કરવું
criticism/ક /
criticism/ક્રિટિસિઝમ/ટીકા-વિવેચન
critique
crocodile/ક્રોકોડાઈલ/મગર
crocodile/ક /
crone
crone/ક્રોન/
crony/ક્રોનિ/ ગોઠિયો, જગરી મિત્ર
crooked/ક્રૂકેડ/ દુષ્ટ, વાંકું
crop up/ક્રોપઅપ/ઉદ્ભવવું, ઉભું થવું
crop/ક્રોપ/પાક, ફાલ, પેદાશ, ચરવું
crop/ક /
cropper/ક્રોપર/મોટી નિષ્ફળતા, નુકશાન
cross off-વું
cross out/ક /
cross out-વું
cross/ક્રોસ/ચોકડી, ઓળંગવું
cross/ક /
cross-hold
crotchety/ક્રોચેટિ/તરંગી-તોરી
crow/ક્રો/કાગડો
crow/ક /
crowd/ક્રાઉડ/ટોળું
crowd/ક /
crown/ક્રાઉન/મુગટ, તાજ
crown/ક /
crowned/ક્રાઉન્ડ/મુગટ, તાજ
crucial/ક્રુસિઅલ/નિર્ણાયક, અતિમહત્વનું
crucible/ક્રુસિબલ/
crucify/ક્રુસિફાય/કોસ પર ચડાવવું
crud

crude/ક્રુડ/બરછટ
crude/ક /
cruel(ty)/ક /
cruel/ક્રુઅલ/ક્રુર
cruet/ક્રુએટ/
cruise/ક્રુઈઝ/હંકારવું
cruise/ક /
crumble/ક્રમ્બલ/કડડભૂસ-ટુકડાં-ભુકો થવો
crummy/ક્રમિ/ભંગાર, કચરો
crunch/ક્રન્ચ/ચાવવું, નિર્ણયાત્મક ઘડી
crusade/ક્રુઝેઈડ/ધર્મયુધ્ધ
crusader/ક્રુઝેઈડર/ધર્મયોધ્ધો, લડવૈયો
crush/ક્રશ/કચડવું
crush/ક /
crux/ક્રક્ષ/કોયડો, ગૂંચ, કેન્દ્ર
cry off-વું
cry out-વું
cry wolf/ક્રાયવૂલ્ફ/
cry/ક્રાય/રડવું, રાડ પાડવી
cry/ક /
crypt
cryptic
crystal/ક્રિસ્ટલ/સ્ફટિક
crystallise/ક્રિસ્ટલાઈઝ/સ્ફટિક-પાસાદાર થવું
cub/ક /
cub/કબ/શિકારી પ્રાણીનું બચ્ચું
cube/ક /
cubes/ક્યુબ્ઝ/ચોસલા
cubicle
cuckoo/ક /
cuckoo/કુકુ/કોયલ
cucumber/ક /
cucumber/કકુમ્બર/કાકડી
cuddle
cuddle up-વું
cudgel
cue/ક /
cue/ક્યુ/સંકેત, ઈશારો
cuisine
cul-de-sac/કુલદીસે/બંધગલી
culinary
cull/કલ/તોડવું
culminated
culmination/કલમિનેશન/ચરમસીમા
culpability
culpable
culprit/કલપ્રિટ/ગુનેગાર
cult/કલ્ટ/પંથ, સંપ્રદાય
cultivate
cultivate/ક /
culvert

cumbersome
cumulate/ક્યુમ્યુલેટ/સંગ્રહ થવો, એકઠું થવું
cumulative
cunning
cup/ક /
cup/કપ/કપ
cupboard/ક /
cupboard/કબર્ડ/કબાટ
Cupid/ક્યુપિડ/કામદેવ
cupidity/ક્યુપિડિટિ/ધનલાલસા, લોભ
curator
curb/કર્બ/નિયંત્રણ-અંકુશમાં રાખવું
cure/ક /
cure/કયોર/ઈલાજ, સાજા કરવું
curfew/કર્ફ્યુ/સંચારબંધી
curriculum/કરિક્યુલમ/અભ્યાસક્રમ
curios/ક્યુરિઓઝ/
curiosity/ક /
curiosity/ક્યુરિઓસિટી/જીજ્ઞાસા
curious/ક /
curious/ક્યુરિઅસ/જીજ્ઞાસુ, વિચિત્ર
curl up-વું
curl/ક /
curl/કર્લ/ગૂંચળું
curly/કર્લી/વાંકડિયા વાળ, ગૂંચળાવાળું
curmudgeon
currant/કરન્ટ/કિસમિસ
current/ક /
current/કરન્ટ/ચાલુ, સાંપ્રત, પ્રવાહ
currently/કરન્ટલિ/હાલમાં, અત્યારે
curriculum/કરિક્યુલમ/અભ્યાસક્રમ
curry/કરિ/રાંધેલું શાક
curse/ક /
curse/કર્સ/શ્રાપ, અપશબ્દ, ગાળ
curtive
curt/કર્સિ/ઉપરછલ્લું, છીછરું
curt/કર્ટ/તોછડું, ચોખ્ખું ચટ
curtail/કર્ટેલ/કાપ મૂકવો
curtain/ક /
curtain/કર્ટન/પડદો
curvaceous/કર્વેશિઅસ/નજાકતભર્યું
curve/ક /
curve/કર્વ/વળાંક
cusped/કસ્સડ/કઢેગુ, હઠીલું, અવળચંડુ
custodial/કસ્ટોડિઅલ/હવાલાતનું, કબજામાંનું
custody/કસ્ટડિ/હવાલો, કબજો
custom/ક /
custom/કસ્ટમ/રૂઠિ
customary/કસ્ટમરી/રૂઠિગત, રોજિંદું
customer/ક /
customer/કસ્ટમર/ગ્રાહક

customise
customs/કરટમ્સ/જકાત, સીમાશુલ્ક
cut across-વું
cut back-વું
cut caper
cut down-વું
cut in/ક /
cut in-વું
cut off-વું
cut out/ક /
cut out-વું
cut up-વું
cut/ક /
cut/કટ/કાપવું, કાપ, કાપો
cut-back/કટબેક/ઘટાડો, કાપ મૂકવો
cute/ક /
cute/કયુટ/આકર્ષક, નાજુક, મજાનું
cut-out/કટઆઉટ/ઘટાડો કરવો, આકાર પ્રમાણે કાપેલું ચિત્ર
cut-throat/કટથ્રોટ/ગળાકાપ
cyber
cybernetics/સાયબરનેટિક્સ/સ્વયં સંદેશાવ્યવહાર
cycle/ક /
cycle/સાયકલ/સાયકલ, ચક્ર
cyclist/ક /
cyclist/સાયકલિસ્ટ/સાયકલસ્વાર
cyclone/સાયકલોન/વાવાઝોડું
cyclopean/સાયકલોપીઅન/વિરાટ
cymbal / /
cymbal/સિમ્બલ/
cynic/સિનિક/વાંકટેષુ, દોષદર્શી
cynical/સિનિકલ/ઉપહાસ કરવું
cynosure/સિન્ઝુઅર/વિખ્યાત વ્યક્તિ
da capo/ડિકાપો/
dab/ડ /
dab/ડબ/
dabble/ડબલ/છબછબિયાં કરવાં, માથું મારવું
dad/ડ /
dad/ડડ/પિતાજી, પપ્પા
daft/ડફ્ટ/
dag/ડગ/
dagger/ડગર/ખંજર, છરો
daily/ડ /
daily/ડેઈલી/રોજ, દરરોજ
dainty/ડેઈન્ટી/સુઘડ અને સુંદર
dairy/ડ /
dairy/ડેઈરી/દૂધઉત્પાદન કેન્દ્ર
dais/ડાયસ/મંચ, વ્યાસપીઠ
dalliance/ડલિઅન્સ/નિરાંતનો સમય
dally
dam/ડ /

dam/ડમ/જળબંધ
damage/ડ /
damage/ડમિજ/નુકશાન
dame/ડ /
dame/ડેઈમ/રત્ની(અનોપચારિક) સચગચસ
damn(ed)/ડ /
damn/ડમ્ન/(ગવ્યસસૌ) નરકનો શાપ દેવો
damned
damp/ડ /
damp/ડમ્પ/ભેજવાળું
dampen/ડમ્પન/નિરૂત્સાહ કરવું
dampener/ડમ્પર/નિરૂત્સાહ કરનાર
damp-squib/ડમ્પરિક્કબ/સૂરસૂરિયું
damsel/ડમ્સલ/યુવતી, રત્ની, લલના
dance/ડ /
dance/ડાન્સ/નૃત્ય
dander/ડન્ડર/
dandruff/ડન્ડ્રફ/માથાનો ખોડો
dandy/ડન્ડિ/વરણાગિયો, છેલછબીલો
danger(ous)/ડ /
danger/ડન્જર/ભય
dangerous/ડન્જરસ/ભયજનક
dangle/ડંગલ/લટકવું, ટીંગાવું
dank/ડન્ક/ભીનું, ભેજ વાળું
danseuse
dapper/ડપર/મોજીલું, ટાપટીપિયું
dapple/ડપલ/
dappled
darbies/ડારબીઝ/
dare/ડ /
dare/ડેર/હિંમત કરવી
dare-devil/ડેર-ડેવિલ/મરજીવો માણસ, જાંબાઝ
daresay
darg/ડાર્ગ/
dark horse/ડાર્કહોર્સ/છુપો રસ્તમ
dark(ness)/ડ /
dark/ડાર્ક/કાળું, અંધારિયું
darn/ડાર્ન/રફૂ કરવું
dash off-વું
dash/ડ /
dash/ડેશ/ધસી જવું, દોટ મૂકવી, અથડાવું
dastardly/ડાસ્ટર્ડલિ/કાયરતાપૂર્ણ
data/ડેટા/માહિતી પૂટ-સંગ્રહ
database
date/ડ /
date/ડેટ/તારીખ, ખજૂર, સંવનન
daub/ડોઉબ/ચોપડવું, લપેડામારવા
daughter/ડ /
daughter/ડૉટર/પુત્રી
daunt/ડૉઉન્ટ/ડર, ભય
daunting

dauntless/ડૉઉન્ટ/બહાદુર, નિભય
dawdle/ડૉડલ/વેઠ-રમતરાળાં કરવાં
dawn/ડૉન/પરોઢ, જ્ઞાન થવું
day/ડૉ /
day/ડૉઈ/દિવસ
daybreak/ડૉઈબ્રેક/પરોઢ
day-dream/ડૉઈડ્રીમ/દિવાસ્વપ્ન
dayy
dazzle/ડૉઝલ/આંજીદેવું
de facto/ડિક્કેક્ટો/હકિકતમાં
déjà vu/ડેજા વુ/પુર્વાનુભુતિ આભાસ
de jure
de luxe
dead(ful)/ડ /
dead/ડેડ/મરેલું, મૃત, સ્વર્ગસ્થ
deadline/ડેડલાઈન/સમયમર્યાદા **mehtal**
deadlock/ડેડલૉક/મડાગાંઠ
deadly/ડેડલિ/ઘાતક, ખતરનાક
deadpan
deaf/ડેફ /
deaf/ડેફ/બહેરું
deafen/ડેફ/બહેરું બનાવવું
deal with/ડી /
deal with/ડીલવિથ/સોદો-કામ પાર પાડવું
deal/ડેલ /
deal/ડીલ/સોદો, કરાર, લે વેચ કરવી
dear/ડેર /
dear/ડીઅર/વહાલું, મોંઘુ,
dearth/ડેર્થ/તંગી, કમી
death/ડેથ /
death/ડેથ/મોત, મૃત્યુ
debacle/ડેબાક્લ/રકાસ, ઘોર પરાજય
debar
debase
debatable/ડેબેઈટેબલ/ચર્ચાપાત્ર
debate/ડેબેઈટ/ચર્ચા, પરિસંવાદ
debate/ડેબ /
debauchery/ડેબૉચરી/વ્યભિચાર
debaunch
debenture/ડેબેન્ચર/રૂઝણપત્ર
debilitate/ડેબિલિટેઈટ/જજૂરિત થવું
debility/ડેબિલિટી/નબળાઈ
debit/ડેબિટ/ખાતે ઉધારવું
debonair/ડેબોનેર/ખુશમિજાજ, મોકળા મનનું
debrief/ડેબ્રિફ/માહિતી આપવી
debris/ડેબ્રી/ભંગાર, કાટમાળ
debt/ડેટ /
debt/ડેટ/કરજ, દેણું
debug
debunk/ડેબન્ક/ઉઘાડા પાડવું, પોલ ખોલવી

debut/ડેબ્યુ/નવાગતુક, પ્રથમ પ્રવેશ
debutante
débutante/ડેબ્યુટન્ટ/પ્રથમ પ્રવેશ કરનાર
decade/ડેકેડ/દશકો, દશવર્ષ
decadence
decalogueદશ આજ્ઞા/આદેશો(ધર્મ)
decamp/ડેકેમ્પ/નાસી જવું
decandence
decandence
decant/ડેકેન્ટ/દેભ, ડોળ
decapitate
decay/ડેકે/સડવું, કોહવાવું
decay/ડેક /
deceased/ડેસિઝડ/મૃતક, ગુજરી જનાર
deceit/ડેસિટ/છેતરપીડી
deceit/ડેસિટ /
deceive/ડેસીવ/છેતરવું
deceive/ડેસિવ /
decelerate
decent/ડેસન્ટ/ભલું, સરસ, મજાનું, મનોગમ્ય
decent/ડેસન્ટ /
decentralise/ડેસેન્ટ્રલાઈઝ/વિકેન્દ્રીકરણ કરવું
deception/ડેસેપ્શન/છેતરપીડી
deceptive/ડેસેપ્ટીવ/છેતરામણું, ભ્રામક
decide/ડેસાઈડ/નિર્ણય કરવો
decide/ડેસાઈડ /
deciduous
decimal/ડેસિમલ /
decimate/ડેસીમેઈટ/વસ્તી નાશ પામવી
decipher/ડેસાઈફર/સાંકેતિક ભાષા ઉકેલવી
decision/ડેસીઝન/નિર્ણય
decision/ડેસિઝન /
decisive/ડેસાઈઝિવ/નિર્ણયાત્મક
deck/ડેક /
deck/ડેક/તૂતક(વહાણ)
declaim/ડેક્લેઈમ/આવેષમય ભાષણ
declaration/ડેક્લેરેશન /
declaration/ડેક્લેરેશન/ઘોષણા, જાહેરનામું
declare/ડેક્લેર /
decline/ડેક્લેઈન/ઘટવું, નકારવું
declivity/ડેક્લિવિટી/ઢોળાવ
decode/ડેકોડ/સંકેતો ઉકેલવા
decollete
decompose/ડેકમ્પોઝ/સડવું, કોહવાવું
decomposed/ડેકમ્પોઝડ /
decomposition/ડેકમ્પોઝિશન/સડો
decorate/ડેકોરેટ /
decorate/ડેકોરેટ/શણગારવું
decoration/ડેકોરેશન /
decorative/ડેકોરેટિવ/રોચક, સુશોભિત
decorum/ડેકોરમ/શિષ્ટાચાર, ઔચિત્ય

decoy/ડિકોય/પ્રલોભન, છટકું
decrease/ડિક્રીઝ/ઘટાડવું, ઓછું કરવું
decrease/s /
decree/ડિક્રી/ચુકાદો, હુકમ
decree/s /
decrepit
decrepitude
decry/ડિક્રાય/વખોડવું
dedicate/ડિકેટ/સમર્પિત કરવું
dedicated/ડિકેટેડ/સમર્પિત
deduce/ડિડ્યુસ/તારણ કાઢવું
deduce/s /
deducible
deduct/ડિડ્યુક્ટ/અનુમાન તારવવું, બાદ કરવું
deed/s /
deed/ડીડ/કૃત્ય, દસ્તાવેજ
deem/ડીમ/માનવું, ગણવું
deemed to
deep/s /
deep/ડીપ/ઊંડું
deepen/ડીપન/ઘેરું-ગંભીર બનવું
deer/s /
deer/ડીઅર/હરણ
de-escalation/ડિએસ્કેલેશન/બેકાબુ પરિસ્થિતી
deface/ડિકેઈસ/ખરાબ કરવું, કદરૂપું બનાવવું
defalcate/ડિકાલકેટ/હડપ કરવું
defamation/ડિકેઈમેશન/બદનામી, બદનકી
defame/ડિકેઈમ/બદનામી
default/ડિકૉલ્ટ/નિયત, ખામી, ફરજ ચુકવી
defeat/ડિકીટ/પરાજય-આપવો, હરાવવું
defeat/s /
defeatist/ડિકીટિસ્ટ/પરાજયવાદી, નિરાશાવાદી
defecate/ડિકેકેઈટ/મળત્યાગ કરવો
defection/ડિકેક્શન/પક્ષાંતર, પક્ષપલટો
defective/ડિકેક્ટિવ/ખામીવાળું
defector/ડિકેક્ટર/પક્ષપલટુ
defence/ડિકેન્સ/સંરક્ષણ, બચાવ
defence/s /
defend/ડિકેન્ડ/રક્ષણ કરવું, બચાવ કરવો
defend/s /
defendant/ડિકેન્ડન્ટ/બચાવ કરનાર
defensive/ડિકેન્સિવ/રક્ષણાત્મક
defer/ડિફર/મુલતવી રાખવું, નમવું
deference
deferential/ડિફરેન્શીઅલ/મર્યાદાશીલ
defiant/ડિક્વાયન્ટ/ખુલ્લી અવગણના કરતું
deficiency/ડિક્વિસીઅન્સિ/ખામી
deficient/ડિક્વિસીઅન્ટ/અપૂરતું
deficit/ડિક્વિસીટ/ખાધ, અધૂરપ
defile/ડિક્વાઈલ/ભ્રષ્ટ કરવું

define/ડિફાઈન/વ્યાખ્યા, નિશ્ચિત કરવું
definite(ly)/s /
definite/ડિક્વિનેટ/નિશ્ચિત, ચોકકસ
definitive
deflate/ડિક્વેલેઈટ/હવા કાઢી નાખવી
deflect
deflower/ડિક્વ્લાવર/
defoliate
deform/ડિક્વોર્મ/સ્વરૂપ બગાડવું, કદરૂપું કરવું
defray/ડિક્વે/ચુકવણું કરવું
defrock
deft/ડિક્વટ/નિપુણ, કુશળ
defunct/ડિક્વન્ક્ટ/કાલગ્રસ્ત, રદબાતલ
defy/ડિક્વાઈ/પડકારવું, સામે થવું
degenerate/ડિક્વેજનરેટ/પતન થવું
degrade/ડિક્વેડ/પડતી થવી, હલકું પડવું
degraded/ડિક્વેડેડ/પતન થયેલું,
degree/ડિક્વેડી/માત્રા, પ્રમાણ, ઉપાધી
degree/s /
dehydrate
deify/ડિક્વિફાઈ/સંકીર્ણ
deign/ડિક્વેઈન/મહેરબાની કરવી, ગણવું
dejected/ડિક્વેજેક્ટેડ/ગમગીન, ઉદાસ
dejection
dekko/ડિક્વો/
delay/ડિક્વેલેઈ/ઢીલ કરવી, મોડું કરવું
delay/s /
delectation
delegate/ડિક્વેલીગેટ/પ્રતિનિધિ, સત્તા આપવી
delegation/ડિક્વેલીગેશન/પ્રતિનિધિમંડળ
delete/ડિક્વેલીટ/રદ્દ કરવું, કાઢી નાખવું
deleterious/ડિક્વેલેટરિઅસ/હાનિકારક
deliberate(ly)/s /
deliberate/ડિક્વેલીબ્રેઈટ/ઈરાદાપૂર્વક, વિચારવું
delicate/s /
delicate/ડિક્વેલીકેઈટ/નાજુક, સંવેદનશીલ
delicious/ડિક્વિલિશસ/સ્વાદિષ્ટ
delicious/s /
delight/ડિક્વેલાઈટ/આનંદ
delineate/ડિક્વેલીનેટ/રેખાંકિત કરવું
delinquency
delinquency/ડિક્વિલિન્ક્વન્સિ/અપરાધ, ગુન્હાખોરી
delinquent/ડિક્વિલિન્ક્વન્ક્ટ/અપરાધ કરનારું
delirious/ડિક્વિલિરિઅસ/ગાંડપણમાં લવારો કરતું
delirium/ડિક્વિલિરિઅમ/ચિતભ્રમ, સંનિપાત
deliver/ડિક્વિલિવર/તારવું, પહોંચાડવું
deliver/s /
deliverance/ડિક્વિલિવરન્સ/મુક્તિ, છટકારો
delivery/ડિક્વિલિવરિ/પ્રસૂતિ, વહેંચણી
delta
delude/ડિક્વેલ્યુડ/છેતરવું

deluge/ડિલ્યુજ/જળબંબાકાર, પૂર
delusion/ડિલ્યુજન/ખોટોભ્રમ, છેતરપિંડી
delusive
delve
delve into/ડિલ્વ ઈન્ટુ/ડૂબકી મારવી
demagogue/ડિમેગોગ/ટોળા ને ઉશ્કેરતો નેતા
demand/ડિમાન્ડ/માગણી, માગવું
demand/ડ /
demean
demeanor
demeanour/ડિમીનર/રીતભાત, આચરણ
demented
demine
demirep
demise/ડીમાઈસ/અવસાન, મૃત્યુ
demit charge
democracy/ડિમોક્રસિ/લોકશાહી
democratic/ડિમોક્રેટિક/લોકશાહીનું
demographic/ડિમોગ્રાફિક/વસ્તી ને લગતું
demolish/ડિમોલિશ/જમીનદોસ્ત-ધ્વંસ કરવો
demolition/ડિમોલિશન/ધ્વંસ, જમીનદોસ્તી
demon/ડિમન/(**daemon**) શૈતાન, રાક્ષસ
demoniac
demonstrate/ડિમાન્સ્ટ્રેટિવ/દેખાવો-પ્રદર્શન કરવું
demonstration
demonstrative/ડિમોન્સ્ટ્રેટિવ/નિર્દેશનાત્મક
demoralise/ડિમોરાલાઈઝ/
demotic/ડિમોટિક/
demotion/ડીમોશન/પદ-પાયરી ઘટાડો
demur/ડિમર/વાંધો ઉઠાવવો અચકાવું
demure/ડીમર/શરમાળ, ગંભીર, દંભી મોભાદાર
demurrage/ડિમરીજ/વિલંબ શુલ્ક
den/ડ /
den/ડિન/જંગલી પ્રાણીની બોડ-ગુફા
denial/ડિનાઅલ/રદિયો, ઈન્કાર
denigrate/ડિનિગ્રેટ/બદનામ કરવું
denizen/ડિનિઝન/રહેવાસી, વસવાટ કરતું
denomination/ડિનોમિનેશન/મૂલ્યાંક, સંજ્ઞા
denotation
denote/ડિનોટ/સૂચવવું
denouement/ડિનૂમાં/રહસ્યરફોટ
denounce/ડિનાઉન્સ/ઈન્કાર કરવો, નિંદા કરવી
dense/ડ /
dense/ડિન્સ/ઘાટું, ઘનઘોર
density/ડિન્સિટી/ઘટ્ટતા
dent/ડિન્ટ/ઘોબો, ખાંચ, ટોચો
dented/ડિન્ટેડ/ઘોબાવાળું, ખાંચાવાળું
denture/ડિન્ટર/દાંતનું ચોકકું
denundiate/ડિન્નડિએટ/નગ્નકરવું
deny/ડિનાય/ઈન્કાર કરવો
deodorise/ડિઓડરાયઝ/ દુર્ગંધ હટાવવી

depart(ment)/ડ /
depart/ડિપાર્ટ/વિદાય લેવી, રવાના થવું
departure
depend on-
depend on/ડિપેન્ડ/આધાર રાખવો
depend/ડ /
dependant/ડિપેન્ડન્ટ/પરાવલંબી, પરોપજીવી
dependent/ડ /
depends/ડ /
depict/ડિપિક્ટ/શબ્દચિત્રણ કરવું
deplete/ડિપ્લીટ/ઘટાડો કરવો
deplore/ડિપ્લોર/ખેદ વ્યક્ત કરવો
deploy/ડિપ્લોય/વ્યૂહાત્મક રીતે ગોઠવવું(શસ્ત્રો)
deport/ડિપોર્ટ/દેશપાર-નિકાલ કરવું
deportment/ડિપોર્ટમન્ટ/વર્તન, ચાલ
depose/ડિપોઝ/પદભ્રષ્ટ કરવું, સાક્ષી આપવી
deposit/ડિપોઝિટ/જમા કરવું, થાપણ
deposit/ડ /
deposition/ડિપોઝિશન/જુબાની, નિવેદન
depot/ડિપો/કિન્દ્ર, મથક
depot/ડ /
depravity
deprecate/ડિપ્રિકેટ/વખોડી કાઢવું
depress/ડિપ્રેસ/દબાવવું
depress/ડ /
depressed
depression/ડિપ્રેશન/નિરાશા, મંદી, સંકુચન
deprive/ડિપ્રાઈવ/થી વંચિત રાખવું
deprive/ડ /
deprivity
depth/ડ /
depth/ડિથ્પ/ઉંડાણ
deputy/ડિપ્યુટિ/નાયબ, મદદનીશ
derail/ડિરેઈલ/પાટા પરથી ખડી જવું
derailed
derange/ડિરેંજ/ગાંડુ થવું, અવ્યવસ્થિત કરવું
dereliction/ડિરેલિક્શન/ફરજમાં બેદરકારી
deribs/ડિરિબ/કટકે કટકે
deride/ડિરાઈડ/ઉપહાસ-ઠકા મશ્કરી કરવી
derision/ડિરિઈઝન/વિડંબના, હાંસી, ઉપહાસ
derisory
derivative/ડિરાઈવેટિવ/માં થી ઉદ્ભવતું
derive/ડિરાઈવ/વ્યુત્પત્તિ-ઉદ્ભવ થવો(શબ્દ)
derive/ડ /
derogatory/ડિરોગેટરિ/ઉતારી પાડતું
derring do
dervish/ડરવિશ/
descend/ડિસેન્ડ/ઉતરતું
descend/ડ /
descendent/ડિસેન્ડન્ટ/વંશજ, વારસદાર
descent/ડિસન્ટ/ઢાળ, વંશ, ઉદ્ભવ

descent/s /
describe/ડિસક્રાઇબ/વર્ણન કરવું
describe/s /
description/s /
descriptive/ડિસક્રિપ્ટીવ/વર્ણનાત્મક
descriptive/s /
descrier/ડિસ્ક્રાઇવર થી ઓળખી કાઢવું
desecration/ડીસેક્રેશન/ભ્રષ્ટ કરવું
desert/s /
desert/ડિઝર્ટ/તરછોડવું, રણ, ત્યજવું
deserve/ડિઝર્વ/ને લાયક હોવું
deserve/s /
design/ડિઝાઇન/ચિત્ર, કાવત્રુ
design/s /
designate/ડિઝીગનેટ/નિયુક્ત-કરવું
desirable/ડિઝાયરેબલ/ઇચ્છનીય
desirable/s /
desire/ડિઝાયર/ઇચ્છા
desire/s /
desirous/s /
desist from/ડિઝિસ્ટ/ થી દૂર રહેવું
desk/s /
desk/ડિસ્ક/મેજ
desolate/ડિઝોલેટ/વેરાન, અવાવરું, સૂમસામ
despair/ડિસપેર/નિરાશા, હતોત્સાહ
despatch/ડિસ્પેચ/રવાના કરવું
despatch/s /
desperado/ડિસ્પેરેડો/ગુંડો
desperate/ડિસ્પેરેટ/મરણિયો, ધાંધો
despicable/ડિસ્પીકેબલ/ધિક્કારપાત્ર
despise/ડિસ્પાઇઝ/ધિક્કારવું
despite/ડિસ્પાઇટ/તેમ છતાં, માનહાનિ
despoil/ડિસ્પોઇલ/લૂંટફાટ કરવી
despondent/ડિસ્પોન્ડન્ટ/નિરાશ
despotic/ડિસ્પોટિક/સરમુખત્યાર-નિરંકુશ શાસક
dessert/s /
dessert/ડીઝર્ટ/ભોજન અંતેની વાનગી
destabilise/ડિસ્ટેબલાઇઝ/અસ્થિર કરવું
destination/ડિસ્ટીનેશન/મંજિલ, ગંતવ્ય સ્થળ
destine/ડિસ્ટીન/નિમિત્ત બનવું
destiny/ડિસ્ટીની/વિધાતા, ભાગ્ય, કિસ્મત
destitute/ડિસ્ટીટ્યુટ/બેહાલ, નિરાધાર
destroy/ડિસ્ટ્રોય/નાશ કરવો
destroy/s /
destruction/ડિસ્ટ્રક્શન/વિનાશ, પાયમાલી
destruction/s /
destructive/ડિસ્ટ્રક્ટીવ/વિનાશક, તોડફોડિયું
desultory/ડિસલ્ટ્રી/આડેઘડ, જેમતેમ
detach/ડિટેચ/અલગ-છુટું પાડવું
detail/ડિટેઇલ/વિગત

detail/s /
detain/ડિટેઇન/અટકાયત કરવી, રોકી પાડવું
detect/ડિટેક્ટ/શોધી કાઢવું
détente/ડિટાંટ/તંગદિલી ઘટાડવી
detention/ડિટેન્શન/અટકાયત, ધરપકડ
deter/ડિટર/રોકવું, નિરુત્સાહ કરવું
deteriorate/ડિટેરીઓરેટ/વણસવું
determination/s /
determine/ડિટરમાઇન/નિશ્ચય કરવો
determine/s /
deterrent/ડિટરન્ટ/પ્રતિબંધક
detest/ડિટેસ્ટ/ધિક્કારવું
dethrone/ડિથ્રોન/ગાદી પરથી હટાવવું
detonate/ડિટોનેટ/ઘડાકો કરવો
detour/ડિટૂર/ટુંકો રસ્તો લેવો
detract/ડિટ્રેક્ટ/બાદ કરવું, ફંટાવું, વખોડવું
detract/s /
detractor/ડિટ્રેક્ટર/ફંટાબાજ
detrimental/ડિટ્રીમેન્ટલ/નુકસાનકારક
deuce/ડ્યુસ/ટેનિસ માં સરખા અંક
devastate/ડિવાસ્ટેટ/વિનાશ-પાયમાલી વેરવી
devastating/ડિવાસ્ટેટિંગ/વિનાશક
develop/ડિ'વેલપ/વિકસવું
develop/s /
deviate/ડિવિએઇટ/વિષયાંતર કરવું, ચલીત થવું
deviation/ડિવિએશન/વિચલન
device/ડિવાઇસ/યુક્તિ, તરકીબ (નામ)
devil/s /
devil/ડિવિલ/શેતાન, દૈત્ય
devil's dozen તેરની સંખ્યા
devious/ડિવિઅસ/ઢોંગી, કપટી
devise/ડિવાઇઝ/ઘડી કાઢવું, રચના કરવી (ક્રિયા)
devoid of/ડિવોઇડ-ઓફ/ના થી વંચિત-રહિત
devote/ડિવોટ/સમર્પિત કરવું
devote/s /
devotional/ડિવોશનલ/ભક્તિભાવનું
devour/ડિવાઉર/હડપ કરવું, સ્વાહા કરી જવું
devoured
devout/ડિવાઉટ/ભાવિક, શ્રદ્ધાળું
dew/s /
dew/ડ્યુ/ઝાકળ
diabetic/ડાયાબિટિક/મધુપ્રમેહ રોગી
diabolical/ડાયાબોલિક/દુષ્ટ, આસુરી
diadem/ડાયડેમ/મુકુટ, સરતાજ
diagnose/ડાઓગ્નાઇઝ/નિદાન કરવું
diagnosis/ડાઓગ્નોસિસ/નિદાન
diagnostic
diagram/s /
dial/s /
dial/ડાયલ/ચકરું, ચહેરો

dialect/ડાયાલેક્ટ/સ્થાનિક બોલી
dialogue/ડાયલોગ/વાતચિત, વાટાઘાટો
diametrically/ડાયમેટ્રિકલી/સંપૂર્ણરીતે
diamond/ડ /
diary/ડ /
diary/ડાયરી/નોંધપોથી
diatribe/ડાયટ્રાઇબ/સખત ટીકાયુક્ત ભાષા
dicey
dicky/ડિકી/ડ્રાઇવર સીટ
dictate/ડિક્ટેઇટ/કરમાવવું, હુકમ ચલાવવો
dictate/ડ /
dictatorial આપખુદ, સરમુખત્યાર
dictionary/ડિક્શનરી/શબ્દકોશ
dictionary/ડ /
dictum
dicty
didactic/ડાયડેક્ટિક/ઉપદેશાત્મક
diddle/ડિડલ/
die away-વું
die down-વું
die of/from-
die off-વું
die out-વું
die/ડ /
die/ડાઇ/મૃત્યુ પામવું, બીજું, પાસો
die-hard/ડાઇહાર્ડ/રૂઢિચુસ્ત, જીદી, ન સુધરે તેવું
diesel/ડ /
diesel/ડીઝલ/
dietician
differ from થી જુદા પડવું
differ(ence)/ડ /
difference/ડિફરન્સ/
different/ડ /
differentiate/ડિફરન્સિએટ/ભેદ પાડવો-પારખવો
difficul(ty)/ડ /
difficult/ડિફીકલ્ટ/
difficulty with-
diffuse/ડિફ્યુઝ/વિખેરી નાખવું, દુર કરવું
dig at/ડિગ એટ/કટાક્ષ કરવો
dig in-વું
dig into-વું
dig out/ડિગ આઉટ/ખોદી કાઢવું, શોધી કાઢવું
dig out-વું
dig up-વું
dig/ડિગ/ખોદવું, ચાળો કરવો
dig/ડ /
digest/ડાયજેસ્ટ/સારાંશ, પચાવવું
dignitary/ડિગનિટરી/મહાનુભાવ, શ્રેષ્ઠી
dignity/ડિગનિટી/મોભો, સ્વમાન
dignity/ડ /

digress/ડાયગ્રેસ/વિષયાંતર કરવું, ફંટાવું
diktat/ડિક્ટાટ/જોહુકમી
dilapidated/ડિલેપિડેટ/જૂજરિત
dilemma/ડાયલેમા/ધર્મસંકટ, અવઢવ, દ્વિધા
dilettante/ડિલેટાંટ/છીછરું કલારસિક
diligent/ડિલિજન્ટ/ખંતીલું, ધગશ-ચીવટવાળું
diligent/ડ /
dillydally
dilute/ડાઇલ્યુટ/હળવું કરવું, પ્રવાહી પાતળું કરવું
dim/ડિમ/ઝાંખું,
dim/ડ /
dimension/ડાયમેન્શન/પરિમાણ, માપ, પાસું
diminace
diminish/ડિમિનિશ/ઘટવું જવું
diminutive/ડિમ્યુનિટિવ/વામન, ઠિંગુજી
dimple/ડિમ્પલ/ગાલનો ખાડો, ખંજન
din/ડિન/કોલાહલ, ઘોંઘાટ
dinder/ડિન્ડર/
dine/ડ /
dine/ડાઇન/જમવું
dinkum/ડિન્કમ/અસલ, સાચું
dinky/ડિન્કી/રૂપાળું, દેખાવડું, મજાનું
dinner/ડિનર/રાત્રીભોજન
dinner/ડ /
dint/ડિન્ટ/ફટકો, ના જોરે
dip down
dip into-વું
dip/ડિપ/બોળવું, ડૂબકી મારવી, ઘટવું
dip/ડ /
diphthong/ડિપથોન્ગ/દ્વિસ્વર
diplomacy chankya-niti
diplomat/ડિપ્લોમેટ/રાજદૂત
diplomatic
dipsomania/ડિપ્સોમેનિએક/દારૂની લત
dire/ડાયર/દારૂણ, સખત
direct(ion)/ડ /
direct/ડાયરેક્ટ/સીધું, સૂચના આપવી
direction/ડાયરેકશન/દિશા, સૂચના
directional/ડાયરેકશનલ/દિશાસૂચક
directive/ડાયરેક્ટિવ/સૂચના, આદેશ
directorate/ડાયરેક્ટરેઇટ/
dirge/ડિર્જ/મરશિયું, શોકગીત
dirt(y)/ડ /
dirt/ડર્ટ/ઘૂળ, ગંદકી
disagree/ડ /
disappear/ડિસએપીઅર/અદ્દશ્ય થવું, લુપ્ત થવું
disappear/ડ /
disappoint(ment)/ડ /
disappoint/ડિસઅપોઇન્ટ/નિરાશ કરવું
disappointed with/at/about-
disapprove/ડ /

disarray अस्तव्यस्त, वेरविभेद
disaster डिआस्टर/छोनारत
disastrous डिआस्टरस/छोनारत
disavow
disburse डिस्बर्स/युक्वधुं करवुं
discard डिस्कार्ड/किंकी देवुं
discern डिर्सन/भेद पारभवो
discharge डिस्चार्ज/रजा आपवी
disciple डिसाइपल/शिष्य, येवो
disciplinary डिसीप्लीनरी/शिस्त अंगेनुं
discipline डिसीप्लीन/शिस्त
disclose डिस्कलोज/जाहेर करवुं
discontent डिस्कन्टेन्ट/असंतोष
discord डिस्कॉर्ड/विसंवाद, अंश
discordant डिस्कॉर्डन्ट/विसंवादी
discourage /s /
discover डिस्कवर/शोधवुं
discoverable
discovery /s /
discreet डिस्क्रीट/विवेकी, वर्तन सभान
discrepancy डिस्क्रीपन्स/क्षति, भामी
discretion डिस्क्रीशन/भनस्वीपधुं
discriminate डिस्क्रीमीनेट/भेदभाव राभवो
discrimination डिस्क्रीमिनेशन/भेदभाव, पक्षपात
discursive डिस्कर्सिव/रसाण
discuss(ion) /s /
discuss डिस्कस/
discussion about-
disdain डिस्डेन/धृष्टा, तिरस्कार
disease डिजीज/रोग
disease /s /
disentangle डिस्एन्टेंगल/गूथ उकेलवी
disfigure डिस्फिगर/कदवुं बनावुं
disgrace डिस्ग्रेस/मानडानि, शरम, नामोशी
disgraceful डिस्ग्रेसफुल/शरमजनक, भेशरम
disguise डिस्गायज/वेश पलटो करवो
disgust डिस्गस्ट/सूग, कंटाणो, चितरी
disgust /s /
dish out डिस्-आउट/वहेंथी आपवुं
dish out-वुं
dish up-वुं
dish डिश/थाणी
dish /s /
dishearten डिस्हार्टन/ना-छिंमत करवुं
dishevelled डिस्हीवल्ड/अस्तव्यस्त
dishonour डिस्ओनर/अनादर करवो
disillusion डिस्इल्युजन/भ्रममुक्ति, सत्य समजावुं
disintegrate डिस्इन्टीग्रेट/छुट्टे-अलग प.डी जवुं
disinter डिस्इन्टर/भोदी काढवुं
dislocate डिस्लोकेट/छुट्टे प.डवुं, पसी जवुं

dislodge डिस्लॉज/अस्थिर करवुं
dismal डिस्मल/भेंकार, उदास
dismantle डिस्मॉन्टल/
dismay डिस्मे/नाछिंमत-नासी पास थवुं
dismember डिस्मेम्बर/अंग छेदवुं, भागलां करवा
dismiss डिस्मिस/छकालपटी करवी, नकारवुं
dismiss /s /
disobedient डिस्अबिडियन्ट/अनाज्ञाकित
disobey डिस्ओबे/अवज्ञा करवी
disobey /s /
disorderly डिस्अर्डर/अस्तव्यस्त
disown डिस्ओन/अस्विकार करवो, तरछोडवुं
disparage डिस्पॅरेज/निंदा करवी
disparate डिस्पॅरेट/
disparity डिस्पॅरिटी/असमानता
dispassionate
dispatch डिस्पॅच/(despatch) रवाना करवुं
dispatch /s /
dispel डिस्पॅल/
dispense with-वुं
disperse डिस्पर्स/विभेरी नापवुं, छुट्टे पासवुं
disphoria डिस्फोरिया/अति बेथेनी-तनाव
displace डिस्प्लेस/निर्वासित थवुं
display डिस्प्ले/दभाडवुं, निदर्शन करवुं
display /s /
displease /s /
disposable डिस्पॉजेबल/निकाल थठ शके तेवुं
disposal डिस्पॉजल/निकाल
dispose off-वुं
dispose डिस्पोज/निकाल करवो
dispose /s /
dispute डिस्प्युट/विवाद
disquiet अशांति
disquiet डिस्कवाय/अशांति
disregard डिस्रीगार्ड/अवगणना-करवी
disrespect डिस्रीस्पेक्ट/अनादर, अविवेक
disrupt डिस्रप्ट/छुट्टे प.डी जवुं, अस्तव्यस्त थवुं
dissect डिस्सेक्ट/कापकूप द्वारा पृथक्करण करवुं
dissension
dissent डिसेन्ट/मतभेद, असंतोष
dissent /s /
dissident डिस्सिडन्ट/असंतुष्ट
dissimilar डिस्सिमिलर/भिन्न
dissolve डिस्सोल्व/विभेरेवुं, ओगाणवुं
dissuade डिस्सुअड/न करवा समजावुं
distaff डिस्टाफ़/तकली, त्राक
distance /s /
distant डिस्टन्ट/दूरवुं
distant /s /
distantce डिस्टन्स/अंतर

distill/ડિસ્ટિલ/શુદ્ધ કરવું (રાસાયણિક)
distinct/ડિસ્ટિન્ક્ટ/સ્પષ્ટ, આગવું
distinctive
distinguish/ડિસ્ટિન્ક્ટ/ભેદ પારખવો
distinguished/ડિસ્ટિંગ્વીશ્ડ/ગણમાન્ય, વિશિષ્ટ
distort/ડિસ્ટોર્ટ/વિકૃત રજૂઆત કરવી
distract/ડિસ્ટ્રેક્ટ/બેભાકળ-બેધ્યાન કરવું
distract/ડ /
distraught/ડિસ્ટ્રોટ/ખૂબ અસ્વસ્થ
distribute/ડિસ્ટ્રીબ્યુટ/વહેંચણી કરવી
distribute/ડ /
district/ડિસ્ટ્રીક્ટ/જિલ્લો
district/ડ /
distrust/ડિસ્ટ્રસ્ટ/અવિશ્વાસ
disturb(ance)/ડ /
disturb/ડિસ્ટર્બ/ખલેલ-અશાંતિ કરવી
ditch/ડિચ/ખાડો, તરછોડવું, ઘકકો દેવો
ditch/ડ /
dither/ડિઠર/ભયથી કાંપવું
ditty/ડિટિ/સરળ-ટૂંકુ ગીત-કાવ્ય
diurnal/ડાયુરનલ/દિવસનું
diva/ડાયવે/સંગીતસામ્રાજી, ગાયીકા
dive/ડ /
dive/ડાયવ/ખાબકવું, ભૂસકો મારવો
diverge/ડાયવર્જ/ફંટાવું
divergent/ડાયવર્જન્ટ/ફંટાવું, વિવિધ, ભિન્ન
divers/ડાયવર્સ/પરચુરણ
diverse/ડાયવર્સ/વિવિધ
diversification/ડાયવર્સિફિકેશન/વૈવિધ્યકરણ
divert/ડાયવર્ટ/બીજી દિશામાં વાળવું
divest/ડાયવેસ્ટ/છીનવવું, રોકાણ પાછું ખેંચવું
divide ભાગલા
divide into
divide out-વું
divide up-વું
divide(d)/ડ /
divide/ડિવાઈડ/ભાગલાં કરવા
dividend/ડિવિડન્ડ/નફા ના ભાગની રકમ
divine/ડિવાઈન/દિવ્ય, અલૌકિક, દૈવી
divine/ડ /
divisible/ડિવિઝિબલ/વિભાજ્ય
division/ડિવિઝિન/વિભાજન
division/ડ /
divisional/ડિવિઝનલ/વિભાગીય
divorce/ડીવોર્સ/છૂટાછેડા
divulge
divulge/ડાયવલ્જ/ઉઘાડું પાડવું, કહી દેવું
do =ditto એજ
do away with
do away with વ્યર્થ બનાવવું

do away with/ડ /
do by-વું
do down-વું
do for/ડ /
do for-વું
do in-વું
do out of-વું
do out-વું
do over-વું
do up-વું
do with-વું
do without-વું
do/ડ /
do/ડૂ/કરવું
docile/ડોસાઈલ/નમ્ર, નરમ, ગરીબડું
dock/ડ /
dock/ડૉક/આરોપીનું પાંજરું, બંદર, કાપકૂપ કરવી
doctor/ડ /
doctor/ડૉક્ટર/દાકતરપીમિ
doctrine/ડૉક્ટ્રીન/સિધ્ધાંત, બોધ
document(ary)/ડ /
document/ડોક્યુમન્ટ/દસ્તાવેજ
documentary/ડોક્યુમેન્ટરી/દસ્તાવેજી
dodge/ડ /
dodge/ડોજ/દાવપેચ રમવા, ટાળવું
doff/ડ /
doff/ડોફ/ટોપી ઉતારવી
dog(ged)/ડ /
dog/ડોગ/કૂતરો,
dogged/ડોગેડ/હઠીલું, ચીવટવાળું
dogma/ડોગમા/માન્યતા, સિધ્ધાંત
do-gooder/ડૂ ગુડર/ભલું, ઉપકાર કરનાર
doldrums/ડોલડ્રમ્સ/ઉદાસ, ભિન્ન
doleful/ડોલફુલ/ગમગીન, ઉદાસ
doles/ડોલ્સ/સરકારી રાહત, બેકારી ભથ્થું
doll/ડ /
doll/ડોલ/ઢીંગલી
dollar/ડ /
dollar/ડૉલર/અમેરિકન ચલણ
dollop/ડોલોપ/લોંદો
dolorous/ડોલરસ/શોકમગ્ન
domain/ડોમેન/જાગીર, મુલક, પ્રદેશ
domestic/ડમેસ્ટિક/ઘરગથ્થુ, ઘરનું
domicile/ડોમિસાઈલ/કાયમી વસવાટનું સ્થળ
dominance/ડોમિનન્સ/વર્ચસ્વ, પ્રભુત્વ
dominant
dominant/ડોમિનન્ટ/વર્ચસ્વવાળું
dominate/ડોમિનેઈટ/પ્રભુત્વ હોવું, છવાઈ જવું
don/ડ /
don/ડૉન/ગુંડાનો સરદાર, ધારણ કરવું

donate /ડ/ /	doze /ડોઝ/ઝોડું ખાવું
donate /ડોનેટ/દાન આપવું	drab /ડ્રબ/કંટાળાજનક, શુષ્ક
done up	draconian /ડ્રકોનિઅન/કૂર, અતિકડક
done /ડ/ /	draft doctrine મુસદ્દો
done /ડન/કરેલું, થયેલું	draft /ડ/ /
donkey /ડ/ /	draft /ડ્રાફ્ટ/રૂપરેખા, બેંક ડ્રાફ્ટ
donkey /ડોંકી/ગધા	drag behind -વું
donor /ડોનર/દાતા	drag on -વું
doodle /ડુડલ/અર્થહીન લીટા દોરવા	drag out -વું
doom /ડુમ/નાશ, વિનાશ	drag up -વું
doomsday /ડુમ્સડે/કયામતનો દિવસ	drag /ડ/ /
door /ડ/ /	drag /ડ્રેગ/ધસડવું
door /ડોર/બારણું	dragin -વું
doorway /ડ/ /	dragnet /ડ્રેગનેટ/લચન
dormant /ડોરમન્ટ/સુપ્ત, નિષ્ક્રિય	dragon /ડ/ /
dorsal /ડોરઝલ/પાછળનું (પ્રાણી-અંગ)	dragon /ડ્રોગન/અજગર (ચીન)
dose /ડ/ /	drain /ડ/ /
dose /ડોઝ/માત્રા, પ્રમાણ	drain /ડ્રેઇન/વહી-વેડફાઇ જવું
dossier /ડોસિઅર/દસ્તાવેજોની ફાઇલ	drama(tist) /ડ/ /
dot /ડ/ /	drama /ડ્રામા/નાટક
dot /ડોટ/ટપકું, મીડુ	dramatist /ડ્રમેટિસ્ટ/નાટયાકાર
dotage /ડોટિજ/વૃદ્ધ અને નબળું	drastic /ડ્રાસ્ટીક/કઠોર, કડક
doting /ડોટિંગ/ખૂબ વહાલ વરસાવવું	draught /ડ/ /
double back -વું	draught /ડ્રાફ્ટ/તાણ, લહેર
double up -વું	draw along side -વું
double/over/up -વું	draw away -વું
double /ડ/ /	draw back -વું
double /ડબલ/બેવડું,	draw in -વું
double-cross /ડબલક્રોસ/દગો કરવો	draw on -વું
double-entendre /દબલએતાંદ્ર/દ્વિઅર્થી	draw out /ડ/ /
doublespeak /ડબલસ્પીક/બે મોઢાની વાત	draw out -વું
doubt /ડ/ /	draw up
doubt /ડાઉટ/શંકા	draw up /ડ/ /
dough /ડવ/બાંધેલો લોટ	draw up -વું
doughty /ડાઉટી/બહાદુર, શૂરવીર	draw /ડ/ /
dour /ડાઉર/સખત	draw /ડ્રો/ખેંચવું, દોરવું, હારજીત વિના
douse /ડાઉઝ/ઓલવવું	drawback /ડ્રોબેક/ત્રુતિ, ખામી
dove /ડ/ /	dread /ડ/ /
dove /ડવ/કબૂતર, ભીરુ	dread /ડ્રેડ/ધાક, ભય
dowdy /ડાઉડી/કૂવડ, લઘરવઘર, લબાડ	dreadful /ડ્રેડફલ/ખતરનાક, ભયાનક
down to earth વાસ્તવિક, વ્યવહારું	dream away -વું
down v	dream of/about -
down /ડ/ /	dream up -વું
down /ડાઉન/નીચે, પરાજિત	dream /ડ/ /
downfall /ડાઉનફોલ/પડતી, પતન, વળતા પાણી	dream /ડ્રીમ/સ્વપ્ન
downpour /ડાઉનપોર/ધોધમાર વરસાદ	redge up -વું
down-trodden દલિત-કચડાયેલવર્ગ	redge /ડ્રેજ/કચરો, અવશેષ
dowry /ડાઉરી/દહેજ	drench /ડ્રેન્ચ/તરબોળ થવું
doyen /ડોયેન/અગ્રણી, બિખ્મપિતામહ	dress in -
doze /ડ/ /	dress up -વું

dress/s /**dress**/ડ્રેસ/કપડાં -પહેરવાં**dribble**/ડ્રિબલ/ટપકવું, દડાથી રમત કરવી**drift**/ડ્રિફ્ટ/તણાવું, ઝોક, વલણ**drift**/s /**drill**/ડ્રિલ/કવાયત, કાણું પાડવું**drill**/s /**drink down**-વું**drink in**-વું**drink up**-વું**drink**/ડ્રિંક/પીણું-પીવું**drink**/s /**drip**/ડ્રિપ/ટપકવું**drip**/s /**drive at**-વું**drive back**-વું**drive home**-વું**drive into****drive off**-વું**drive on**-વું**drive up**-વું**drive**/s /**drive**/ડ્રાઇવ/ડુંબેશ, માર્ગ, જુસ્સો**drizzle**/ડ્રિઝલ/ઝરમર વરસાદ**drone**/ડ્રોન/ગુંજારવ**drool**/ડ્રૂલ/લાળ ટપકવી**drop back**-વું**drop behind**-વું**drop in**-વું**drop off**-વું**drop out**-વું**drop**/ડ્રોપ/પડતું મૂકવું, પ્રવાહીનું ટીવું**dropsy**/ડ્રોપ્સી/જલોદર (રોગ)**dross**/ડ્રોસ/નકામું, ફાલતું**drought**/s /**drought**/ડ્રાઉટ/અછત**drove**/ડ્રોવ/**drown**/s /**drown**/ડ્રાઉન/ડૂબી જવું**drowsy**/ડ્રોઝી/ઊંઘ-ઘેન કે તંદ્રામાં**drudge**/ડ્રજ/વેતરું કરવું**drudgery****drug**/s /**drug**/ડ્રગ/દવા, નશીલો પદાર્થ**drum into**-વું**drum up**-વું**drum**/s /**drum**/ડ્રમ/ઢોલક**drunk**/s /**drunk**/ડ્રંક/પીધેલું**drunkard**/ડ્રંકર્ડ/દારૂડિયો**dry off**-વું**dry out**-વું**dry up**-વું**dry**/s /**dry**/ડ્રાઇ/સુકું-સુકવવું**dual**/s /**dual**/ડ્યુઅલ/દ્વિસ્તરીય, બેવડું**dubious**/ડ્યુબિયસ/શંકાસ્પદ**duck**/s /**duck**/ડક/બતક, નીચે બેસી જવું**ductile**/ડકટાઇલ/કળ્યાગવું**dud**/ડડ/ફલોપ, નિષ્ફળ, સૂરસૂરિયું**dude**/ડ્યુડ/વરણાગિયો, છેલછબીલો**dudgeon**/ડજન/કોધ, ગુસ્સો**due**/s /**due**/ડ્યુ/કરજ, યોગ્ય, અપેક્ષિત**due**/ડ્યુ/આવવાની ધારણા**duel**/s /**duel**/ડ્યુઅલ/ઢંદયુધ્ધ, મલ્લયુધ્ધ**duet**/ડ્યુએટ/યુગલ**duff**/ડફ/નકામું, બેકાર, ફાલતું**duffer**/ડફર/જડ, મંદબુધ્ધિ**dull**/s /**dull**/ડલ/ઠોઠ, નિસ્તેજ**duly****dumb**/ડમ/મૂંઝુ**dummy**/ડમી/નકલી, બનાવટી, ખોટું**dump**/s /**dump**/ડમ્પ/ઠાલવવું, ઢગલો કરવો, વિષાદ**dun**/ડન/આકરી ઉઘરાણી કરનાર**dunce**/ડન્સ/ઠોઠ નિશાળિયો**dunderhead**/ડન્ડરહેડ/મૂર્ખ**dung**/ડન્ગ/છાણ**dungeon**/ડજન/જેલ**dupe**/ડ્યુપ/છેતરવું**duplicate**/ડ્યુપ્લીકેટ/બેવડું**durable**/ડ્યુરેબલ/ટકાઉ, મજબૂત**duress**/ડ્યુરેસ/દબાણ, બળજબરી**during**/s /**during**/ડ્યુરિંગ/દરમ્યાન**dusk**/s /**dusk**/ડસ્ક/સંધ્યા ટાણું**dust**/s /**dust**/ડસ્ટ/ધૂળ**dutiable**/ડ્યુટિએબલ/કરપાત્ર**dutiful**/ડ્યુટિફુલ/કરજનિષ્ઠ**duty**/s /**duty**/ડ્યુટિ/કરજ, જકાત, કર**dwarf**/s /

dwarf/ડવૉર્ફ/ઠિંગુજી, વૈતિયો
dwarfish/ડવૉર્ફ/ઠિંગુજી, વૈતિયું
dwell (up/on)-વું
dwell/ડ /
dwell/ડવેલ/રહેવું, વસવાટ કરવો
dwindle/ડવિન્ડલ/ઘટતું જવું
dye/ડાય/કપડાને રંગવું
dying/ડાયિંગ/રંગને લગતું, મરતું
dynamic/ડાયનેમિક/જોમવાળું, તરવરિયું
dynamics
dynastic/ડાયનેસ્ટિક/વંશ-વારસાગત
dynasty/ડાયનોસ્ટી/રાજવંશ
dysfunction
dyslexia
dyspepsia/ડાયપેપ્સિઆ/
dysphasia/ડાયફેસિઆ/ભાષા વિકાર (બિમારી)
each / /
each/ઈચ/દરેક, પ્રત્યેક
eager / /
eager/ઈગર/આતુર, તલપાપડ
ear / /
ear/ઈઅર/કાન
earlier / /
early / /
early/અ:લી/વહેલું
earn / /
earn/અર્ન/કમાવું
earnest / /
earnest/અર્નેસ્ટ/સંનિષ્ઠ
earth / /
earth/અર્થ/પૃથ્વી
earthen/અર્થન/માટીનું
earthly/અર્થલિ/દુન્યવી, પાર્થિવ
ease off/up-વું
ease / /
ease/ઈઝ/હળવાશ, રાહત
easements/ઈઝમન્ટ/સુખાકારીનો હકક
east(ern) / /
east/ઈસ્ટ/પૂર્વ
eastern/ઈસ્ટર્ન/પૂર્વનું
easy / /
easy/ઈઝી/સહેલું
easy-going/ઈઝી ગોઈંગ/
eat away -વું
eat in -વું
eat into -વું
eat out-વું
eat up-વું
eat / /
eat/ઈટ/ખાવું

eaten/ઈટન/ખાધેલું
eavesdrop/ઈવ્ઝડ્રોપ/ છુપાઈને વાત સાંભળવી
ebb/એબ/ઓટ, વળતાં પાણી, પતન
ebullient/ઈબ્યુલિઅન્ટ/ઊંચળતું
eccentric/ઈકસેન્ટ્રિક/તરંગી, ચક્રમ
ecclesiastic/અકલેઝીઆસ્ટીક/ધર્મોપદેશક
echelon/એશલન/વ્યુહબાજી, ઉડયન રચના
echo/એકો/પડઘો, પ્રતિધ્વનિ
éclat/ઈક્લે/ઝળહળતી ફતેહ, પ્રતિષ્ઠા
eclipse / /
eclipse/ઈક્લિપ્સ/ગ્રહણ-છવાઈ જવું
ecology/ઈકૉલજી/પરિસ્થિતિવિજ્ઞાન
economic(al) / /
economic/ઈકનોમિક/સસ્તું, આર્થિક
economical/ઈકોનોમિકલ/કરકસરચુકત
ecosystem/ઈકોસિસ્ટમ/પર્યાવરણ પરાવલંબન
ecstasy/ઈક્સ્ટેસિ/હર્ષોન્માદ, આનંદ-વિભોર
ecstatic/ઈક્સ્ટેટીક/ઉન્માદિત, ગદગદિત
edge out-વું
edge / /
edge/એઈજ/ધાર, કોર, ધીમી ધીમે ખસવું
edgy/એઈજી/ચીરિયું
edible / /
edible/એડિબલ/ખાદ્ય, ખાવાલાયક
edicts/એડિક્ટ્સ/શિલાલેખ, રાજાજ્ઞા, ફરમાન
edifice/એડિફીસ/મકાન, ઈમારત
edition / /
edition/એડિશન/આવૃત્તિ
editorial/એડિટોરિઅલ/સંપાદકીય
educate(ed) / /
educate/એજ્યુકેઈટ/શિક્ષિત કરવું
education / /
erie/ઈઅરી/અજબ, વિચિત્ર, ભયપ્રેરક
effect(ive) / /
effect/ઈફેક્ટ/અમલ, પરિણામ, અસર, છાપ
effective/ઈફેટિવ/અસરકારક
effects/ઈફેક્ટ્સ/માલ, ચીજ વસ્તુ
effeminate બાયલું, સ્ત્રીસહજ
effervescent ઊભરાતું
effete/એફીટ/ખખડી ગયેલું, નબળું
efficacy પરિણામજન્યતા, અસરકારકતા
efficient કાર્યકૂશળ, કાર્યદક્ષ
efficient(ly) / /
effigy/એફિજી/પૂતળું
effluent/ઈફ્લુઅન્ટ/ પ્રદૂષિત પ્રવાહ, પ્રવાહી બગાડ
effort / /
effort/ઈફર્ટ/પ્રયત્ન
effrontery/ઈફ્રન્ટ્રી/નફટાઈ
egg on -વું
egg / /

egg/એગ/ઈડુ
egghead/એગહેડ/ બુધ્ધિજીવી, નિષ્ણાંત
ego અહમ્, હું પશું
egoist સ્વાર્થી
egotist આપવડાઈ કરતું
egregious/ઈગ્રીજસ/આઘાતજનક, ખરાબ
eight /
eight/એઈટ/આઠ
eighty-six verb
either /
either/આઈધર/
eject બહાર ધકેલવું
eke out
elaborate
elaborate /
elaborate//વિસ્તૃત, લંબાણભર્યું
élan/ઈલે/શાંતચિત્ત, જુસ્સો, પ્રસન્નતા
elapse સરકવું,
elaque
elastic સ્થિતિસ્થાપક
elastic /
elate ઉત્તેજિત, ભાવવિભોર
elbow /
elbow/એલબો/કોણી
elder(ly) /
elder/એલ્ડર/વડિલ, મોટું
eldorado/એલ્ડરાડો/કલ્પિત સુવર્ણભૂમિ
eldritch/એલ્ડરિચ/વિકરાળ, ભયાનક
elect /
elect/ઈલેક્ટ/ચૂંટવું
election /
electoral
electorate મતદાતા
electric(ity) /
electric/ઈલેક્ટ્રિક/વિજળી
electricity/ઈલેક્ટ્રિસિટિ/
electrify ઉત્તેજિત કરવું
electrocute વીજળી થી મોત
electronic /
electronic/ઈલેક્ટ્રોનિક/
eleemosynary દાન પર નભતું
elegant ભવ્ય, ખૂબસુરત
elegy/એલિજિ/શોકગીત
elementary /
elementary/એલિમેન્ટરી/પાયાનું મૂળભૂત
elephant /
elephant/એલીફન્ટ/હાથી
elevate/એલીવેઈટ/ઉંચું કરવું
elevator/એલીવેટર/લિફ્ટ (મકાન)
elicit /
elicit/ઈલિસિટ/માહિતી કઢાવવી

eligible/એલિજીબલ/લાયક
eliminate/એલિમિનેટ/બાકાત રાખવું-કરવું
elipsis
elite/એલીટ/ઉચ્ચવર્ગનું, ચુનંદા
elitist/એલિટિસ્ટ/વર્ચસ્વવાળું
elixir/ઈલિક્સર/સંજીવની, અમૃત
elliptical/ઈલિપ્ટિકલ/લંબગોળ
elope/ઈલોપ/પ્રેમી સાથે નાસી જવું
eloquence/ઈલોકવન્સ/વક્તૃત્વ
eloquent/ઈલોકવન્સ/વાકપટુ, વાચાળ
else /
else/એલ્સ/બીજું
elucidate/ઈલ્યુસિડેઈટ/પ્રકાશ પાડવો
elude /
elude/ઈલ્યુડ/સરકી-દૂર જતું
elusive /
elusive/ઈલ્યુઝિવ/સરકી જતું
emaciate/ઈમૅસિએટ/નબળું બનાવવું
emanate/એમનેટ/માંથી આવવું, ઉદ્ભવવું
emancipate/ઈમેન્સિપેઈટ/છુટકારો-મુક્તિ આપવી
emasculate/ઈમૅસ્ક્યુલેટ/ખસી કરવું, બાયલું બનાવવું
embalm
embankment/અંબૅન્કમન્ટ/પાળ, બંધ
embargo/એમ્બાર્ગો/પ્રતિબંધ
embark/એમ્બાર્ગો/સાહસ-યાત્રા શરૂ કરવી
embarrass(ment) /
embarrass/અંબૅરૅસ/મૂંઝવવું
embassy/અંબૅસિ/એલચીકચેરી
embedded
embellish/એમ્બેલિશ/ચમકાવવું
embezzle/એમ્બેઝલ/ઉચાપત કરવી
emblazon/એમબ્લેઝન/લાક્ષણિક શણગાર કરવા
emblem/એમબ્લમ/પ્રતિક, ચિન્હ
embodiment/એમ્બોડિમન્ટ/સ્વરૂપ, અવતાર
embody/એમ્બોડિ/મૂર્તસ્વરૂપ હોવું
embolden/એમ્બોલ્ડન/હિંમત આપવી
embonpoint અદોદરું શરીર
emboss/એમ્બોઝ/ઉપસાવવું
embrace/એમ્બ્રેસ/આલિંગન આપવું
embroiled/એમ્બ્રોઈડલ્ડ/વિવાદમાં ફસાયેલું
embryo/એમ્બ્ર્યો/ગર્ભ-પ્રાથમિક અવસ્થા
emend /
emend/ઈમેન્ડ/સુધારવું
emerge/ઈમર્જ/બહાર આવવું
emergency
emergent
emerging
emigrant/એમિગ્રન્ટ/દેશબહાર જનાર
eminent/એમિનન્ટ/શ્રેષ્ઠ, વિખ્યાત
emissary/એમિસારિ/ખાસદૂત, જાસૂસ
emission/એમિશન/ઉત્સર્જન, નિકાલ

emolument/ઈમોલ્યુમન્ટ/વળતર, પગાર
emotion / /
emotion/ઈમોશન/લાગણી
emotional/ઈમોશનલ/લાગણીસભર
emotive/ઈમોટિવ/ભાવનાત્મક
emperor/એમ્પેરર/શહેનશાહ
emphasis/એમ્ફેસિસ/ભાર, વજન
emphasise / /
emphasise/એમ્ફેસાઈઝ/ભાર મૂકવો
emphatically
empirical/એમ્પેરિકલ/પ્રસ્થાપિત સિધ્ધાંત
employ(ee) / /
employ(er-ment) / /
employ/ઈમ્પ્લોય/કામ-નોકરી આપવી
empower/એમ્પાવર/સત્તા આપવી
empty / /
empty/એમ્પ્ટી/ખાલી
emulate/એમ્યુલેટ/અનુકરણ કરવું
enable/ઈનેબલ/શક્તિમાન-સમર્થ બનાવવું
enact kaaydo ghadvo
encamp/એન્કેમ્પ/મુકામ-પડાવ નાખવો
encircle/એન્સર્કલ/ઘૂમરાવું, ઘેરવું
enclave/એન્કલેવ/પરદેશી સત્તાનો પ્રદેશ
enclose / /
enclose/એન્કલોઝ/સાથે બીડવું, ઘેરવું
enclosure / /
encomium/એન્કોમિયમ/વખાણ, પ્રશંસા
encompass/એનકમ્પાસ/ઘેરાવો લેતું ઘેરવું
encore/ઓકો/વન્સ મોર
encounter/એન્કાઉન્ટર/મુકાબલો, અથડામણ
encourage(ment) / /
encourage/એન્કરેજ/પ્રોત્સાહન આપવું
encroach/એનક્રોચ/પેશકદમી કરવી
encyclopaedia / /
encyclopaedia/એનસાયકલોપિડિયા/જ્ઞાનકોષ
end up-વું
end / /
end/એન્ડ/અન્ત, પુરું થવું,
endeavour/એન્ડેવર/પ્રયત્ન
endemic/એન્ડેમિક/કાયમી રોગ
endgame/એન્ડગેઈમ/અંતાક્ષરી
endogamy/એન્ડોગમી/સગોત્ર વિવાહ
endorse/એન્ડોર્સ/સર્મથન આપવું, સહી કરવી
endow/એન્ડાઉ/સંપન્ન કરવું, થાપણ મૂકવી
endued/એન્ડ્યુડ/
endurable/એન્ડ્યુરેબલ/સહ્ય, ટકાઉ
endurance/એન્ડ્યુરન્સ/સહનશીલતા, ક્ષમતા
endure / /
endure/એન્ડ્યુર/ટકવું, સહન કરવું
enemy / /

enemy/એનીમિ/દુશ્મન, શત્રુ
energetic/એનરજેટિક/સ્ફૂર્તિવાળું
energy / /
energy/એર્નજી/શક્તિ, તાકાત, ઉર્જા
enervate/એનર્વેઈટ/અશક્ત બનાવવું
enfant terrible
enforce/એન્ફોર્સ/અમલ કરવો
enfranchise/એન્ફ્રાઈઝ/મતાધિકાર આપવો
engage(ment) / /
engage/એન્ગેજ/માં રોકવું, સગાઈ કરવી
engaged/એન્ગેઈજ/વ્યસ્ત, સગાઈ થયેલું
engagement
engine(er) / /
engine/એન્જીન/
engineer/એન્જિનિઅર/
engrave/એન્ગ્રેઈવ/કોતરવું
engross/એન્ગ્રોસ/તલલીન થવું
engulf/એન્ગલ્ફ/ઘેરવું, ગળી જવું
enhance/એન્હેન્સ/આગળ વધારવું
enigma/એનિગ્મા/કોયડો, ગૂઢ રહસ્ય
enjoy(able) / /
enjoy/ઈન્જોય/માણવું
enjoyment / /
enlarge/એન્લાર્જ/મોટું કરવું
enlighten/એન્લાઈટન/જ્ઞાનથી જાગૃત કરવું
enlist/એન્લિસ્ટ/યાદી કરવી
enliven/એન્લિવન/જીવંત બનાવવું
enmeshed/એન્મેશ/જાળમાં ફસાવવું
ennui/એન્વી/થાક, કંટાળો, સુસ્તી
enormous / /
enormous/ઈનોરમસ/વિરાટ, મહાકાય, પ્રચંડ
enough / /
enough/ઈનફ/પૂરતું પર્યાપ્ત
enquire / /
enquire/ઈન્કવાયર/તપાસ, પૂછપરછ કરવી
enrage/એનરેઈજ/ત્રાડૂકવું, કોપાયમાન થવું
enrich/એનરિચ/સમૃદ્ધ બનાવવું
enrol(ment) / /
enrol/એન્રોલ/નામ-પ્રવેશ નોંધણી કરવી
ensconced/એન્સ્કોન્સ/આશ્રિત, સ્થાપિત
ensemble/એન્સેમ્બલ/
enslave/એન્સ્લેવ/ગુલામ બનાવવું
ensue/એન્સ્યુ/આનુસંગિક
ensure / /
ensure/ઈન્શ્યૂર/પાકું કરવું, ખાત્રીકરવી
entail/એન્ટેઈલ/અનુસરવું
entangle/એન્ટેંગલ/ગૂંચવાવું, અટવાવું
entanglement/એન્ટેંગલમન્ટ/ગૂંચવાડો, ધર્મસંકટ
enter (up/on)-વું
enter into-વું

enter / /
enter /એન્ટર/દાખલ કરવું, પ્રવેશવું
enterprise /એન્ટરપરાઇઝ/સાહસ
entertain(ment) / /
entertain /એન્ટરટેઇન/ધ્યાન દેવું, મનોરંજનકરવું
enthrall /એન્ટ્રોલ/મંત્રમુગ્ધ કરવું, મોહિત કરવું
enthuse
enthusiasm /એનથ્યુઝિઝમ/ઉત્સાહ, ઉમંગ
enthusiast
enthusiastic /એનથ્યુઝિઝ્ટિક/ઉત્સાહી
entice /ઇન્ટાઇસ/લલચાવવું, લોભાવવું
entire / /
entire /ઇન્ટાયર/સમગ્ર, સંપૂર્ણ
entitle /એન્ટાઇટલ/હકદાર હોવું, અધિકાર હોવો
entourage /એન્ટૂરેજ/
entrance / /
entrance /એન્ટ્રાન્સ/પ્રવેશ
entrap /ઇન્ટ્રાપ/જાળ, છટકું, ફસાવવું
entrap /એન્ટ્રાપ/જાળમાં ફસાવવું
entreat /એન્ટ્રીટ/કાલાવાલા, આજીજી કરવી
entrench /એન્ટ્રેન્ચ/ભરાય રહેવું
entrepreneur /આન્ટ્રાપ્રનર/ઉદ્યોગ સાહસિક
entrust /એન્ટ્રસ્ટ/ભરોસો મૂકવો
enumerate
envelop /એન્વેલપ/લપેટવું
envelope / /
envelope /એન્વેલપ/
envious / /
envious /એન્વિઅસ/ઇર્ષ્યાળું
environ /એન્વીરોન/પર્યાવરણ
environment / /
environment /એનવાયરમન્ટ/પર્યાવરણ
envisage /એન્વીસેજ/કલ્પના, આશા કરવી
envoy /એન્વૉય/રાજદૂત, એલચી, ખાસ પ્રતિનિધિ
envy / /
envy /એન્વિ/ઇર્ષ્યા કરવી, અદેખાઈ
ephemeral /ઇફેમરલ/ક્ષણભંગુર, ક્ષણિક
epic / /
epic /એપિક/મહાકાવ્ય, વીરચરિત્ર ગાથા
epicenter /એપિસેન્ટર/ધરતીકપનું ઉદ્દગમ બિંદુ
epicurean /એપિક્યુરીઅન/ભોગવાદી-વિલાસી
epidemic /એપિડેમિક/રોગચાળો
epigram /એપિગ્રામ/મર્મ વાળી ટૂંકી વાત
epilepsy /એપિલેપ્સિ/વાઈ, મૂછાઈ
epilogue /એપિલોગ/ઉપસંહાર
episode /એપિસોડ/પ્રસંગ, હપ્તો
epitome /એપિટમ/સારાંશ
epoch /ઇપૉક/જમાનો, યુગ
equal(ity) / /
equal /ઇકવલ/સમકક્ષ, બરોબરીયું, બરાબર

equality /ઇકવૉલિટી/સમાનતા
equanimity /ઇકવેનિમિટી/સ્વસ્થતા, શાંતિ
equation /ઇકવેશન/સમીકરણ, સરખામણી
equator /ઇકવેશન/વિષુવવૃત્ત
equestrian /ઇકવેસ્ટ્રીઅન/ધોડેસવારી
equidistance
equilibrium /ઇકવીલીબ્રિઅમ/સમતુલા
equinox /ઇકવીનોક્ષ/સરખા દિવસ અને રાત
equip with /ઇકવીપ વિથ/થી સજ્જ કરવું
equip(ment) / /
equipment /ઇકવીપમન્ટ/સાધન, સરંજામ
equipped /ઇકવીપ્ડ/સજ્જ થયેલું
equity /ઇકવીટી/કંપની શેર, વાજબીપણું, ન્યાય
equivocal /ઇકવીવોકલ/શંકાસ્પદ
equivocate /ઇકવીવોકેટ/ગોળગોળ વાત કરવી
era /ઇરા/યુગ
eradicate /ઇરેડિકેઇટ/નાબૂદ કરવું
erase /ઇરેઇઝ/છેકવું, કાઢી નાકવું
ere / /
erect /ઇરેક્ટ/ઊભું કરવું
erection /ઇરેક્શન/ઊભું કરવાની ક્રિયા
ergonomics /અરગોનોમિક્સ/યંત્રઆકારશાસ્ત્ર
erode /ઇરોડ/ધોવાણ-પડતી થવી
Eros /ઇરોઝ/કામદેવ
erosion /ઇરોઝન/ધોવાણ, ઘસારો, પડતી
erotic / /
erotic /ઇરૉટિક/કામોત્તેજક,
err(atic) / /
err /એર/ભૂલ કરવી
errand /એરાન્ડ/દોડાદોડીનું નાનું મોટું કામ
errant /એરાન્ટ/ભૂલકરનાર, ભટકતું
erratic /ઇરૉટિક/અનિયમિત, ખામી વાળું, લહેરી
erring /એરીંગ/ભેજવાબદાર
erroneous /ઇરોનિઅસ/ભૂલ ભરેલું, ખોટું
error / /
error /એરર/ભૂલ, ખામી
ersatz /એઅઝેટસ/નકલી, કૃત્રિમ
erstwhile /અર્સ્ટવાઇલ/તે સમયનું, પૂર્વેનું
erudite /એરુડાઇટ/વિદ્વાન, પંડિત
erupt /ઇરપ્ટ/ભભૂકવું, ફાટવું (જ્વાળામુખી)
eruption /ઇરપ્ટશન/ભડકો, ફાટવાની ક્રિયા
escalate /એસ્કેલેટ/કાબૂ બહાર જવું, વકરવું
escalating /એસ્કેલેટિંગ/કાબૂ બહાર જતું
escalation /એસ્કેલેશન/એકદમ વધારો, ઉછાળો
escapades /ઇસ્કેઇપેડ/સ્વૈરવર્તન, તોફાન
escape / /
escape /ઇસ્કેઇપ/છટકી-નાસી છુટવું, છુટકારો
escheat /એસ્ચીટ/ખાલસા કરવું, પડાવી લેવું
eschew /ઇસ્ચ્યુ/થી દૂર રહેવું, ટાળવું
escort /એસ્કોર્ટ/વળાવનાર રક્ષક, અંગરક્ષક

esulent ખાવાલાયક
esoteric/એસોટરિક/વિશિષ્ટ લોકભોગ્ય
especially / /
especially/ઈસ્પેશ્યલિ/ખાસ કરીને
espionage/એસ્પિનાજ/જાસૂસી
espouse/એસ્પાઉઝ/હિમાયત કરવી, ટેકો દેવો
essay / /
essay/એસે/નિબંધ
essential / /
essential/ઈસેન્શલ/આવશ્યક
establish(ment) / /
establish/ઈસ્ટાબ્લીશ/સ્થાપવું, પ્રસથાપિત કરવું
establishment/ઈસ્ટાબ્લીશ્મન્ટ/સંસ્થાન, સ્થાપના
estate/ઈસ્ટેટ/મિલકત, જાગીર
esteem/ઈસ્ટીમ/માન, મોભો
estimate/એસ્ટીમેટ/અંદાજ
etc.= et cetera/એટસેટરૌ/વગેરે
eternal/ઈટર્નલ/કાયમ, શાશ્વત
ethereal/ઈથિરીઅલ/અલૌકિક, હળવું
ethical/એથિકલ/નૈતિક
ethics/ઈથિક્સ/નીતિશાસ્ત્ર, નીતિમતા
ethnic/એથનિક/વંશીય, જાતિય
ethnicity
ethos/એથોસ/પ્રકૃતિ, સ્વભાવ વર્તન
etiquette/એટીકેટ/ઓથિત્ય, શિષ્ટાચાર
etymology/ઈટીમૉલજી/વ્યુત્પત્તિ, ઉદ્ભવ
eulogise/યુલોજાઈજ/સ્તુતિ કરવી
eunuch/યુનક/નપુંસક, નામદ
euphemism/યુફ્યમીઝમ/હળવો પર્યાય
euphonious
euphoria/યુફોરિઆ/ખુશાલી, ખુશી ની લહેર
eureka/યરેકા/મળી ગયું! (ઉદ્ગાર)
evacuate/ઈવેક્યુએટ/સ્થળ-જગ્યા ખાલી કરવી
evade/ઈવેડ/ટાળવું, ઉલ્લંઘન કરવું
evaluate/ઈવેલ્યુએટ/મૂલ્યાંકન કરવું
evaluation/ઈવેલ્યુએશન/મૂલ્યાંકન
evanescent/ઈવેનેશન્ટ/અદ્શ્ય થતું
evaporate/ઈવાપોરેટ/બાષ્પીભવન થવું
evasion/ઈવેઈઝન/ઉલ્લંઘન, ચોરી
evasive/ઈવેઝિવ/ઉડાઉ, ટાળતું
eve/ઈવ/(evening) સાંજ, સ્ત્રી
even
even out-વું
even up-વું
even / /
even/ઈવન/છતા પણ, સમતળ, વ્યાજબી
evening / /
evening/ઈવનીંગ/સાંજ
event / /
event/ઈવન્ટ/બનાવ, ઘટના, પ્રસંગ

eventful/ઈવન્ટફુલ/બનાવપૂર્ણ
eventually/ઈવેન્યુઅલી/આખરે, અંતે
ever / /
ever/એવર/ક્યારેય, કોઈ દિવસ
every / /
every/એવરી/દરેક
everyone / /
everything / /
everywhere / /
eve-teasing છેડતી, પજવણી
evict/ઈવિક્ટ/તગડી-ભગાડવું મુકવું
eviction/ઈવિક્શન/હકાલપટી, તગડી
evidence/ઈવિડન્સ/પુરાવો, સાબિતી
evident/ઈવિડન્ટ/સ્પષ્ટ
evil / /
evil/ઈવલ/અનિષ્ટ, દુષ્ટ
evince/ઈવિન્સ/સૂચવવું, દર્શાવવું
evocative/ઈવૉકેટિવ/આવાહન-સાદ કરતું
evoked/ઈવૉક/પ્રતિભાવ મેળવવો
evolution/ઈવોલ્યુશન/ઉત્ક્રાંતિ
evolve/ઈવૉલ્વ/ઘડીકાઢવું
ex gratia/એક્સ-ગ્રેશિ/મહેરબાનીરૂપ
ex nihilo
ex officio/એક્સ-ઓફિશિયો/હોદ્દાની રૂએ
exacerbate/ઈગ્ગાસરબેટ/વેદના ઉગ્રથવી
exact / /
exact/ઈગ્ગેક્ટ/વસુલવું, ચોકકસ
exactly / /
exaggerate/ઈગ્ગાજરેટ/અતિશયોક્તિ કરવી
exalted/ઈગ્ગૉલ્ટેડ/ઉન્નત, પ્રતિષ્ઠિત
examination / /
examine / /
examine/ઈગ્ગામિન/તપાસવું, પરીક્ષા કરવી
example / /
example/ઈગ્ગૉમ્પલ/દાખલો, ઉદાહરણ
exasperating/ઈગ્ગાસ્પરેટિંગ/ચિડવતું
excavate/એક્સકેવેટ/ખોદી કાઢવું
excavator/એક્સકેવેટર/ખોદનાર
exceed / /
exceed/ઈક્સીડ/થી વધી જવું
excel(lent) / /
excel/ઈક્સેલ/ચાડિયાતું હોવું
excellence/ઈક્સેલન્સ/શ્રેષ્ઠતા
excellent/ઈક્સલેન્ટ/ઉત્તમ, શ્રેષ્ઠ
except(ion) / /
except/ઈક્સેપ્ટ/સિવાય, ના વિના
exception/ઈક્સેપ્શન/અપવાદ
exceptional/ઈક્સેપ્શનલ/અપવાદરૂપ
excerpts/એક્સર્પ્ટ્સ/અંશ, ભાગ
excess(ive) / /

excess/ઇકસેસ/અતિરેક, વધારાનું
excessive/ઇકસેસિવ/વધારે પડતું
exchange / /
exchange/ઇક્સચેન્જ/વિનિમય, અદલાબદલી
exchequer/ઇક્સચેકર/તેજુરી, નાણાંખાતું
excite(ment) / /
excite/ઇક્સાઇટ/ઉશ્કેરવું
exclaim / /
exclaim/ઇક્સક્લેઇમ/ઉદ્ગાર-રાડ પાડવી
exclude/ઇક્સક્લુડ/બાકાત રાખવું
exclusive/ઇક્સક્લુઝિવ/વિશિષ્ટ-ખાસ પ્રકારનું
excommunicate નાત બહાર મૂકવું
excrete/એક્સ્ક્રીટ/ મળમુત્ર વિસર્જન કરવું
excruciate/ઇક્સક્રુશિએટ/તીવ્ર વેદના થવી
exculpate/ઇક્સ્કલ્પેટ/દોષમુક્ત કરવું
excursion/ઇક્સ્કર્ઝન/ પ્રવાસ, સહેલ
excuse / /
excuse/ઇક્સક્યૂઝ/માફ કરવું, બહાનું
exeat/એક્સિએટ/રજા, છુટી
execrate/એક્સિ/શ્રાપ આપવો, ભાંડવું
execute/ઇક્ઝીક્યુટ/અમલ કરવો, મૃત્યુદંડ દેવો
executioner/ઇક્ઝીક્યુશનર/જલ્લાદ
executive/ઇક્ઝેક્યુટિવ/કાર્યપાલક, કારોબારી, અધિકારી
exemplary/ઇઝેમ્પ્લરિ/દાખલારૂપ
exemplify/ઇઝેમ્પ્લીફાય/ઉદાહરણ આપવું
exempt / /
exempt/ઇઝેમ્પ્ટ/મુક્તિ-છુટ આપવી
exequies/એક્સિક્વિવઝ/ઉતરક્રિયા
exercise / /
exercise/એક્સરસાઝ/મહાવરો, વ્યાયામ, કસરત
expert/ઇઝર્ટ/વાપરવું, મહેનત કરવી
exhale/ઇક્ઝેઇલ/ઉચ્છ્વાસ, શ્વાસ બહાર કાઢવો
exhaust/ઇઝઝૉસ્ટ/બહાર કાઢવું, થાકવું, ખલાસ થવું
exhaustive/ઇઝઝૉસ્ટિવ/વિસ્તૃત, વ્યાપક
exhibit(ion) / /
exhibit/એઝિબિટ/પ્રદર્શિત કરવું
exhilarate/ઇઝીલરેટ/આનંદિત કરવું
exhorbitant/ઇઝઝૉરબિટન્ટ/વધારે પડતું, અતિશય
exhort/ઇઝર્ટ/ કરવા પ્રેરવું
exhortation/ઇઝર્ટશન/ કરવાની પ્રેરણા
exhuberance જીવંત, જોમ ભરેલું
exhume ખોદી કાઢવું
exigencies તાકીદની જરૂરિયાત
exigent//કડક, સખત કામ કરાવનાર
exile/ઇઝાઇલ/ દેશવટો, સ્વદેશત્યાગ
exist(ence) / /
exist/ઇઝીસ્ટ/અસ્તિત્વ ધરાવવું
existence/ઇઝીસ્ટન્સ/અસ્તિત્વ
existent/ઇઝીસ્ટન્ટ/ વિદ્યમાન, અસ્તિત્વ ધરાવતું
exit/ઇઝીટ/નિકાલ, પ્રસ્થાન

exnihilo
exodus/ઇક્ઝૉડસ/ સાગમટે-પ્રસ્થાન-હિજરત
exonerate/ઇક્ઝૉનરેટ/ નિર્દોષ છોડવું
exorbitant અતિભારે, ખર્ચાળ
exorcist/ઇઝૉર્સિસ્ટ/ મેલીવિદ્યા ઉપાસક, ભૂવો
exordium/ઇઝૉરડિયમ/પ્રસ્તાવના
exoteric/ઇઝૉટેરિક/લોકભોગ્ય
exotic/ઇઝૉટિક/ભાતીગળ, દેશ વિદેશનું
expand/ઇક્સપાન્ડ/વિસ્તરણ કરવું
expansion/ઇક્સપાન્ઝન/વિસ્તરણ
expatriate/એક્સપૅટ્રિએટ/વિગતવાર કહેવું
expatriate/એક્સપૅટ્રિએટ/દેશનિકાલ કરવો
expect(ation) / /
expect/ઇક્સપેક્ટ/આશા રાખવી
expectant/ઇક્સપેક્ટન્ટ/અપેક્ષા રાખતું
expedient/ઇક્સપેડિઅન્ટ/ડહાપણભર્યું, અનુકુળ
expedite/ઇક્સપેડાઇટ/ઉતાવળથી કરવું
expedition/ઇક્સ્પિડીશન/સાહસયાત્રા
expeditious/ઇક્સ્પિડીશસ/તાકીદનું, ઝડપી
expel/ઇક્સપેલ/કાઢી મૂકવું, હકાલપટી કરવી
expend/ઇક્સપેન્ડ/ખર્ચવું, વાપરવું
expenditure/ઇક્સપેન્ડિચર/ખર્ચ
expensive / /
expensive/ઇક્સપેન્સીવ/મોંઘુ, ખર્ચાળ
experience / /
experience/ઇક્સપેઅરિઅન્સ/અનુભવ
experiment / /
experiment/ઇક્સપેરિમન્ટ/પ્રયોગ, અખતરો
expert/એક્સપર્ટ/નિષ્ણાંત, નિપૂણ, તજજ્ઞ
expertise/આક્સપર્ટીઝ/તંત્રજ્ઞાન, કુશળતા
expiate/એક્સ્પિએટ/પ્રાયશ્ચિત કરવું
expire મૃત્યુ પામવું, પુરું થવું
explain away-વું
explain to-
explain / /
explain/ઇક્સપ્લેઇન/સમજાવવું, ખુલાસો કરવો
explanation / /
explicative/ઇક્સપ્લિકેટિવ/ શપથ, તોછડી ભાષા
explicable/ઇક્સપ્લિકેબલ/ સમજાવી શકાય તેવું
explicit/ઇક્સપ્લિસિટ/ સ્પષ્ટ, ચોખ્ખું
explode / /
explode/ઇક્સપ્લૉડ/ધડાકો-વિસ્ફોટ થવો
exploit/ઇક્સપ્લૉઇટ/ શોષણ કરવું, પરાક્રમ
exploitation/ઇક્સપ્લૉટશન/ શોષણ
exploration/ઇક્સપ્લૉરેશન/ સંશોધન
exploratory/ઇક્સપ્લૉરેટરિ/સંશોધનાર્થ
explore/ઇક્સપ્લૉઝન/ ફરીને શોધવું
explosion / /
explosion/ઇક્સપ્લૉઝન/ ધડાકો, વિસ્ફોટ
explosive / /

explosive/ઇક્સપ્લોઝિવ/સ્ફોટક
export //
export/ઇક્સપોર્ટ/નિકાસ
expose/ઇક્સપોઝિવિઝિટ/ ખુલ્લું કરવું
expostulate વિરોધ કરવો
exposure પર્દાફાસ, ઘટસ્ફોટ
expound/ઇક્સપાઉન્ડ/રજુકરવું, સવિસ્તર સમજાવવું
express(ion) //
express/ઇક્સપ્રેસ/અભિવ્યક્ત કરવું
expressive અભિવ્યક્તિવાળું
expropriate/એક્સપ્રોપ્રિએટ/ છીનવી લેવું
expulsion/ઇક્સપલ્ઝન/ હકાલપટ્ટી, પાણીચું
expunge/એક્સપંજ/ કાઢી નાખવું
exquisite/એક્સક્વિઝિટ/શ્રેષ્ઠ, ઉત્કૃષ્ઠ
extempore/ઇક્સટેમ્પરી/શીઘ્ર વક્તૃત્વ
extend/ઇક્સટેન્ડ/લંબાવવું
extensive/ઇક્સટેન્સિવ/સઘન, ઘનિષ્ટ
extent/ઇક્સટેન્ડ/હદ, સીમા, વિસ્તાર
extenuate/ઇક્સટેન્યુએટ/ગંભીરતા ઘટાડવું
exterior/ઇક્સ્ટિરિઅર/બહારનું
exterminate/ઇક્સ્ટર્મિનેટ/સંપૂર્ણ નાશ કરવો
external/ઇક્સ્ટર્નલ/બાહ્ય, બહારનું
externment/ઇક્સટેન્ડ/ હદપારી, તડીપાર
extinct/ઇક્સ્ટિન્ક્ટ/લુપ્ત, અદૃશ્ય, નામશેષ
extinction/ઇક્સ્ટિન્ક્શન/નાશ, નાબુદી
extinguish/ઇક્સ્ટિંગ્વિશ/બૂઝાવવું, ઓલવાવું
extirpate/ઇક્સ્ટર્પેટ/સંપૂર્ણ નાશ કરવો
extol/ઇક્સટોલ/બિરદાવવું, ગુણગાવા
extort/ઇક્સર્ટ/ઘાક-ઘમકીથી પડાવવું
extortion/ઇક્સર્ટોશન/ ઘાક-ઘમકી, બળજબરી
extortionist/ઇક્સર્ટોશનિટ/ઘાક-ઘમકી આપનાર
extra //
extra/એક્સ્ટ્રા/વધારાનું
extract/ઇક્સ્ટ્રેક્ટ/અર્ક, નિચોડ કાઢવો
extradite/ઇક્સ્ટ્રેડાઇટ/ગુનેગારોની આપલે
extradition/ઇક્સ્ટ્રેડિશન/ગુનેગારો આપલે/પ્રત્યાર્પણ
extraordinary/ઇક્સ્ટ્રોડિનરિ/ઉત્તમ, અસાધારણ
extravagant/ઇક્સ્ટ્રેવેગન્ટ/ઉડાઉ, ખર્ચાળ
extravaganza/ઇક્સ્ટ્રેવેગન્ઝ/ઉડાઉ, વિચિત્ર વર્તન
extreme(ly) //
extreme/ઇક્સ્ટ્રીમ/અંતિમ, હદ વટાવનારું
extremist/ઇક્સ્ટ્રીમિસ્ટ/અંતિમવાદી, ઉગ્રવાદી
extricate/ઇક્સ્ટ્રિકેટ/ખેચીને બહાર કાઢવું
extrinsic/ઇક્સ્ટ્રિન્સિક/બાહ્ય
extrovert/ઇક્સ્ટ્રોવર્ટ/બહિર્મુખી
extrude/ઇક્સ્ટ્રુડ/બહાર ખેચવું-થકેલવું
exuberance/ઇગ્ઝબરન્સ/ઉલ્લાસ
exuberant/ઇગ્ઝબરન્ટ/ઉલ્લાસપૂર્ણ
exult/ઇગ્ઝલ્ટ/આનંદ વિભોર થવું
eye up -વું

eye(lid) //
eye/આઈ/આંખ, જોવું
eyeful/આઈફુલ/આર્કષક-અસાધારણ-વ્યક્તિ
eyesore/આઈસૌર/આંખનું કણું, ખટકનારું
eyewash/આઈવૉશ/ઢોંગ, છેતરપિંડી
eye-witness/આઈવિટનિસ/સાહેદ, નજરે જોનાર
fab/ફેબ/કાલ્પનિક, આશ્ચર્યજનક
Fabian/ફેબીઅન/સાવચેત, ખંતીલું
fable/ફેબલ/ઉપદેશકથા, બોધકથા
fabricate/ફેબ્રિકેટ/રચવું, ઉપજાવી કાઢવું
fabrication/ફેબ્રિકેશન/મનઘડંત રચના,
fabulous/ફેબ્યુલસ/કાલ્પનિક, આશ્ચર્યકારક
façade/ફાસાદ/આમુખ, મુખરૂં, મહોરૂં, ભ્રમક દેખાવ
face the music પરિણામ ભોગવવું
face up to-વું
face //
face/ફેઈસ/ચહેરો, સામનો કરવો, ભયમાં, નફટાઈ
face-lift સજાવટ કરવી, ઓપ આપવો
facet/ફેસિટ/પહેલ, બાજું
facetious/ફેસીશસ/ટીખળ, ટોળ
facia/ફેસીઆ/મોટરનું પાટિયું(અંદર)
facial/ફેસીઅલ/ચહેરાનું ઉપચાર, મોઢાનું
facile/ફેસાઈલ/સહેલું, સરળ
facilitate/ફેસિલિટેઈટ/સરળ બનાવવું
facsimile/ફેક્સિમિલિ/પ્રતિકૃતિ
fact(ual) //
fact/ફેક્ટ/હકિકત
faction/ફેક્શન/પક્ષ, જૂથ, ટુકડો
factor/ફેક્ટર/દલાલ, કારણ, પાસું
factory //
factory/ફેક્ટરી/કારખાનું
factotum/ફેક્ટોટમ/જે તે કામ કરનાર નોકર
factual/ફેક્ટ્યુઅલ/વાસ્તવિક, સાચું
faculty/ફેક્લ્ટી/શાખા, વિભાગ, માનસિક શક્તિ
fad //
fad/ફેડ/ધેલછા, ફેશન, લત
fade away-વું
fade in-વું
fade out-વું
fade //
fade/ફેઈડ/ઝાંખુ થવું, કરમાવું, રંગ ઉડી જવો
faded/ફેઈડ્ડ/ઝાંખું, નિસ્તેજ
fag/ફેગ/વૈતરૂં, સિગરેટ
fail(ure) //
fail/ફેઈલ/નિષ્ફળ થવું, ઉપેક્ષા કરવી
failure/ફેઈલ્યોર/નિષ્ફળતા
fain/ફેઈન/રાજી-ખુશીથી
faint //
faint/ફેઈલ/ઝાંખું, મૂર્છિત થવું
fair(ly) //

fair / /**fair**/ફેઅર/ન્યાયી, વ્યાજબી, ગોરું, મેળો**fait accompli**/ફેઈટઅકૉમ્પ્લિ/હકિકત આમ બની**faith(ful)** / /**faith**/ફેઈથ/પંથ, વિશ્વાસ, શ્રદ્ધા**fake**/ફેઈક/નકલી, ઢોંગ કરવો**falcon**/ફૉલ્કન/બાજ, શકરો**fall about**-વું**fall away**-વું**fall back on**-વું**fall back**-વું**fall behind**-વું**fall down**-વું**fall for**-વું**fall in with** / /**fall in with**-વું**fall off** / /**fall off**-વું**fall on**-વું**fall out with** / /**fall out**-વું**fall over**-વું**fall through** / /**fall through**-વું**fall upon** / /**fall upon**/ફૉલ અપોન/આવી પડવું**fall** / /**fall**/ફૉલ/પાનખર, ઘટાડો, પડતી, પતન, પડવું**fallacious**/ફૉલ્શિયસ/ ભ્રામક, ભૂલ ભરેલું**fallacy**/ફૉલ્સિ/ભ્રમ, ખોટી માન્યતા**false(hood)** / /**false**/ફૉલ્સ/કપટી, જૂઠું, ખોટું, નકલી**falsehood**/ફૉલ્સહૂડ/કપટ, જૂઠુંપણું**falter**/ફૉલ્ટર/અચકાવું**fame** / /**fame**/ફેઈમ/કિર્તિ, ખ્યાતી**familiar** / /**familiar**/ફમિલીઅર/પરિચિત, માહિતગાર**family** / /**family**/ફમિલિ/કુટુંબ, જુથ**famine**/ફેમીન/દુષ્કાળ**famish**/ફેમિશ/ભૂખે મરવું**famous** / /**fan** / /**fan**/ફેન/પંખો નાખવો, ચાહક**fanaticism**/ફેનેટિસિઝમ/ધર્માધતા**fancy** / /**fancy**/ફેન્સિ/કલ્પના, ગમી જવું, ભ્રાન્તિ**fanfare****fanfare**/ફેનફેઅર/ધૂમધામ, હો-હા**fang** / /**fangs**/ફેન્ગઝ/ઝેરી દાંત(સાંપ)**fantasise**/ફેન્ટસાઈઝ/કલ્પનામાં રાચવું**fantastic**/ફેન્ટેસ્ટિક/અજબ ગજબ, અદ્ભૂત**fantasy**/ફેન્ટસિ/કલ્પના, દિવાસ્વપ્ન**far** / /**far**/ફાર/દૂર**farcical**/ફાર્સિકલ/હાસ્યાસ્પદ**fare** / /**fare**/ફેઅર/ભાડું, ચલાવવું, દેખાવ કરવો**far-fetched** અતિ કલ્પનાસભર**farm out**-વું**farm(er)** / /**farm**/ફાર્મ/ખેતર, ખેડવું**farther**/ફાર્થર/આગળ, દૂર(અંતર)**farthing**/ફાર્થિંગ/કોડી, દમડી**fascinate**/ફેસિનેટ/મોહિત-મંત્રમુગ્ધ કરવું**fascinating** / /**fascination**/ફેસિનેશન/મોહિની,**fascist**/ફેસિસ્ટ/સરમુખત્યાર**fashion(able)** / /**fashion**/ફેશન/ઢબ, રીત, ચલણ**fast(en)** / /**fast**/ફાસ્ટ/ઉપવાસ, ઝડપી, પાકકુ(રંગ)**fasten**/ફાસન/બાંધવું**fastidious** અતિઆગ્રહી**fastner**/ફાસનર/**fat** / /**fat**/ફેટ/ચરબી, ઝાડું**fatal** / /**fatal**/ફેઈટલ/ઘાતક, ગમખવાર**fatalist**/ફેટલિસ્ટ/પ્રારબ્ધવાદી**fatality**/ફેટલિટિ/ખુવાર**fate** / /**fate**/ફેઈટ/ભાગ્ય, વિધાતા**fateful**/ફેઈટફૂલ/ઘાતક, કમનસીબ**father(ly)** / /**father**/ફાધર/પિતા, પિતા બનવું**fathom**/ફેથમ/ઊંડાણ, તાગ લેવો**fatigue**/ફેટિગ/થાક**fatigues**/ફેટિગ્ઝ/કામ, લશ્કરી ગણવેશ**fatuous**/ફેટ્યુઅસ/**faucet**/ફૉસેટ/નળ**fault(y)** / /**fault**/ફૉલ્ટ/ખોટકો, ખામી**faulty**/ફૉલ્ટી/ખામીવાળું**fauna**/ફૉઉના/પ્રાણીઓ**faux pas**/ફૉપા/અવિચારી કૃત્ય-ભૂલ**favour(able)** / /**favour**/ફેઈવર/પક્ષપાત, મહેરબાની

favourable/ફેઠવરેબલ/સાનુકૂળ**favourite** /**fawn**/ફૉન/હરણનું બચ્ચું**fear** /**fear**/ફીઅર/ડર, ભય, દહેશત હોવી**fearful** /**feasible**/ફીઝિબલ/શક્ય, વ્યવહારું**feast** /**feast**/ફીસ્ટ/મિજબાની, જૂયાફત**feat**/ફીટ/પરાક્રમ, સિધ્ધિ**feather** /**feather**/ફેધર/પીંછુ**feature** /**feature**/ફીચર/લક્ષણ, મુખ્ય-લેખ, બાબત**feckless****fecund**/ફેકન્ડ/ફળદ્રુપ**fecundity**/ફેકન્ડિટી/**feeble**/ફીબલ/નબળું, અશક્ત**feed in** -વું**feed up**-વું**feed** /**feed**/ફીડ/ખવડાવવું**feel up to**-વું**feel up**-વું**feel** /**feel**/ફીલ/લાગવું, અનુભવવું**fees** /**fees**/ફીસ/મહેનતાણું**feet** /**feet**/ફીટ/પગ (બ.વ.)**feign**/ફેઈન/ઢોંગ કરવો**feint**/ફેઈન્ટ/ફટકો**felicitate**/ફેલિસિટેટ/અભિનંદન આપવા**felicitation**/ફેલિસિટેશન/અભિનંદન**felicity**/ફેલિસિટિ/પરમસુખ**feline**/ફેલિન/બિલાડી ને લગતું**fell**/ફેલ/ઝાડ કાપવું, કચનન (ભૂ.કા)**fellow** /**felony**/ફેલોની/અતિ ગંભીર ગુનો-હિંસા**female** /**female**/ફિમેઈલ/સ્ત્રી, નારીજાતી**feminine**/ફેમિનાઈન/નારી સહજ, સ્ત્રીજાતિ**feminism**/ફેમિનિઝમ/સ્ત્રીઓના હકો-સ્વાતંત્રતા**feminist**/ફેમિનિસ્ટ/સ્ત્રીઓની નેતા**fence** /**fence**/ફેન્સ/વાડ, તલવારબાજી**ferment**/ફરમન્ટ/આથો બનવો**ferocious**/ફરોશિઅસ/વિકરાળ, ક્રૂર**ferret out**/ફેરેટ આઉટ/ઘડી કાઢવું**ferry**/ફેરિ/ફેરાં-આવ જા કરવી**fertile**/ફર્ટાઈલ/ફળદ્રુપ**fertilise**/ફર્ટિલાઈઝ/ફળદ્રુપ બનાવવું**fervent**/ફર્વન્ટ/ઉત્સાહી, લાગણી સભર**fervid**/ફર્વિડ/આતુર**feravour**/ફર્વર/હર્ષોલ્લાસ**festival** /**festival**/ફેસ્ટિવલ/ઉત્સવ, ઉજાણી**festivity**/ફેસ્ટીવિટી/ઉત્સવ, ઉજવણી**fetch up**-વું**fetch** /**fetch**/ફેચ/જઈ ને લાવવું**fete** /**fete**/ફેઈટ/મેળાવડો, આનંદમેળો**fetid**/ફેટિડ/ગંધાતું**fetish**/ફેટિશ/અતાર્કિક સિધ્ધાંત**feud**/ફ્યુડ/કલેષ, ઝઘડો**feudal**/ફ્યુડલ/જાગીર સંબંધી**fever** /**fever**/ફીવર/તાવ, ઉન્માદ**feverish**/ફીવરિશ/માંદલું, ફિકકું**few** /**few**/ફ્યુ/એકેય નહિ**fiancée**/ફીએન્સી/વાગ્દતા, મંગેતર**fiasco**/ફીઆસ્કો/રકાસ, ઘબડકો, સાવ નિષ્ફળતા**fiat**/ફાયટ/હુકમ, ફતવો**fib**/ફિબ/જુઠાણું**fibrous**/ફાઈબરસ/રિસાવાળું**fickle**/ફિકલ/નબળું, ચંચળ**fictional**/ફિક્શનલ/કલ્પનાનું**fictitious**/ફિક્ટિશસ/કાલ્પનિક**fiddle about/around**-વું**fiddle**/ફિડલ/છેતરવું, સારંગી વગાડવી**fideliy**/ફાઈડેલિટિ/વફાદારી**fidgety**/ફિજેટિ/બેચેન**field** /**field**/ફિલ્ડ/ખેતર, મેદાન, ક્ષેત્ર, મેદાનમાં ઉતારવું**fiend**/ફિઅન્ડ/શેતાન**fierce** /**fierce**/ફિઅર્સ/ક્રાંતિલ, ક્રૂર, ભીષણ, ઉગ્ર**fiesta**/ફિએસ્ટા/ઉત્સવ**fifth** /**fifth**/ફિફ્થ/પાંચમું**fig** /**fight back**-વું**fight down**-વું**fight off**-વું**fight on**-વું**fight out**-વું**fight with**-વું**fight** /

fight/ફાઈટ/લડાઈ, મારામારી
figment/ફિગમન્ટ/કાલ્પનિક શોધ
figurative/ફિગરેટિવ/પ્રતિકાત્મક, અલંકારિક
figure on-વું
figure out-વું
figure//
figure/ફિગર/ચમકવું, સંખ્યા, આકાર, ચિત્ર વ્યક્તિ,
filch/ફિલ્ચ/ચોરી-ઉઠાંતરી કરવી
file//
file/ફાઈલ/કાનસ, કતાર, ફાઈલ
filial/ફિલિઅલ/પુત્ર કે પુત્રી માટેની લાગણી
filibuster/ફિલિબસ્ટર/નડતર ઉભું કરનાર
fill in//
fill in-વું
fill out-વું
fill up-વું
fill//
fill/ફિલ/ભરવું
fillip/ફિલિપ/પ્રેરણા, ચપટી, ટકોરો
film//
film/ફિલ્મ/આવરણ, પડ
filter out-વું
filter//
filter/ફિલ્ટર/ગાળવું, ગળણી
filth(y)//
filth/ફિલ્થ/ગંદકી, કચરો
filthy/ફિલ્થી/ગંધારું, અશ્લીલ, મેલું
final(ly)//
final/ફાઈનલ/અંતિમ
finale/ફિનાલી/પૂર્ણાહુતિ
finalise/ફાઈનલાઈઝ/અંતિમરૂપ આપવું
finance//
finance/ફાઈનાન્સ/નાણું
financial//
financial/ફાઈનાન્સિઅલ/નાણાંકીય
find out//
find out-વું
find//
find/ફાઈન્ડ/શોધવું, લાગવું
fine//
fine/ફાઈન/સુંદર, મજાનું, ઝીણું, દંડ
finery/ફાઈનરિ/શણગાર, શિષ્ટતા
finesse/ફિનેસ/છટા, કુશળતા
finger crossed
finger//
finger/ફિંગર/આંગળી
finicky/ફિનિકિ/ચોક્કસાઈવાળું
finish off-વું
finish up-વું
finish//

finish/ફિનિશ/પૂરું કરવું
finite/ફાઈનાઈટ/મર્યાદિત, નિશ્ચિત
fire away-વું
fire//
fire/ફાયર/આગ, ગોળીબાર, કાઢી મુકવું
fireplace//
firm//
firm/ફર્મ/મકકમ, અડગ, પેઢી
firmament/ફર્માન્ટ/આકાશ
firmly/ફર્મલિ/મકકમતાથી
first//
first/ફર્સ્ટ/પહેલો, પ્રથમ
fiscal/ફિસકલ/નાણાંકીય
fish out-વું
fish up-વું
fish(erman)//
fish/ફિશ/માછલી, મચછીમારી કરવી
fissile/ફિસાઈલ/વિભાજનક્ષમ અણુ
fission/ફિઝન/અણુબીજક
fissure
fist//
fist/ફિસ્ટ/મૂઠી
fistful/ફિસ્ટફુલ/મૂઠીભર
fisticuff/ફિસ્ટિકફ/
fit in-વું
fit//
fit/ફિટ/યોગ્ય, આંચકી-તાણ
fitness/ફિટનેસ/યોગ્યતા, સક્ષમતા
five//
five/ફાઈવ/પાંચ
fix on-વું
fix up-વું
fix//
fix/ફિક્સ/સમુ કરવું, ગોઠવવું, નકકી કરવું
fizzle out-વું
fizzle/ફિઝલ/સિસકારવું, સરુસરિયું થવું
flab/ફ્લૉબ/મોટું પેટ, ચરબી ના થર
flabbergasted/ફ્લૉબરઘાસ્ટેડ/મૂંઝાઈ ગયેલું
flaccid/ફ્લેકસિડ/ઢીલું, નબળું
flag down-વું
flag//
flagitious
flagrant/ફ્લૉગ્રન્ટ/શરમજનક
flair//
flair/ફ્લૉર/છટા, ખાસ આવડત
flak//
flak/ફ્લૉક/સખત ટીકા, તોપમારો
flake out-વું
flake//
flake/ફ્લેઈક/

flamboyant/ફલેમબોયન્ટ/ભવકાદાર
flame / /
flame/ફલેમ/અગનજવાળા, પ્રજ્વલિત કરવું
flammable/ફલેઈમબલ/સળગી ઉઠે તેવું
flank/ફલેન્ક/પડખાં, બાજું પરનું
flap / /
flap/ફલેપ/ઝુલવું
flare up / /
flare up/ફલેરઅપ/ફાટી નીકળવું(હુલ્લસ-તોફાન)
flare / /
flare/ફલેર/તોફાનની શરૂઆત
flash / /
flash/ફલેશ/ચમકારો, ઝબકારો
flash-back/ફલેશબેક/પશ્ચાદ ભૂમીકા
flash-point/ફલેપોઈન્ટ/પશ્ચાદ ભૂમીકા
flask / /
flask/ફલાસ્ક/
flat(ten) / /
flat/ફલેટ/સપાટ, બહુમાળી રહેઠાણ
flatten/ફલેટન/સમતળ બનાવવું
flatter/ફલેટર/પુશામત કરવી
flaunt/ફલોન્ટ/દિખાડવું, પ્રદર્શિત કરવું
flavour/ફલેવર/સ્વાદ, પુ
flawless/ફલોલેસ/શુદ્ધ, ખામી રહિત
flay/ફલેઈ/સખત ટીકાકરવી, ઝાટકવું
flea / /
flea/ફલી/ચાંચડ
fleck/ફ્લેક/ડાઘ
fled/ફલેડ/નાસી ગયું **flee** ભૂ.કા
fledgling/ફલેજલિંગ/શિખાઉ, બિનઅનુભવી
flee / /
flee/ફલી/નાસી જવું
fleece/ફલીસ/ઉન-ઉતારવું, શોષણ કરવું
fleet / /
fleet/ફલીટ/કાફલો(વાહન, નૌકા)
flesh / /
flesh/ફલેશ/માનવ માંસ
flew/ફ્લ્યુ/ઉડ્યું કનઅ ભુ.કા.
flexible/ફલેક્સિબલ/સ્થિતિસ્થાપક
fliberti-gibbet/ફલિબર્ટિજિબેટ/વાતોડિયું, બાલિશ
flick/ફલિક/ટાપલી મારવી
flicker/ફલિકર/ટમટમવું
flight / /
flight/ફલાઈટ/ઉડાન
flimsy/ફલિમ્સી/નજીવું, નબળું
fling / /
fling/ફલિંગ/ફેકવું, મોજ, મસ્તી, ફંગોળવું
flip over-વું
flip/ફલિપ/ટપલી મારવી
flip-flop/ફલિપફલોપ/પીછેહઠ કરવી

flippant/ફલિપન્ટ/છોકરમત, ઉછાંછળું
flirt/ફલર્ટ/લફરું કરવું
flirtion/ફલર્ટિશન/પ્રેમનું લફરું
float(a)round-વું
float / /
float/ફલોટ/તરવું, તરતું મૂકવું
flock / /
flock/ફલોક/ટોળે મળવું
flog/ફલોગ/ફટકારવું
flood in-વું
flood out-વું
flood / /
flood/ફલડ/પૂર, પ્રલય, ધોધ
floor / /
floor/ફલોર/ભોંતળિયું, પછાડવું
flop/ફલોપ/રકાસ, નિષ્ફળતા
flora & fauna વન્યસૃષ્ટિ
flounder/ફલાઉન્ડર/તરફડવું
flour / /
flour/ફલાવર/લોટ
flourish/ફલરિશ/છટા, ફાલવું
flout/ફલાઉટ/તરછોડવું, અનાદર કરવો
flow / /
flow/ફ્લો/વહેવું, પ્રવાહ
flower / /
flower/ફ્લાવર/ફૂલ, વસંત આવવી
fluctuate/ફ્લક્ચ્યુએટ/ચડઉતર થવી
flue / /
flue/ફ્લૂ/
fluent / /
fluent/ફ્લુઅન્ટ/પ્રવાહી, અસ્ખલિત
fluid / /
fluid/ફ્લ્યુડ/પ્રવાહી
fluke / /
fluke/ફ્લ્યુક/નસીબનો તુકકો, ખેલ, અકેગહે
flummox/ફલમોક્સ/મૂંઝવવું, સ્તબ્ધ કરવું
flunk/ફલન્ક/નિષ્ફળ-નાપાસ કરવું
flunky/ફલન્કી/પુશામતીયું, દરવાન
furry/ફલરી/ખળભળાટ, સપાટો, ઉશ્કેરાટ
flush / /
flush/ફ્લેશ/સફાયો કરવો, હુકમ(પત્તી)
fluster/ફલસ્ટર/મૂંઝાવું
flute / /
flute/ફ્લ્યુટ/વાંસળી
flutter/ફલટર/પાંખો ફફડાવવી, ગભરાટ
flux/ફ્લક્સ/
fly in-વું
fly off-વું
fly out-વું
fly past-વું

fly / /
fly/ફ્લાય/ઉડવું, માખી
foam / /
foam/ફોમ/પરપોટા, ફીણ
fob/ફોબ/છેતરવું
focus/ફોકસ/કેન્દ્ર, કેન્દ્રીત કરવું
fodder/ફોડર/ધાસચારો, મસાલો
foe/ફો/દુશ્મન, હરીફ, પ્રતિસ્પર્ધી
foetus/ફોટસ/ગર્ભ
fog / /
fog/ફોગ/ધૂમ્મસ
foggy/ફોગી/ધુંધળું, ધૂમ્મસવાળું
foible/ફોઈબલ/
foil/ફોઈલ/આવરણ, વરખ, વ્યર્થ બનાવવું
foist/ફોઈસ્ટ/ખોટી વસ્તુ પધરાવી દેવી
fold away-વું
fold / /
fold/ફોલ્ડ/પડ-ગડી વાળવી
folk / /
folk/ફોક/લોકો, લોક સંબંધી
follow on-વું
follow out-વું
follow through-વું
follow up-વું
follow / /
follow/ફોલો/અનુસરવું, સમજવું
folly/ફોલિ/મુખાઈ
foment / /
foment/ફોમેન્ટ/ઉશ્કેરવું, ઉગ્ર બનાવવું
fomenting/ફોમેન્ટિંગ/બળવું, સળગવું
fond of/ફોન્ડ ઓફ/શોખ હોવો
fond / /
fondle/ફોન્ડલ/લાડ લડાવવા
font/ફોન્ટ/અક્ષર નો પ્રકાર, પથ્થરની કૂંડી
food / /
food/ફુડ/ખોરાક
fool around-વું
fool(ish) / /
fool/ફુલ/મુર્ખ
foolhardy/ફુલહાર્ડી/મહામુર્ખ
foolish/ફુલિશ/મુખાઈભર્યું
foolproof/ફુલપ્રૂફ/સજ્જડ
foolscap/ફુલસ્કેપ/કાગળનું માપ
foot(ball) / /
foot/ફુટ/પગ, ચૂકવવું
footage/ફુટેજ/પ્રસિધ્ધી
footstep / /
foppish/ફોપિશ/છેલછબીલો, વરણાગીયું
for / /
for/ફોર/માટે, ના હેતુ થી

forage
foray/ફોરે/આક્રમણ, ચડાઈ
forbear/ફોરબીઅર/ધીરજ રાખવી
forbid / /
forbid/ફરબિડ/મનાઈ કરવી
forbidden/ફરબિડન/પ્રતિબંધીત
force / /
force/ફોર્સ/શક્તિ, તાકાત, દળ
forcible/ફોર્સિબલ/દબાણયુક્ત, મજબુત
ford/ફોર્ડ/ઓવારો, નદીમાં છીછરી જગ્યા
forecast / /
forecast/ફોરકાસ્ટ/વર્તારો, આગાહી
forefather/ફોરફાધર/વડવા, પૂર્વજ
forefront/ફોરફ્રન્ટ/અગ્રીમ મોરચે
forehead / /
forehead/ફોરીડ/કપાળ
foreign(er) / /
foreign/ફોરેન/વિદેશી
foremost/ફોરમોસ્ટ/પ્રથમ હરોળનું
forensic/ફોરેન્સિક/ગુનાહ-તપાસ વિજ્ઞાન
forerunner/ફોર રનર/અગ્રિમ, પ્રથમ હરોળ
foresee/ફોરસી/આગળ દેખાવું
foresight/ફોરસાઈટ/દિર્ઘદષ્ટિ
forest / /
forest/ફોરિસ્ટ/જંગલ
foretell/ફોરટેલ/અગમચેતી કરવી
foreword/ફોરવર્ડ/પ્રસ્તાવના
forex(ક્રીયહીટબરચહથી)વિદેશી મુદ્રા
forfeit/ફોરફીટ/જપ્ત કરવું
forge / /
forge/ફોર્જ/ટીપવું, આગળ વધવુંચેડાકરવાં
forgery/ફોર્જરિ/છેતરપિંડી
forget / /
forget/ફરગેટ/ભૂલી જવું
forgive / /
forgive/ફરગિવ/માફ કરવું
forgo/ફોરગો/જતું કરવું
fork out/ફોર્ક આઉટ/
fork / /
fork/ફોર્ક/કાંટા
forlorn/ફોર્લોન/દયાજનક, નિરાધાર
form / /
form/ફોર્મ/રચવું, ઘડવું, સ્વરૂપ
formal / /
formal/ફોર્મલ/ઔપચારિક
formation/ફોર્મેશન/સંરચના, સ્વરૂપ
former(ly) / /
former/ફોર્મર/ભૂતપુર્વ
formidable/ફોર્મિડબલ/જોરાવર, ડરામણું
formula/ફોર્મ્યુલા/રીત,

formulate/ /

formulate/કોમ્પ્યુલેઈટ/ઘડી કાઢવું

forray/ફોરે/

forsaken/ફર્સેકન/ત્યજાયેલું, તરછોડાયેલું

fort/ /

fort/ફોર્ટ/કિલ્લો

forte/ફોર્ટે/વિશેષ આવડત

forth/ફોર્થ/ચોથું

forthcoming/ફોર્થકમિંગ/આગામી/થનાર/બનનાર

forthright/ફોર્થરાઈટ/સરળ, નિખાલસ

fortified/ફોર્ટિફાઈડ/કિલ્લેબંધ, રક્ષિત

fortitude/ફોર્ટિટ્યુડ/સંકટ, ધૈર્ય

fortnight/ /

fortress/ફોર્ટ્રેસ/કિલ્લો

fortuitous/ફોર્ટ્યુઈટસ/આકસ્મિક

fortunate/ /

fortunate/ફોર્ચ્યુનેટ/નસીબદાર

fortune/ /

fortune/ફોર્ચ્યુન/ભાગ્ય, કિસ્મત

forum/ફોરમ/સંસ્થા

forward/ /

forward/ફોરવર્ડ/આગળ, આગળનું

fossil/ફોસિલ/અશિમ, અવશેષો

foster/ફોસ્ટર/ઉછેરવું, પાલન કરવું

fought/ફોટ/લડયા, ઝઘડ્યા

foul/ /

foul/ફાઉલ/કપટી, ભ્રષ્ટ, ગેરકાયદેસર

found/ /

founder/ફાઉન્ડર/સ્થાપક, શોધક

fountain/ /

fountain/ફાઉન્ટેન/ફુવારો

four(th)/ /

four/ફોર/ચાર

four-letter word

four-line/ફોર/ચારમાર્ગીય

fourth/ફોર્થ/ચોથું

fowl/ /

fowl/ફાઉલ/

fox/ /

fox/ફોકસ/શિયાળ

foyer

fracas/ફ્રેકા/ઝગડો, તોફાન

fragile/ફ્રેજાઈલ/નાજુક, નબળું

fragment/ફ્રેગમન્ટ/ટુકડો

fragrance/ /

fragrance/ફ્રેગરન્સ/સુગંધ

fragrant/ફ્રેગરન્ટ/સુગંધી

frail/ /

frail/ફ્રેઈલ/નાજુક, તકલાદી

frame/ /

frame/ફ્રેઈમ/ઘડવું, માળખું, બાંધો

franchise/ફ્રેન્ચાઈઝ/મતાધિકાર

frank(ly)/ /

frank/ફ્રેન્ક/નિખાલસ

frantic/ફ્રેન્ટિક/બેભાકળું

fraternal/ફ્રેટરનલ/ભાઈચારાનું

fraternity/ફ્રેટરનિટી/ભાઈચારો

fraud/ફ્રૉડ/છેતરપિંડી

fraught/ફ્રૉટ/ચિંતા, નિરાશામય

fray/ફ્રે/લડાઈ, ઝંગ, મેદાન (ચૂંટણી)

freak out-વું

freak/ /

freak/ફ્રીક/તરંગ, તોર, વિચિત્રતા

free/ફ્રી/મુક્ત, નવરું, મફત

freed(om)/ /

freelance મુક્ત/છુટક રીતે કામ કરનાર

free-loader/ફ્રીલોડર/પારકા પૈસે મોજ કરનાર

freeze/ /

freeze/ફ્રીઝ/સ્થગિત, થીજી જવું, થીજાવવું

freight/ /

freight/ફ્રાઈટ/માલવહન ભાડું

frenetic જોરદાર, ઝનૂની, બેકાબૂ

frenzied/ફ્રેન્ઝીડ/

frenzy/ફ્રેન્ઝી/ ઉન્માદ, ઝનૂન

frequent/ /

frequent/ફ્રીકવન્ટ/વારંવારનું

fresco/ફ્રેસ્કો/ભીંતશિલ્પ

fresh/ /

fresh/ફ્રેશ/તાજું, નવું

fret over/ફ્રેટઓવર/ધુવાં પુવા થવું

fret/ફ્રેટ/

fretful/ફ્રેટફુલ/રિસાળ, ચીડિયું

friars

friend(ly)/ /

friend/ફ્રેન્ડ/મિત્ર, સાથી

frieze/ફ્રીઝ/ચિત્રપટ્ટો

fright(en)/ /

fright/ફ્રાઈટ/ડર, ભય

frighten away-વું

frighten/ફ્રાઈટન/ભીવડાવવું, ધાક બેસાડવી

frigid/ફ્રિજીડ/નીરસ, મંદ

fringe/ફ્રિન્જ/ઝાલર, કિનાર, આનુસંગિક

frisky/ફ્રિસ્કી/મોજાવું

frisson/ફ્રિસન/ઉર્મિ આવેશ

frivolous/ફ્રિવોલસ/ઉછાંછળું, છોકરમત

frog/ /

frog/ફ્રોગ/દેડકો

from/ /

from/ફ્રોમ/થી

front/ /

front/ફ્રન્ટ/આગળ
frontiers/ફ્રન્ટીઅર્સ/સીમાઓ
frost/ /
frost/ફ્રોસ્ટ/ઝાકળ
froth/ફ્રોથ/ફીણ
frown on-વું
frown/ /
frown/ફાઉન/ભવાં ચડાવવાં
frozen/ફ્રોઝન/થીજાવેલું
fructify/ફ્રુક્ટિફાય/ફળ આવવાં
frugal/ફ્રુગલ/કરકસરિયું
fruit/ /
fruit/ફ્રુટ/ફળ
fruitful/ફ્રુટફુલ/ફળદાયી
frustrate/ફ્રસ્ટ્રેટ/નિરાશ કરવું
frustration/ફ્રસ્ટ્રેશન/નિરાશા
fry/ /
fry/ફ્રાય/તળવું
fudge/ફજ/ /
fuel/ /
fuel/ફ્યુલ/બળતણ
fugitive/ફ્યુજીટીવ/નાસતું ફરતું, ભાગેડું
fugue/ફ્યુગ/સંગીત રચના
fulcrum/ફુલક્રમ/ટોકો, આલંબ
fulfil/ /
full swing/ફુલસ્વિંગ/પુરજોસમાં
full(y)/ /
full/ફુલ/સંપૂર્ણ, ભરેલું, આખું
full-fledged પૂર્ણકક્ષાનું, સંપૂર્ણ
fulsome/ફુલસમ/અતિશય, વધુ પડતું
fumble/ફમ્બલ/ફાંફા મારવાં, થોથવાવું
fumigate/ફ્યુમિગેટ/શુદ્ધ કરવું
fuming/ફ્યુમિંગ/ધૂવા ફૂવા
fun(ny)/ /
fun/ફન/મજાક, મોજ
functionary/ફંક્શનરિ/કર્મચારી, અધિકારી
fund/ /
fundamental/ફન્ડામેન્ટલ/પાયાનું મૂળભૂત
fundamentalist/ફન્ડામેન્ટલિસ્ટ/કટર-રૂઢિવાદી
funds/ફંડ/ફાળો, નાણું
funeral/ /
funeral/ફ્યુનરૂલ/અંતિમવિધિ-ક્રિયા
fungi/ફુન્ગિ/ફૂગ (બ.વ.)
fungus ફૂગ(એ.વ.)
funky/ફન્કિ/સરળ, પ્રચંડ, ફંશનેબલ
funnel/ફનલ/ગળણી, નાળવું
funny/ફનિ/વિચિત્ર, રમુજી, વિનોદી
fur/ /
fur/ફર/રંવાદી, રેસા
furious/ફ્યૂરિઅસ/ધૂવાફૂવા

furl/ફર્લ/સંકેલવું
furnish/ /
furnish/ફર્નિશ/સજાવવું, પૂરું પાડવું, આપવું
furniture/ /
furniture/ફર્નીચર/રાચરચીલું
fuore/ફ્યોરોરી/ધાંધલ, હંગામો
furrow/ફરો/ચાસ(ખેતર)
further/ /
further/ફરધર/આગળ-વધારવું
furtherance/ફરધરન્સ/પ્રગતી, પ્રોત્સાહન
furtive/ફર્ટિવ/છાનુંછપનું
fury/ફ્યુરી/કોપ, રોષ
fuse/ /
fuse/ફ્યુઝ/વાટ, ઓગળવું, જામગરી, સુરંગ
fuselage/ફ્યુઝલાઝ/વિમાનનું ભંડકિયું
fusillade/ફ્યુઝિલેડ/સતત તોપમારો-ગોળીબાર
fusion/ફ્યુઝન/એકીકરણ, મિલન, જોડાણ
fuss(y)/ /
fuss/ફસ/લપ્પન છપ્પન, ચિકાસ
fussy/ફસિ/લપિયું, ચીકણું
fustian/ફસ્ટિઅન/આડંબરી ભાષા, એક કાપડ
 futile/ફ્યુટાઇલ/વ્યર્થ, નિરર્થક, નકામું
futility/ફ્યુટિલિટિ/વ્યર્થતા, નિરર્થકતા
future/ /
future/ફ્યુચર/ભવિષ્ય
futuristic/ફ્યુચરિસ્ટિક/ભવિષ્યલક્ષી
fuzz/ફઝ/ફીણ, ઝીણા કણ, પોલિસમૅન
fuzzy/ફઝિ/ઝાંખું, ફૂલાયેલું, ધૂંધળું
ga ga
gabble/ગૅબલ/બબડાટ-લવારો કરવો
gad about/ગૅડ અબાઉટ/ભટકવું, રખડવું
gadgetory
gaffe/ગૅફ/છબરડો, લોચો મારવો
gag/ગૅગ/ટુંપો, ગુંગળાવવું
gage/ /
gage/ગેજ/
gaily
gain on-વું
gain/ /
gain/ગેઇન/લાભ, પ્રાપ્ત કરવું, મેળવવું, લાભ
gainsay/ગેઇનસે/રદિયો આપવો
gait/ /
gait/ગેઇટ/ચાલવાની રીત
gaitly/ગેઇટિ/આનંદ, મોજ
gala/ગાલા/ભવ્ય
gale/ગેઇલ/વાવાઝોડું
gall/ગૅલ/નારાજ કરવું
gallant/ગૅલૅન્ટ/શાનદાર, બહાદુર, ઈશકબાજ
gallantry/ગૅલૅન્ટ્રી/વીરતા, શૌર્ય
gallop/ગૅલપ/છલાંગ મારવી, ઘોડાની ચાલ

gallows/ગોલ્ડા/ફાંસી નો માંચડો
galore/ગોલોર/મબલક,વિપુલ,પ્રચૂર
galvanise/ગેલ્વેનાઇઝ/પ્રેરવું, જાગૃત કરવું
gambit/ગેમ્બિટ/યુક્તિ,ચાલ
gamble/ /
gamble/ગેમ્બલ/જુગાર
gambol/ /
gambol/ગેમ્બોલ/ગેલ કરવી
game/ /
game/ગેઈમ/રમત,ચાલ
gamin
gammy
gamut/ગેમટ/આખી રચના
gang/ /
gang/ગેંગ/ટોળકી
gangster/ગેંગસ્ટર/ગુંડો
gap/ /
gap/ગેપ/ખાલી જગ્યા,અવકાશ
gape at
gape/ /
gape/ગેઈપ/વકાસવું,બગાસું
garage/ /
garage/ગેરાજ/
garb/ગાર્બ/વસ્ત્રો
garbage/ગાર્બેજ/કચરો
garden/ /
garden/ગાર્ડન/બગીચો
gargantuan/ગાર્ગેન્ટુઆન/વિરાટ,કદાવર
gargle (યેચિની) કોગળાં કરવા
garish/ગેરિશ/ભપકાદાર,ઠસાવાળું
garment/ /
garrison/ગેરિસન/લશ્કરી દળ (કિલ્લો)
garrulous/ગેરુલસ/વાતોડિયું
gas/ /
gas/ગેસ/બડાઈ,ગપ્પાં મારવા,વાયુ
gashed/ગેશ્ડ/કપાયેલું-ઘા થયેલું
gasp/ /
gasp/ગેસ્પ/હાંફવું
gate/ /
gate/ગેઈટ/દરવાજો
gather/ /
gather/ગેઠર/એકઠા થવું-કરવું
gauche/ગોશ/કઠંગું
gaudy/ગોડિ/ભપકાદાર,ચમકીલું
gauge/ /
gauge/ગેઈજ/માપ-તાગ લેવો
gauntlet/ગોન્ટલેટ/લોખંડનો ખોંચો
gauze
gave/ગેઈવ/આપ્યું ઘેપી ભૂ.કા.
gavel/ગેઈવલ/હરાજી કરનાર,ન્યાયઘીશની હથોડી

gawky/ગોકિ/બેડોળ,સંકોચશીલ
gay/ /
gay/ગેય/મોજીલું,સમલિંગી પુરુષ
gaze/ /
gaze/ગેઈઝ/તાકીને જોવું
gazebo/ગેઝેબો/સુંદર દ્રશ્ય સ્થાન
gazette/ગેઝેટ/સરકારી મુખપત્ર
gazump/ગેઝમ્પ/છેતરવું
gear up/ગીઅર અપ/સજ્જ થવું,તૈયાર થવું
gear/ /
gear/ગીયર/દાંતા-ચક્ર
geisha/ગેઈશા/નૃત્ય મનોરંજન કરનાર સ્ત્રી
gems/જેમ્સ/રત્નો
gender/જેન્ડર/લીંગ,જાતી
general(ly)/ /
general/જેનરલ/સામાન્ય,સરસેનાપતી
generate/જનરેટ/ઉત્પાદન કરવું
generation/જનરેશન/પેઢી,ઉત્પાદન
generic/જનરિક/પ્રકાર કે વર્ગ નું
generous/ /
generous/જેનરસ/ઉદાર
genesis/જિનેસિસ/ઉત્પત્તિ,મૂળ
genetic/જિનેટિક/આનુવંશિક
genial/જિનિઅલ/સૌમ્ય
genius/જિનિઅસ/મહાપ્રતિભાશાળી
genocide/જિનોસાઈડ/જાતિ સંહાર,નરસંહાર
genteel/જેન્ટિલ/દંભી રીતભાત
gentle(man)/ /
gentle/જેન્ટલ/નમ્ર,વિનયી
gently/ /
gently/જેન્ટલી/હળવેથી,નમ્રતાથી
gentry/જેન્ટ્રી/ભદ્ર લોકો
genuflect/જેન્યુફ્લેક્ટ/ધૂંટણિયે પડવું
genuine/જેન્યુઈન/અસલી,સાચું
genus/જનસ/વર્ગ,જાતિ
geographical/જિઓગ્રાફિકલ/ભૌગોલિક
geology/જિઓલજી/ભૂસ્તરશાસ્ત્ર
germane/જર્મેઈન/પ્રસ્તુત,સંબંધિત
germinate/જર્મિનેટ/અંકુર ફૂટવાં
gerrymander/જેરીમેન્ડર/મૂર્ખ બનાવવું,છેતરવું
gestation/જેસ્ટેશન/ગર્ભાવસ્થા
gesticulate/જેસ્ટીકયુલેઈટ/હાવ ભાવ સાથે
gesture/જેસ્ટર/ઈશારો,સંકેત
get about-વું
get across/ /
get across-વું
get along/ /
get along//આગળ ચલાવવું
get along-વું
get around-વું

get at-વું
get away with//
get away with-વું
get away-વું
get back at-વું
get back to-વું
get back-વું
get behind-વું
get by//
get by-વું
get down to//
get down to-વું
get down//
get down-વું
get in on-વું
get in with-વું
get in-વું
get into-વું
get off with -વું
get off//
get off-વું
get on for-વું
get on with-વું
get on//
get on/of-
get on-વું
get onto-વું
get out of-
get out of-વું
get out-વું
get over with-વું
get over-વું
get round to-વું
get round-વું
get through-વું
get together-વું
get to-વું
get tough/ગેટ ટફ/સખતાઈ-કડકાઈ_કરવી
get up-વું
get upto-વું
get//
get/ગેટ/મેળવવું
gew gaw/ગિગૌ/તકલાદી
geyser/ગેઈઝર/ગરમ પાણીનો ઝરો
ghastly/ઘાસ્ટલી/ભયાનક
ghetto/ઘેટો/ચૌટો-ચોરો
ghost//
ghost/ઘોસ્ટ/ભૂત-પલિત
ghostly/ઘોસ્ટલિ/ભૂતપ્રેતનો આભાસ
giant//
giant/જાયન્ટ/રાક્ષસ, વિરાટ

gibberish/જીબરિશ/બકવાસ, લવારો
giddy/ગિડિ/ચકકર-ફેર આવે તેવું
gift//
gift/ગિફ્ટ/ભેટ-આપવી
gigantic/જાયગૅન્ટિક/વિરાટ, મહાકાય
giggle/ગિગલ/હાહા-હીહી હાસ્ય
gilt/ગિલ્ટ/સોને મઢવું
gimcrack/ગિમક્રક/તકલાદી
gimmick/ગિમિક/યુક્તિ, ચાલ, ગતંકુ
gimmicky/ગિમિકિ/ચાલાકી વાળું
gin//
gin/જિન/ચરખો, એક શરાબ
gingerly/જિન્જર્લિ/સાવચેતી પૂર્વક
girl//
girl/ગર્લ/છોકરી
gist/જિસ્ટ/સારાંશ, ટૂંકસાર, અર્ક
give away//
give away-વું
give in//
give in/ગિવઈન/નમતું જોખવું
give off//
give off-વું
give onto -વું
give out//
give out-વું
give over-વું
give up//
give up/ગિવઅપ/છોડી દેવું, ત્યાગવું
give up-વું
give upon-વું
give way-વું
give//
give/ગિવ/આપવું
given/ગિવન/આપેલું
glad//
glad/ગલ્ડ/ખુશ, રાજી
gladden/ગલ્ડન/ખુશ કરવું
glamorous/ગલ્મરસ/મોહક, ભવ્ય
glamour/ગલ્મર/મોહકતા, ચમક-દમક
glance//
glance/ગલ્ન્સ/ઝલક, દૃષ્ટિપાત, નજર કરવી
glare//
glare/ગલ્અર/ચળકાટ, ચમક, તેજસ્વીતા
glaring/ગલ્અરિંગ/ચળકતું, ઝળહળતું
glasnost/ગલ્સ્નોસ્ટ/મુક્ત વ્યવહાર
glass//
glass/ગલાસ/કાચ, પ્યાલો
glaze/ગલેઈઝ/ચમક
glazed/ગલેઈઝડ/ચકચકિત
gleam//

gleam/ગલીમ/પ્રકાશનું કિરણ, ચમક
glee/ગલી/આનંદ, હરખ
glib-talker/ગિલબટૉકર/વાચાકુશળ, વાક્યાતુર્ય વાળું
glide/ /
glide/ગ્લાઇડ/સરકવું, લપસવું
glimmer/ગિલમર/ચમક, ચમકવું
glimpse/ /
glimpse/ગિલમ્પ્સ/ઝલક, ઝાંખી
glint/ગિલન્ટ/ચમક
glitch/ગિલચ/ખોટકો
glitter/ગિલટર/ચળકાટ, ચમકવું
glitzy/ગિલટઝિ/ભપકાદાર, શાનદાર
gloat/ગ્લોટ/કામુક-લોભી દૃષ્ટિ થી જોવું
global/ગ્લોબલ/વૈશ્વિક
globe/ /
globe/ગ્લોબ/ગોળો, દુનિયા
gloomy/ગ્લૂમિ/અંધકારમય, ધૂંધળું, હતાશ
glorify/ /
glorify/ગ્લોરિફાય/મહિમા-ભવ્યતા વધારવી
glorious/ગ્લોરિઅસ/ભવ્ય, કિર્તિમાન
gloss over છુપાવવું, ટાળવું
glossary/ગ્લોસરી/વિશિષ્ટ શબ્દો
glossy/ગ્લોઝિ/લીસું-ચમકદાર
glotto/ગ્લોટો/ભાષા
glove/ /
glove/ગ્લવ/હાથનું મોજું
glow/ /
glow/ગ્લોઉ/ચમકવું, ચમક
glue/ /
glue/ગ્લૂ/ગુંદર, ચોટી જવું
glum/ /
glum/ગ્લમ/ઉદાસ, ગમગીન
glut/ગ્લટ/છલોછલ, ભરપૂર
glutton/ગ્લટન/ખાઉધરું
gnash/ગ્નેશ/દાંત કચકચાવવા
gnat/ગ્નેટ/મરછર
gnaw/ /
gnaw/ગ્નો/કોરી ખાવું, રિખાવવું
gnome/ગ્નોમ/ખજાનારક્ષક ભુત
go - ga ga
go about-વું
go after-વું
go ahead-વું
go along-વું
go astray અવળામાર્ગે વળવું
go at-વું
go back on-વું
go back-વું
go bad/ /
go by-વું

go down with/ /
go down-વું
go for//વેચાવું, ની પસંદગી કરવી
go in for/ /
go in for-વું
go into-વું
go off/ /
go off-વું
go on ચાલુ રાખવું
go out-વું
go over-વું
go round/ /
go round-વું
go through with-વું
go through/ /
go through-વું
go together-વું
go towards-વું
go under-વું
go up
go up-વું
go with-વું
go without-વું
go/ /
go/ગઉ/જવું
goad/ /
goad/ગોડ/અંકુશમાં રાખવું, વિનતિ કરવી
goal/ /
goal/ગોલ/ધ્યેય, લક્ષ્ય
goat/ /
goat/ગોટ/બકરી
gobble/ગોબલ/ગળી જવું, સ્વાહા કરી જવું
gobbledygook/ગોબ્લડિગૂક/અષ્ટંપષ્ટ ભાષા
go-between ગોબિટવીન/મધ્યસ્થી
god/ /
god/ગોડ/ભગવાન
godfather/ગોડ/ ધર્મપિતા, ગુંડાનો સરદાર
gold(en)/ /
gold/ગોલ્ડ/સોનું
gone/ગોન/ગયેલું
gonna = going to
good/ /
good/ગુડ/સારા, સારી,
goodbye/ /
goods/ /
goods/ગુડ્ઝ/માલ, સામાન
gooey/ગુયી/ચિકણું
goof up/ગૂફ/ગોટો-છબરડો કરવો
goof/ગૂફ/મંદબુધ્ધિ, મૂર્ખ
goofy/ગૂફિ/અકકલ વિનાનું, મંદબુધ્ધિ

goon/ગૂન/ભારૂતિ ગુંડો, મૂર્ખ, બુધ્ધિહિન
gorge/ગોર્જ/કોતર, ખીણ
gorgeous/ગોર્જિઅસ/ભવકાદાર, ભવ્ય
gorilla /
gorilla/ગોરીલા/માનવ જેવો વાંદરો
gormandise/ગોરમૅન્ડાઈઝ/ખૂબજ ખાવું
gory/ગોરિ/લોહિયાળ, રક્તરંજિત
gospel/ગોસ્પેલ/ઉપદેશ, સુવાર્તા
gossamer/ગોસામર/તંતુ જેવું
gossip/ગોસિપ/ગપ્પાં મારવાં
got/ગોટ/મેળવ્યું, મળ્યું
gourmet/ગૂરમે/સ્વાદરસિક-શોખીન
govern(ment) /
govern/ગવર્ન/શાસન-વહિવટ કરવો
governance/ગર્વનન્સ/શાસન-વહિવટ
grab /
grab/ગ્રેબ/ખૂંચવી, ઝૂંટવી લેવું
grace(ful) /
grace/ગ્રેસ/કૃપા, નજાકત
graceful/ગ્રેસફુલ/કૃપાળુ, નજાકતભર્યું
gracious/ગ્રેસીઅસ/દયાળું
grade /
grade/ગ્રેડ/અંક, કક્ષા, વર્ગ
gradient/ગ્રેડિઅન્ટ/
gradual /
gradual/ગ્રેજ્યુઅલ/ક્રમિક, ધીમું, ઉત્તરોત્તર
graduate /
graduate/ગ્રેજુએટ/સ્નાતક-થવું
graffiti/ગ્રાફિટિ/દિવાલ પરનું પ્રચારચિત્ર
graft/ગ્રેફ્ટ/કટકી, ગોલમાલ, છોડની કલમ
grain /
grain/ગ્રેઈન/દાણો, અનાજ, કણ
gram /
gram/ગ્રામ/ચણા, કિલોનો હજારમો ભાગ
grammar /
grammar/ગ્રેમર/વ્યાકરણ
granary/ગ્રેનરિ/ અનાજના ભંડાર-કોઠાર
grand /
grand/ગ્રાંડ/ભવ્ય, સર્વગાહી
grandeur/ગ્રેજર/ભવ્યતા
grandfather /
grandiloquence/ગ્રાંડઈલોકવન્સ/આડંબરી ભાષા
grandiose/ગ્રાંડીઓઝ/મોટા પાયે, ભવ્ય, નિર્ધારીત
grandmother /
grandparent /
grant /
grant/ગ્રાંટ/માન્યતા, અનુદાન, મંજૂરી
granular/ગ્રેન્યુઅલ/દાણાદાર, કણીદાર
grape /
grape/ગ્રેઈપ/દ્રાક્ષ

grapevine/ગ્રેપવાઈન/જાણકાર સુત્રો
graph(ic) /
graph/ગ્રાફ/આલેખ, ચિત્ર
graphic/ગ્રાફિક/આબેહુબ, કોતરકામ
grapple/ગૅપલ/બાથ ભીડવી, મથવું
grasp /
grasp/ગ્રાસ્પ/પકડવું, ગ્રહણ કરવું
grass /
grass/ગ્રાસ/ઘાસ
grassroots/ગ્રાસરૂટ/પાયો, મૂળ, મતદાતાઓ
grate /
grate/ગ્રેટ/ખમણવું, સગડી
grateful /
grateful/ગ્રેટફુલ/આભારી, ઉપકૃત
gratification/ગ્રેટિફિકેશન/તૃપ્તિ, આનંદ, સંતોષ
gratify/ગ્રેટિફાય/સંતોષ થવો, આનંદ થવો
gratis/ગ્રાટી/મફત
gratuitous/ગ્રેટ્યુઈટસ/ફોગટનું, સ્વૈચ્છિક
grave /
grave/ગ્રેવ/ગંભીર, કબર, કોતરવું
graveyard/ગ્રેવયાર્ડ/કબ્રસ્તાન
gravity/ગ્રેવિટિ/ગાંભીર્ય, ગુરુત્વાકર્ષણ, ઘટ્ટતા
gray matter બુધ્ધિ ચાતુર્ય
graze /
graze/ગ્રેઝ/ચરવ, છોલાવું
grease /
grease/ગ્રીસ/ઉજણ(યંત્ર)ચિકાસવાળું પ્રવાહી
greasy/ગ્રીઝિ/ખુશામતિયું, ચીકણું, લપસણું
greasy-palms લાંચિયું
great(ly) /
great/ગ્રેટ/મહાન, મોટું
greed /
greed/ગ્રીડ/લોભ
greedy/ગ્રીડિ/લોભી
green /
green/ગ્રીન/લીલું, તાજું
greet /
greet/ગ્રીટ/અભિવાદન કરવું
gregarious/ગ્રિગેરિઅસ/મળતાવડું
grenade/ગ્રેનેડ/હાથગોળો
grey /
grey/ગ્રે/ભૂખરું
grey-matter/ગ્રેમૅટર/મગજ, માનસિક શક્તિ
grid/ગ્રિડ/જાળી, માળખું
grief /
grief/ગ્રીફ/દુઃખ,
grievance/ગ્રીવન્સ/અસંતોષ
grieve /
grieve/ગ્રીવ/શોક કરવો
grievous/ગ્રીવીઅસ/મહાવ્યથા, ભારે ઈજા

grill / /
grill/ગ્રીલ/શેકવું, જાળી, ઉલટ તપાસ કરવી
grim / /
grim/ગ્રિમ/બીહામણું, ગંભીર, ગમગીન
grimace/ગ્રિમેસ/મોં વાંકું કરવું
grime/ગ્રાઈમ/
grime/ગ્રાઈમ/મેલ
grin / /
grin/ગ્રિન/દાંતિયા કરવા, હાસ્ય
grind / /
grind/ગ્રાઈન્ડ/દબવું, ભુકો કરવો
grip / /
grip/ગ્રિપ/પકડ-પકડવું
grisly/ગ્રિઝલી/ભયાનક, વિકરાળ
grist/ગ્રિસ્ટ/દબણું
grit/ગ્રિટ/કપચી, સહનશક્તિ
grizzle/ગ્રિઝલ/ડૂસકા ભરવાં
grizzly/ગ્રિઝલિ/રીંછ, ભુરું
groan / /
groan/ગ્રોઉન/કષ્ટસવું
grocer/ગ્રોસર/કરિયાણા વાળો
grocery / /
grocery/ગ્રોસરિ/કરિયાણું
groggy/ગ્રોગિ/પીથેલું, લથડિયાખાતું
groom/ગ્રૂમ/વરરાજા, ઘડતર કરવું
groomsmate/ગ્રૂમ્સમેટ/અણવર
groove/ગ્રૂવ/ખાંચો, કાપો
grope / /
grope/ગ્રોપ/ફાંફાં મારવા
gross/ગ્રોસ/એકંદર, અતિશય, ૧૨ ડઝન
grotesque/ગ્રોટેસ્ક/કદરૂપું, વિચિત્ર
grotty/ગ્રોટ્ટિ/કદરૂપું, ન ગમે તેવું
grouchy/ગ્રાઉચિ/બહાડાટ કરવું
ground / /
ground/ગ્રાઉન્ડ/મેદાન, આધાર
grounds/ગ્રાઉન્ડ્ઝ/મુદ્દા, આધાર
group / /
group/ગ્રુપ/જૂથ, ટુકડી
grouse/ગ્રાઉઝ/રંજ, રોદણાં રોવા
grove/ગ્રૂવ/વૃક્ષઘટા, વનરાજી
grow apart-વું
grow in-વું
grow out of-વું
grow up-વું
grow / /
grow/ગ્રો/વધવું, ઉગવું
growl / /
growl/ગ્રાઉલ/ધુરકવું
grown-up મોટેરાં, ઘરડાં, પુખ્ત
growth/ગ્રોથ/વિકાસ, ઉદ્ભવ

grudge/ગ્રજ/રંજ, રોષ હોવો
gruel/ગ્રૂએલ/થકવી નાખે તેવું
grueling/ગ્રૂએલિંગ/
gruesome/ગ્રૂસમ/અરેરાટી પુર્ણ
gruff/ગ્રફ/તોછડું
grumble/ગ્રમ્બલ/બબડ્યા કરવું
grunt / /
grunt/ગ્રન્ટ/ભૂંડનો અવાજ
guarantee/ગૅરન્ટિ/બાંધધરી, જામીન
guard against-વું
guard / /
guard/ગાર્ડ/રક્ષણ, ચોકી, રક્ષક
gubernatorial/ગબરનેટોરિઅલ/રાજ્યપાલનું
guerrilla/ગૅરિલા/છાપામાર સૈનિકો
guess / /
guess/ગેસ/અનુમાન-કરવું
guest / /
guest/ગેસ્ટ/મહેમાન, અતિથી
guffaw/ગફૉ/લોચો-છબરડો વાળવો
guidance / /
guide / /
guide/ગાઈડ/માર્ગદર્શક
guided/ગાઈડેડ/નિર્ધારીત, ના લક્ષી
guideline/ગાઈડ/માર્ગદર્શક, સાથી
guilt(y) / /
guilt/ગીલ્ટ/ગુન્હો-પાપ કર્યા ની લાગણી
guitar/ગિટાર/
gulf / /
gulf/ગલ્ફ/ખાડી, અખાત, અંતર
gullible/ગલિબલ/ભોળુંભટ્ટ, માની લે તેવું
gulp/ગલ્પ/ગળી જવું, સ્વાહા
gum / /
gum/ગમ/પેઢાં, ગુંદર
gumption/ગમ્પશન/સાધન-સંપન્નતા, સૂઝ
gun down/ગન ડાઉન/ભડાકે દેવું
gun / /
gun/ગન/બંદુક
gung-ho/ગંગ હો/અતિ ઉત્સાહી
gurgle/ગર્ગલ/કોગળા કરવાં, ખળખળ અવાજ
gush/ગશ/ખળખળ વહેવું, ધોધ વહેવો
gust / /
gust/ગસ્ટ/મજા, લિજ્જત
gusto/ગસ્ટો/મજા, લિજ્જત, સ્વાદ
gut / /
guts/ગટ્સ/હિંમત, આંતરડા
guttled/ગટેડ/ખાક, સ્વાહા
gutter
guy/ગાય/વ્યક્તિ, જણ
guzzle/ગઝલ/ઢીંચવું
gypsy (ચૈજમ) જીપ્સી, ભટકતી જાતી

gyration/જાયરેશન/ચકાવો, ભ્રમણ**gyves****habeas corpus** કેદીને રજૂ કરવાનો હુકમ**haberdasher**/હંબરડેશર/સીલાઈ નો માલવેચનાર**habiliments**/હંબિલિમેન્ટ/કપડાં, વિશિષ્ટ પોષાક**habit(ual)** / /**habit**/હેબીટ/ટિવ, આદત**habitual**/હંબિચ્યુઅલ/આદત પ્રમાણેનું**habituate**/હંબિચ્યુએટ/આદત પડવી, ટેવાવું**habitué**/હંબિચ્યુએટ/આદતી મુલાકાતી**hack**/હૅક/માહિતી ચોરવી, કાપી ને હત્યા કરવી**hacked****hackle**/હૅકલ/લડાયક મિજાજમાં**hackneyed**/હૅકનીડ/ભાડૂતી લેખક, કામ કરનાર**had**/હેડ/હતું, અનુભવ્યું, કર્યું**hades**/હેડીઝ/નરક, પાતાળ**haemorrhage** આંતરિક રક્તસ્ત્રાવ**hag**/હેગ/ડાકણ**haggard**/હેગાર્ડ/ચીમળાઈ ગયેલું, નિસ્તેજ**haggle**/હેગલ/રકઝક, કચકચ**hail** / /**hail**/હેઈલ/વધાવી લેવું, આવકારવું, બરફ ના કરાં**hair(y)** / /**hair**/હેઅર/વાળ**halberd**/હેલ્બર્ડ/ફરસી, ભાલો**halcyon**/હેલસિયન/સમૃદ્ધિવાળું**hale & hearty** ખુશી મજામાં**hale** / /**hale**/હેલ/**half** / /**half**/હાફ/અર્ધ**halitosis**/હેલિઓટોટિસ/મોઠાં ની દુર્ગંધ**hall** / /**hall**/હૅલ/કમરો, ઓરડો**hallelujah**/હેલ્યુલુજા/જયજયકાર હો**hallmark**/હેલમાર્ક/**hallow**/હેલો/પવિત્ર**hallucination** આભાસ, ભ્રમણા**halo****halt** / /**halt**/હૅલ્ટ/અટકવું, રોકાણ, રોક, રૂક જાવ**halve** / /**halve**/હાલ્વ/બે ભાગ કરવા**hamlet**/હેમલેટ/નાનું ગામડું, નેસડો**hammer home**-વું**hammer out**-વું**hammer** / /**hammer**/હેમર/હથોડી થી ટીપવું**hammock** હિંચકો, સુલો**hamper** અવરોધવું, બાસ્કેટ**hamstrung****hamstrung****hand back**-વું**hand down**-વું**hand in glove** સાંકળાંક**hand in**-વું**hand out**-વું**hand over**-વું**hand** / /**hand**/હેન્ડ/હાથ**handicap**/હેન્ડિકૅપ/ અપંગ, અંતરાય**handiwork**/હેન્ડિવર્ક/હાથથી કરેલું**handkerchief** / /**handle** / /**handle**/હેન્ડલ/હાથોનસંભાળવું**handout**/હેન્ડઆઉટ/ચોપાનિયું**hand-picked** ચૂંદા, ચૂંટેલું**handy**/હેન્ડિ/હાથવગું**hang about** / /**hang about/around**-વું**hang back** / /**hang back**-વું**hang down**-વું**hang in**-વું**hang on to** / /**hang on to**-વું**hang on** / /**hang on**-વું**hang out**-વું**hang together**-વું**hang up** / /**hang up**-વું**hang** / /**hang**/હેન્ગ/લટકાવવું, ટિંગાડવું**hangar** / /**hangar**/હેન્ગર/વિમાન રાખવાનું સ્થળ**hanger** / /**hanger**/હેન્ગર/લટકણીયું**hang-over**/હેન્ગ ઓવર/પશ્ચાદ અસર**hanker after****hanker**/હેન્કર/ટળવળવું**hanky-panky**/હેન્કપેન્કિ/ગોલમાલિયું, લફરાંબાજ**haphazard**/હેફેઝાર્ડ/જિમતેમ, આડેધડ**haphazardly****hapless**/હેપલેસ/કમનસીબ**happen along**-વું**happen** / /**happen**/હેપન/બનવું, થવું**happy** / /**happy**/હેપિ/ખુશ, મજામાં, રાજી**haptic**/હેપ્ટિક/સ્પર્શ ને લગતું

harangue /હર્અંગ/બકવાસ, બફાટ	haunt /હાઉન્ટ/ભમવું, ઝળુંબવું
harass /હર્અસ/સતાવવું, હેરાન કરવું	haute couture
harbinger /હાર્બિન્જર/છડીદાર	have around -વું
harbour /હાર્બર/બંદર, આશ્રય આપવો	have back -વું
hard up /	have in -વું
hard /	have off -વું
hard /હાર્ડ/સખત, કઠણ, અઘરૂ	have on -વું
hardcore /હાર્ડકોઅર/પેઠી ગયેલું, અઠંગ, રીઠું	have out -વું
hardly /	have up -વું
hardly /હાર્ડલિ/ભાગ્યેજ	have /
hardship /	have /હવ/
hardware /હાર્ડવેઅર/યંત્ર-સામાન, શસ્ત્રો	haven /
hare /	haven /હવન/બંદર, આશ્રયસ્થાન
hare /હર/સસલું	havoc /હવોક/વિનાશ, પાયમાલી, બરબાદી
hark back -વું	hawk(er) /
hark /હાર્ક/સાંભળો	hawk /હૉક/બાજ, ચાલીને વેચવું
harlot /હાર્લટ/વેશ્યા	hawker /હૉકર/ફેરિયો
harm(ful-less) /	hawkish
harm /હાર્મ/ઇજા	hay /
harmony /હાર્મોનિ/સંવાદીતા	hay /હૈય/
harness /હાર્નેસ/જોતરવું, નાથવું	haywire /હૈવાયર/અસ્તવ્યસ્ત-ગાંડુ થવું
harp /હાર્પ/તાર ઝણઝણાવવા	hazard /હૉઝર્ડ/ખતરો, જોખમ
harried	hazardous /હૉઝર્ડસ/ખતરનાક
harrow /હરો/ચીરવું	haze /
harrowing ordeal	haze /હૈઝ/ઝાંખું
harrowing /હરોઈંગ/અતિ પીડાજનક	hazel /હૈઝલ/બદામી
harsh /	hazy /હૈઝિ/ઝાંખું, ધૂંધળું
harsh /હાર્શ/કઠોર	he /
harvest /હાર્વેસ્ટ/પાક, લણણી કરવી	head for આગળ વધવું
has /હાસ/ને છે	head off -વું
hash /હૈશ/	head on સામે સામા, માથાભેર
hassle /હૈસલ/માથાકુટ	head up -વું
haste /	head /
haste /હૈસ્ટ/ઉતાવળ	head /હૈડ/દોરી જવું
hasten /હૈસ્ટન/ઉતાવળ કરવી	head /હૈડ/
hasty /	headstrong
hasty /હૈસ્ટી/ઉતાવળીયું	heal /
hat /	heal /હીલ/સાજા કરવું
hat /હૈટ/	health(y) /
hatch /	health /હેલ્થ/
hatch /હૈચ/ઈંડા સેવવા, કાવતરું કરવું	healthy /હેલ્થી/તંદુરસ્ત
hate /	heap /
hate /હૈટ/ધિકકારવું	heap /હીપ/ઢગલો
hatred /	hear of -વું
hattrick ઉપરા ઉપર ત્રણવાર વિકેટ કે ગોલ	hear out -વું
haughty /હૉટિ/અહંકારી	hear /
haul up	hear /હીઅર/સાંભળવું
haul /	heard /
haul /હાઉલ/દલ્લો હાથ લાગવો, ચોરાવું, ખેંચવું	heard /હૉર્ડ/સાંભળ્યું
haunt /	hearsay /હિઅરસેઈ/ઉડતી વાત, અફવા

hearse શબવાહિની
heart(ty) / /
heart હાર્ટ/હૃદય
heart-rending હૃદયદ્રાવક
heart-throb દિલનો શહેનશાહ
heartly હાર્ટિ/હાર્ટિક, જબરું
heat up-વું
heat / /
heat/હીટ/ગરમી
heathen જંગલી માણસ
heave ઉછળવું, નિસાસા નાખવા
heaven / /
heaven/હેવન/સ્વર્ગ
heavy / /
heavy/હેવી/ભારે, અતિ
heckle વક્તાને ભીડવવું
hectic દોડધામવાળું, આવેશમય, રઘવાયું
hector દગડા
hedge / /
hedge/હેજ/વાડ, ઝાડી
hedging
hedonist ભોગવાદી
heed / /
heed/હીડ/ધ્યાન દેવું
heel / /
heel/હીલ/ઝેડી
hefty/હેફ્ટિ/રૂપ્પુષ્ટ, કદાવર, જબરું, તગડું
hegemony/હેજિમનિ/વર્ચસ્વ, નેતાગીરી
height / /
height/હાઈટ/ઉંચાઈ
heighten/હાઈટન/વધવું, સતેજ થવું
heinous/હીનઅસ/ઘોર, ઘૃણાસ્પદ
heir / /
heir/એઅર/વારસદાર
held / /
held/હેલ્ડ/યોજાયું, ધરપકડ થઈ
hell / /
hell/હેલ/નરક
hello / /
hello/હેલો/
helm / /
helm/હેલ્મ/સુકાન
helmsman/હેલ્મસમેન/સુકાની
help(ful) / /
help/હેલ્પ/મદદ, રાહત, સહાય
helter-skelter અંધાધૂંધિમય, રઘવાયું
hem / /
hemlock/હેમલોક/ઝેરનો ઘુંટડો
hemorrhage/હેમરિજ/આંતઃરક્તસ્ત્રાવ
hen / /

hen/હેન/મરઘી
hence/હેન્સ/તેથી
henceforth/હેન્સફોર્થ/ હવે પછી-આગળ
henchman/હેન્ચમેન/ટેકેદાર, સાગરીત, મળતિયો
henna/હેના/મહેંદી
henpecked/હેન્પેકડ/જોરૂકા ગુલામ
her(s) / /
her/હર/તેણીનું
herald/હેરાલ્ડ/છડી પોકારનાર
herbal/હર્બલ/ઔષધિય, ઓસડિયું
herbivorous/હર્બિવોરસ/અહિંસક પ્રાણી
Herculean/હર્ક્યુલિઅન/મહામુશ્કેલ, ભગીરથ
herd / /
herd/હર્ડ/પશુઘણ
here / /
here/હિઅર/અંહિ
heredity/હેરિડિટિ/ આનુવંશ
heretic/હેરેટિક/નાસ્તિક
heretical/હેરેટિકલ/ પાખંડી
heritage/હેરિટેજ/સાંસ્કૃતિક વારસો
hernia/હેરિનિઆ/આંતરગાંઠ
heroic/હિરોઈક/શૌર્યપૂર્ણ
heroin/હિરોઈન/નાયિકા
heroine/હિરોઈન/કેફી દ્રવ્ય
hers/હર્સ/તેણીનું
herself / /
herself/હરસેલ્ફ/
hesitant/હેઝિટન્ટ/અચકાતું
hesitate / /
hesitate/હેઝિટેટ/અચકાવું
hetaerism રખાતપ્રથા
heterogeneous વિભિન્નતાવાળું
het-up excited
hexagonal ષટ્કોણ
hey / /
hey/હેય/(હાકલ)
heyday પુરબહાર-યુવાની કાળ
hiatus/હિએટસ/ખાલીપો, ફાંકું
hibernation સુસ્તી, નિષ્ક્રિયતા
hiccup/હિકપ્પ/હિડકી
hidalgo/હિડાલ્ગો/
hide out-વું
hide / /
hide/હાઈડ/છુપાવવું, કાચું ચામડું
hideous/હિડીઅસ/બિહામણું, ભયાનક
hideout/હાઈડઆઉટ/આશ્રયસ્થાન, છુપું સ્થાન
hierarchy/હાઈરાકી/સંગઠન, સંસ્થા-માળખું
Hi-Fi/હાઈફાય/(રેયર-કેગીનોઆ) ચોકસાઈવાળું
high / /
high/હાઈ/ઉંચું

high-handed
high-profile/હાઈપ્રોફાઈલ/મોટાઈ-ડોળવાળું
hijack/હાઈજૅક/વાહન સાથે અપહરણ કરવું
hike/હાઈક/વધારો, લાંબું ચાલવું
hilarious/હિલૅરિઅસ/વિનોદી, હાસ્યપ્રધાન
hill /
hill/હિલ/ટિકરી
him(self) /
him/હિમ/તેને
himself/હિમસેલ્ફ/તે પોતે-જાતે
hinder/હિન્ડર/અવરોધવું
hinderance/હિન્ડરન્સ/વિધન, અંતરાય
hindsight
hinge /
hinge/હીન્જ/મીજાગરો, અવલંબવું
hint /
hint/હિન્ટ/સંકેત, ઈશારો
hinterland દરિયા કાંઠા અંદરનો મુલક
hip /
hip/હિપ/જાંઘ
hire /
hire/હાયર/ભાડે દેવું-લેવું
hireling/હાયરિંગ/ભાડુતી માણસ, વેઠિયો
hirsute/હિર્સૂટ/રૂંવાટીવાળું
his /
his/હિઝ/તેનું
hiss /
hiss/હિસ/ફૂંફાડો, સીસકારો, સૂસવાટો
historic યાદગાર-ઐતિહાસિક પ્રસંગ
historic(al) /
historical/હિસ્ટરી/ઐતિહાસિક સ્થળ/બાબત
history /
history/હિસ્ટરી/ઈતિહાસ, ભૂતકાળ
histrionic/હિસ્ટ્રીઓનિક/નાટકિય વેળા-છટા
hit back-વું
hit off-વું
hit on-વું
hit out at/હિટઆઉટ ઍટ/સખત ટીકા/ઝાટકણી કાઢવી
hit out-વું
hit /
hit/હિટ/ફટકારવું, થી અસરગ્રસ્ત થવું, સફળ
hitch/હિચ/અડચણ, આંકડો મારવો
hitch-hike/હિચહાઈક/લીફ્ટ માગીને પ્રવાસ કરવો
hitherto/હિથરટુ/અત્યાર સુધી
hive off/હાઈવ ઍફ/
hive off-વું
hive /
hive/હાઈવ/
hoard /
hoard/હોર્ડ/સંગ્રહ કરવો

hoarder/હોર્ડર/સંગ્રાહખોર
hoarding
hoarse /
hoarse/હોર્સ/ઘોઘરો અવાજ
hoary પુરાણું, ઉંમર થી આદરપાત્ર
hoax /
hoax/હોક્સ/પોકળ-પોલી ધમકી, મશ્કરી
hobble/હોબલ/લંગડાવું
hobby /
hobby/હોબી/શોખ
hobnobbing/હોબ્નોબિંગ/મોટાઈમાં મહાલવું
hobo/હોબો/નવરુ, રખડેલ
hockey /
hockey/હોકી/રમત
hocus-pocus નજરબંદી
hog/હોગ/ડુકકર
hoggish/હોગિશ/
hoi-poloi/હોયપોલોય/સામાન્ય જનતા
hoist /
hoist/હોઈસ્ટ/ઉંચે ચડાવવું, ફરકાવવું
hoity-toity/હોયટિટોયટી/ધમંડી, આપ વડાઈ કરતું
hokum/હોકમ/લાગણી વેડાં
hold against-વું
hold back /
hold back/હોલ બેક/અવરોધવું
hold back-વું
hold down-વું
hold forth /
hold forth-વું
hold in-વું
hold off-વું
hold on /
hold on /
hold on/હોલ ઍન/થોભવું
hold out on-વું
hold out /
hold out/હોલ આઉટ/પ્રતિકાર થી ટકવું
hold out-વું
hold to-વું
hold up /
hold up-વું
hold with-વું
hold ઠેરવવું
hold /
hold/હોલ/ધરપકડ કરવી
hold/હોલ/થોજવું, ધારણ કરવું, ધરપકડ કરવી
holding રોકાણ, ભાગ, કબ્જો
hole up-વું
hole /
hole/હોલ/કાણું
holiday /

holiday/હોલીડે/રજા
holistic/હોલિસ્ટિક/એકરૂપ
holler/હોલર/ભૂમ પાડવી
hollow / /
hollow/હોલો/પોહું, ખોખું
holocaust/હોલોકોસ્ટ/સર્વનાશ, વિનાશ
holy / /
holy/હોલી/પવિત્ર
homage/હોમિજ/શ્રધ્ધાંજલી
home in on-વું
home / /
home/હઉમ/ઘર, આશરો
homely/હોમલિ/ઘર જેવું
homosexuality
honcho/હોચો/બોસ, મુખ્ય, કપ્તાન
hone up/હોન અપ/ધાર કાઢવી
honest(y) / /
honest/ઓનિસ્ટ/પ્રમાણિક
honorary/ઓનરરિ/માનદ્
honour(able) / /
honour/ઓનર/આદર, માન
honourable/ઓનરેબલ/માનનીય, આદરણીય
hooch/હૂચ/લકો, દેશી દારૂ
hood / /
hood/હૂડ/છાપરું, ઢાંકણું, ફેણ
hoodlum/હૂડલમ/ટપોરી, મવાલી
hoodwink/હૂડવિંક/આંખે પાટા બાંધવા, છેતરવું
hook up-વું
hook / /
hook/હૂક/આંકડો-ભરાવવો
hooked
hooligan/હૂલિગન/ગુંડો, બદમાશ, ટપોરી
hooliganism ગુંડાગીરી, મવાલીવેડાં
hoot out/હૂટ આઉટ/હડધૂત કરવું
hoot / /
hoot/હૂટ/હૂરિયો બોલાવવો
hop / /
hop/હોપ/કુદવું, ઠેકવું
hope(less-full) / /
hope/હોપ/આશા-રાખવી
horde / /
horde/હોર્ડ/ઘણા, ટોળું
horizon / /
horizon/હરાઈઝન/ક્ષિતિજ
horizontal/હોરિઝોન્ટલ/આડું
horn / /
horn/હોર્ન/શીંગડુ, વાહનનું હોર્ન
hornet's nest(ભમરી)મધપૂડો છંછેડવો
horrendous
horrible / /

horrible/હોરીબલ/ડરામણું, ભયાનક, ભયંકર
horrified
horrify ડરાવવું, ભયભીત કરવું
horse sense સામાન્યબુધ્ધિ
horse / /
horse/હોર્સ/ઘોડો
horse-trading/હોસ્ટ્રેડિંગ/સત્તા ની સોદાબાજી
horticulture/હોર્ટિકલ્ચર/બાગાયત
hose / /
hose/હોસ/રબ્બરનું ભૂંગળું, નળી
hospice/હોસ્પિસ/ધર્મશાળા
hospitable/હોસ્પિટેબલ/આતિથ્ય સત્કારવાળું
hospital / /
hospital/હોસ્પિટલ/ઈસ્પીતાલ
hospitality/હોસ્પિટેલિટિ/આતિથ્ય, પરોષાગત
host / /
host/હોસ્ટ/યજમાન-થવું
hostage/હોસ્ટિજ/બંદિવાન, બાન
hostel / /
hostel/હોસ્ટેલ/વિદ્યાર્થી નિવાસ
hostile / /
hostile/હોસ્ટાઈલ/શત્રુતાભર્યું, વિરોધી
hostility/હોસ્ટિલિટિ/દુશ્મનાવટ, વેરભાવ
hot potato/હોટપટેટો/કઢંગી-વિચિત્ર પરિસ્થિતિ
hot up/હોટઅપ/ગરમી આવવી
hot / /
hot/હોટ/ગરમ, માદક, તીખું
hotel / /
hotel/હોટેલ/વીશી
hound/હાઉન્ડ/શિકારી કૂતરોપ
hour / /
hour/અર/કલાક
hourly / /
house / /
house/હાઉસ/મકાન, રહેઠાણ
hover હવામાં ભમવું, ઝળુંબવું
how come/હાઉ કમ/એમ કેમ
how much / /
how / /
how/હાઉ/કેમ, કેવી રીતે
however / /
however/હાઉએવર/તેમ છતાં, તો પણ
howitzer/હાવિત્ઝર/રણતોપ
howl / /
howl/હાઉલ/ચૂરકવું
howler/હાઉલર/છબરડો, ગોટો, ગંભીર ભૂલ
hub/હબ/કેન્દ્ર, ઘરી
hubbub/હબબ/કોલાહલ, ગરબડ, ઘમાલ
hubby/હબી/પતિદેવ
hubris/હબ્રિસ/ઉધ્ધત, તોછડું

huckster/હકસ્ટર/ભાડુતિમાણસ, ફેરિયો
huddle/હડલ/નાસભાગ-ભીડ કરવી
hue and cry પોકાર, ભુમરાણ, દેકારો
hues/હ્યુઝ/રંગો
hug/હગ/ગળે લગાડવું
huge//
huge/હ્યૂજ/વિરાટ
hull//
hull/હલ/જહાજનું તળિયું
hum//
hum/હમ/સંદેહ, ગણગણાટ
human//
human/હ્યુમન/
humane
humanitarian/હ્યુમૅનિટૅરિઅન/માનવતાવાદી
humanities
humble નકામું બનાવી દેવું
humble/હમ્બલ/નમ્ર, ગરીબું
humblebug/હમ્બગ/જૂંટું, બકવાસ
humid/હ્યુમિડ/ભેજ વાળું
humiliate/હ્યુમિલિએટ/અપમાનિત કરવું
humorous//
humorous/હ્યુમરસ/રમુજ, વિનોદી
humour//
humour/હ્યુમર/રમૂજ, હાસ્ય
hunchback/હચબૅક/ઢૂંઢો, (ઉંચી પીઠ)
hundred//
hundred/હન્ડ્રેડ/સો, ૧૦૦
hunger//
hunger/હન્ગર/ભૂખ
hungry//
hungry/હન્ગ્રી/ભૂખ્યું
hunk/હન્ક/અખડધજ-કદાવર માણસ
hunky-dory/હંકિડોરિ/શ્રેષ્ઠ, સર્વોત્તમ
hunt down//
hunt down-વું
hunt out//
hunt out-વું
hunt(er)//
hunt/હન્ટ/શિકાર કરવો, શોધવું
hurl ફેંકવું, ઘા કરવો
hurly-burly ધાંધલ-ધમાલ, દેકારો
hurricane/હરિકેઇન/વાવાઝોડું, ઝંઝાવાત
hurriedly
hurry along-વું
hurry up-વું
hurry//
hurry/હરી/ઉતાવળ-કરવી
hurt//
hurt//

hurt/હર્ટ/ઈજા કરવી-થવી
hurtling/હર્ટલિંગ/ની ઉપર ફેંકવું
husband//
husband/હસબન્ડ/પતિ
husbandry
hush//
hush/હશ/ચુપથવું, ચૂપકીદી
husk//
husk/હસ્ક/ફોતરાં, છાલ
hustings/હસ્ટિંગ્સ/ચુંટણી ની ચહલપહલ
hustle/હસલ/ધાંધલ, ચહેલ પહેલ
hustler/હસલર/વેશ્યા
hut//
hut/હટ/ઝૂંપડી
hutments/હટમન્ટ/ઝૂંપડપટ્ટી
hybrid/હાઇબ્રિડ/વર્ણશંકર
hydrophobia/હાઇડ્રોફોબિઆ/હડકવા
hygiene//
hygiene/હાયજીન/આરોગ્ય
hygienic/હાયજીનિક/સ્વાસ્થ્યપ્રદ, આરોગ્યપ્રદ
hype/હાયજીન/ખૂબ પ્રચાર
hyperbole/હાયપરબોલી/અતિશયોક્તિ
hypnotise/હાયજીન/મંત્રમુગ્ધ કરવું
hypochondria/હાયજીન/રોગભ્રમ
hypocrisy દંભ, પાખંડ, ઢોંગ
hypocrite દંભી
hypocritical ઢોંગી, દંભી, પાખંડી
hypotheate/હાયપોથિકેટ/ગીરો મૂકવું
hypothermia/હાયપોથર્મિઆ/શરીર નું નીચું તાપમાન
hypothesis/હાયપોથિસિસ/અનુમાન
hypothetical માની લીધેલું
hysteria/હિસ્ટીરિઆ/તાણ, આંચકી, વાઈ
hysterics/હિસ્ટરિક્સ/વાતોન્માદ
ice over-વું
ice up-વું
ice/આઈસ/બરફ
ice-cliff
icon/આઈકન/મૂર્તિ, પ્રતિમા, ચિન્હ
iconoclast/આઈકોનોક્લાસ્ટ/મૂર્તિ ખંડન કરનાર
icy//
idea(I)//
idea/આઈડિઆ/વિચાર, ઉપાય
ideal/આઈડિઅલ/આદર્શ, શ્રેષ્ઠ
identical/આઈડેન્ટિકલ/સમરૂપ, એક સરખું
identified//
identify//
identikit/આઈડેન્ટિકિટ/વર્તન પરથી રેખાચિત્ર (ગુન્હા)
identity/આઈડેન્ટિટી/ઓળખ, પરિચય
ideological/આઈડીઓલોજિકલ/વિચારધારાનું
ideology/આઈડીઓલજી/વિચારધારા, મત

idiomatic/ઇડીઓલોજિકલ/રૂઢિપ્રયોગવાળું
idiosyncrasy/ઇડીઓસીનક્રસિ/તરંગ, ધૂરી, ધૂન
idiotic/ઇડીઓટિક/તોરી, તરંગી, તથલખી
idle /
idle/આઈડલ/નવરું, કામ વગરનું
idol /
idol/આઈડોલ/મૂર્તિ
idyllic/ઇડીલિક/રમ્ય, શાંતિ સભર
if /
if/ઇફ/જો, કદાચ
iffy/ઇફિ/
igh down-વું /
igneous/ઇગ્નીઅસ/લાવાનો પથ્થર
ignite/ઇગ્નાઈટ/પ્રજ્વલિત કરવું
ignoble/ઇગ્નોબલ/નિચ, અધમ
ignominious/ઇગ્નોમિનસ/લજજાસ્પદ
ignominy/ઇગ્નોમિનિ/નામોશી, બદનામી
ignorant/ઇગ્નરન્ટ/અજ્ઞાની, અજાણ
ignore /
ignore/ઇગ્નોર/અવગણના-ઉપેક્ષા કરવી
ignormous/ઇગ્નોરમસ/અજ્ઞાની માણસ
ilk/ઇલ્ક/કુટુંબ કે વર્ગનું
ill with-
ill(ness) /
ill/ઇલ/બિમાર
illegal /
illegal/ઇલ્લીગલ/ગેરકાનૂની, ગેરકાયદે
illegible/ઇલ્લેજબલ/અવાચ્ય
illegitimate/ઇલ્લેજિટમેટ/અનોરસ
ill-fated/ઇલ્લફેઈટેડ/કમનસીબ
illicit/ઇલ્લિસિટ/ગેરકાયદેસર
ill-informed/ઇલ્લિઈન્ફોર્મ્ડ/કાન ભંભેરણી થયેલું
illiterate/ઇલ્લીટરેટ/અભણ, નિરક્ષર
illogical/ઇલ્લોજિકલ/અતાર્કિક
illude/ઇલ્લ્યુડ/ભરમાવવું, છેતરવું
illuminate/ઇલ્લ્યુમિનેટ/પ્રકાશિત કરવું
illusion/ઇલ્લયઝન/ભ્રમણા, આભાસ
illusionary/ઇલ્લયઝનરિ/ભ્રામક
illusivૈ/નનેર્જિઅિ/ભ્રામક, છેતરામણું
illustrate/ઇલ્લસ્ટ્રેટ/સચિત્ર સમજાવવું
illustrious/ઇલ્લસ્ટ્રિઅસ/દાખલારૂપ
im promptu/ઇમ્પ્રોમ્પટ્યુ/શીઘ્ર વક્તૃત્વ
image /
image/ઇમેઈજ/પ્રતિકૃતિ, છાપ
imaginary /
imaginary/ઇમેજિનરિ/કાલ્પનીક
imagination /
imaginative/ઇમેજિનટિવ/કલ્પનાશીલ
imagine /
imagine/ઇમેજન/કલ્પના કરવી

imbecile/ઇમ્બેસાઈલ/નિર્બળ, જડબુદ્ધિ, મંદબુદ્ધિ
imbibe/ઇમ્બાઈબ/આત્મસાત કરવું, શોષવું
imbroglio/ઇમ્બ્રોલ્યો/વિટંબણા
imbue/ઇમ્બ્યુ/તરબોળ-સંતુપ્ત થવું
imitate/ઇમિટેટ/અનુકરણ કરવું
imitative/ઇમિટેટિવ/અનુકરણ કરવું
immanent/ઇમ્મેનન્ટ/અન્તર્ગત, વિશ્વવ્યાપી
immediate/ઇમીડિએટ/તાત્કાલિક, તાકિદનું
immediately /
immediately/ઇમીડિએટલિ/
immense/ઇમેન્સ/પ્રચંડ, અતિશય, વિશાળ, વિપુલ
immersion/ઇમર્સન/પધરાવવું, ડૂબાડવું
immigrant/ઇમીગ્રન્ટ/વસાહતી
immigrate/ઇમીગ્રેઈટ/વસવાટ કરવા આવવું
immigration/ઇમીગ્રેઈશન/વસાહત, દેશાગમન
imminent/ઇમિનન્ટ/તોળાઈ રહેલું, અણીપર
immodest/ઇમ્મોડેસ્ટ/તોછડું, બેશરમ
immolation/ઇમ/બલિદાન
immoral /
immoral/ઇમમોરલ/અનૈતિક, વ્યભિચારી
immortal/ઇમ્મોર્ટલ/અમર, સાશ્વત
immortalise/ઇમ્મોર્ટલાઈઝ/અમર બનાવવું
immovable/ઇમ્મૂવેબલ/સ્થાવર, અડગ, અચળ
immune/ઇમ્મ્યુન/થી રક્ષિત, મુક્ત
immunity/ઇમ્યુનિટિ/કાયદા-રોગ સામે પ્રતિરક્ષા
imp/ઇમ/શેતાનનું બચ્ચું
impact/ઇમપેક્ટ/આઘાત, અસર, સંઘાત
impair/ઇમપૈર/નબળું પાડવું
impart/ઇમપાર્ટ/કેળવણી, માહિતી આપવી
impartial/ઇમ્પાર્શલ/નિષ્પક્ષ
impasse/અમ્પાસ/મડાગાંઠ
impatient /
impatient/ઇમ્પેશન્ટ/અધીરું
impeach/ઇમ્પીચ/આરોપ-ફરમાવવો
impeachment/ઇમ્પીચમન્ટ/મહાભિયોગ/આરોપનામું
impecunious/ઇમપેક્યુનસ/નિર્ધન, ગરીબ
impede/ઇમ્પીડ/અડચણ-અવરોધ ઊભો થવો
impediment/ઇમ્પેડિમન્ટ/અડચણ, વિઘ્ન
impel/ઇમ્પેલ/પ્રેરવું, આગળ વધારવું
impending/ઇમ્પેલ/તોળાઈ રહેલું, અણીપર
imperative/ઇમ્પેલ/ફરજિયાત
imperceptible/ઇમ્પેલ/અદૃશ્ય
imperial
imperious/ઇમ્પેલ/મનસ્વી, તાકીદનું
impersonator/ઇમ્પેલ/બહુરૂપી, વેશધારી
imperturbable/ઇમ્પેલ/ધીર, ગંભીર
impetus/ઇમ્પેલ/જોર, ધક્કો
impinge/ઇમ્પેલ/અસર ઉભી કરવી, જોરથી પહોંચવું
impious/ઇમ્પેલ/દુષ્ટ, અધર્મી
implant/ઇમ્પેલ/રોપવું, ઠસાવવું, સાધન

implement/ઈમ્પેલ/અમલ કરવો, સાધન
implementation/ઈમ્પેલ/અમલીકરણ
implicate/ઈમ્પેલ/સંડોવવું
implication/ઈમ્પેલ/સંડોવણી, સૂચિતાર્થ
implicit/ઈમ્પેલ/ગર્ભિત, નિઃશંક
implore/ઈમ્પેલ/આજીજી કરવી
imply/ઈમ્પ/આડકતરો સંકેત કરવો
import(ed) / /
import/ઈમ્/આયાત કરવું
importance / /
important / /
important/ઈમ્પોર્ટન્ટ/અગત્યનું
imported/ઈમ્પોર્ટેડ/આયાતી
importune/ઈમ્/કાલા વાલા કરવાં
impose upon / /
impose/ઈમ્પોઝ/લાદવું, ઠોકી બેસાડવું
imposing/ઈમ્પોઝિંગ/ઠોકી બેસાડવું
imposition/ઈમ્પોઝિશન/વેરો, છેતરપિંડી, ભારણ
impossible / /
impossible/ઈમ્પોસિબલ/અશક્ય
impostor/ઈમ્પોસ્ટર/ધુતારો, ઠગ
impotent/ઈમ્પોટન્ટ/નામદ, નપુંસક, કમજોર
impound/ઈમ્પાઉન્ડ/જપ્ત કરવું
impoverish/ઈમ્પોવરિશ/ગરીબ બનાવવું
imprecation/ઈમ્પ્રીકેશન/શ્રાપ, બદદુવા
impregnable/ઈમ્પ્રેગનેબલ/અજેય, દુર્ગમ
impregnate/ઈમ્પ્રેગનેટ/સગર્ભા બનાવવું, ભેદવું
impresario/ઈમ્પ્રેસારિઓ/મનોરંજન કાર્યક્રમ વ્યવસ્થાપક
impress / /
impressed with/by-
impressive / /
impressive/ઈમ્પ્રેસીવ/અસરકારક, પ્રભાવી
imprint/ઈમ્પ્રિન્ટ/પ્રતિકૃતિ, છાપ પાડવી
imprison/ઈમ્પ્રિઝન/જેલમાં નાખવું, કેદ કરવું
improbable/ઈમ્પ્રોબેબલ/અસંભવિત
improve(ment) / /
improve/ઈમ્પ્રૂવ/સુધારવું
improvement / /
improvise/ઈમ્પ્રોવાઈઝ/પૂરું પાડવું, ખોટ પૂરવી
imprudent/ઈમ્પ્રુડન્ટ/અવિવેકી
impugn/ઈમ્પ્યુન/વાંધો લેવો, પડકારવું
impulsive/ઈમ્પલ્સિવ/આવેગી, મનમોજી
impure/ઈમ્પ્યુઅર/અશુદ્ધ, ભેગસેળયુક્ત
impute/ઈમ્પ્યુટ/આરોપ મૂકવો
in accordance ના પ્રમાણે
in all
in camera બંધબારણે, ખાનગીમાં
in in-વું
in situ મૂળસ્થાને
in spite of / /

in the red કરજમાં
in the red કરજમાં, ઢેશામાં
in / /
inaccessible/ઈઅક્સેસિબલ/પહોંચ બહાર, અગમ્ય
inactive/ઈઅક્ટિવ/સુસ્ત, આળસું
inadvertently/ઈઅન્ડર્વર્ટન્ટલિ/અજાણતા, ભૂલથી
inanimate/ઈનઅનિમેટ/અચેતન, નિર્જીવ
inanity/ઈનએનિશન/ક્ષીણતા (પોષણના અભાવે)
inappropriate/ઈનઅપ્રોપ્રિએટ/અયોગ્ય
inaudible/ઈનઓડિબલ/સંભળાય નહિ તેવું
inaugural
inauguration/ઈનઓગ્યુરેશન/ઉદ્ઘાટન
inauspicious/ઈનઓસ્પિશસ/અશુભ, કમનસીબ
incandescent/ઈન્કન્ડેસન્ટ/ગરમીથી પ્રકાશતું
incapable/ઈન્કેપેબલ/અશક્તિમાન, અસમર્થ
incarcerate/ઈન્કાર્સરેઈટ/કેદમાં પૂરવું
incarnate/ઈન્કાર્નિઈટ/અવતાર ધારણ કરવો
incendiary/ઈન્સેન્ડિઅરી/આગ લગાડતું
incense/ઈન્સેન્સ/કોપાયમાન, સુગંધ
incentive/ઈન્સેટીવ/પ્રોત્સાહ, પ્રલોભન
inception/ઈન્સેપ્શન/આરંભ, શરૂઆત
incessant/ઈન્સેઝન્ટ/સતત, વારંવાર
inch / /
inch/ઈચ/
inchoate/ઈન્કોએટ/અપૂર્ણ, પ્રાથમિક, શરૂઆતનું
incidence/ઈન્સિડન્સ/બનાવ, અવકાશ, અસર
incident / /
incident/ઈન્સિડન્ટ/ઘટના, બનાવ
incidental/ઈન્સિડન્ટલ/પ્રાસંગિક, આનુષંગિક
incinerate/ઈન્સિપિઅન્ટ/બાળી નાખવું, ખાક થઈ જવું
incipient/ઈન્સિડન્ટ/શરૂઆતનું, પ્રારંભિક
incisions/ઈનસિઝન/ઊંડો ઘા
incite/ઈન્સાઈટ/ઉશ્કેરવું, પ્રેરવું
inclement/ઈન્કિલમન્ટ/વિષમ (હવામાન)
inclination / /
incline/ઈનક્લાઈન/ની તરફ ઝુકવું-નમવું
inclivity/ઈનક્લીવિટિ/તોછડાઈ, ઉઘ્ઘટાઈ
include / /
include/ઈનક્લુડ/સમાવેશ કરવો
inclusive/ઈનક્લુઝિવ/સમાવેશ કરતું, સહિત
incognito/ઈનકોગ્નિટો/વેષધારી, છુપાવેષે
income / /
income/ઈનકમ/આવક, કમાણી
incommunicado/ઈનકોમ્યુનિકેટો/સંપર્કવંચિત
incomparable/ઈનકમ્પેરેબલ/અજોડ, અદ્વિતિય
incompatible/ઈનકોમ્પટિબલ/
incompetent/ઈનકોમ્પિટન્ટ/બિનકાર્યક્ષમ, ગેરલાયક
incomplete/ઈનકમ્પ્લીટ/અપૂર્ણ
incomprehensible/ઈનકોમ્પ્રિહેન્સિબલ/અકળ
inconclusive/ઈનકોન્ક્લુઝિવ/અનિર્ણાયક, અધૂરું

incongruent

incongruous/ઇનકોન્ગ્રુઅસ/અસંગત

inconsequential/ઇનકોન્સિક્વેન્સીયલ/નગણ્ય

inconsistent/ઇનકન્સિસ્ટન્ટ/વિસંગત

inconvenient/ઇનકનવિનિઅન્ટ/અગવડભર્યું

incorrigible/ઇનકોરિજીબલ/વર્તન સુધરે નહિ તેવું

increase / /

increase/ઇનક્રીઝ/વધારવું, વધવું, વધારો

incredible/ઇન્ક્રેડિબલ/ન માની શકાય તેવું

incredulous/ઇનક્રેડ્યુલસ/માની ન લે તેવું

incriminate/ઇન્ક્રિમિનેટ/ગુન્હામાં સંડોવવું

inculcate/ઇન્કલકેટ/કેળવવું, ખિલવવું ઠસાવવું

incumbency

incumbent/ઇન્કમબન્ટ/હોદ્દો ધારણ કરનાર

incurable/ઇન્કયોરેબલ/અસાધ્ય

incurred/ઇન્કર્ડ/વહોરવું, ભોગવવું

incursion

indecent

indecent/ઇન્ડિસન્ટ/અસભ્ય, અશ્લીલ

indecisive/ઇનડિસાઇઝિવ/અનિર્ણાયક

indeed / /

indeed/ઇન્ડિડ/ખરેખર, સાચેજ

indefatigable થાકે નહિ તેવું

indefinite/ઇન્ડેફિનેટ/અનિશ્ચિત

indelible/ઇન્ડેલિબલ/ભૂંસી ન શકાય તેવું

indent/ઇન્ડેન્ટ/માગણી

indented/ઇન્ડેન્ટેડ/ખાંચાવાળું, ખાંચેલું

independent / /

independent/ઇન્ડિપેન્ડન્ટ/સ્વતંત્ર

indescribable/ઇન્ડિસ્ક્રાયબેબલ/અવર્ણનીય

indestructible/ઇન્ડિસ્ટ્રક્ટિવ/અવિનાશી

indication/ઇન્ડિકેશન/સંકેત, ઇશારો

indicative/ઇન્ડિકેટિવ/સૂચક, દર્શાવતું

indict/ઇન્ડાઇટ/આરોપી ઠરાવવું

indictment/ઇન્ડાઇટમન્ટ/આરોપનામું

indifference/ઇન્ડિફરન્સ/ઉપેક્ષા, દુર્લક્ષ

indigence/ઇન્ડિજન્સ/ગરજાઉ, ગરીબું

indigenous/ઇન્ડિજનસ/સ્વદેશી

indignant/ઇન્ડિગનન્ટ/તિરસ્કારપૂર્ણ

indignation

indirect/ઇન્ડાયરેક્ટ/આડકતરું

indiscriminate/ઇન્ડિસ્ક્રિમિનેટ/અધાંધૂધ, અવિચારી

indispensable/ઇન્ડિસ્પેન્સબલ/અનિવાર્ય

indisposed/ઇન્ડિસ્પોઝડ/માંદુ, અશક્ત

indistinct/ઇન્ડિસ્ટિન્ક્ટ/અસ્પષ્ટ, ઝાંખું

individual / /

individual/ઇન્ડિવિજ્યુઅલ/વ્યક્તિ, વ્યક્તિગત

indivisible/ઇન્ડિવિઝબલ/અવિભાજ્ય

indoctrinate/ઇન્ડોક્ટ્રીનેટ/વિચારસણી રેડવી

indolent/ઇન્ડોલન્ટ/સુસ્ત, આળસુ

indomitable/ઇન્ડોમિટબલ/અણનમ, અજેય

indoor(s) / /

indoor/ઇન્ડોર/

induce/ઇન્ડ્યુસ/કરવા પ્રેરવું- લલચાવવું

induct/ઇન્ડક્ટ/સમાવેશ કરવો

indulge/ઇન્ડલજ/માં પડવું, દારૂ ઢીંચવો

indurate/ઇન્ડ્યુરેટ/સખત-રીઠું બનાવવું

industrial / /

industrial/ઇન્ડસ્ટ્રીઅલ/ઔદ્યોગિક

industrious/ઇન્ડસ્ટ્રીઅસ/ઉદ્યમી, મહેનતુ

industry / /

industry/ઇન્ડસ્ટ્રી/ઉદ્યોગ

inebriate/ઇનએબ્રિએટ/છાકટું, નશામાં ચકચૂર

inedible/ઇનએડબલ/અખાદ્ય

ineffable/ઇનએફબલ/અગમ્ય, ગૂઢ

inefficiency/ઇનએફિસિન્સિ/બિનકાર્યક્ષમતા

inept અયોગ્ય, અસ્થાને

ineptly

inert નિષ્ક્રિય, સુસ્ત, મંદ

inertia જડતા, નિષ્ક્રિયતા

inescapable ટાળી ન શકાય તેવું

inevitable અનિવાર્ય, અટલ

inexhaustive અખૂટ

inexorable /ઇનોક્ઝોરેબલ/

inexorable નિર્દય, કઠોર

inexperienced શિખાઉ, નવાણીયો

infallible અચૂક, ખાતરીવાળું

infamous કુખ્યાત, નામચીન

infanticide બાળહત્યા, શિશુહત્યા

infantry

infatuation અતિલગાવ-મોહ

infect(ion) / /

infect/ઇન્ફેક્ટ/ચેપ લાગવો

infectious ચેપી

infectious / /

infer અનુમાન કરવું-તારવવું

inference અનુમાન, તર્ક

inferior હલકું, નીચલું

infernal નરક સમાન

inferno નરક

infertile ઉજૂજડ

infested with

infidel કાફર, નાસ્તિક

infiltration ધૂસણખોરી

infiltrator ધૂસણખોર

infinite અનંત

infinitive / /

infirm માંદુ, અશક્ત

inflame સળગાવવું, જલ્વનશીલ

inflammable સળગી ઉઠે તેવું

inflammation સોજો

inflammatory ઉશ્કેરણીજનક
inflate ફુલાવવું, હવા ભરવી
inflation ફુગાવો
influence / /
influence/ઇન્ફ્લુઅન્સ/અસર, લાગવગ
influential / /
influx અંદર આવતો પ્રવાહ-ધસારો
inform(ation) / /
inform/ઇન્ફોર્મ/માહિતી આપવી, જાણ કરવી
informative માહિતીપ્રદ
infrared પારકટ કિરણો
infrastructure માળખું
infringement ઉલ્લંઘન
infertious નિષ્ફળ, નિરર્થક
infuriate ક્રોધ ચડાવવો
infuriated
infuse ઠસાવવું, રેડવું, મનમાં ઉતારવું
infusion
ingenious કુશળ
ingenuous સરળ, ભોળું, નિખાલસ
ingot ગઢો, લઠિયો
ingredient ઘટક, તત્વ
inhabited
inhale શ્વાસમાં લેવો
inherent જન્મજાત, પ્રકૃતિ, સ્વભાવજન્ય
inherit વારસામાં મેળવવું
inherited
inhibitions નિષેધ, મનાઈ, સદાચાર
inhospitable આશ્રયવિનાનું (સ્થળ)
inhuman પાશવી, અમાનવીય
inimical વેરી, શત્રુતાવાળું
inimitable અનુપમ
iniquitous અન્યાયકારી, ગેરવ્યાજબી
initial પ્રારંભિક, શરૂઆતનું
initially
initiate શરૂઆત કરવી, પહેલ કરવી
initiative/ઇનીશીટિવ/પહેલ, સાહસ, પગલાં
inject માં પ્રવાહી દાખલ કરવું-રેડવું
injunction મનાઈ આદેશ
injure / /
injure/ઇન્જર/ઇજા કરવી
injurious/ઇન્જરિઅસ/નુકશાનકારક
injury / /
injury/ઇન્જરી/ઇજા
injustice/ઇન્જસ્ટિસ/અન્યાય
ink / /
ink/ઇન્ક/શાહી
inkling/ઇન્કલિંગ/મનોસંકેત, અણસાર
inlay/ઇનલેય/કોતરણીથી જડવું, બેસાડવું
inmate/ઇનમેઇટ/સાથે વસનારો
inn / /

inn/ઇન/હોટેલ, ધર્મશાળા
innate/ઇન્નેઇટ/જન્મજાત
inner / /
inner/ઇનર/અંદરનું
innocent / /
innocent/ઇનસન્ટ/નિર્દોષ
innocuous/ઇનોક્યુઅસ/નિરૂપદ્રવી
innovate નાવિન્ય સર્જવું
innovation નવીનતા
innovative નાવિન્યપૂર્ણ
innuendo અપમાન, કટાક્ષ, વક્રોક્તિ,
innumerable અસંખ્ય, અગણિત
inordinate અપરિમિત, અતિશય
inquest/ઇન્કવેસ્ટ/આકસ્મિકમૃત્યુ નોંધ
inquire / /
inquire/ઇન્કવાયર/તપાસ કરવી
inquiry / /
inquisition/ઇન્કવીઝીશન/પૂછપરછ, ઉલટ તપાસ
inquisitive/ઇન્કવીઝીટિવ/જિજ્ઞાસુ
insane / /
insane/ઇનસેઇન/પાગલ
insatiable/ઇન્સૈટિએબલ/અતિલોભી
insatiate/ઇન્સૈશિએટ/અતૃપ્ત રહેવું
inscribe/ઇન્સ્ક્રાઇબ/કોતરવું
inscrutable ગૂઢ, ગહન
insect / /
insect/ઇન્સેક્ટ/
insensate સંવેદના વિહિન
insensitive સંવેદના રહિત
insensitivity
inseparable અવિભાજ્ય
insert દાખલ કરવું
inside / /
inside/ઇનસાઇડ/
insideous દગાખોર, પ્રપંચી
insight દિર્ઘદષ્ટિ, આંતરસૂઝ
insignia ચિન્હ, સંજ્ઞા
insignificant બિન મહત્વનું
insipid બેસ્વાદ, ફિક્કું
insist on/for ને માટે આગ્રહ કરવો
insist(ence) / /
insists
insobriety/ઇનસોબ્રેઇટિ/અસયંમ
insolent ઘમંડી, અપમાનકારક, તોછડું
insolvent નાદાર, દેવાળિયું
insomnia અનિદ્રા
insouciance બેફિકરાઈ, મોજલાપણું
inspect(ion) / /
inspect/ઇન્સ્પેક્ટ/તપાસવું, નિરીક્ષણ કરવું
inspire / /

inspire/ઈન્સ્પાયર/પ્રેરણા આપવી
install સ્થાપવું, બેસાડવું(યંત્ર)
installation સ્થાપના
instance દાખલો, ઉદાહરણ
instant /
instant/ઈન્સ્ટન્ટ/તાત્કાલિક, ત્વરિત
instantaneous તાકીદનું
instead /
instead/ઈન્સ્ટેડ/
instigate ઉશ્કેરવું
instigated
instill માં ઉતારવું, પ્રેરવું
instinct જન્મજાત વૃત્તિ, સ્વભાવ લક્ષણ
instinctive સ્વયંસ્ફુરિત, સાહજિક
institution /
institution/ઈન્સ્ટીટ્યુશન/સંસ્થા
institutional /ઈન્સ્ટીટ્યુશનલ/સંસ્થાગત
instruct(ion) /
instruct/ઈન્સ્ટ્રક્ટ/શીખવવું/સુચના-બોધ આપવો
instrument /ઈન્સ્ટ્રુમેન્ટ/સાધન/ઓજાર/દસ્તાવેજ
instrument /
instrumental/ઈન્સ્ટ્રુમેન્ટલ/વાદ્યનું, કારણરૂપ
insubordinate/ઈન્સબોર્ડિનેટ/ હુકમ ન માનવો
insulate/ઈન્સ્યુલેટ/કવચ ચઢાવવું
insult /
insult/ઈન્સલ્ટ/અપમાન કરવું
insurance /
insurance/ઈન્સોયરન્સ/વીમો
insure /
insure/ઈન્સ્યોર/વીમો ઉતારવો
insurgency/ઈન્સરજન્સ/
insurgency/ઈન્સરજન્સ/ બંડ, વિદ્રોહ, ભાંગફોડ
insurgent/ઈન્સરજન્ટ/બંડખોર, વિદ્રોહી, ભાંગફોડિયા
insurmountable કઠીન, અજેય
insurrection બળવો, હુલ્લડ
intact અકબંધ
intangible અગ્રાહ્ય, અમૂર્ત
integral આવશ્યક
integrated
integration
integrity nishtha.ekta
intellect/ઈન્ટલેક્ટ/બુદ્ધિ
intellectual/ઈન્ટલેકચ્યઅલ/ બૌદ્ધિક, બુદ્ધિજીવી
intelligence /
intelligence/ઈન્ટેલીજન્સ/બુદ્ધિ
intelligent /
intelligent/ઈન્ટેલિજન્ટ/બુદ્ધિશાળી
intelligentsia/ઈન્ટલ/ બુદ્ધિજીવી વર્ગ
intelligible/ઈન્ટલિજિબલ/સમજાય તેવું
intend /

intend/ઈન્ટેન્ડ/ઈરાદો રાખવો, આશા સેવવી
intense સખત, તીવ્ર, સઘન, વેધક
intensify તીવ્ર થવું, જોર વધારવું
intensity તીવ્રતા, ઘનિષ્ટતા, વેધકતા
intensive/ઈન્ટેન્સિવ/સઘન, એકાગ્ર
intent/ઈન્ટેન્ડ/ઈરાદો, હેતુ
intention /
intentional/ઈન્ટેન્શનલ/ઈરાદા પૂર્વક નું
intentions/ઈન્ટેન્શન/ઈરાદાઓ, દાનત
inter/ઈન્ટર/ દફનાવવું, અરસપરસનું
inter-act આદાનપ્રદાન-આપલે કરવી
interaction/ઈન્ટરેક્શન/આદાનપ્રદાન-આપલે, પરસ્પર વ્યવહાર
intercede મધ્યસ્થી-દરમ્યાનગીરી કરવી
intercept આંતરવું
interchange પરસ્પર બદલવું
interdict મનાઈ કરવી
interest(ing) /
interest/ઈન્ટ્રેસ્ટ/રસ, વ્યાજ, હિત, રુચિ
interested in-
interfere(nce) /
interfere/ઈન્ટરફીઅર/દખલ દેવી, માથું મારવું
interference/ઈન્ટરફીઅરન્સ/દખલગીરી
interim/ઈન્ટીરીમ/વચગાળાનું
interior/ઈન્ટીરીઅર/આંતરિક
interlocutor/ઈન્ટરલોક્યુટર/વાટાઘાટ કરનાર
interloper/ઈન્ટરલોપર/હસ્તક્ષેપ કરનાર
intermediate/ઈન્ટરમિડિએટ/મધ્યમકક્ષાનું
intermittent/ઈન્ટરમિટન્ટ/વારંવાર થતું
internal/ઈન્ટરનલ/આંતરિક, આત્મલક્ષી
international /
international/ઈન્ટરનેશનલ/આંતરરાષ્ટ્રીય
internecine/ઈન્ટરનેશિન/પરસ્પર નાશ કરનારું
internment/ઈન્ટરનમન્ટ/નજરકેદ
interpolate/ઈન્ટરપોલેટ/લખાણમાં સુધારો કરવો
interpret/ઈન્ટરપ્રિટ/અર્થઘટન કરવું
interpretation/ઈન્ટરપ્રિટેશન/અર્થઘટન
interrogation/ઈન્ટ્રોગેશન/પૂછપરછ
interrogative /
interrupt(ion) /
interrupt/ઈન્ટરપ્ટ/વિક્ષેપ-ભંગ પાડવો
interruption/ઈન્ટરપ્શન/વિક્ષેપ, ખલેલ, ભંગ,
inter-se/ઈન્ટરસિ/અંદરો અંદર
intersect/ઈન્ટર સેક્ટ/છેદવું, કાપવું
intervene/ઈન્ટરવીન/દરમ્યાનગીરી કરવી
intervention/ઈન્ટરવેન્શન/દરમ્યાનગીરી
intimate /
intimate/ઈન્ટિમેઈટ/ગાઠ, તદ્દન અંગત
intimidate/ઈન્ટિમિડેઈટ/ધમકાવવું, ડરાવવું
intimidation/ઈન્ટિમિડેશન/ડરામણી, ડાટી
into /

into/ઈન્ટુ/માં-અંદર
intolerable/ઈન્ટોલરેબલ/અસહ્ય
intolerant/ /
intoxicate/ઈન્ટોક્સિકેટ/નશો કરવા, કેફ ચડવો
intra vires/ઈન્ટ્રાવાયર્સ/સત્તા અનુસાર
intractable/ઈન્ટ્રેક્ટબલ/હઠીલું, જિદદટી
intransigence/ઈન્ટ્રાન્સિજન્સ/કઠ્ઠર
intrepid/ઈન્ટ્રેપિડ/નિર્ભય, બહાદુર
intricacies
intricate/ઈન્ટ્રિકેટ/ગૂંચવણભર્યું, જટિલ
intrigant/ઈન્ટ્રિગંટ/કાવચું કરનાર
intrigue/ઈન્ટ્રિગ/કાવતરું, કારસ્તાન, કુતૂહલ થવું
intriguing લુચ્ચાઈ કરતું
intrinsic/ઈન્ટ્રિન્સીક/અન્તર્ગત
intro
introduce/ /
introduce/ઈન્ટ્રોડ્યુઝ/રજૂ કરવું, પરિચય આપવો
introduction/ /
introspect/ઈન્ટ્રોસ્પેક્ટ/આત્મનિરીક્ષણ
introspective/ઈન્ટ્રોસ્પેક્ટિવ/આત્મનિરીક્ષણ કરતું
introvert/ઈન્ટ્રોવર્ટ/અન્તર્મુખી
intrude/ઈન્ટ્રુડ/ઘૂસણખોરી કરતું
intruder/ઈન્ટ્રુડર/ઘૂસણખોર
intruders
intruding
intrusion/ઈન્ટ્રુઝન/ઘૂસણખોરી
intrusive/ઈન્ટ્રુઝિવ/ઘૂસણખોરી કરતું
intuition/ઈન્ટ્યુશન/રઠ્ઠરણા
inundate/ઈન્નડેઈટ/પૂર આવવું, છલોછલ થવું
inutile
invade/ઈનવેઈડ/હુમલો-ચઢાઈ કરવી
invaiaja
invalid/ઈનવૈલિડ/અમાન્ય, રદ્દ, અપંગ થયેલું
invaluable/ઈનવૈલ્યુઅબલ/અમૂલ્ય
invasion/ઈન્વેઝન/ચઢાઈ, આક્રમણ
invasive/ઈન્વેઝિવ/આક્રમક
invective/ઈનવેક્ટિવ/ગાળાગાળી, ભાંડણાલીલા
inveigle/ઈનવેઈલ/છેતરવું, લલચાવવું
invent(ion)/ /
invent/ઈવેન્ટ/શોધ કરવી
invention/ઈવેન્શન/શોધ
inventory/ઈનવેન્ટરિ/વિગતવાર યાદી
invert/ઈનવર્ટ/ઉલટાવવું
invest/ /
investigate/ઈન્વેસ્ટીગેટ/શોધ-તપાસ કરવી
investiture પદ-હોદ્દો પ્રહણ વિધિ
investment/ઈન્વેસ્ટમન્ટ/મૂડી-રોકાણ
invidious ઈર્ષ્યા પેદા કરે તેવું
invincible અજેય
inviolable hallowed
invisible/ઈન્વી/ અદ્દશ્ય

invitation/ /
invite/ /
invite/ઈન્વાઈટ/આમંત્રણ આપવું
invocation આવાહન, જાગૃતી
invoke/ઈન્વોક/આવાહન-લાગુ કરવું
involve/ /
involve/ઈન્વોલ્વ/સંડોવવું, સમાવવું
involvement/ઈન્વોલ્વમન્ટ/સંડોવણી
inward(s)/ /
inwards/ઈન્વર્ડ્ઝ/અંદરની તરફ
ion/આયન/અણુ
iota/આયોટા/અંશ, અણું
ipso facto આપોઆપ
irascible ચીડિયું
irate/આઈરેટ/કોધી, ધૂંવા ફૂંવા
ire/આયર/ગુસ્સો, કોધ
iridescent વિવિધરંગદર્શી
irk/અર્ક/કંટાળો આપવો
iron out-વું
iron/ /
iron/આર્યન/
ironical વક્રોક્તિ-કટાક્ષવાળું
irony/આઈરની/કટાક્ષ, વક્રોક્તિ
irrational/ઈરરેશનલ/તર્કહીન
irrectaimable
irrefutable/ઈરરેફ્યુટેબલ/ખંડન ન થઈ શકે તેવું
irregular/ /
irregular/ઈરરેગ્યુલર/અનિયમિત
irregularity/ઈરરેગ્યુલરિટિ/ગેરરિતી, અનિયમિતતા
irrelevance
irrelevant/ઈરરેલવન્ટ/અપ્રાસંગિક, અસંબધ
irrepressible/ઈરપ્રેસીબલ/અદમ્ય
irresistible/ઈરરેઝિસ્ટીબલ/અપ્રતિકર, અદમ્ય
irrevocable/ઈરરીવોકબલ/અટલ, અફર
irritable ચીડિયું, ખીજકણું
irritation
island/ /
island/આઈલન્ડ/ટાપુ
isolation/આઈસોલેશન/અલગાવ, સંપર્કવિહીનતા
issue/ઈશ્યુ/બાબત, બાળક, અંક, રવાના કરવું
isthmus સાંકડો જોડતો ભૂમાર્ગ
it/ /
it/ઈટ/
it's/ઈટ્સ/
italic ત્રાંસું
itch ખજવાળવું, ખોતરવું
itch/ /
itch/ઈચ/
item/ /
item/આઈટેમ/

itinerant ફરતું, પ્રવાસી
itinerary આઈટીનેરરી, પ્રવાસ-સુચિ
its /
it's /
its/ઈટસ/
itself /
jab /
jab/જબ/હથિયારથી કાપો કરવો
jack in-વું
jack up-વું
jackal /
jackal/જેકલ/
jackpot તગડો લાભ, મોટું ઇનામ
jail (gaol) /જેઈલ/
jail /
jalopy જુની કાર/પ્લેઈન
jam in(to)-વું
jam on-વું
jam up-વું
jam /
jam/જામ/
jamboree મહાસંમેલન, મેળાવડો
jammed
jam-packed
jangle તીણો અકર્ષણિય ધ્વનિ
janissary સંનિષ્ઠ-વફાદર ટેકેદાર
Janus-faced બે-મુખે વાત કરતું
jar on-વું
jar /
jar/જાર/
jargon/જાર્ગન/વિશિષ્ટ વર્ગના ખાસ શબ્દો-ભાષા
jarring કમકમાટી વાળો અવાજ
jaundice/જૉન્ડીસ/કમળો
jaunt મોજયાત્રા
jaunty/જૉન્ટી/મોજલું
jaw /
jaw/જૉ/જડબું
jazz up-વું
jazz /
jazz/જાઝ/
jealous(y) /
jealous/જેલસ/ઈર્ષાળુ, અદેખું
jeer ઉપહાસ કરવો
jelly /
jelly/જેલી/
jeopardise ભયમાં મૂકવું
jeremiad રોદણાં રોનાર, રોતલ
jerk આંચકો, ઝટકો મારવો
jest
jester /

jester/જેસ્ટ:/
jet /
jet/જેટ/છિદ્ર માંથી ઉડતો કૂવારો
jettison વજન ઘટાડવા ફેંકી દેવું
jewel /
jewel/જૂવેલ/રત્ન
jewellery /
jig
jigsaw ચિત્ર કોયડો
jilt પ્રેમમાં તરછોડવું
jingle રણકાર, ખણખણાટ
ingoistic યુધ્ધાહ્લ, લડાયક મિજાજ
jink હાથ તાળી આપવી
jinx
jittery રઘવાયું
job /
job/જોબ/કામ, નોકરી
jobbery/જોબરી/જાહેર કામમાં ભ્રષ્ટાચાર
jockey for-વું
jockey રેસનો ધોડેસ્વાર
jockey into-વું
jocular વિનોદી, રમુજી
jocund મોજલું, આનંદી
jog along-વું
jog /
jog/જોગ/
join in-વું
join on-વું
join up-વું
join(t) /
join/જોઈન/જોડાવું, જોડવું
joint/જોઈન્ટ/સાંધો, જોડ
joke /
joke/જોઉક/મજાક, મશ્કરી, ટુચકો
jolly /
jolly/જોલી/મોજલું, આનંદી
jolt ઝટકો, આંચકો
jostle/જોસલ/ઘક્કા મારીને આગળ વધવું
jot down ટપકાવવું, નોંધી લેવું
journal(ist) /
journalist/જર્નલિસ્ટ/પત્રકાર
journey /
journey/જર્ની/મુસાફરી, યાત્રા, પ્રવાસ
joyial મોજલું, પ્રસન્નચિત્ત
joy(ful) /
joy/જોય/આનંદ, મોજ
joyous/જોયસ/મોજમાં, મોજલું
joyful/જયુબીલન્ટ/આનંદવિભોર
jubilation/જયુબીલેશન/હર્ષોઉલ્લાસ
jubilee/જયુબીલી/જયંતી, મહોત્સવ

judge(ment)/ /**judge**/જજ/ન્યાયધીશ, મૂલ્ય આંકવું**judicial** ન્યાયાલયનું, ને લગતું**judiciary** ન્યાયતંત્ર**judicious** ડહાપણભર્યું, વિવેકપૂર્ણ**jug/ /****jug**/જગ/**juggernaut** વિરાટ બળ, જગન્નાથ**juggler/ /****juggler**/જગલર/જાદુગર/હાથચાલાકી કરનાર**jugglery** હાથચાલાકી, જાદુગરી**jugglery of words** શબ્દછલ-પ્રપંચ**juice/ /****juice**/જયુસ/રસ**juicy/ /****juicy**/જયુસી/રસદાર**jump at-વું****jump down-વું****jump on-વું****jump/ /****jump**/જમ્પ/કૂદવું, કૂદકો**juncture**/જંકચર/તબક્કો**jungle/ /****jungle**/જંગલ/**junior most****junior/ /****junior**/જુનીયર/**junk** ભંગાર, કચરો**junkie** કેફીદ્રવ્યનો નો બંધાણી**junta** લશ્કરી સત્તા-મંડળ, ચંડાળ ચોકડી**jurisdiction** કાર્યક્ષેત્ર**just(ice)/ /****just**/જસ્ટ/ન્યાયી, વ્યાજબી**justice**/જસ્ટીસ/**justification** વેધકતા, યોગ્યતા**justify** વ્યાજબી-વેધ ઠેરવવું**jut out** બહાર દેખાવું**jute**/જ્યુટ/શણ**juvenile**/જુવેનાઈલ/સગીર**juxtapose** બાજુ બાજુમાં મૂકવું**kaleidoscopic** વિવિધ દૃશ્યાવલી**kamikaze**//આત્મઘાતી વર્તન-વ્યવહાર**karaoke** સાથે ગાવું**keel over-વું****keen****keen/ /****keen**/કીન/આતુર, ઉત્સુક**keep abreast****keep at/ /****keep at-વું****keep away-વું****keep back-વું****keep down-વું****keep from-વું****keep in with-વું****keep off****keep off** થી દૂર રહેવું**keep off-વું****keep on/ /****keep on**//ચાલુ રાકવું**keep on-વું****keep out-વું****keep to-વું****keep up-વું****keep/ /****keep**/કીપ/રાખવું**ken**/કેન/જ્ઞાનની સીમા**kerfuffle**/કર્ફફલ/ધાંધલ**kernel**/કર્નલ/ફળનો ગર્ભ**kerosene/ /****kerosene**/કેરોસીન/**kettle/ /****kettle**/કેટલ/કીટલી**key/ /****key**/કી/મુખ્ય બાબત, ચાવી, ઉકેલ**keyed up/ /****kibosh**/કિબોશ/બકવાસ**kick about/around-વું****kick in-વું****kick off-વું****kick out-વું****kick up****kick up-વું****kick/ /****kick**/કિક/લાત**kick-back**/કિકબેક/કટકી, લાંચ, દલાલી**kick-off**/કિકઓફ/રમત શરૂ કરવી**kid/ /****kid**/કિડ/બાળક**kidding** મજાક, બાલિશતા**kidnap** અપહરણ કરવું**kill/ /****kill**/કિલ/હત્યા કરવી**killjoy** વિઘ્નસંતોષી**kiln**/કિલ્ન/ઈંટોનો ભઠ્ઠો**kilo/ /****kilo**/કિલો/૧૦૦૦, હજાર**kilogram/ /****kilometre/ /****kilometre**/કિલોમીટર/

kin/ /	knot/ નોટ/ગાંઠ
kin/ કિન/સગાં	knotty/ નોટી/અટપટું, ગાંઠોવાળું
kind to-	know of- વું
kind/ /	know/ /
kind/ કાઈન્ડ/માયાળુ	know/ નો/જાણવું, ખબર હોવી, ઓળખવું
kindle/ કીન્ડલ/પ્રેરવું	know-how/ નો-હાઉ/જાણકારી
kindred સગાસબંધી	knowledge(able)/ /
king(dom)/ /	knowledge/ નોદિજ/જ્ઞાન, જાનકારી
king/ કિંગ/રાજા	known/ નોન/જાણીતું
kingpin/ કિંગપિન/બેતાજ બાદશાહ, સર્વેસર્વ	knuckle under- વું
kinsman/ કિન્સમન/સગું	knuckle/ નકલ/આંગળી ના વેઢાં
kiosk/ કિઓસ્ક/છાપરી, કૅબિન, માંડવો	kosher વિશ્વાસપાત્ર, અસ્સલ
kiss/ /	kow-tow ગુલામી કરવી
kit/ /	trip ગોથું ખાવું, ગોટો કરવો, ફેરો
kit/ કિટ/સામાન, ચીજવસ્તુ	kudos વખાણ, શાબાસી
kitchen/ /	kulak રશિયન ખેડૂત
kitchen/ કિચન/રસોડું	kymograph દબાણ માપક યંત્ર
kite/ /	label/ /
kite/ કાઈટ/પતંગ	label/ લેબલ/
kith and kin સગાંવહાલા	laboratory/ /
kitsch/ કિચ/કલામાં આડંબર-દંભ	laboratory/ લેબોરેટરિ/
klaxon સાયરન	laborious મહેનતુ
kleptomania ચોરી ની અદમ્યવૃત્તિ	labour મજૂરી
knack/ નોક્/કુનેહ, કસબ	labour/ /
knave/ નોઈવ/ઠગ, બદમાશ	labourer/ /
knead/ નીડ/મસળવું	labourer/ લેબરર/
knee(I)/ /	labourpains/ પ્રસવવેદના
knee/ ની/ઘૂંટણ	labyrinth/ લે/લુલભુલામણી
knelt/ નીલ/ઘૂંટણિયે પડવું	lace/ /
knell/ નેલ/મૃત્યુઘંટ	lace/ લેસ/
knew/ ન્યુ/જાણ્યુ, ખબર હતી	lacerate/ લેસિરેઈટ/ચીરવું, જખમી કરવું
knife/ /	lachrymose વેવલું, રોતલ
knife/ નાઈફ/છરી, ચકકુ	lack in-
knit/ /	lack of-
knit/ નીટ/ગૂંથવું	lack/ /
knock about/around- વું	lack/ લૅક/ઉણપ-ખોટ હોવી
knock back- વું	lackadaisical સુસ્ત, નિરુત્સાહી
knock down/ /	lacklustre નિરસ, નિસ્તેજ
knock down- વું	lacky/ રાજકારણી ખુશામતિયા, ચમચા
knock off/ /	laconic
knock off- વું	laconic ટૂંકુ ને ટચ, અસરકારક છટા
knock out/ /	lacuna ખુટતું, ખાલીખો, ચુટિ
knock out- વું	lad/ /
knock over- વું	lad/ લૅડ/છોકરો
knock together- વું	ladder/ /
knock up- વું	ladder/ લેડર/
knock/ /	laden
knock/ નોક્/ટકોરાં મારવા	ladi-da રીતભાત નું ડોળ-દંભી
knoll/ નોલ/ટેકરી, ડુંગર	lady/ /
knot(ty)/ /	lady/ લેડી/

lag
lag/ /
lag/લેગ/
lager બીઅર ની એક જાત
lagging પાછળ રહી જતું
laissez-faire/લેઈસે ફેઅર/મુક્તવ્યાપાર
lake/ /
lake/લેક/
lamb/ /
lamb/લેમ્બ/
lambast/e/લેમ્બાસ્ટ/ઝાટકણી કાઢવી
lame duck ટેવાળિયો, નાદાર
lame/ /
lame/લેઈમ/લંગડુ
lament વિલાપ, આકંઠ કરવો
lamina પડ, થર
lamp/ /
lamp/લેમ્પ/દિવો, બતી
lampoon ઠકા-મશ્કરી
lance/ /
lance/લેન્સ/
land/ /
land/લેન્ડ/જમીન
landmine જમીનમાં ગોઠવેલી સુરંગ
landslide જબરદસ્ત જીત, ભૂસ્ખલન
lane/ /
lane/લેન/ગલી, શેરી
language/ /
language/લેંગવેજ/
languid જડ, સુસ્ત, મંદ
languish સબડવું
languor
lanky ઊંચુ ને પાતળું, તાડ જેવું
lantern ફાનસ
lap/ /
lap/લેપ/ખોળો
lapidary હિરાઉઘોગ
lapse ખાલસા થવું, રદ થવું
laptop ખોળામાં રાખી શકાય તેવું કોમ્પ્યુટર
larceny/લાર્સની/ચોરીનો ગુનો
large/ /
large/લાર્જ/
largesse ઉદાર ભેટ, દાન
lark/ /
lark/લાર્ક/
lascivious લંપટ, કામી
lash down-વું
lash into-વું
lash સખત ટીકા, આપટું (વરસાદ)
lash out ઝાટકણી કાઢવી, ફટકારવું

lash out/ /
lash out-વું
lashing ભરપૂર, વિપુલ
lass છોકરી
lassitude પ્રમાદ, આળસ, સુસ્તી, થાક
lasso ગાળિયો
last out-વું
last/ /
last/લાસ્ટ/ટકવું, છેલ્લું
late(ly)/ /
late/લેઈટ/
latent સુપ્ત, ગુપ્ત, અદ્શ્ય
later/ /
lateral બાજુનું
lather ફીણ
latitude
latter/ /
latter/લેટર/બે માંથી છેલ્લું
laud/લોઉડ/વખાણવું
laugh about-
laugh at-
laugh off-વું
laugh(ter)/ /
laugh/લાફ/
launch તરવું મૂકવું, પ્રારંભ કરવો
launch into-વું
launch out-વું
launch/ /
launch/લોન્ચ/
launder ધોલાઈ કરવી
laureate રાજકવિ
laurel વખાણ, પ્રશંસા
lave ફળદ્રુપ
lavish ઉડાઉ
lavitate
law/ /
law/લૉ/
lawn/ /
lawns/લૉન/લીલું ઘાસ
lawyer/ /
lawyer/લૉયર/વકીલ
laxitive/રિચક
laxity ઢીલાશ
lay about-વું
lay by/ /
lay by//બચત કરવી
lay down/ /
lay down//હેટું મૂકવું
lay down-વું
lay in/ /

lay in-વું
lay off /
lay off-વું
lay on-વું
lay out /
lay out-વું
lay up /
lay up-વું
lay /
lay/લે/મૂકવું
layer /
layer/લેયર/થર, પડ
layman સામાન્ય માણસ
lay-off છટકી, કાર્યછૂટી
layout આલેખ, રચના, નકશો
lazy /
lazy/લેઝી/આળસુ
lead on-વું
lead up-વું
lead /
lead/લીડ/વિતાવવું, આગેવાની લેવી, સુરાગ
lead/લેડ/સીસું
leaf /
leaf/લીફ/પાંદડુ, પાનું
leaflet/લીફલેટ/પત્રિકા
league
league/લીગ/સંઘ, પાંચ કિલોમીટરનું અંતર
leak /
leak/લીક/ચૂકાક થવો, ગળતર, બહાર પડવું
lean on-વું
lean /
lean/લીન/ઢળવું, ઢૂંબણું-પાતણું, ઝુકવું
leap કૂદકો મારવો
leap /
learn /
learn/લર્ન/શીખવું
lease of life જીવતદાન
lease પટ્ટાપર ભાડે આપવું
leash
least /
least/લીસ્ટ/
leather /
leather/લેથર/
leave behind-વું
leave off /
leave off-વું
leave out-વું
leave /
leave/લીવ/રજા, છોડવું
lecher
lectern પુસ્તક વાંચવાની ઘોડી

led
ledger ખાતાવહી
lee ઓથ-આશરો
leech લોહી ચૂસતી જળો
leer કામુકતાથી જોવું
leeway છુટછાટ, પવનથી ઉલટી દિશા
left /
left/લેફ્ટ/ડાબું, છોડી દીધું
leg /
leg/લેગ/પગ
legacy વારસો
legal(ly) /
legal/લીગલ/કાનૂની, કાયદેસર
legatee
legend /
legend/લીજન્ડ/દંતકથા
legendary
legendary સુપ્રસિદ્ધ, દંતકથાનું
legible વાંચી શકાય તેવું
legion લશ્કરી દળ
legislate કાયદો ઘડવો
legislation//કાયદો, ધારો
legislative
legislator ધારાસભ્ય
legislature
legitimate કાયદેસર
leisure નિરાંત
leitmotif/લેઈટમોટીફ/તકિયાકલામ
lemon /
lemon/લેમન/
lend /
lend/લેન્ડ/ઉછીનું આપવું
length(en) /
length/લેન્થ/
lengthen/લેન્થન/લંબાવવું
leopard /
leopard/લેપર્ડ/
leprosy/લેપ્રોસિ/રક્તપિત
leptopirosis
lesbian/લેસ્બીઅન/સમલીંગી સ્ત્રીઓ નો સહવાસ
less /
less/લેસ/ના કરતા ઓછું
lessen/લેસન/ઘટાડવું, ઓછું કરવું
lesson /
lesson/લેસન/પાઠ
lest /
lest/લેસ્ટ/રખેને, કદાચ ને
let છુટ આપવી
let down /
let down//હલકા પાડવું/પાડવું
let in for-વું

let in- વું	lie/ /
let off ભાગી જવા દેવું, ભાડે આપવું	lie/ લાઈ/જૂઠું બોલવું, પડયા રહેવું
let off/ /	lien કબજો કે ધારણ અધિકાર
let off- વું	lies/ લાઈસ/
let on- વું	lieu of/ લ્યુઓફ/ને બદલે
let out કહી દેવું, જવા દેવું	lieutenant/ લેફ્ટેનન્ટ/લશ્કરી હોદ્દો
let out- વું	life/ /
let up રાહત-છુટકારો થવો	life/ લાઈફ/જીવન
let up- વું	life-long આજીવન
let/ /	lifer આજીવન કેદ
let/ લેટ/	lift/ /
lethal ઘાતક	lift/ લિફ્ટ/
lethargy આળસ, પ્રમાદ	light up- વું
letter/ /	light/ /
letter/ લેટર/	light/ લાઈટ/
leukaemia લોહીનું કૅન્સર	lighten હળવું કરવું
level/ /	lightening પ્રકાશમય કરવું
level/ લેવલ/	lightning આકાશી વિજળી
leviathan રાક્ષસી, પ્રચંડ	lightning/ /
levitate	like(ly)/ /
levity મજાક, હળવાશ	like/ લાઈક/
levy કર	likely શક્ય, સંભવિત
lewd/ લ્યુડ/લંપટ, વ્યભીચારી	likewise
lex કાયદો	limb/ /
lexicon શબ્દકોશ	limb/ લિમ્બ/
liable આધિન, જવાબદાર	limber
liaison/ લિએઝોં/પરસ્પર વ્યવહાર, જનસંપર્ક	limbo અનિશ્ચિત સ્થિતિ, લટકતું
liar/ /	lime light
liar/ લાયર/	lime/ /
libel/ લાઈબલ/બદનકી	lime/ લાઈમ/
libellous/ લાઈબિલસ/બદનકી ભરેલું	limelight
liberal ઉદાર	limelight પ્રકાશ, લોકપ્રિય
liberalization ઉદારીકરણ	limit/ /
liberty/ /	limit/ લિમિટ/મર્યાદા, સીમા
liberty/ લિબર્ટી/	limn ચિત્રણ કરવું
libido કામવાસના	limousine/ લીમુઝીન/મોટરગાડી
library/ /	limp/ /
library/ લાઈબ્રેરી/	limp/ લિમ્પ/લંગડાવુ
licence/ /	limpid
licence/ લાઈસન્સ/પરવાનો(નામ)	line up- વું
license પરવાનો આપવો (ક્રિયાપદ)	line/ /
licentious/ લાસેન્સિઅસ/લંપટ	line/ લાઈન/
lick/ /	lineage વંશ
lick/ લિક/ચાટવું	linen બરછટ કાપડ
lid/ /	liner હવાઈ જહાજ,
lid/ લિડ/	linger લંબાવું, ઢીલ કરવી, ઝળુંબવું
lie back- વું	lingerie/ લીંગરી/સ્ત્રી ઓના અંગત કપડાં
lie down/ /	lingo વિદેશી-ખાસ ભાષા
lie in- વું	linguistically
lie up- વું	link/ /
	link/ લિન્ક/

lion / /	live-wire તરવરિયો
lion /લાયન/સિંહ	livid ધૂવાં ફૂવા
lip service	lizard / /
lip / /	lizard /લિઝર્ડ/
lip /લિપ/	lo સાંભળો
liquefy પ્રવાહી માં ફેરવવું	lo /લો/સાંભળો
liquid / /	load down -વું
liquid /લિક્વિડ/	load up -વું
liquidate ચુકવી દેવું, મારી નાખવું	load / /
liquidity રોકડ,તરલતા	load /લોડ/
liquor /લીકર/શરાબ,દારૂ	loaf / /
lisp / /	loaf /લોઉફ/ભટકવું,પાંઉ-રોટી
lisp /લિસ્પ/તોતડાવું	loan / /
lissome /લિસમ/ચપળ	loan /લોઉન/ઉછીનું આપવું
list / /	loathsome ધિક્કારપૂર્ણ
list /લિસ્ટ/	lobbying તરફેણ-ટેકો મેળવવો
listen in -વું	local / /
listen to /લિસન ટુ/	local /લોઉકલ/
listen / /	locale ઘટનાસ્થળ
listless ઉદાસીન સુસ્ત,નિરુત્સાહ	locate સ્થપાવું,ખોળી કાઢવું,વસવું
literacy /લિટરસિ/સાક્ષરતા	lock away -વું
literal / /	lock horn શિંગડા ભરાવવા
literal /લિટરલ/શબ્દશઃ	lock in -વું
literary / /	lock out -વું
literary /લિટરરિ/સાહિત્ય ને લગતું	lock up -વું
literate /લિટરેટ/સાક્ષર	lock / /
literati /લિટરાટિ/સાહિત્યકાર	lock /લૉક/તાળું
literature / /	lockout તાળાબંધી
literature /લિટરેચર/	loco /લોકો/પાગલ
lithe /લાઇઘ/ચપળ,તરવરિયું	locomotive આગગાડીનું એજિન
litigate દાવો ચલાવવો	locus standi માન્યસ્થિતિ
litigation અદાલતમાં વિવાદ	lodge / /
litmus-test અગ્નિપરીક્ષા,કસોટી	lodge /લૉજ/વીશી,મૂકવું,દાખલ કરવું
litre / /	lodgings / /
litre /લિટર/	loft / /
litter /લિટર/ગંદવાડ,ગલુડિયાં,કચરો	lofty ઉંચું,ઉન્નત
litterateur /લિટરેટર/સાહિત્યકાર	log in
litterbug જાહેરમાં કચરો ફેંકનાર	log / /
little / /	log /લૉગ/લાકડું
little /લિટલ/	loggerheads /લોગરહેડ/તંગ સંબંધો
littoral કાંઠા નો પ્રદેશ	logical તાર્કિક
live down -વું	logistics પુરવઠો પહોંચાડવો
live in/out -વું	logorhoea
live off -વું	loin કમર
live on -વું	loiter ભ્રમણ કરવું,રખડવું
live up to -વું	lonely / /
live / /	lonely /લોન્લિ/
live /લાઇવ/જીવંત	long for -વું
live /લિવ/જીવવું,જીવીત,રહેવું,વસવું	long / /
livery વિશિષ્ટ પોષાક	long /લોન્ગ/

longevity દીર્ઘયુષ્ય, લાંબી આવરદા**longitude****loo** સંડાસ-બાથરૂમ**look about-****look after//****look after//****look after-વું****look at-****look at-વું****look back-વું****look down on//****look down on-વું****look for//****look for//**શોધવું**look for-વું****look forward to//****look forward** આતુરતાથી રાહ જોવી**look in//****look in-વું****look into//****look into-વું****look on to-વું****look on-વું****look out for-વું****look out-વું****look over-વું****look to-વું****look up to//****look up to-વું****look up//****look up-વું****look//****look/લુક/****loom** ઝળુંબવું, ભમવું, શાળ (કાપડ)**loophole** છટકબારી, ક્ષતિ**loose//****loose/લુસ/ઠીલું, છૂટું****loosen up-વું****loot** લૂટવું**loquacious** વાચાળ, વાતોડિયું**lord//****lord/લોર્ડ/જમીનદાર. માલિક, ભગવાન, નામદાર****lore//**સાહિત્ય, વિદ્વતા**lose out-વું****lose//****lose/લુસ/ગુમાવવું, હારવું, નાશ પામવું****loss//****loss/લોસ/નુકશાની****lost/લોસ્ટ/ગૂમ, ખોવાયેલ****lot//****loud(ly)//****loud/લાઉડ/બુલંદ, મોટો અવાજ****lounge//****lounge/લાઉન્જ/****louse up-વું****lousy** ખદબદતું, ઘૃષ્ટાસ્પદ**love(able)//****love/લવ/પ્રેમ, લગાવ****low pitch****low(ly)//****low/લો/નીચું****lower//****loyal(ty)//****loyal/લોયલ/વફાદાર****lubricate** ઊંજણપૂરવું**lucid** સ્પષ્ટ, રસાળ**luck(y)//****luck/લક/****lucrative** ખૂબ પૈસા મળે તેવું**ludicrous** હાસ્યાસ્પદ**luggage//****luggage/લગેજ/****lugubrious** શોકમગ્ન**lukewarm** ઠંડું, નવશેકું હોંશ વિનાનું, નવશેકું**lull** સમી જવું, શાંત પડવું**lullaby/લલાબિ/હાલરડું****lumber****lump//****lump/લમ્પ/લોંદો, સહન કરવું****lumpsum** બધી રકમ સાથે**lunar****lunatic** પાગલ**lunch//****lunch/લન્ચ/****lung//****lung/લન્ગ/****lunge** આગળ ધસી જવું**lurch****lure** લલચાવવું**lurid** વિવિધ, બદલાતું, દશ્યાવલી**lurk** ઝળુંબવું**luscious****lust** તીવ્ર કામવાસના, લંપટતા**luxuriant** વિપુલ, અતિ પ્રચૂર**luxurious** વિલાસી, મોજશોખનું**lymphatic** નબળી-ફિક્કી વ્યક્તિ**lynch** ટોળા દ્વારા હત્યા થવી**lyric//**ઉર્મિકાવ્ય-ગીત**lyrical** ઉર્મિકાવ્યનું, ભાવનામય**macabre** બિહામણું, વિકરાળ**machiavellian/મેકીયાવેલીઅન/કપટી****machinations** કાવાદાવા, કાવતરું, ષડયંત્ર

machine(ry) / /
machine/મશિન/યંત્ર, સંચો
machismo/મૈકિઝમો/મર્દાનગીપૂર્ણ
macho/મૈચો/પૌરુષત્વવાળું
mad / /
mad/મૈડ/પાગલ, ગાંડુ
madam / /
madam/મૈડમ/
made/મેઈડ/
madonna વર્જિન મૈરિ
maestro/મૈસ્ટ્રો/ઉસ્તાદ, પંડિત(સંગીત)
Mafia આંતરરાષ્ટ્રિય ગુન્હાટોળકી
magazine / /
magazine/મૈગેઝિન/સામયિક, ગોળીનું ખોખું
Magi/મૈજાઈ/નાતાલ સમયે ભેટ લાવનાર
magic(al) / /
magic/મૈજિક/જાદુ
magician / /
magnanimity/મૈગ્નૈનિમિટિ/ મોટું મન, ઉદારતા
magnanimous/મૈગ્નૈનિમસ/મોટા મનનું ઉદાર
magnate/મૈગ્નેઈટ/ધનપતિ
magnet/મૈગ્નેટ/લોહચુંબક
magnificent/મૈગ્નિફિકૅસન્ટ/ ભવ્ય, પ્રભાવશાળી
magnify/મૈગ્નિફાય/મોટું કરવું
magnitude/મૈગ્નિટ્યુડ/પરિમાણ, વ્યાપ, માત્રા
mahout / /
mahout/મહાઉત/મહાવત
maid / /
maid/મેઈડ/નોકરાણી, કુમારિકા
maiden/મેઈડન/ પ્રથમ, કુમારી
mail / /
mail/મેઈલ/ટપાલ
maim/મેઈમ/અપંગ-વિકૃત બનાવવું
main / /
main/મેઈન/મુખ્ય
mainstay/મેઈનસ્ટે/મુખ્યઆધાર-ટેકો
mainstream મુખ્ય-રાષ્ટ્રિય ધારા
maintainનિર્વાહ, જાળવવું, સમર્થન આપવું
maintenance//જાળવણી, ભરણપોષણ
maize / /
maize/મેઈઝ/મકાઈ
majestic / /
majestic/મૈજિસ્ટિક/ભવ્ય, રાજવી ઠાઠ
major / /
major/મેજર/મુખ્ય, પુખ્ત, મહત્વનું
make for / /
make for-વું
make good
make of/from-
make off with-વું

make off / /
make off-વું
make of-વું
make out / /
make out//સમજવું
make out-વું
make over / /
make over-વું
make up for / /
make up for-વું
make up to-વું
make up પહોંચી વળવું
make up / /
make up//વળતર-બદલો વાળવો_પહોંચી_વળવું
make up-વું
make way જગ્યા આપવી, માર્ગ કરવો
make / /
make/મેઈક/બનાવવું, બનાવટ
make-believe મન મનાવવું, આભાસી
make-shift કામચલાઉ
malady/મૈલૅડિ/ માંદગી, રોગ
malafide/મૈલાફાઈડ/ મલીન, દુષ્ટ
malaise/મૈલૅઈઝ/અસુખ, બેચેની
male / /
male/મેઈલ/પુરુષ, નર
malediction શાપ, બદદુવા
malevolence/મૈલિવૉલન્સ/ દ્વેષ
malevolent/મૈલિવૉલન્ટ/ દ્વેષયુક્ત
malicious દુષ્ટ, હરામી
malign/મલાઈન/ નાલેશી-બદનામી કરવી
malignant/મૈલિગ્નન્ટ/ જીવલેણ, ઘાતક(કર્ન્સર)
malinger/મૈલિન્જર/કામચોર, આળસું
malleable/મૈલિએબ્લ/ટીપી શકાય તેવી ધાતુ
malpractice/મૈલપ્રૅક્ટિસ/ગેરરીતી, ગોલમાલ
mammal/મેમલ/સસ્તન પ્રાણી
mammoth/મેમથ/વિરાટ, જંગી
man(ly) / /
man/મેન/માણસ, મનુષ્ય
manage(r) / /
manage/મેનેજ/વ્યવસ્થા-પ્રબન્ધ કરવો
mandarin/મેન્ડરિન/સુબાઓ
mandate/મેન્ડઈટ/ ફરમાન, લોકાદેશ, જનાદેશ
mandatory/મેન્ડટરિ/ આદેશમૂલક, ફરજિયાત
mane / /
mane/મેઈન/કેશવાળી (પ્રાણી)
mangle/મેન્ગલ/ ચૂંથી નાખવું
mango / /
mango/મેન્ગો/કેરી, આમ્રફળ
manhandle/મેનહૅન્ડલ/ ધક્કે ચડાવવું
manhole/મેનહૉલ/ ગટરખાડું

mania/મૈનિઆ/ધેલછા, વિકૃતિ, ગાંડપણ
maniac/મૈનિએક/ગાંડો, પાગલ
manifest/મૈનિઆ/ પ્રગટ-છતું કરવું
manifesto/મૈનિફેસ્ટો/ ઘોષણાપત્ર, ઢંઢેરો
manipulate/મૈનિપ્યુલેટ/ ધાલમેલ-ગોલમાલ કરવી
manned/મૈન્ડ/માનવ સહિત
manner/ /
manner/મૈનર/રીત, ઢંઢ
mannikin(**mannequin**) પૂતળું
manoeuvre/મનુવર/ઢાવપેચ, વ્યૂઢબાજી
manor/મૈનોર/
mansion/મૈન્સન/ મકાન, ઘર
mantle
manual/મૈન્યુઅલ/ નાની પુસ્તિકા, હાથનું કામ
manufacture/મૈન્યુફેકચર/ ઉત્પાદન કરવું
manumit ગુલામ ને મુક્ત કરવો
manuscript/મૈન્યુસ્ક્રિપ્ટ/ હસ્તપ્રત
many/ /
many/મૈનિ/ઘણા, ઘણી
map out વિગતવાર ગોઠવવું
map/ /
map/મૈપ/નકશો
mar/ /
mar/માર/ખરડાવું, ખરાબ કરવું-થવું
marathon લાંબી દોડ (૪૨કિ.મી.)
marauder લૂંટારો
march/ /
march/માર્ચ/કૂચ કરવી
mare/ /
mare/મૈઅર/ઘોડી
marginal નજીવું, ઘારો ઘાર
marginalise મહત્વ ઘટાડવું-ઓછું કરવું
marigold/ /
marigold/મૈરિગોલ્ડ/
marijuana ચરસ, ગાંજો
marine સમુદ્ર, નૌકા સબંધી
maritime
maritime બંદરનું, દરિયાનું
mark up-વું
mark/ /
mark/માર્ક/નિશાની, ચિન્હ,
market/ /
market/માર્કેટ/હાટ
maroon સંપર્ક વંચિત-વેરાન થવું
marriage to-
marriage/ /
marriage/મૈરિજ/લગ્ન, વિવાહ
married to-
married/ /
marry off-વું

marry/ /
marry/મૈરિ/પરણવું
marsh/ /
marsh/માર્શ/નીચી જમીન
marshal/માર્શલ/કમબધ ગોઠવવું
marshy/માર્શિ/નીચાણ વાળી જમીન
martial/માર્શલ/લશ્કરી, સ્વરક્ષણ કસરત
Martian/માર્શિઅન/મંગળવાસી
martinet કડકશિસ્તનું આગ્રહી
martyr/માર્ટિર/શહીદ, હુતાત્મા
martyrdom શહાદત, શહીદી
marvel(lous)/ /
marvellous અદ્ભુત
marvellous/માર્વેલસ/
mascot//શુભચિન્હ, પ્રતિક
mash/ /
mash/મૈશ/
mask/ /
mask/મૈસ્ક/મહોરું, બુકાની, બુરખો
mason કડિયો
mass appeal smooch
mass/ /
mass/મૈસ/જથ્થો, સમૂહ, વ્યાપક, સંગઠન
massacre કત્લેઆમ, હત્યાકાંડ
massage માલિશ
mass-appeal
masses જનતા, સમૂહો
massive ભારે, વ્યાપક, મોટેપાયે
mast સ્તંભ, ધ્વજ સ્તંભ
master/ /
master/માસ્ટર/
mastiff
mat/ /
mat/મૈટ/
match/ /
match/મૈચ/
mate/ /
mate/મૈટ/
material/ /
material/મટીરિયલ/ભૌતિક, પદાર્થ
materialise/મટીરિયલાઈઝ/સાકાર થવું
maternal માતૃપક્ષનું, માતાનું
matey મળતાવડું
mathematics/ /
maths/ /
maths/મૈથ્સ/
matriarch/મૈટ્રિઆર્ક/માતૃવિશેષ
matrimonial લગ્નવિષયક
matter/ /
matter/મૈટર/

mattoid મહાપ્રતિભા અને મૂર્ખ
mature પરિપકવ, પ્રૌઢ
maturity પરિપકવતા
maudlin વેવલું, રોતલ
maul છુંદવું, છિન્નભિન્ન કરવું
maunder ફરતી ફરતી વાત કરવી
maven નિષ્ણાંત, કલાપારખુ
maverick નવો ચીલો પાડનાર
mawkish વેદિયું, અતિ લાગણીશીલ
maxim મંકઝીમ/સૂત્ર, સિધ્ધાંત
maximum / /
maximum / મેક્ષિમમ/
may be / /
may / /
may / મે/કદાય
maybe / મેયબી/કદાય
mayhem / મેયહેમ/હિંસાચાર, કત્લેઆમ
maze / /
maze / મેઝ/ભુલભુલામણી, ગૂંચવાડો
me / /
meadow / /
meadow / મેડોઉ/લીલાગાંસનુ મેદાન
meagre / મીગર/અલ્પ, જૂજ, નજીવું
meal / /
meal / મીલ/ખાણું
mean / /
mean / મીન/હલકટ, નીચ, અર્થ હોવો
meander / મીર્નર/વાંકુચું વહેવું
means સાધન, ઉપાય
means / /
measles / અછબડાં, ઓરિ
measure up -વું
measure / /
measure / મેઝર/માત્રા, પગલું, માપવું
measurement / /
meat / /
meat / મિટ/પ્રાણીનું માંસ
mechanical યાંત્રિક
mechanism
medal / /
medal / મેડલ/ચંદ્રક
meddle / /
meddle / મેડલ/માથું મારવું
media / સમાચાર//માધ્યમો
mediaperson / સમાચાર//માધ્યમો
mediator મધ્યસ્થી, વચેટિયો
medical / /
medical / મેડિકલ/
medicinal / મેડિસિનલ/ઔષધી, દવાને લગતું
medicine / /

medicine / મેડિસિન/દવા, ઔષધી
medico મેડીકલ વિદ્યાર્થી-ડોક્ટર
medieval / મેડીઆઈવલ/મધ્યયુગીન
mediocre / મિડીઓકર/ હલકી, મધ્યમ કોટીનું
mediocrity / મિડીઓક્રિટિ/મધ્યમવર્ગ, તુચ્છ
meditate ધ્યાન, ચિંતન કરવું
meek ગરીબું, બીકણ
meet up -વું
meet with -વું
meet / /
meet / મિટ/
megalomania અતિ અહંકારી
melancholic વિષાદપૂર્ણ
melange મિશ્રણ, વૈવિધ્ય
melee દંગલ, ઘકકામૂકી
mellifluous
mellow રસદાર, મધુર, માફક,
melodious કર્ણપ્રિય, સુમધુર
melt away -વું
melt down -વું
melt / /
melt / મેલ્ટ/ઓગળવું
member / /
member / મેમ્બર/
memento / મિમેન્ટો/સ્મૃતિચિન્હ
memoirs / મેમ્વાર/સંસ્મરણો
memorable સંસ્મરણીય, યાદગાર
memorandum આવેદનપત્ર
memorise યાદકરવું, ગોખવું
memorise / /
memory / /
memory / મેમરિ/યાદશક્તિ, સ્મૃતિ, સંસ્મરણ
men / /
men / મેન/માણસો (બ.વ.)
menace / મેનેસ/ઉપદ્રવ-ત્રાસજનક વસ્તુ
menagerie / મેનેજરિ/પ્રાણીસંગ્રહાલય
mend / /
mend / મેન્ડ/સમું કરવું
mendacity / મેન્ડેસિટિ/જુઠાણું
mendicant
menial / મેન્શિઅલ/નોકર-ચાકર
mental / /
mental / મેન્ટલ/માનસિક
mention / /
mention / મેન્શન/ઉલ્લેખ કરવો, દર્શાવવું
mentor / મેન્ટર/માર્ગદર્શક, શિક્ષક, ગુરુ
mercenary / મરસિનરિ/ભારૂતી/પૈસા માટે કામ કરનાર
merchandise / મર્ચેન્ડાઈઝ/માલસામાન
merchant / /
merchant / મરચન્ટ/વેપારી

mercurial/મરક્યુરિઅલ/બદલાતું
mercy-killing વેદનામુકિત મૃત્યુ
mere/ /
mere/મિઅર/માત્ર
merge/મર્જ/બેળવવું, જોડી દેવું
merger/મર્જર/જોડાણ, વિલિનીકરણ
meritocracy/મેરિટોક્રસિ/ગુણી-જ્ઞાની જનોનું શાસન
meritorious/મેરિટોરિઅસ/ગુણવાન, પ્રશંસાપાત્ર
mermaid/મેર્મેડ/મત્સ્ય કન્યા
merry/ /
merry/મેરિ/આનંદી
mesh/મેશ/જાળી, છુંદો,
mesmerise/મેસ્મેરાઇઝ/વશીકરણ કરવું
mesomorphic/મેસ્મોરફિક/નકકર સ્નાયુ વાળું
mess about/around-વું
mess up/મેસ/
mess/ /
mess/મેસ/ગોટાળો, અવ્યવસ્થા, એંઠવાડ
message/ /
message/મેસેજ/સંદેશો, કહેણ, ઉપદેશ
messenger/ /
messiah/મેસિઆહ/તારણહાર
messy/મેસી/ગંદું, ગોટાળીયું, ફૂવડીયું
metabolism/મેટાબોલિઝમ/પોષક દ્રવ્યનું, તંત્ર-રચના
metal/ /
metal/મેટલ/ઘાતુ
metamorphosis/મેટામોર્ફોસિસ/જાદુઈ રૂપાંતર
metaphor/મેટાફરફ/રૂપક અલંકાર
mete out/મિટ-આઉટ/સાટું વાળવું, યોગ્ય બદલો લેવો
meteor/મેટિઓર/ઉલ્કા
meteorite/મેટિઓરાઇટ/આંજી દેતું
meteorologists/મેટિરીઓલજીસ્ટ/હવામાનશાસ્ત્રી
meteorology/મેટિરીઓલજી/હવામાનશાસ્ત્ર
meter/ /
meter/મિટર/માપનયંત્ર
method/ /
method/મેથડ/રીત, પદ્ધતી
methodical/મેથડિકલ/વ્યવસ્થિત
meticulous/મેટિક્યુલસ/સંપૂર્ણતાનું આગ્રહી
metier/મેટિઅર/ધંધો, રોજગાર
metre/ /
metre/મિટર/માપ સો. મી.
metric/ /
mettle/ /
mettle/મેટલ/દમ, જુસ્સો, પાણી
mew/મ્યૂ/મ્યાંઉં
mewl/મ્યૂલ/આઉં વાઉં રૂ દન
mezzanine પ્રથમ માળ નીચેનો માળ
miasma/મિઆઝમા/ઝેરી હવા, વરાળ
mice/ /

mice/માઇસ/ઉંદર(બ. વ.)
microcosm/માઇક્રોકોઝમ/બહાંડના લઘુ રૂપે જીવ
microscope/ /
mid/ /
middle/ /
middle/મિડલ/મધ્ય, માધ્યમિક
midget/મિજેટ/ઠિંજીજી
midst/ /
midst/મિડસ્ટ/ની વચ્ચે
mid-term/મિડ ટર્મ/ મધ્યસત્ર
midwife daayan
mien/મિઅન/સાહિત્ય-કલાકારનું વર્તન
miff/મિફ/નારાજ કરવું, ઝગડો કરવો
might/ /
might/માઇટ/શક્તિ, બળ
mighty/માઇટી/બળવાન, શક્તિમાન
migraine/માઇ/આઘાશીશી
migrate વસવાટ માટે સ્થળાંતર કરવું
milch/મિલ્ચ/દૂઝાણું
mild/ /
mild/માઇલ્ડ/નરમ, સૌમ્ય
mile/ /
mile/માઇલ/
milestone/માઇલ/સીમાચિન્હ
milieu/મિલ્યુ/સમકાલીન પરિસ્થિતિ
militant લડાઈખોર
militarism
military/ /
military/મિલિટરી/લશ્કર, સેના
militia/મિલીશિઆ/લશ્કરી દળ
milk/ /
milk/મિલ્ક/દૂધ
mill/ /
mill/મિલ/યંત્ર, ચકકી, કારખાનું, દળવું
millennium સુવર્ણયુગ, સહસ્ત્રસદી
miller/ /
miller/મિલર/કારખાનેદાર
millet/મિલેટ/ બાજરી
million/ /
million/મિલિયન/દશલાખ
millionaire/મિલિયોનેર/ દશ-લાખપતિ
mince/મિન્સ/ કૂચો કરવો, હળવું બનાવવું
mind/ /
mind/માઇન્ડ/મન, ધ્યાનમાં લેવું
mindset/માઇન્ડ/મનોદશા, મનોવૃત્તિ
mine/ /
mine/માઇન/ખાણ, સુરંગ, મા
mineral/ /
mineral/મિનરલ/ખનીજ
mingle/મિન્ગલ/માં ભળવું, મિશ્રણ થવું

mingy/મિજ/ચિંગૂસ, કંજૂસ
miniature/મિનિએચર/લઘુચિત્ર
minimise/મિનિમાઈઝ/ઓછું કરવું
minimum/મિનિમમ/અલ્પતમ, લઘુતમ
minister / /
minister/મિનિસ્ટર/પ્રધાન, મંત્રી
ministered/મિનિસ્ટરડ/
ministerial/મિનિસ્ટેરિઅલ/ મંત્રીને લગતું
mink / /
mink/મિન્ક/રૂંવાટી-ચામડુ (પ્રાણી)
minnowing
minor/માઈનોર/સગીર, ગૌણ, નજીવું
minority/માઈનોરિટિ/લઘુમતી
minstrel/મિન્સ્ટ્રલ/ચારણ, કવિ, ગાયક
mint / /
mint/મિન્ટ/ટંકશાળ, સિક્કા પાડવા, ફુદીનો
minute / /
minute/માઈન્યુટ/સૂક્ષ્મ
minute/મિનિટ/મિનિટ
minutes/મિનિટ્સ/કાર્યવાહી નોંધ
minx/મિન્કશ/લુચ્ચી છોકરી
miracle/મીરૅકલ/ચમત્કાર
miraculous/મિરૅક્યુલસ/ચમત્કારિક
mirage/મિરાજ/મૃગજળ
mire/માયર/કાદવ, સંકટ
mirror / /
mirror/મિરર/અરીસો
misappropriate/મિસઅપ્રોપ્રિએટ/ગોલમાલ કરવી
miscellaneous/મિસલૅનિઅસ/પરચૂરણ, વિવિધ
mischief / /
mischievous તોફાની, શરારતી
misconception/મિસ્કન્શેપ્શન/ખોટી માન્યતા, મત
misdemeanour/મિસડીમીનર/દુરાચરણ
miser / /
miser/માઈઝર/કંજૂસ, લોભી
miserable/મિઝરબલ/દુઃખી
misery/મિઝરી/કંગાળ સ્થિતિ
misgivings/મિસગિવિંગ/શંકા, સંદેહ
misguide ગેરમાર્ગે દોરવું
mishap દુર્ઘટના, અકસ્માત
misjoinder/મિસજોઈન્ડર/ખોટું અર્થઘટન
mislead/મિસલીડ/ગેરમાર્ગે દોરવું
misnomer/મિસનોમર/ખોટું નામ-ઉપયોગ
misogamist/મિસોગૅમિસ્ટ/લગ્નધિક્કારતું
misogynist/મિસોજિનિસ્ટ/સ્ત્રીને ધિક્કારતું
misplaced/મિસપ્લેસડ/
miss out-વું
miss / /
miss/મિસ/કુમારી, ચુકી જવું
missing/મિસિંગ/ગૂમ,

mission/મિશન/ સંઘ, જીવનમંત્ર-ઉદ્દેશ
missionary/મિશનરિ/ધર્મપ્રચારક, સેવાસર્મપિત
missive/મિસિવ/કાગળ, પત્ર
mist / /
mist/મિસ્ટ/ઝાકળ
mistake / /
mistake/મિસ્ટેઈક/ભૂલ, ગેરસમજ
mistier
mistress / /
mistress/મિસ્ટ્રેસ/માસુકા
misty/મિસ્ટિ/ઝાંખું, ધૂંધળું, અસ્પષ્ટ
misuse / /
misuse/મિસયુસ/દુરુપયોગ(સત્તા-હોદ્દો)
mite / /
mite/માઈટ/ ઉઘઈ, અંશ, પાંખડી
mitigate/મિટિગેઈટ/શાંત પાડવું, શમન કરવું
mitigation/મિટિગેશન/શમન
mix up-સેળભેળ થવું
mix / /
mix/મિક્સ/ભેળવવું
mixture / /
mizzle/મિઝલ/ઝરમર વરસાદ
moan / /
moan/મોઉન/વિલાપ કરવો
mob / /
mob/મોબ/હિંસક ટોળું
mobile/મોબાઈલ/હરતું ફરતું
mobilisation/મોબિલાઈઝેશન/ગતીશીલતા, સૈન્યજમાવટ
mobility/મોબિલિટિ/હલનચલન
mobocracy
mock / /
mock/મૉક/ઠહામશ્કરી-ઉપહાસ કરવો
modal/મોડલ/અર્થ કે રીત બતાવતું
modalities/મોડાલિટિઝ/રીતરસમ
mode / /
mode/મોડ/રીત
model / /
model/મોડલ/નમુનો
moderate/મોડરેટ/નરમ-માફક બનાવવું
moderator/મોડરેટર/ઉદાર-નરમ મતવાળું
modern / /
modern/મોડન/આધુનિક, અર્વાચીન
modes/મોડ્ઝ/રીતભાત
modest/મોડેસ્ટ/અલ્પ, નમ્ર, માફક
modesty/મોડેસ્ટિ/નમ્રતા, ગરવાઈ
modicum/મોડિકમ/જરાક, અલ્પ
modify/મોડિફાય/સુધારા વધારા કરવા
modish/મોડિશ/છેલછબીલું, ફેશન વાળું
modus vivendi/મોડસ વિવેન્ડિ/કામચલાઉ તડજોડ, જીવનપ્રથા
modus operandi/મોડસઓપરન્ડિ/કાર્યપદ્ધતિ

moffusil/મોફુસિલ/ગ્રામ્ય વિસ્તાર
moiety/મોયટિ/અર્ધભાગ
moist/ /
moist/મોઈસ્ટ/ભેજવાળું, ભીનું
mole/ /
mole/મોલ/શરીર પરનો તલ, જાસૂસ
molecule/મોલેક્યુલ/અણુ નો લઘુ અંશ
molest/મોલેસ્ટ/સતાવવું, છેડતી કરવી
molestation
molestation/મોલેસ્ટેશનન/સતામણી, છેડતી
mollify/મોલિફાય/નરમ, શાંત પાડવું
mollycoddle/મોલિકોડલ/આળસપાળ કરવી
moment/ /
moment/મોમેન્ટ/ક્ષણ, પળ
momentous/મોમેન્ટસ/અગત્યનું
monarchy/મોનાર્કી/રાજાશાહી
monastery/મોનાસ્ટ્રી/બૌદ્ધમઠ
monetary/મોનીટરી/નાણાંકીય, આર્થિક
money/ /
money/મની/ધન, પૈસા
monitor/ /
monitor/મોનિટર/દિખરેખ સંકલન, વર્ગનેતા
monitoring/મોનિટરિંગ/દિખરેખ સંકલન
monk/ /
monk/મન્ક/સાધુ, સન્યાસી
monkey/ /
monkey/મંકી/વાંદરો
monoecious hermaphrodite
monogamy/મોનોગેમિ/એકપત્નિપ્રથા
monopoly/મોનોપોલિ/ઈજારો, એકાધિકાર
monotheism/મોન્થેઈઝમ/એકેશ્વરવાદ
monotonous/મોનોટોનસ/એકધારું, કંટાળાજનક
monotony/મોનોટોનિ/નિરસતા, કંટાળાજનક
monsieur/મસ્યુ/શ્રીમાન(ફ્રેંચ)
monsoon/ /
monsoon/મન્સૂન/ચોમાસુ
monstrance/મોન્સ્ટ્રન્સ/જહાજ
monstrous રાક્ષસી, પ્રચંડ
month/ /
month/મંથ/મહિનો, માસ
monument/મોન્યુમન્ટ/સ્મારક, અવશેષ
mooch/મૂચ/રખડવું, ભટકવું
mood/ /
mood/મૂડ/મિજાજ, મન:સ્થિતી
moon/ /
moon/મૂન/ચાંદો, ચંદ્ર
moonstruck/મૂનસ્ટ્રક/ચસકેલું, ગાંડુ, પાગલ
moor/ /
moor/મૂઅર/સીદી, હબસી
moorings/મૂરિંગ્સ/લાંગરવું

moot point/મૂટ પોઈન્ટ/વિવાદાસ્પદ મુદ્દો
moot/મૂટ/ચર્ચા માટે દરખાસ્ત રજૂ કરવી
mope/ /
mope/મોપ/પોતું કરવું, સાફ કરવું
moped/ /
moped/મોપેડ/એન્જીન સાથે પેડલ
mopping-up
moraine//હિમ નદીમાં તણાયેલા ખડકો
moral/ /
moral/મોરલ/નૈતિક, નિતિમતા
morale/ /
morale/મોરાલ/જુસ્સો, મનોબળ
morass વિષ્ન
moratorium મોકૂફી, વિલંબીત ચૂકવણું
morbidity/મોરબિડ/મનોરોગી
morbidity/મોરબિડિટિ/રોગી મનોવૃત્તિ
mordant
mordant/મોરડાન્ટ/દાહક, મર્મભેદી, આકરું
more/ /
more/મોર/વધારે
mores/મોરીઝ/સામાજિક રૂઢિઓ
morgue/મોર્ગ/શબઘર
moribund/મોરિબન્ડ/ મરણોન્મુખ
morning/ /
morning/મોર્નિંગ/સવાર
moron/મોરોન/મૂર્ખ, મંદ બુદ્ધિ
morose/મોરોઝ/ઉદાસ, ચીડિયું
morphine/મોર્ફિન/અફીણનો અર્ક
morrow/ /
morsel/મોર્સલ/કોળિયો
mortal/મોર્ટલ/મનુષ્ય, મરણાધિન
mortar/મોર્ટાર/
mortgage/મોરગેજ/ગીરો મૂકવું
mortified/મોર્ટિફાઈડ/શરમિંદુ/છોભીલું
mosque/ /
mosque/મોસ્ક/મસ્જિદ
mosquito/ /
mosquito/મસ્કિટો/મચ્છર
most(ly)/ /
most/મોસ્ટ/મોટા ભાગના, સૌથી વધુ
moth/ /
moth/મોથ/જીવાંત
mother/ /
mother/મધર/માતા, માં
mother-tongue/મધરટન્ગ/માતૃભાષા
motif/મોટિફ/કથાઘટક, વિષયવસ્તુ
motion/ /
motion/મોઉશન/ગતિ, દરખાસ્ત, પ્રસ્તાવ
motivate/મોટિવેટ/પ્રેરવું, પ્રવૃત્ત કરવું
motivation/મોટિવેશન/પ્રેરકબળ

motivator/મોટિવેટર/પ્રેરક
motley/મોટલી/પચરંગી, બહુરંગી, વિવિધ
motor/ /
motor/મોટર/એન્જિન
mottled/મોટલ્ડ/ચટાપટા વાળું(સાપ)
motto/મોટો/મુદ્રાલેખ, સિધ્ધાંત
mould/ /
mould/મોઉલ્ડ/ઘસતર કરવું ઓહું, ફૂગ લાગવી
moulting/મોલ્ટીંગ/નવપલ્લવિત કરવું
mound/ /
mound/માઉન્ડ/ટિકરો
mount/ /
mount/માઉન્ટ/સવાર થવું, ની ઉપર ગોઠવવું
mountain/ /
mountain/માઉન્ટન/પર્વત, પહાડ
mountainous/માઉન્ટેનઅસ/પહાડી, પર્વતિય
mountebank/માઉન્ટબેન્ક/ઊંટવેદ/પાખંડી
mourn/ /
mourn/મોર્ન/શોક-વિલાપ કરવો
mournful/મોર્નફુલ/શોકાતુર
mouse/ /
mouse/માઉસ/ઉંદર
moustache/મસ્ટાશ/મૂછ
mouth/ /
mouth/માઉથ/મોહું
move along-વું
move in-વું
move on-વું
move out-વું
move up-વું
move(ment)/ /
move/મૂવ/ખસેડવું/ચાલ/ચલિત થવું
movement હિલચાલ/ચળવળ/ગતિ
movie/ /
movie/મૂવી/ચલચિત્ર
mow/ /
mow/મોઉ/ઘાંસ કાપવું
much/ /
much/મચ/ઘણું(જથ્થો)
muck
muck up
muck up
mucus મેલો-ચિકણો પદાર્થ
mud slinging/મડસ્લીંગીંગ/કાદવ ઉછાળવો
mud(dy)/ /
mud/મડ/કાદવ
muddle along/on-વું
muddle up-વું
muddle/મડલ/
muddleheaded/મડલહેડિડ/ભૂલકણું

mug/ /
mug/મગ/
mugged
mugger/મગર/
muggy/મગી/ઉકળાટ-બફારો થાય તેવું
mugwump/મગવમ્પ/ધૂરંધર, મહારથી
mulct/મલ્કટ/વંચિત કરવું, છેતરવું
mule/ /
mule/મ્યૂલ/ખચ્ચર
mull over મનન કરવું, વિચારવું
multilateral
multiple/મલ્ટિપ્લ/અનેક, બહુ
multiply/ /
multiply/મલ્ટિપ્લાય/
multi-pronged બહુપાંખિયો
multitude અસંખ્ય લોકો-ટોળાઓ
mum/ /
mum/મમ/માતા
mumble/મમ્બલ/બકવાસ કરવો
mumbo-jumbo નિરર્થક કર્મકાંડ
mummy/ /
mummy/મમ્મી/માતા
mumps/ /
mumps/મમ્સ/ગાલપચોલિયા
munch/મન્ચ/ચાવવાનો અવાજ
mundane/મન્ડેઈન/દુન્યવી, પાર્થિવ
munificent
murder/ /
murder/મર્ડર/ખૂન, હત્યા
murky/મર્કી/અંધકારમય, કાળું, બિહામણું
murmur/મર્મર/ગણગણાટ કરવો
muscle in-વું
muscle/ /
muscle/મસલ/સ્નાયુ
muscular/મસ્ક્યુલર/પહેલવાન, સ્નાયુનું
muse/મ્યુઝ/મનન કરવું, કલાની ટેલી
museum/ /
museum/મ્યુઝીયમ/સંગ્રહાલય
mushroom/મશરૂમ/બિલાડીના ટોપ-ફૂટી નિકળવું
mushy
music(ian)/ /
music/ /
music/મ્યુઝીક/સંગીત
musical/મ્યુઝીકલ/સંગીતમય
musician/મ્યુઝીશન/સંગીતકાર
musk/ /
musk/મસ્ક/કસ્તૂરી
must/ /
must/મસ્ટ/અવશ્ય, જોઈએ
mustang/મસ્ટાંગ/જંગલી ઘોડો

muster/મસ્તર/એકઠું કરવું, પનક
mutation/મ્યુટેશન/ફેરફાર, વિવિધતા
mute/ /
mute/મ્યુટ/મૂંગુ, ચૂપ
mutinous/મ્યુટિનસ/બળવાખોર
mutter/મટર/બબડવું
mutual/મ્યુચ્યુઅલ/અન્યોન્ય, આપસમાં
muzzy/મઝી/મંદદૃષ્ટિ, ઇકઠું
my/ /
myopia/માયોપિઆ/ટૂંકીદૃષ્ટિ
myopic/માયોપિક/ટૂંકીદૃષ્ટિ વાળું
myriad/મિરિઅડ/અનેક, અસંખ્ય
mysterious/ /
mysterious/મિસ્ટરીઅસ/રહસ્યમય, ગૂઢ
mystery/ /
mystery/મિસ્ટરી/રહસ્ય
mystic/મિસ્ટિક/આધ્યાત્મિક
mystics
mystique/મિસ્ટિક/રહસ્યમય ઘટના-બનાવ
myth/ /
myth/મિથ/દંતકથા, વાર્તા
mythological
mythological/માયથોલોજિકલ/દંતકથા નું, પૌરાણિક
nab/નૉબ/ઝડપી-પકડી લેવું
nabbed
nadir/નાદિર/તળિયે, સૌથી નીચે
nagging સતત દોષ કાઢવું, ઝઘડવું
nail/ /
nail/નેઈલ/નાખ, ખિલો, કબુલાવવું
naïve/ /
naïve/નાઈવ/ભોળું
naked/નેકિડ/નગન, ખુલ્લું
namby-pamby નબળું, સુસ્ત
name/ /
nap/નેપ/ઝોકું
napping/નેપિંગ/ઊંઘવું, સૂવું
narcissism/નારસિસિઝમ/આત્મશ્લાઘા-પ્રેમ
narcotic/નારકૉટિક/કેફીદ્રવ્ય
narcotics
nark/નાર્ક/ભાતમીદાર
narrate/નારેઈટ/વર્ણન કરવું
narrow down-વું
narrow/ /
narrow/નેરો/સાંકડુ
nasty/ /
nasty/નેસ્ટી/
natal/નેટલ/જન્મ સંબંધી
natality/નેટલ/જન્મદર
nation(al)/ /
nation/નેશન/રાષ્ટ્ર

national/નેશનલ/રાષ્ટ્રીય
nationalise/નેશનાલાઈઝ/રાષ્ટ્રીયકરણ કરવું
native/ /
native/નેટિવ/મુળ રહેવાસી, વતની
natty/નેટિ/ટાપટીપવાળું
natural/ /
natural/નેચરલ/કુદરતી
nature/ /
nature/નેચર/કુદરતી
naught/ /
naught/નોટ/શૂન્ય, ઝીરો
naughty/નોટિ/તોફાની, શરારતી
nausea/નોઝીઆ/અણગમો, સૂગ
nauseate/નોસીએટ/સૂગ-ઘુણા પેદા થવી
naval/ /
navigate/નેવિગેઈટ/હંકારવું, દિશાસૂચન કરવું
navvy/નેવિ/બાંધકામ મજૂર
navy/ /
navy/નેવી/નોસેના
naxalite/નેકલ્લાઈટ/નક્ષલવાદી
near(ly)/ /
near/નીઅર/નજીક
neat/ /
neat/નીટ/સ્વચ્છ, ચોખ્ખું
necessary/ /
necessary/નેસેસરી/જરૂરી, આવશ્યક
necessities/નેસેસિટિ/આવશ્યક વસ્તુઓ
neck/ /
neck/નેક/ગરદન
necropolis/નેક્રોપોલિસ/સ્મશાન, કબ્રસ્તાન
nectar/નેકટર/અમૃત
need(y)/ /
need/નીડ/જરૂરિયાત
needle/ /
needle/નીડલ/સોય
needy/નીડિ/જરૂરિયાતવાળું
nefarious/નેફરિઅસ/દુષ્ટ, અધમ
negative/ /
negative/નેગેટીવ/નકારાત્મક
negativision
neglect(ful)/ /
neglect/નેગ્લેક્ટ/ઉપેક્ષા કરવી
negligent/નેગ્લીજન્ટ/બેદરકાર
negligible નજીવું, સામાન્ય
negotiable વાટાઘાટ યોગ્ય, હસ્તાંતરિય
negotiate/નિગોશીએટ/વાટાઘાટો કરવી
neigh/નેઈ/હણહણાટ
neighbour(hood)/ /
neighbour/નેઈબર/પડોસી
neither/ /

neither/નાઈઘર/એકેય નહિ
nemesis/નેમિસિસ/કુદરતી ન્યાય, યોગ્યસજા
neologism/નીઓલોજીઝમ/નવો શબ્દ પ્રયોગ
neophyte/નીઓફાઈટ/શિખાઉ, નવાણિયુ
nephew /
nephew/નેફ્યુ/ભાણેજ, ભત્રીજો
nepotism/નેપોટિઝમ/સગાંવાદ, મામકાવાદ
nerve /
nerve/નર્વ/જ્ઞાનતંતુ
nervous /
nervous/નર્વસ/ગભરાયેલું, બેચેન
nescience જ્ઞાનવિહીન
nest /
nest/નેસ્ટ/માળો
nestle/નેસલ/હૂંફમાં પડ્યા રહેવું
net /
net/નેટ/જીતવું, મેળવવું, જાળી
nettle/નેટલ/ખીજવવું, ચામડી નો સોજો
network /
network/નેટવર્ક/શૃંખલા
neutral /
neutral/ન્યુટ્રલ/નિષ્પક્ષ, તટસ્થ
neutralise/ન્યુટ્રલાઈઝ/નકામું બનાવી દેવું
neutrality
never never હખ્તાથી કરેલી ખરીદી
never /
never/નેવર/કદાપી નહિ
nevertheless
new /
newfangled/ન્યુફંગલડ/નવો ફણગો
news(paper) /
news/ન્યુઝ/સમાચાર
newshound/ન્યુઝહાઉન્ડ/સમાચાર ભૂખ્યા પત્રકારો
next /
next/નેક્સ્ટ/પછીનું, બાજુનું
nexus/નેક્સસ/સાંઠગાંઠ, ગઠબંધન, નાતો
nibble/નિબ્લ/કરડી ખાવું
nice /
nice/નાઈસ/મજાનું, સુંદર
niche/નિચ/અનુકૂળ સ્થાન, દિવાલમાં ખાડો
nicks/નિક્સ/
niece /
niece/નીસ/ભત્રીજી, ભાણેજ
niggard/નિગાર્ડ/કંજૂસ, લોભી
niggle/નિગલ/અતિ આગ્રહી, ચીકણું, લપીયું
night /
night/નાઈટ/રાત, રાત્રી
nightingale/નાઈટિંગેલ/બુલબુલ
nightmare/નાઈટમેઅર/દુઃસ્વપ્ન
nihilism/નિહિલિઝમ/વિનાશવૃત્તિ, ધ્વંસલીલા

nil /
nil/નીલ/શુન્ય, કાંઈ નહિ
nimble/નિમ્બલ/ચપલ
nimbus/નિમ્બસ/તેજોવલય
nincompoop/નિન્કોમ્પૂપ/મૂર્ખ, જડભરત
nine /
nine/નાઈન/નવ
ninth /
ninth/નાઈનથ/નવમું
nip/નિપ/અટકાવવું, દાબી દેવું
nippy
nisi/નિસિ/પ્રારંભિક
nitty-gritty/નિટિગ્રિટિ/ytkxeDqkxeytu?
nix
no one /
no /
no/નો/ના, નહિ
noble /
noble/નોબલ/ઉમદા, ગુણવાન
nobleman /
nocturnal નિશાયર
nod off-વું
nod /
nod/નોડ/માથું હલાવવું, હા પાડવી
nodal mdhysth
noddle mathu
noise /
noise/નોઈસ/ઘોંઘાટ, ઘમાલ
noisome/નોઈસમ/ખરાબ, અરુચિકર(ગંધ)
noisy/નોઈઝિ/ઘોંઘાટીયું, ઘમાલિયું
nomad ભટકતી જાતિ
nomadic ભટકતું
nomenclature નામકરણ, નામાભિધાન
nominal/નોમિનલ/નામ પૂરતું
nominate/નોમિનેઈટ/નીમવું
nomination/નોમિનેશન/ઉમેદવારી
nominee umedvar
non sequitur/નોન સીકવેટર/અસંગત વિધાન
non /
non-aligned/નોનઅલાઈન્ડ/અલિપ્ત
nonce/નન્સ/હાલ પુરતું
nonchalant
nonchalant/નોનશલન્ટ/ઉદાસીન
nonconformist
nondescript/નોનડિસ્ક્રિપ્ટ/નિરસ, કંટાળાજનક
none /
none/નન/કોઈ નહિ, કાંઈ નહિ
non-entity/નોન એન્ટિટિ/નગણ્ય
nonetheless
nonetheless/નન્થલેસ/તેમ છતાં
non-pareil/નોનપરલ/અજોડ, બેનમૂન

nonplus/નોનપ્લસ/મુંઝાયેલું
nonsense / /
nonsense/નોનસેન્સ/બકવાસ
non-violent/નોનવાયોલન્ટ/અહિંસક
noodle bholo, moorkho
noon / /
noon/નૂન/બપોર
noose/નૂઝ/ફાંસો, ગાળિયો
nor / /
norm / /
norm/નોર્મ/ધારા ધોરણ, નિયમ
normal / /
normal/નોર્મલ/સામાન્ય
normalcy સામાન્ય સ્થિતિ
normalise સામાન્ય બનાવવું
norms ધારા-ધોરણ, નિયમ
north / /
north/નોર્થ/ઉત્તર
northern / /
nose / /
nose/નોઝ/નાક
nosedive/નોઝ/નાક
nosh/નોશ/ખાવું, ખાવટું
nostalgia/નોસ્ટાલજિઆ/ભૂતકાળની ઝંખના
nostrum/નોસ્ટ્રમ/ઊંઠવેદુ
not(e) / /
not/નોટ/નહિ, નથી
notable/નોટૅબલ/વિખ્યાત
notary/નોટરિ/વિલેખ પ્રમાણક વકીલ
notch up/નોચ અપ/-વું
notch/નોચ/ખાંચ, કાપો
note/નોટ/નોંધ-યાદી કરવી
noteworthy/નોટવર્થી/નોંધપાત્ર
nothing / /
nothing/નર્થિંગ/કાંઈ નહિ
notice / /
notice/નોટીસ/જાહેરાત, ધ્યાન માં લેવું
noticeable / /
notification/નોટિફિકેશન/જાહેરનામું
notify / /
notify/નોટિફાય/જાહેરાત કરવી
notion/નોઉશન/ખ્યાલ, માન્યતા
notorious/નોટોરિઅસ/કુખ્યાત, નામચીન
notwithstanding/નોટવિધર્સ્ટેન્ડિંગ/તેમ છતાં
noun / /
noun/નાઉન/નામ
nourish/નરિશ/પોષણ આપવું
nous/નૂ/સામાન્ય બુધ્ધિ, વહેવારું જ્ઞાન
nouveau riche/નોવૂરીસ/તાજું ધનવાન
nova/નોવા/ખૂબજ તેજસ્વી તારો

novelist / /
novelist/નોવલિસ્ટ/નવલકથાકાર
novice/નોવિસ/શિખાઉ, નવાણિયો
now / /
now/નાઉ/અત્યારે, હમણાં, હવે
nowadays / /
nowadays/નાવાડેઈઝ/આજકાલ, હાલમાં
nowhere / /
noxious/નોક્ષિઅસ/હાનિકારક
nuances/નુઆન્સિઝ/સુક્ષ્માર્થભેદ
nubile/ન્યુબાઈલ/વિવાહ યોગ્ય
nuclear/ન્યુક્લીઅર/અણુશક્તિ
nucleus/ન્યુક્લીઅસ/બીજક, મૂળ
nude/ન્યુડ/નગ્ન
nudge/નજ/કોણીથી ધ્યાન ખેચવું
nugatory/નગૅટરિ/નકામુ, વ્યર્થ, નિષ્ફળ
nuisance/ન્યુસન્સ/ત્રાસ, ઉપદ્રવ
nukes/ન્યુક્સ/(nuclear)અણુશસ્ત્રો
null & void/નલ અન્ડ વૉઈડ/રદ્દબાતલ
nullify/નલિફાય/રદ્દબાતલ કરવું, નકામું બનાવવું
numb/નમ્બ/જડ, સંવેદનાશૂન્ય
number / /
number/નમ્બર/સંખ્યા, આંક, ક્રમ
numerous
numerous/ન્યુમરસ/અસંખ્ય
numinous
numismatics/ન્યુમિસમેટિક/સિકકાસંગ્રહ
nun / /
nun/નન/સાધ્વી
nuptial લગ્નનું, વૈવાહિક
nurse / /
nurse/નર્સ/રૂઝવવું, ચાકરી કરવી, નર્સ
nurture/નર્ચર/પાલન પોષણ કરવું
nut / /
nut/નટ/કાજુ, ચાકી, મુખ
nutrition/ન્યુટ્રિશન/પોષણ
nutritious/ન્યુટ્રિશસ/પૌષ્ટિક
nylon / /
nymphomania/નિમ્ફોમેનિઆ/અતિ કામવાસના
o'clock/અક્લોક/
oaf જડ, બુધ્ધિહીન, અકકલમઠો
oar / /
oar/ઓઅર/હલેસું
oasis/ઓએસિસ/મરુભૂમિ
oath / /
oath/ઓઉથ/સોગન
obedience / /
obedient / /
obedient/અબિડિઅન્ટ/આજ્ઞાકિંત
obeisance/ઓબેઉસાન્સ/નમન, પ્રણામ

obeisant/ઓબેસાન્ટ/શિષ્ટાચાર
obese/ઓબીઝ/સ્થૂળ
obesity/ઓબેસિટિ/સ્થૂળતા, ચરબી ના થર
obey / /
obey/ઓબે/આજ્ઞાપાલન કરવું
obituary/ઓબિચ્યુઅરિ/શ્રધ્ધાંજલી
object(ion) / /
object/ઓબ્જેક્ટ/પદાર્થ, વાંધો ઉઠાવવો
objection/ઓબ્જેક્શન/વાંધો
objective/ઓબ્જેક્ટિવ/લક્ષ્ય, હેતુ, વસ્તુનિષ્ઠ
oblation/ઓબ્લેશન/દેવતા ને અર્પણ ભેટ
obligatory/ઓબ્લીગેટરી/બંધનકારક
oblige/ઓબ્લાઇઝ/ઉપકાર કરવો, બંધનમાં હોવું
oblique/ઓબ્લીક/ત્રાંસી લીટી, આડકતરું
oblivion/ઓબ્લિવીઅન/વિસ્મૃતિ
oblivious/ઓબ્લિવીઅસ/ ભૂલીજનારું
obloquy/ઓબ્લોકવી/નામોશી
obnoxious/ઓબ્નોક્ષીઅસ/ ત્રાસદાયક, નુકશાનકારક
obscene/ઓબ્સીન/અશ્લીલ
obscure/ઓબસ્ક્યુર/અસ્પષ્ટ, અજાણ્યું
obsequious/ઓબસીક્વીઅસ/ખુશામતિયું
observance/ઓબ્ઝરવન્સ/પાલન
observatory/ઓબ્ઝર્વેટરિ/વેદ્યશાળા
observe / /
observe/ઓબ્ઝર્વ/નિરીક્ષણ કરવું, પાળવું
obsessed with
obsession/અબ્સેશન/ધેલણ, વળગણ
obsessive/ઓબ્સેસિવ/ધેલણવાળું
obsolete/અબસલીટ/પ્રાચીન, ચલણ ન હોવું
obstacle/ઓબ્સ્ટેકલ/વિઘ્ન, અંતરાય
obstinate/આબ્સ્ટીનેટ/હડીતું
obstreperous દેકારો મચાવતું
obstruct/ઓબ્સ્ટ્રક્ટ/અવરોધવું
obstude/ઓબ્સ્ટ્રુડ/ દખલગીરી કરવી
obtain / /
obtain/ઓબ્ટેઇન/મેળવવું, પ્રાપ્ત કરવું
obtainable/અબ્ટનેબલ/પ્રાપ્ય, મેળવી શકાય તેવું
obtrusive/ઓબસ્ટ્રુઝિવ/ધુસાડનારું
obtuse/ઓબસ્ટ્યુયઝ/ભૂર્તું
obviate/ઓબવિએઇટ/ટાળવું
obvious(ly) / /
obvious/ઓબ્વિયસ/દિખીતું
obviously/ઓબ્વિયસલિ/દિખીતી રીતે
occasion / /
occasion/ઓકેઝન/પ્રસંગ
occidental/ઓકિસ્ટેન્ટલ/પશ્ચિમનું
occult/અકલ્ટ/ગહન, રહસ્યમય
occupant/ઑક્યુપન્ટ/કબ્જેદાર
occupation/અકરન્સ/કબ્જો, વ્યવસાય
occupied/ઑક્યુપાઇડ/કબ્જાગ્રસ્ત, વ્યસ્ત

occupy/ઑક્યુપાય/કબ્જો લેવો, જગ્યા રોકવી
occur(rence) / /
occur/અકર/બનવું, સૂઝવું
occurrence/અકરન્સ/ઘટના, બનાવ
ocean / /
ocean/ઓશન/દરિયો, સમુદ્ર, સાગર
ochre/ઓકર/ગેરુ રંગનું
o'clock / /
octogenarian/ઑક્ટોજનેરિઅન/ઐસી વર્ષનું
odd / /
odd/ઑડ/ઐકી અંક, વિચિત્ર, વિષમ
oddity/ઑડિટિ/વિચિત્રતા
oddment/ઑડમન્ટ/બાકી વધેલું, રહ્યું સહ્યું
odds/ઑડ્ડ/વિષમતા
odds/ઑડ્ડ/વિષમતા
odious/ઑડિઅસ/તિરસ્કારપાત્ર
odium/ઑડિઅમ/ફિટકાર, તિરસ્કાર
odyssey/ઑડિસિ/મહાપ્રયાણ
oeuvre/ઑવર/સર્જન, કૃતિ
of / /
off / /
off/ઑફ/માંથી બહાર-નીચે-અલગ
offal/ઑફલ/વધ્યું ઘટવું, કચરો
off-day/ઑફડેય/ખરાબ દિવસ, રજાનો દિવસ
offence / /
offence/ઑફેન્સ/ગુન્હો, મર્યાદાભંગ
offend / /
offend/ઑફેન્ડ/નારાજ કરવું
offending
offensive / /
offensive/ઑફેન્સિવ/આક્રમણ, અપમાજનક
offer / /
offer/ઑફર/આગળ ધરવું, પ્રસ્તાવ, દરખાસ્ત
off-hand તૈયારી વિના, તરત
office(r) / /
office/ઑફિસ/
office-bearers/ઑફિસબેરરસ/હોદ્દેદારો
official / /
official/ઑફિશ્યલ/સત્તાવાર, અધિકારી
officials/ઑફિશ્યલ/દખલ દેનારું
offing/ઑફિન્ગ/ નજીક માં થનારું
off-set/ઑફસેટ/
offspring બાળક, ફરજંદ
often / /
often/ઓફન/વારંવાર
ogle/ઓગલ/કામુક નજરે જોવું
ogre/ઑગર/ નરભક્ષી રાક્ષસ
oh / /
oh/ઓહ/અરે!
oil / /

oil/ઓઈલ/તેલ-નાખવું
okay/ઓકે/બરાબર, ઠીક, માન્ય કરવું
old /
old/ઓલ્ડ/જુનું, વૃદ્ધ, ઉંમરનું
oligarchy/ઓલિગાર્કી/અલ્પજન-ઉચ્ચવર્ગનું શાસન
ombudsman/ઓમ્બુડ્ઝમન/ફરિયાદ નિવારક **mkM:t**
omen/ઓમેન/સંકેત
ominous/ઓમિનસ/અશુભ
omit /
omit/ઓમિટ/બાકાત રાખવું
omlette/ઓમ્લેટ/ઈંગ્લી વાનગી
omnibus/ઓમ્નિબસ/સર્વગ્રાહી+
omnipotent/ઓમનિસાયન્ટ/સર્વશક્તિમાન (ઈશ્વર)
omnipresent/ઓમનિસાયન્ટ/સર્વવ્યાપી
omniscient/ઓમનિસાયન્ટ/સર્વજ્ઞ
omnivorous/ઓમનિવોરસ/સર્વભક્ષી
on cards હાથવેતમા
on the brink
on the wake
on /
once /
once/વન્સ/એકવાર
one up-manship સચેહાચેહ જામબર ચગપચહાયથી
one /
one/વન/એક
onerous/ઓનરસ/ભારરૂપ
oneself /
onion /
onion/અનિયન/ડૂંગળી
only /
only/ઓન્લિ/માત્ર
onomatopoeia/ઓનમૅટોપોઈઆ/ધ્વનિ અલંકાર
onset/ઓનસેટ/હુમલો, જોરદાર શરૂઆત
onslaught/ઓનસ્લૉટ/આક્રમણ, આઘાત
onto /
ontology/ઓન્ટૉલજી/સત્વ-સ્વરૂપ મીમાંસા
onus/ઓનસ/જવાબદારી, બોજ
ooze/ઊઝ/પ્રવાહી બહાર વહેવું
opaque/ઓપેક/અપારદર્શક
open on to-વું
open out-વું
open up-વું
open /
open/ઓપન/ખુલ્લું, નિખાલસ
operate સંચાલન-શસ્ત્રક્રિયા-કાર્ય કરવું
operate on-
operate /
operation /
operative/ઓપરેટિવ/અમલી, શસ્ત્રક્રિયાનું
opinion /

opinion/ઓપીનીયન/મત, અભિપ્રાય, વિચાર
opium/ઓપિયમ/અફિણ
opponent /
opponent/ઓપોનન્ટ/વિરોધી, વેરી
opportune/ઓપર્ચ્યુન/સમયસરનું, યોગ્ય સમય
opportunist/ઓપર્ચ્યુનીસ્ટ/તકસાધુ
opportunity /
opportunity/ઓપર્ચ્યુનીટી/તક, મોકો
oppose /
oppose/ઓપોઝ/વિરોધ કરવો
opposite /
opposite/ઓપોઝીટ/ની સામે, ના થી ઊલટું
opposition /
opposition/ઓપોઝીશન/વિરોધ, પ્રતિકાર
oppress/ઓપ્રેસ/દમન, અન્યાય કરવો
oppression/ઓપ્રેશન/જોર, જુલમ
opprobrium/ઓપ્રોબ્રિઅમ/નામોશી, નિંદા, કલંક
opt for
opt out-વું
opt/ઓપ્ટ/વિકલ્પ પસંદ કરવો
optative/ઓપ્ટેટિવ/ઈચ્છાદર્શક
optimal/ઓપ્ટિમલ/વધુમાં વધુ
optimise/ઓપ્ટિમાઇઝ/વધુમાં વધુ કરવું
optimism/ઓપ્ટિમિઝમ/આશાવાદ
optimistic /
optimistic/ઓપ્ટિમિસ્ટિક/આશાવાદી
optional/ઓપ્શનલ/વૈકલ્પિક
opulence/ઓપ્યુલન્ટ/સમૃદ્ધી, વૈભવ
opulent/ઓપ્યુલન્ટ/સમૃદ્ધ, વૈભવશાળી
opus
oracle/ઓરેકલ/દિવવાણી
oracular/ઓરેક્યુલર/દિવવાણી જેવું, ગૂઢ
oral /
oral/ઓરલ/મૌખિક
orange /
orange/ઓરેન્જ/
orb/ઓર્બ/ગ્રહ
orbit/ઓર્બિટ/ભ્રમણકક્ષા
orchard/ઓર્ચર્ડ/ફલોદ્યાન
orchestrate/ઓર્કસ્ટ્રેટ/છાની યોજના ઘડવી
ordain/ઓર્ડેઇન/દીક્ષા આપવી
ordeal/ઓર્ડેઅલ/અગ્નિ પરીક્ષા
order /
order/ઓર્ડર/હુકમ, આજ્ઞા
orderly/ઓર્ડરલિ/વ્યવસ્થિત, નોકર
ordinal/ઓર્ડિનલ/ક્રમિક
ordinance/ઓર્ડિનાન્સ/વટહુકમ
ordinary /
ordinary/ઓર્ડિનરિ/સામાન્ય
ordination/ઓર્ડિનેશન/દીક્ષા

ordnance/ઓર્ડનાન્સ/શસ્ત્રસરંજામ
ore/ /
ore/ઓર્/ /
organ/ /
organ/ઓર્ગન/અંગ, વાજું
organic/ઓર્ગેનિક/કાર્બનયુક્ત
organisation/ /
organise/ /
organise/ઓર્ગેનાઇઝ/યોજવું
organization/ઓર્ગેનાઇઝેશન/સંસ્થા, સંગઠન
orgies/ઓર્ગીઝ/ઉન્મત-નશાયુક્ત ઉત્સવ
oriental/ઓરિએન્ટલ/પૂર્વનું
orientation/ઓરિએન્ટેશન/ના લક્ષી અભિગમ, સંસ્કરણ
origin(al)/ /
origin/ઓરિજિન/મૂળ, ઉદ્ભવસ્થાન
original/ઓર્જિનલ/અસલી
originality/ઓર્જિનાલિટિ/અસલીયત, ખરાપણું
originate/ઓર્જિનેટ/માં થી ઉદ્ભવવું
orion/ઓર્રિઓન/હરણી નક્ષત્ર, તારા મંડળ
ornament/ /
ornament/ઓર્નામેન્ટ/આભુષણ
ornate/ઓર્નેઇટ/અલંકૃત, શંગારેલું
orotund/ઓર્રોટન્ડ/ભવ્ય
orphan/ઓર્ફન/અનાથ
orthodox/ઓર્થોડોક્સ/રૂઢિચુસ્ત, જુનવાણી,
oscillate/ઓસ્સિલેટ/ઝુલવું
osculate/ઓસ્ક્યુલેઇટ/ચૂંબન કરવું
ostensible/ઓસ્ટિન્સિબલ/તથાકથિત, દેખીતું
ostentatious/ઓસ્ટેન્ટેશ્યઅસ/આડંબરી
ostracise/ઓસ્ટ્રેસાઇઝ/નાત બહાર મૂકવું
ostrich/ /
ostrich/ઓસ્ટ્રિચ/શાહમૃગ
other/ /
other/અધર/બીજુ-જા
otherwise/ /
otherwise/અધરવાઇઝ/
otiose/ઓટિઓઝ/નકામું, બિન જરૂરી
ought to/ /
ought to/ઓટ ટુ/જોઇએ
ouja-board/ઓઉજાબોર્ડ/પ્રેતાત્મા સંપર્ક પુંદું
our(s)/ /
our/અર/અમારું, આપણું
ourselves/ /
oust/આઉસ્ટ/હટાવવું, હકાલપટ્ટી કરવી
oustee/આઉસ્ટી/વિસ્થાપીત
out to/આઉટ ટુ/ વેતરણમાં
out/ /
out/આઉટ/બહાર
outburst/આઉટબર્સ્ટ/ઉભરો
outcome/આઉટકમ/પરિણામ, અસર

outcry/આઉટક્રાય/ભુમરાણ, પોકાર, ગોકીરો
outdoor(s)/ /
outer/ /
outface/આઉટફેઇસ/ડોળા કાઢવાં
out-fit/આઉટફિટ/એકમ, સાધન સરંજામ
outlandish/આઉટલેન્ડિશ/વિચિત્ર-છટાદાર ફેશન
outlast
outlast/આઉટલાસ્ટ/
outlaw/આઉટલો/બહારવટિયો, બહિષ્કૃત
outlay/આઉટલે/ખર્ચ
outlet/આઉટલેટ/નિકાલ
outline/આઉટલાઇન/રૂપરેખા
out-of whack
output/આઉટપુટ/ઉત્પાદન
outrage/આઉટરેઇજ/અત્યાચાર, જુલ્મ
outrageous/આઉટરેજઅસ/અત્યાચારી, જુલ્મી
outré/ઓઉટ્રે/વિચિત્ર, ધૂની
outside/ /
outskirts/આઉટસ્કર્ટ્સ/સીમા, હદ, પાદર, ભાગોળ
outspoken/આઉટસ્પોકન/આખાબોલું
outwit/આઉટવિટ/મહાત કરવું
oval/ઓવલ/અંડાકાર, લંબગોળ
over play/ઓવરપ્લે/ ચગાવવું, વધારવું
over/ /
over/ઓવર/ની બાબતે, પુરું થયેલું
overbear/ઓવરબેઅર/દબાવી દેવું
overcome/ઓવરકમ/કાબુ મેળવવો, પહોંચી વળવું
overcrowded/ઓવરક્રાઉડેડ/ખીચોખીચ, ભરચક
overhaul/ઓવરહોલ/સંપૂર્ણ મરામત-તપાસ
overhear/ઓવરહીઅર/સાંભળવું
overlap/ઓવરલેપ/
overlook/ઓવરલુક/ઉપરથી જોવું
overrule/ઓવરરૂલ/રદ્દ કરવું
overseas/ઓવરસીજ/વિદેશ, પરદેશ
oversee/ઓવરસી/દેખરેખ રાખવી
overstate/ઓવરસ્ટેઇટ/અતિશયોક્તિ કરવી
overt/ઓવર્ટ/પુલ્લો સંકેત
overtake/ /
overtake/ઓવરટેઇક/આગળ નિકળી જવું
overthrow/ઓવરથ્રો/ઉથલાવવું, ઘા કરવો
overture/ઓવર્ચર/ઓપ્યારિક માગણી
overturn/ઓવર્ટન/પલટાવવું, ઉથલાવવું
overwhelm/ઓવરવેલ્મ/ગદગદિત થવું, કચડાવું
overwrought/ઓવરરોટ/અતી બેચેન, ચિંતિત
ovrcome/ઓવરકમ/જીતવું, નિયંત્રણ મેળવવું
owe/ /
owe/ઓ/ના દેવાદાર હોવું, ના ઋણી હોવું
owing to/ /
owl/ /
owl/આઉલ/ધૂવડ

own up-વું
own / /
own/ઓન/માલિકી ધરાવવી
owner(ship) / /
owner/ઓનર/માલિક
ox / /
ox/ઑક્સ/બળદ
oxygen / /
oxygen/ઑક્સિજન/પ્રાણવાયુ
pace / /
pace/પેઇસ/ગતિ, બે ડગલા વચ્ચેનું અંતર
pachyderm/પેકિડર્મ/હાથી, ગેંડો, જાડી ચામડી વાળું
pacifist શાંતિવાદી
pacify શાંત પાડવું
pack
pack away-વું
pack in-વું
pack -વું
pack off-વું
pack out-વું
pack up-વું
pack / /
pack/પ/સામાન બાંધવો, જથ્થો
package / /
package/પેકિજ/પરીકું, પોટલું
packet / /
pact/પેક્ટ/કરાર, સમજૂતી
pad / /
pad/પેડ/ગાદી, ટેકો
paddle/પેડલ/પગથી સંચાલન કરવું
paddy/પેડિ/ધાન ચોખા
paean/પેયન/સ્તુતિ, વિજયગીત
paedophile/પીડોફાઇલ/બાળપ્રેમી(વિકૃતી)
pagan/પેગન/કાફર, મૂર્તિપૂજક
pagans
page / /
page/પેઇજ/પાનું, નોકર
pageant/પેજન્ટ/શાનદાર દેખાવ
paid / /
pail / /
pail/પેઇલ/બાલદી, ડોલ
pain(ful) / /
pain/પેઇન/પીડા, દુઃખ, વેદના
painless
painstakingly/પેઇનસ્ટેકિંગલિ/અતિ પરિશ્રમ કરનારું
paint / /
paint/પેઇન્ટ/ચિત્રકામ, રંગકામ કરવું
pair / /
pair/પેઅર/જોડી
palace / /

palace/પેલિસ/મહેલ
palatable/પેલેટેબલ/રોચક, મનભાવક
palate / /
palate/પેલેટ/સ્વાદ, તાળવું
palatial/પેલેસીઅલ/આલીશાન, ભવ્ય
pale / /
pale/પેઇલ/ફીકું, નિસ્તેજ
palette/પેલેટ/
palindrome/પેલિન્ડ્રોમ/આગળ પાછળ સરખો શબ્દ
pall / /
pall/પોલ/આવરણ, કફન
palliative/પેલિએટિવ/જોર ઘટવું, થાગડ થીગડ
pallid/પેલિડ/ફીકું
palm off/પામ ઑફ/ઘાબડવું, છેતરી દેવું
palm / /
palm/પામ/હથેળી
palpable/પાલ્પેબલ/સ્પષ્ટ
palpitate/પાલ્પિટેઇટ/ઘડકવું
paltry/પોલ્ટ્રી/મામૂલી
pamper/પેમ્પર/પંપાળવું
pan / /
pan/પેન/
panacea/પેનસીઆ/રામબાણ ઈલાજ
panache/પેનશ/છટા, બડાઈનું પ્રદર્શન
panachromatic/પેનક્રોમેટિક/સર્વવર્ણ-રંગી
pandemonium/પેન્ડેમોનિયમ/ધાંધલ, શોરબકોર
pander/પેન્ડર/ભડવાઈ કરવી, ભડવો
Pandora's box/પેન્ડોરાઝ બોક્ષ/તકલીફનું પોટલું
pane / /
pane/પેઇન/
panel/પેનલ/પંચ, તકતી
pangs/પેન્ગ્સ/વેદના, શૂળ
panic/પેનિક/ગભરાટ, ઘ્રાસકો, ભયભીત
pannier/પેનિઅર/ઘોડા-ગથેડા પરના ટોપલાં
panoply/પેનોપ્લાય/પૂર્ણબખ્તર
panorama/પેનોરમા/દૃશ્યાવલી
pant/પેન્ટ/હાંકવું
pant/પેન્ટસ/પાટલુન
pantheon/પેનથીઅન/ દેવતાગણ, સર્વધર્મ-ઉન્નત મંદિર
panther / /
panther/પેનથર/ચિતો
pantry/પેન્ટ્રી/કોઠાર, રસોઈઘર
pants / /
paparazzi/પાપારાઝિ/વિખ્યાત લોકોનો પીછો ફોટોગ્રાફર
paper / /
paper/પેપર/કાગળ, પત્ર
paperback/પેઇપરબેક/કાચાપૂંઠાની ચોપડી
par/પાર/સમકક્ષ, બરાબર
parable/પેરેબલ/બોધકથા, ઉપદેશકથા
parade/પેરેઇડ/કવાયત, દેખાડો

paradigm/પેરડાઈમ/ઉદાહરણ, નમૂનો
paradox/પેરોડોક્સ/વિરોધાભાસ
paradoxical/પેરોડોક્સિકલ/વિરોધાભાસી
paragon/પેરેગોન/શ્રેષ્ઠતાનો નમૂનો
parallel /
parallel/પેરેલલ/સમાંતર
paralyse/પેરેલાઈઝ/પક્ષધાતી-અસ્તવ્યસ્ત થવું
paralytic/પેરેલિટિક/પક્ષધાતનું રોગી
parameter/પેરામિટર/પરિમાણ, પાસાંઓ
paramilitary/પેરામિલિટરિ/ અર્ધલશ્કરી દળ
paramount/પેરેમાઉન્ટ/સર્વોપરી
paramour/પેરેમર/યાર, માસુકા, રખાત
paranoia/પેરેનોઈઆ/ખીડા ઉન્માદ, વિકૃતિ
paranoid/પેરેનોઈડ/ અતિસંવેદનશીલ, વિભ્રમી
paraphernalia/પેરેફર્નેલિઆ/સરસામાન
paraplegic/પેરોપ્લેજિક/
parasite/પેરેસાઈટ/પરાવલંબી, પરોપજીવી
parcel /
parcel/પાર્સલ/પોટલું, દાગીનો, માલ
parch/પાર્ચ/સુકાવું, શેકાવું
pardon /
pardon/પાર્ડન/માફ કરવું, માફી
pare /
pare/પેર/
parent /
parenthesis/પેરેન્થિસિસ/કોંસ
parents/પેરન્ટ્સ/માતા-પિતા
pariah/પેરિઆ/જાતિબહિષ્કૃત, અછૂત
parity//સરખામણી
park /
park/પાર્ક/
parlance/પાર્લન્સ/ભાષા ઢબ
parleys/પાર્લિ/વાટાઘાટ
parliament /
parliament/પાર્લિઆમન્ટ/સંસદ
parliamentary સંસદીય
parlour/પાર્લર/બેઠકરૂમ
parochialism/પ/પ્રાંતવાદ, સંકુચિતપણું
parody/પ/ઠજા-મશ્કરી કાવ્ય
parole /
parole/પ/શરતી મુક્તિ, વચન
paroxysm/પ/આવેશ, ઉભરો
parried/પ/
parrot /
parrot/પ/પોપટ
parry/પ/ટાળવું, રોકવું
parsimonious/પ/કંજૂસ
part & parcel અનિવાર્યઅંગ
part /
part/પાર્ટ/ભાગ

partake/પાર્ટેઈક/માં જોડાવું
partial/પાર્શિઅલ/આંશિક, પક્ષપાતી
partiality/પાર્શિઅલિ/પક્ષપાત
participate /
participate/પ/માં ભાગ લેવો
participle /
particular /
particular/પ/ખાસ, વિશિષ્ટ
partisan/પાર્ટિઝન/પક્ષના કાર્યકરો
partition/પ/ભાગલાં, ટુડા
partly/પાર્ટલિ/આંશિક રીતે
partner /
party /
party/પાર્ટિ/ટુકડી, પક્ષ, મહેફીલ, પક્ષીય
parvenu/પારવન્યૂ/લેભાગુ
pass away ગુજરી જવું, મૃત્યુ પામવું
pass away /
pass away-વું
pass by-વું
pass off /
pass off-વું
pass on-વું
pass out /
pass out-વું
pass over-વું
pass the buck બીજા પર ઢોળી દેવું
pass up-વું
pass /
pass/પ/પસાર કરવું
passage સ્વીકૃતિ, માન્યતા, પસાર
passage /
passage/પ/ફકરો, માર્ગ, મુસાફરી
passe સમયથી પાછળ
passenger /
passion//અતિઉર્મિ
passionate અતિમનોભાવી, કામુક
passive શાંત, નિષ્ક્રિય
passport /
passport/પ/
past /
past /
past/પ/ભૂતકાળ, ભુતપૂર્વ
paste /
paste/પ/પોચું મિશ્રણ, લુગદી
pastiche/પોસ્ટિશ/વિવિધ સંગીત રચના
pastor
pastoral ગોવાળો નું
pastry /
pastry/પ/
pasture/પેસ્ટર/ ઘાસની વીડી, ચરિયાણ

pat/ /
pat/પેટ/પીઠ થાબડવી
patch up-/પેચઅપ/થીગડું મારવું
patch/ /
patch/પેચ/થીગડું, પટ્ટી
patch-up/પેચ/ સમાધાન, થાગડ થીગડ
patent/ /
patent/પેટન્ટ/ સ્વનિર્માણ-ધારણક
paternal/પેટર્નલ/ પિતાનું, પિતાતુલ્ય
path/ /
path/પાથ/રસ્તો, માર્ગ
pathetic/પ/દયાજનક
pathology/પ/રોગશાસ્ત્ર
patience/ /
patient/ /
patient/પ/ધીરજવાન, દર્દી
patriarch/પ/કુટુંબનો વડો
patriarchal/પ/પિતૃપ્રધાન
patriot/પ/દેશભક્ત
patriotic/પ/દેશભક્તિવાળું
patriotism દેશભક્તિ
patron આશ્રયદાતા, પાલનદાર
patronise આશ્રય આપવો
pattern/ /
pattern/પેટર્ન/
patting
paucity અછત, તંગી
pauper/પૌપર/કડકો, દરિદ્ર
pause/ /
pause/પ/થોભવું, અટકવું
pave/ /
pave/પ/માર્ગ બનાવવો, બાંધવું, બનાવવું
paving
paw/ /
paw/પૌ/
pawn/ /
pawn/પૌન/ખ્યાદું
paws/પૌઝ/પ્રાણીનો પંજો
pay back-વું
pay for-
pay off-વું
pay out-વું
pay up-વું
pay/ /
pay/પે/ચૂકવવું
payment/ /
pea/ /
pea/પી/
peace/ /
peace/પીસ/શાંતિ

peaceful
peaceful/ /
peach/ /
peach/પીચ/
peacock/ /
peacock/પીકૉક/
peak/ /
peak/પીક/શિખર, સુકલકડી
pear/ /
pear/પીઅર/
pearl/ /
pearl/પર્લ/મોતી
peasant/પિઝાન્ટ/ખેડુત
peccadillo ક્ષતિ, ત્રુટિ, નજવો ગુનો
peck/ /
peck/પેક/
peculiar/પિક્યુલર/વિચિત્ર
pecuniary નાણાંકીય
pedagogical પાંડિત્યપૂર્ણ
pedagogue પંતુજી, દંભી વિદ્યાન
pedantic વિદ્યતાનો ડોળ કરનાર
pederasty/પ/કુદરત વિરુદ્ધનું કાર્ય
pedestrian/ /
pedestrian/પ/પદયાત્રી, રાહદારી
pedigree/પ/જાત, વંશ, ઓલાદ
peek/ /
peek/પ/છુપાઈને જોવું
peel/ /
peel/પ/છાલ ઉખાડવી
peep/ /
peep/પ/કાણામાંથી જોવું
peer/ /
peer/પ/સમકક્ષ, હરિફ, ઝીણી આંખે જોવું
peeve/પ/ત્રાસ લાગવો
peevish/પ/રિસાળ, મિજાજી
peg/ /
peg/પ/જાળવી રાખવું. ખીલી, એક માપ
peg/પ/જાણવી રાખવું
pelf/પ/સમૃદ્ધિ
pelican/ /
pelican/પ/
pellet//કરચો, છરા
pell-mell આડેધડ, સમજ્યા વગરનું
pelt ફેંકવું, ઘા કરવો
pelted
pen/ /
pen/પેન/કલમ, વાડો
penal/પિનલ/સજાપાત્ર, શિક્ષાત્મક
penalise/પિનલાઈઝ/સજા કરવી
penance/પિનાન્સ/તપ

pence / /
pence/પેન્સ/
pencil / /
pencil/પેન્સિલ/
pending/પેન્ડિંગ/પડતર, નિકાલ થયાવિનાનું
penetrate ઘૂસવું, પ્રવેશવું
pen-friend
peninsula દ્વીપકલ્પ
penitent પ્રાયશ્ચિત કરવું
penny / /
penny/પેનિ/
pension
pent up દબાવેલી, અવ્યક્ત
penumbra/પેન્યુમ્બ્રા/પડછાયો
penurious/પેન્યુરિઅસ/દરિદ્ર, ગરીબ
penury/પેન્યુરિ/દારિદ્ર્ય, દારુણ ગરીબી
peon / /
peon/પ્યુન/પટાવાળો
people / /
people/પિપલ/લોકો
pep talk/પેપટાલ્ક/
pep up/પેપ અપ/જુસ્સો વધારવો
pepper / /
pepper/પેપર/
peptic/પેપ્ટિક/પાચક
per cent / /
per se સ્વયં, આપમેળે
per / /
per/પર/
perceive
perceive/પરસીવ/સમજવું, જોવું
perceived
percent/પર્સન્ટ/ટકા
percept/પરસેપ્ટ/ધારણા, કલ્પના
perceptible/પર્સિપ્ટીબલ/ગ્રાહ્ય
perception/પર્સેપ્શન/ધારણા, ગ્રહણશક્તિ
perceptive/પર્સેપ્ટિવ/ગ્રહણશક્તિવાળું
perch/પ/savari
perched/પ/
percolate/પર્કોલેટ/માંથી ટપકવું, ઝમવું
perdition/પર્ડિશન/વિનાશ, શાશ્વત પીડા, શ્રાપ
peregrination/પ/મુસાફરી, પ્રવાસ
peremptory/પરિ/નિશ્ચયાત્મક
perennial/પરેનિયલ/સનાતન, અનંત
perestroika/પિઅરસ્ટ્રોઈકા/પુનઃરચના(રશિયા)
perfect / /
perfect/પર્ફેક્ટ/સંપૂર્ણ, પારંગત
perfidious/પર્ફિડિઅસ/વિશ્વાસઘાતી, દગાબાજ
perforate/પેરફોરેટ/કાણાં પાડવા
perform / /

perform/પર્ફોર્મ/ભજવવું, કરવું
performance / /
perfunctory/પરફંક્ટરિ/ઉપરછલ્લ, છીછરું
perhaps / /
perhaps/પર્હેપ્સ/કદાચ
peril/પેરિલ/સંકટ, જોખમ
period / /
period/પિરીઅડ/ગાળો, તબ્બકો
periodic/પિરિઓડિક/નિયત સમયે થતું
periodical/પિરિઓડિકલ/સામયિક, નિયતકાલિક
peripatetic/પેરિપટેટિક/ભટકતું
peripheral/પેરિફરલ/ગોણ, પરિઘનું
peripherally/પેરિફરલિ/ગોણ, પરિઘરૂપે
periphery/પેરિફરિ/પરિસર
periscope/પેરિસ્કોપ/સબમરિનનું દૂરબીન
perishable/પેરિશેબલ/નાશવંત, બગડી જાય તેવું
perished/પેરિશડ/નાશ પામ્યું
perjury/પરજરિ/ખોટી જુબાની
perky/પર્કી/અકકડ, મિજાજી
permanent / /
permanent/પર્મેનન્ટ/કાયમી, શાશ્વત
permeate/પરમિએટ/માં ઘૂસવું, ઉતરી જવું
permissible/પરમિસિબલ/છુટપાત્ર
permission / /
permission/પરમિટ/છુટ, રજા
permit / /
permit/પરમિટ/પરવાનો, છુટ-રજા આપવી
permutation/પરમ્યુટેશન/
pernicious/પર્નિશિયસ/દુષ્ટ, ઘૃણાપાત્ર
pernickety/પરનિકેટિ/અતિ ચીકાસવાળું(રીત ભાત)
perntinacious/પર્ન્ટિનેશ્યઅસ/
perpendicular/પર્પેન્ડિક્યુલર/ઊભું, સીધું
perpetrate/પર્પિટ્રેટ/આચરવું
perpetrator/પર્પિટ્રેટર/કામા-કરતૂત કરનાર
perpetual/પર્પેચ્યુઅલ/શાશ્વત, કાયમી
perpetuate/પર્પેચ્યુએટ/શાશ્વત બનાવવું
perplex/પર્પ્લેક્સ/મૂંઝાવુ
perquisite(પીજી)પગાર+ અન્ય લાભ
persecute/પર્સિક્યુટ/ત્રાસ ગુજારવો
persecution/પર્સિક્યુશન/ત્રાસ, જુલમ
persevere/પર્સેવીઅરન્સ/ખંતપૂર્વક મથવું
persiflage/પર્સિફલેજ/મજાક, મશકરી
persist/પર્સિસ્ટ/વળગી રહેવું
persistent/પર્સિસ્ટન્ટ/આગ્રહી
person / /
person/પર્સન/વ્યક્તિ, જણ
persona non grata અનિચ્છનિય માણસ
personal / /
personification/પર્સોનિફિકેશન/સજીવારોપણ અલંકાર
personify/પર્સોનિફાય/

personnel/પર્સનેલ/કર્મચારીઓ
perspective/પર્સપેક્ટિવ/પરિપેક્ષ્ય, યથાર્થ
perspicacious/પર્સ્પિકેશિયસ/સુસ્પષ્ટ, સુગમ કુશાસ્ત્ર
perspire/પરસ્પાયર/પરસેવો થવો
persuade / /
persuade/પરસ્ચુએડ/સમજાવવું
persuasive/પરસ્ચુએઝિવ/સમજાવવાની કુનેહ
pert / /
pert/પર્ટ/ઉદ્ધત, અવિનયી
pertaining/પર્ટેનિંગ/ની બાબતે
perturb/પર્ટબ/અસ્વસ્થ બનાવવું
pervade/પર્વેઈડ/ફેલાવું, છવાવું
perverse/પર્વસ/વિકૃત, વિકારગ્રસ્ત
pervert/પર્વટ/વિકૃત, વિકારી
pessimism/પેસિમિઝમ/નિરાશાવાદ
pessimistic / /
pessimistic/પેસિમિસ્ટિક/નિરાશાવાદી
pest / /
pest/પેસ્ટ/જીવાંત, ઉપદ્રવી
pester/પેસ્ટર/
pestilence/પેસ્ટિલન્સ/શ્રાપ, મહામારી, પ્લેગ
pet / /
pet/પેટ/માનીતું, પાળેલું
petite/પેટિટ/નાજુક, નાનું
petition/પેટિશન/અરજ, અરજી, યાચીકા
petrify/પેટ્રિફાય/ભયભીત, સ્તબ્ધ થવું
petrol / /
petrol/પેટ્રોલ/પેટ્રોલ
pettifogger/પેટિફોગર/અપ્રમાણિક વકીલ
pettish/પેટિશ/ચીડિયું, રિસાળ
petty/પેટિ/પરચૂરણ, નજીવું
petulant/પેટ્યુલન્ટ/ચીડિયું
phase / /
phase/ફેઈઝ/તબ્બકો
phenomenon/ફિનોમેનન/ઘટના જગત, સાક્ષાત વિષય
phial/ફાયલ/માત્રા
philander/પ્રેમના લારા ચાવવાં
philanthropic/ફિલેન્થ્રોપિક/માનવતાપ્રેમી-વાદી
philately/ફિલેટલિ/પોસ્ટ, ટિકિટ સંગ્રહ
philistine/ફિલિસ્ટીન/અસંસ્કારી, જંગલી
Phlegm/ફલેમ/કફ
phlegmatic/ફલેમેટિક/મંદ, ધીમું, જડ
phobia/ફોબિઆ/માનસિક નબળાઈ, ભય
phone / /
phone/ફોન/અવાજ
phonetics/ફોનેટિક્સ/ધ્વનિશાસ્ત્ર, ઉચ્ચારવિજ્ઞાન
photo-finish/ફોટોફિનિશ/કટોકટ
photograph(y-er) / /
photograph/ફોટોગ્રાફ/તસવીર
phrase / /

phrase/ફેઈઝ/શબ્દસમૂહ
phrenetic/ફ્રેન્ટિક/પાગલ, દિવાનો, ઉન્માદી
physical / /
physical/ફિઝિકલ/ભૌતિક, શારીરિક
physiognomy/ફિઝિઓનોમિ/શરીર રચના, બાંધો
physique/ફિઝિક/શરીરનો બાંધો-ઘાટ
piano / /
piano/પીઆનો/
picaresque sahs,prakram ktha
pichheht
pick off-વું
pick on-વું
pick out-વું
pick up / /
pick up-વું
pick / /
pick/પિક/પસંદ કરવું
pictorial/પિક્ટોરીઅલ/સચિત્ર
picture / /
picture/પિક્ચર/ચિત્ર
picturesque/પીકચરસ્ક/આબેહૂબ, દૃશ્યાવલી
pie-bald/પાઈબાલ્ડ/કાબરચીતરું
piece / /
piece/પીસ/ટુકડો, કટકો
piecemeal/પીસમીલ/ચહુતક
pie/પાઈડ/કાબરચિતરું
pier/પાયર/
pierce / /
pierce/પીઅર્સ/ભોંકવું, ભેદવું
pietism/પાઈટિઝમ/ધર્મ નો અતિરેક
pig / /
pig/પિગ/ડુકકર, ભૂંડ
pigmy/પિગ્મિ/ઠિંગુજી, વામન
pike / /
pike/પાઈક/
pile up/પાઈલઅપ/ખડકલો થવો, જમા થવું
pile / /
pile/પાઈલ/ઢગલો, હરસ
piled
pilfer/પિલ્ફર/ચોરવું
pilferage/પિલ્ફરેજ/ચોરી
pilgrim/પિલગ્રિમ/યાત્રાળુ
pilgrimage/પિલગ્રિમેજ/યાત્રા
pill / /
pill/પિલ/ગોળી (દવાની)
pillage/પિલેજ/લૂંટફાટ કરવી, લૂંટનો માલ
pillion/પિલ્થિન/પાછલી સીટ
pillory/પિલોરી/લાકડામાં જડીને ફજેતી કરવી
pilot / /
pilot/પાઈલટ/વિમાનચાલક

pimp/પિમ્પ/ભડવો, વેશ્યાનો દલાલ
pin down-વું
pin hope/પ/
pin point/પ/
pin/ /
pin/પિન/ટાંગણી
pincers/પિન્સર્સ/
pinch/ /
pinch/પિન્ચ/ખૂંચવું, દુખવું, ખટકવું
pine for/પાઈન ફોર/વિલાપ કરવો
pine/ /
pingpong/પિન્ગપોન્ગ/ટેબલ ટેનિસ
pinion/પિનિયન/દાંતા, ગીયર
pink/ /
pink/પિન્ક/ગુલાબી
pinnacle/પિનેકલ/શિખર, ટોચ, ચરમસીમા
pinned down રોકી રાખવું
pint/ /
pint/પાઈન્ટ/એક પ્રમાણ (પ્રવાહી)
pioneer/પાયોનીઅર/પાયો નાખનાર, સ્થાપક
pious/ /
pious/પાયસ/પવિત્ર, ધાર્મિક
pip up બઢતી આપવી
pip/પિપ/ફળના બીજ++
pipe down-વું
pipe dream
pipe/ /
pipe/પાઈપ/નળી, ભૂંગળું
piquant/પિકવન્ટ/ચટાકેદાર
pique/પિક/આકોશ, ક્રોધ
piracy/પાયરસિ/સાહિત્ય કે કલાની ચોરી
pirate/પાયરેટ/ચાંચીયો
pit/ /
pit/પિટ/ખાડો
pitch/પિચ/ડામર, ફેકવું, માત્રા, ટપ્પો ખાવો
pitch++ pit v
pitfall/પિટફોલ/ખામી, ત્રુટિ
pithy સંક્ષિપ્ત, કસદાર
pittance/પિટાન્સ/અલ્પ જથ્થો
pitted ઉતારવું, ગોઠવવું (ચૂંટણી)
pity/ /
pity/પિટિ/દયા
pivotal/પિવોટલ/ધરી રૂપ
placard/પ્લેકાર્ડ/પાટિયું, પતાકડું
placate/પ્લેકેટ/શાંત પાડવું
place/ /
place/પ્લેસ/સ્થળ, મૂકવું, જગ્યા
placebo/પ્લેસિબો/મનોશમન, ઈલાજ (દવા)
placid/પ્લેસિડ/શાંત, પ્રસન્ન
plagiarism/પ્લેજિયારિઝમ/સાહિત્ય-કલાની ચોરી

plague/પ્લેઈગ/મરકી, મહામારી
plaguing રોગગ્રસ્ત
plain/ /
plain/પ્લેઈન/કોરૂં, સાદું
plaintiff/પ્લેઈનટિફ/વાદી, ફરિયાદી
plait/ /
plait/પ્લેટ/ચોટલો
plan/ /
plan/ /
plan/પ્લેન/યોજના
planchette પ્રેતાત્મા સંપર્ક પુંદું
plane/ /
plane/પ્લેઈન/સમતળ, રંદો, વિમાન
planet/ /
planet/પ્લેનેટ/ગ્રહ
planetarium તારાગૃહ
plangent ઊંડો મોટો અવાજ
plank/ /
plank/પ્લેન્ક/પાટિયું
plankton સમુદ્રની જીવાંત-વનસ્પતિ
plant/ /
plant/પ્લાંટ/છોડ, યંત્ર સામગ્રી, બનાવટ કરવી
plaque/પ્લેક/તકતી, ધાતુપત્ર
plastic/ /
plastic/પ્લાસ્ટિક/
plate/ /
plate/પ્લેટ/થાળી
plateau/પ્લેટો/સપાટ પ્રદેશ-મેદાન
platform/ /
platform/પ્લેટફોર્મ/ઓટો,
platitudes/પ્લેટિટ્યુડ/ચવાઈ ગયેલું, તુચ્છ, નીરસ
platonic/પ્લેટોનિક/નિષ્કામ, વાસના રહિત
plaudit/પ્લોઉડિટ/જયજયકાર, વાહવાહ, પ્રશસ્તી
plausible/પ્લોઝિબલ/વ્યાજબી, સ્પષ્ટ
play about/around-વું
play along-વું
play back-વું
play down છૂપાવવું, ઓછું દેખાડવું
play down-વું
play off-વું
play on-વું
play out-વું
play up-વું
play/ /
play/પ્લે/રમત, નાટક, રમવું, મઝાક**bhajvvu**
play-boy/પ્લેબોય/છેલબટાઉ, બિનધારત
plaza/પ્લાઝા/ચોક, સાર્વજનિક સ્થળ
plea/પ્લી/મદદ માટે હાકલ, વિનંતી, બહાનું
plead/ /
plead/પ્લીડ/દલીલ કરવી

pleasant /
pleasant /પ્લેઝન્ટ/મજાનું, આનંદદાયક
pleasantries /પ્લેઝન્ટ્રીઝ/
please /
please /પ્લીઝ/પ્રશ્ન થવું, મહેરબાની કરવી
pleasure /
pleasure /પ્લેઝર/આનંદ, મોજ
plebeian /પ્લેબિઅન/સામાન્ય જનતા-વર્ગ
plebiscite /પ્લેબિસાઈટ/લોકમત
pledge /પ્લેજ/વચન સમર્પણ કરવું, સોગંદ લેવા
plenary /પ્લેનરિ/સંપૂર્ણ હાજરીવાળું
plenipotentiary /પ્લેનીપોટેન્શિઅરિ/સર્વ સત્તાધારી
plenty /
plenty /પ/અસંખ્ય, અગણિત, પુષ્કળ
plethora /પ્લીથોરા/અગણિત, પુષ્કળ
pliable /પ્લાયેબલ/સ્થિતિસ્થાપક
pliant /પ્લાયન્ટ/મૂઠુ, પરગજુ
plight /પ્લાઈટ/વેદના, દુઃખદર્દ
plinth /
plinth /પ્લિંથ/
plod /પ્લોડ/થાકેલા-ભારે પગે ચાલવું
plonk /પ્લોન્ક/ભારથી નીચે પડવું
plot /
plot /પ્લોટ/કાવત્રુ કરવું, ટકડો
plough back-વું
plough /
plough /પ/ખેડવું
ploy /પ્લોય/બહાનું
pluck /
pluck /પ્લક/
plug in-વું
plug up-વું
plug /
plug /પ્લગ/
plum /
plum /પ્લમ/
plumage /પ્લમેજ/પીંછા
plummet
plummet /પ્લમિટ/ખાબકવું, ભૂસકો મારવો
plump for-વું
plump /
plump /પ્લંપ/
plumpy /પ્લંપિ/રૂપ્પુષ્ટ
plunder /પ્લંડર/લૂંટ ચલાવવી
plunge /
plunge /પ્લંજ/ખાબકવું, ભૂસકો મારવો
plural /
plural /પ્લુઅરલ/બહુવચન
pluralistic /પ્લુઅરાલિસ્ટિક/બહુજન
plus /

plus /પ્લસ/
ply /પ્લાય/ફેરાં કરવા
pneumatic /પ્ન્યુમેટિક/
poach /પોચ/ચોરી, શિકાર કરવો
pock /પૉક/ઘા નું નિશાન, ચાહું
pocket vistar
pocket /
pocket /પૉકિટ/ખીસ્સું, વિસ્તાર
podium /પૉડિયમ/મંચ
poem /
poem /પૉઈમ/કાવ્ય
poet /
poetic /પૉઈટિક/કાવ્યાત્મક
poetry /
poetry /પૉઈટ્રી/કવિતા
pogrom /પૉગ્રોમ/માનવસંહાર, હત્યાકાંડ
poignant /પોઈન્ટ/ચટાકેદાર, હૃદયદ્રાવક
point blank તદ્દન નજીકથી, સ્પષ્ટ
point out બતાવવું, દર્શાવવું
point up-વું
point /
point /પૉઈન્ટ/બિંદુ, મુદ્દો
pointed /
poise /પૉઈઝ/ની અણીપર, સમતુલા
poison /
poison /પૉઈઝન/ઝેર, વિષ
poisonous /
poisonous /પૉઈઝનસ/ઝેરી, વિષકારક
poke about/around-વું
poke out-વું
poke /પોક/ભોંકવું
polarity
polarization ધ્રુવીકરણ
polarize ધ્રુવીકરણથવું
pole /
pole /પોલ/ધ્રુવ, થાંભલો
polemic /પોલ/વિવાદ
police /
police /પોલિસ/પોલિસ
policing /પોલિસિંગ/પોલિસ
polish off-વું
polish up-વું
polish /
polish /પૉલિશ/ચમકાવવું
politburo સર્વોચ્ચસમિતિ (સામ્યવાદી)
polite(ness) /
polite /પોલાઈટ/નમ્ર, વિવેકી
politicisation
politicise
politics(al) /

politics/પૉલિટિક્સ/રાજકારણ
poll/ /
poll/પોલ/ચૂંટણી, મતદાન
pollute/પલ્યુટ/પ્રદૂષીત કરવું
pollution/ /
pollution/પલ્યુશન/પ્રદુષણ
poltergeist બદમાશ-શરારતી ભૂત
polyandry/પૉલિએન્ડ્રી/બહુપતિ પ્રથા
polygamy/પૉલિગેમી/બહુપત્નિ પ્રથા
polyglot/પૉલિગ્લૉટ/બહુભાષાવિદ
pomell/પૉન્ડ/તલવારની મૂઠ
pompous/પૉમ્પસ/ભવકાદાર
pond/ /
pond/પૉન્ડ/તળાવ
ponder/પૉન્ડર/ચિંતન-મનોમંથન કરવું
pontificate/પૉન્ટિફિકેટ/અતિસિધ્ધાંત ઢોંગી હોવું
pool/ /
pool/પૂલ/ખાબોચીયું, ચકરડું,
poor/ /
poor/પૂઅર/ગરીબ
pop off-વું
pop/ /
pop/પૉપ/પ્રચલિત ગીત
popinjay/પૉપિન્જે/અભિમાની માણસ
poppadam
populace/પૉપ્યુલસ/જનતા, લોકો
popular/ /
popular/પૉપ્યુલર/લોકપ્રિય
popularity/ /
populated/પૉપ્યુલેટેડ/ગીચવસવાટ
population/ /
population/પૉપ્યુલેશન/વસતી, જનસંખ્યા
populous/પૉપ્યુલસ/ગીચવસ્તીવાળું
pore over-વું
pore/ /
pore/પૉર/ઝીણાં છિદ્ર
pork/ /
pork/પ/ડુકકરનું માંસ
pornographic/પૉર્નોગ્રાફિક/અશ્લીલ-બિભત્સ
pornography/પૉર્નોગ્રાફી/બિભત્સ સાહિત્ય
port/ /
port/પૉર્ટ/બંદર,
portable/પૉર્ટેબલ/સાથે ફેરવી શકાય તેવું
portal/પૉર્ટલ/
portent/પૉટેન્ટ/ભાવિ સૂચક ઘટના
porter/ /
porter/પૉર્ટર/મજૂર, માલ ઉંચકનાર
portion/પૉર્શન/ભાગ, અંશ
portrait/પૉર્ટ્રેટ/વ્યક્તિચિત્ર
portray/પૉર્ટ્રે/વ્યક્તિચિત્ર-આલેખ દોરવો

ports/ /
pose/ /
pose/પોઝ/ ડોળ કરવો, આગળધરવું
posh/પૉશ/ઉચ્ચવર્ગનું, ભવકાદાર
position/ /
position/પોઝીશન/સ્થિતી.
positive/ /
positive/પોઝિટિવ/હકારાત્મક
posse/પોસિ/દળ, ટુકડી, દસ્તો
possess(ion)/ /
possess/પોસેઝ/ધરાવવું, કબ્જામાં હોવું
possibility/ /
possible/ /
possible/પૉસિબલ/શક્ય
possibly/ /
post/ /
post/પૉસ્ટ/પશ્ચાદ, પદ, થાંભલો, ટપાલ
posterior/પૉસ્ટીરિઅર/પાછળનું
posterity/પોસ્ટેરિટિ/ભાવિ પેઢી
postgraduate/પોસ્ટગ્રેજ્યુએટ/અનુસ્નાતક
posthumous/પોસ્ટયુમસ/મરણોત્તર
postmortem/પોસ્ટમોર્ટમ/શબપરીક્ષણ
postpone/પોસ્ટપોન/મુલતવી રાખવું
postulant/પોસ્ટયુલેટ/સાયું, સાબિત કરતું
postulate/પોસ્ટયુલેટ/માગણી કરવી
posture/પોસ્ટ્યર/મુદ્રા, વલણ
pot/ /
pot/પૉટ/ઘડો, માટલું
potable/પૉટેબલ/પીવા લાયક
potato/ /
potato/પૉટેટો/બટેટા
potboiler
potent/પોટેન્ટ/ખૂબજ અસરકારક
potentate/પૉટેન્ટેટ/આપખુદ
potential/ /
potential/પોટેન્શયલ/સંભવિત ક્ષમતા-શક્તિવાળું
pothor/પોધર/ગરબડ
pothole
pothole/પોશન/ઝેર કે દવાનો ઘૂંટડો
pot-pourri/પોપુરી/ખિચડો, સેળભેળ
potter/ /
potter/પોટર/કુંભાર
pouch/ /
pouch/પાઉચ/કોથળી
poultry/પૉલ્ટ્રી/મરઘાં ઉછેર કેન્દ્ર
pounce/પાઉન્સ/તરાપ મારવી
pound/ /
pound/પાઉન્ડ/ખાંડવું, ધરબવું, ઢોર નો ડબ્બો
pounding/પાઉન્ડિંગ/
pour in

pour out-વું

pour/ /

pour/પોર/રિડવું

pout/પાઉટ/ઉલ્ટી કરવી

powder/ /

powder/પાઉડર/ભુકકી,

power/ /

power/પાવર/શક્તિ, સત્તા

power-broker/પાવર બ્રોકર/સત્તાના દલાલ

powerful/ /

practicable/પ્રેક્ટિકેબલ/વ્યવહારુ

practical/ /

practical/પ્રેક્ટિકલ/વ્યવહારુ, પ્રયોગ, પ્રત્યક્ષ

practice/ /

practice/પ્રેક્ટિસ/મહાવરો (નામ) રિવાજ

practise/ /

practise/પ/મહાવરો કરવો (ક્રિયા)

pragmatic/પ્રેગમેટિક/વ્યવહારું

pragmatism/પ્રેગમેટિઝમ/વ્યવહારુપણું

praise/ /

praise/પ્રેઈઝ/વખાણ-વું

praiseworthy/પ્રેઈઝવર્થિ/પ્રશંસનીય

pram/ /

pram/પ્રેમ/બાબાગાડી

prance/પ્રેન્સ/તરાપ મારવી

prank

prattle/પ્રેટલ/બકવાસ કરવો

pray/ /

pray/પ્રે/પ્રાર્થના કરવી, વિનવણી કરવી

prayer/ /

prayer/પ્રેઅર/પ્રાર્થના, યાચના

pre/ /

preach/ /

preach/પ્રીચ/ઉપદેશ આપવો

preacher/પ્રીચર/ઉપદેશક

preamble/પ્રિએમ્બલ/પ્રાસ્તાવિક, આમુખ

precarious/પ્રિકેરિઅસ/જોખમકારક

precautionary/પ્રિકૉશનરિ/અગમચેતી રૂપ

precede/પ્રિસીડ/પહેલાં/અગાઉ થવું-બનવું

precedence/પ્રિસીડન્સ/શિરસ્તો, ચાલ (નામ)

precedent/પ્રિસીડન્ટ/શિરસ્તો, ચાલ (વિષેશણ)

preceding/પ્રિસીડિંગ/આગળનું, પૂર્વ

precept/પ્રિસેપ્ટ/ઉપદેશ

precinct/પ્રિસિંક્ટ/પરિસર, નિકટતા

precious/ /

precious/પ્રેશસ/કિમતી

precipice/પ્રિસિપિસ/ભેખડ, પવર્તનું શિખર

precipitate/પ્રિસિપિટેટ/અવિચારી

precipitous કરાડ જેવું, ઊભું થવું

precise ચોકકસ, નિશ્ચિત

precisely

precision/પ્રિસિઝન/ચોકસાઈ

precocious નાની ઉંમરે પ્રોઢતાવાળું

precursor અગ્રદૂત, છડીદાર

predator પરભક્ષી, લૂંટારો

predecessor પૂર્વગામી, પૂરોગામી

predicament/પ્રિડિકામન્ટ/ધર્મસંકટ

predict/પ્રિડિક્ટ/ભવિષ્ય ભાખવું

pre-emptive પ્રથમ પ્રહાર કરવું

preen/પ્રીન/કપડાં, વાળ ઠીક કરવા

prefer/ /

prefer/પ્રેફર/વધારે પસંદ કરવું

preferential/પ્રેફરન્શિયલ/વિશેષ પસંદગીવાળું

prefix/ /

pregnant/પ/સગર્ભા, અર્થપૂર્ણ

prehensile/પ્રિહેન્સાઈલ/ગ્રહણક્ષમ, ગ્રાહ્ય

prejudice/પ્રેજ્યુડિસ/પૂર્વગ્રહ, પક્ષપાત

prelates

premier/પ/પ્રમુખ, પ્રધાનમંત્રી

premiere/પ/પ્રથમખેલ

premonition/પ/પૂર્વાભાસ

preoccupied પૂર્વચરત, કબજામાં

preordained

preparation/ /

preparatory પ્રારંભિક

prepare/ /

prepare/પ્રિપેઅર/તૈયાર કરવું

preposition/ /

preposterous મૂર્ખામી ભયું

prerequisite પૂર્વશરત

prerogative વિશિષ્ટ-પરમાધિકાર

presage/પ્રિસેજ/સંકેત, પૂર્વભાસ, અંધાણ

prescribe/પ્રિસ્ક્રાઈબ/ઉપાય સૂચવવો

presence/ /

present/ /

present/પ્રેઝન્ટ/હાજર, ભેટ, વર્તમાન, રજુ કરવું

presentiment સંકેત, પૂર્વભાસ, અંધાણ

preserve/ /

preserve/પ્રિઝર્વ/ટકાવી રાખવું

preside(nt)/ /

preside/પ્રિઝાઈડન્સ/પ્રમુખ-અધ્યક્ષ થવું

president/પ્રેઝિડન્ટ/પ્રમુખ

press for/પ્રેસફોર/દબાણ કરવું, માગણી કરવી

press(ure)/ /

press/પ્રેસ/દબાવવું,

pressed on/ /

pressure/પ્રેશર/દબાણ

prestigious/પ્રેસ્ટિજસ/પ્રતિષ્ઠ

presto/પ્રેસ્ટો/ઝટપટ (જાદુગરનો ઉદ્દગાર)

presume/પ્રિઝ્યુમ/ધારવું, છુટ લેવી

presumption/પિઝમ્શન/અહંકાર, ધારણા

presumptuous/પિઝમખ્યુઅસ/અહંકારી, અભિમાની

pretend / /

pretend/પ્રિટેન્ડ/ઢોંગ કરવો, બહાનું બતાવવું

pretentious/પ્રિટેન્શ્યસ/ઢોંગી, આડંબરી

pretext/પ્રિટેક્સ્ટ/બહાનું

pretty / /

pretty/પ્રિટિ/રૂપાળું, ઠીકઠીક

prevail/પ્રિવેઇલન્ટ/વર્ચસ્વ-પ્રભુત્વ હોવું

prevalent/પ્રિવેલન્ટ/પ્રચલિત

prevaricate/પ્રિવરિકેઇટ/ગેરરસ્તે દોરવું

prevent from-/પ્રિવેન્ટ/અટકાવવું, રોકવું

prevent(ion) / /

preventive/પ્રિવેન્ટિવ/અટકાયતી

previous / /

previous/પ્રિવિઅસ/આગલું, પહેલાનું

prey / /

prey/પ્રે/શિકાર, ભોગ

price / /

price/પ્રાઇસ/કિંમત, મુલ્ય

prick / /

prick/પ્રિક/ભોંકવું

prickly/પ્રિક/ખૂંચે તેવું

pride / /

pride/પ્રાઇડ/ગર્વ-લેવો

priest / /

priest/પ્રીસ્ટ/પાદરી, પુરોહિત

prima donna/પ્રાઇમા ડોના/મુખ્ય ગાયીકા

prima facie/પ્રાઇમા ફેસિ/પ્રથમદર્શી

primary / /

primary/પ્રાઇમરિ/પ્રાથમિક, શરૂઆતનું

prime / /

prime/પ્રાઇમ/મુખ્ય

primeval/પ્રાઇમીવલ/આદિકાળનું, આદ્ય, આદિમ

primitive/પ્રિમિટિવ/પ્રાચીન, આદિકાળનું

prince(ss) / /

prince/પ્રિન્સ/રાજકુમાર

princess/પ્રિન્સેસ/રાજકુમારી

principal/પ્રિન્સિપલ/પ્રમુખ, મુખ્ય, મુદલ, આચાર્ય

principle / /

principle/પ્રિન્સિપલ/સિદ્ધાંત, નિયમ

print out-વું

print/પ્રિન્ટ/છાપવું, છાપ, નકલ

printed / /

prison(er) / /

prison/પ્રિઝન/કારાવાસ, જેલ

prissy/પ્રિસિ/વરણાગિયું, ટાપટીપવાળું

pristine/પ્રિસ્ટાઇન/શુદ્ધ, પવિત્ર

private / /

private/પ્રાઇવેટ/ખાનગી, ગુપ્ત

privation/પ્રાઇવેશન/તંગી, અભાવ, હાલાકી

privatize/પ્રાઇવેટાઇઝ/ખાનગીકરણ કરવું

privilege/પ્રિવિલેજ/વિશેષાધિકાર

privy/પ્રિવિ/ગુપ્ત, ખાનગી

prize / /

prize/પ્રાઇઝ/ઇનામ, મુખ્ય

pro rata/પ્રો રેટા/ભાગે પડતું, પ્રમાણાનુસાર

pro tem/પ્રોટેમ/હંગામી

proactive initiative to control the situation

probability / /

probability/પ્રોબેબિલિટિ/સંભવિતા

probable / /

probable/પ્રોબેબલ/સંભવિત

probably / /

probate/પ્રોબટ/મૃત્યુનો દાખલો આપવો

probationary/પ્રોબેશનરિ/અજમાયશી, શિખાઉ

probe / /

probe/પ્રોબ/ઉંડી તપાસ કરવી

probity/પ્રોબિટિ/સચ્ચાઈ, ઈમાનદારી

problem / /

problem/પ્રોબ્લમ/સમસ્યા

procedure/પ્રોસિજર/કાર્યપદ્ધતિ, કાર્યરીતિ

proceed/પ્રોસીડ/આગળ વધવું

proceedings/પ્રોસીડિંગ્સ/કાર્યવાહી

proceeds/પ્રોસીડ્સ/વકરો, એકઠી થયેલી આવક

process(ion) / /

process/પ્રોસેસ/પ્રક્રિયા-કરવી, પદ્ધતિ

proclaim/પ્રોક્લેઇમ/વટહુકમ બહાર પાડવો

proclaiming/પ્રોક્લેઇમિંગ/વટહુકમ કરવું

proclamation/પ્રોક્લેમ્શન/જાહેરનામું

proclivity/પ્રોક્લીવિટિ/લગાવ, વલણ

procrastinate/પ્રોક્રેસ્ટિનેશન/ઢીલ કરવી

procreate/પ્રોક્રિએટ/પ્રજોત્પત્તી કરવી

procure/પ્રોક્યુઅર/પ્રાપ્ત કરવું, મેળવવું

prodigal/પ્રોડિગલ/ઉડાઉ

prodigy/પ્રોડિજી/અસાધારણ બાળક

produce / /

produce/પ્રડ્યુસ/ઉત્પાદન કરવું, નીપજ

product(ion) / /

product/પ્રોડક્ટ/ઉત્પાદન, ફળ

productive/પ્રોડક્ટિવ/ઉત્પાદક

poem/પ્રોઇમ/પ્રસ્તાવના

profane/પ્રોફેઇન/અપવિત્ર, ધર્મનિંદક

profess(ion) / /

profess/પ્રોફેસ/શિખ-ઉપદેશ દેવો

professional/પ્રફેશનલ/ધંધાદારી, વ્યવસાયી

professor / /

proffer/પ્રોફર/આપવું, રજૂ કરવું

proficient / /

proficient/પ્રોફિસીઅન્ટ/નિષ્ણાંત, તજજ્ઞ

profile/પ્રોફાઇલ/રિખાકૃતિ, ચરિત્ર
profit /
profit/પ્રોફિટ/નફા, ફાયદો
profitable/પ્રોફિટેબલ/નફાકારક
profiteering/પ્રોફિટીઅરિંગ/નફાખોરી
profligacy/પ્રોફિટ/દુરાચાર, લંપટતા
profound/પ્રોફાઉન્ડ/ડુંડું, ગહન
progeny/પ્રોજેનિ/સંતતિ, પ્રજા
prognosis/પ્રોગ્નોસિસ/પૂર્વાનુમાન-નિદાન
prognosticate/પ્રોગ્નોસ્ટિકેટ/ભવિષ્યવાણી કરવી
programme / /
programme/પ્રોગ્રેમ/કાર્યક્રમ, સમયબદ્ધ કરવું
progress(ive) / /
progress/પ્રોગ્રેસ/પ્રગતી
progressive/પ્રોગ્રેસિવ/પ્રગતિલક્ષી, આગળ વધતું
prohibit(ed) / /
prohibit/પ્રોહિબિટ/મનાઈ કરવી
projection/પ્રોજેક્શન/
projector / /
projector/પ્રોજેક્ટર/
proletarian/પ્રોલેટરિઅન/સામાન્યવર્ગનું
pro-liberation આઝાદી તરફી
proliferate/પ્રોલિફરેટ/ઝડપથી પ્રસાર થવો
prolific/પ્રોલિફિક/ફલપ્રદ, ઉત્પાદક
prolix/પ્રોલિક્ષ/લાંબુ ભાષણ કે લખાણ
prologue/પ્રોલોગ/પ્રસ્તાવના
prolong/પ્રોલોંગ/લંબાવવું
promiscuity
promiscuous/પ્રામિસ્ક્યુઅસ/અવૈધ
promise / /
promise/પ્રોમિસ/વચન-આપવું
promissory/પ્રોમિસરી/વચનચિહ્ની
promote/પ્રમોટ/આગળ વધારવું
promotional/પ્રમોશનલ/પ્રચારાત્મક
prompt/પ્રોમ્પ્ટ/ત્વરિત, પ્રવૃત કરવું, કહેવા પ્રેરવું
promptly / /
promulgate/પ્રોમ્યુલગેટ/જાહેરાત-વટહુકમ કરવો
promulgation
prone / /
prong/પ્રોન્ગ/કાંટો, દાંતો
pronoun / /
pronounce(ment) / /
pronounce/પ્રોનાઉન્સ/ઉચ્ચારવું
pronunciation / /
pronunciation/પ્રન્નસિએશન/ઉચ્ચારણ, ઉચ્ચાર
proof / /
proof/પ્રૂફ/સાબિતી
prop up
prop up-વું
prop/પ્રોપ/આધાર, ટેકો, અવલંબન

propaganda/પ્રોપાગેન્ડા/પ્રચાર
propagate/પ્રોપેગેટ/પ્રચાર કરવો
propel/પ્રોપેલ/ધકેલવું, હાંકવું
proper / /
proper/પ્રોપર/યોગ્ય, જરૂરી
property / /
property/પ્રોપર્ટિ/મિલકત
prophecy/પ્રોફેસિ/ભવિષ્યવાણી કરવી
prophetic/પ્રોફેટિક/ભવિષ્ય ભાખતું
propinquity/પ્રોપિન્કિવિટિ/સમીપતા, નિકટતા
propitiate/પ્રોપિસિએટ/શમન કરવું
propitious/પ્રાપિશ્યસ/સદ્ભાવવાળું, અનુકૂળ, શુભ
proponent/પ્રોપોનન્ટ/હિમાયતી, પુરસ્કર્તા
proportionate/પ્રોપોર્શનેટ/પ્રમાણસર
proposal / /
proposal/પ્રપોઝલ/દરખાસ્ત, પ્રસ્તાવ
propose / /
propose/પ્રપોઝ/દરખાસ્ત-પ્રસ્તાવ મૂકવો
propound/પ્રોપાઉન્ડ/આગળ ધરવું-રજુ કરવું
propping up
propriety/પ્રોપ્રાઈટિ/યોગ્યતા, વ્યાજબીપણું
proroatagate/પ્રોપાઉન્ડ/સત્ર સમાપ્ત કરવું
prorogue/પ્રરોગ/સત્ર મુલતવી રાખવું
prosaic/પ્રોસેઈક/નીરસ, ચીલાચાલું
proscribe/પ્રોસ્ક્રાઈબ/મનાઈ ફરમાવવી
prose / /
prose/પ્રોઝ/ગદ્યલેખન
prosecute/પ્રોસિક્યુટ/કોર્ટમાં કેસ માંડવો
proselytize/પ્રોસેલિટાઈઝ/તાજું ધર્માતર થયેલું
prospect/પ્રોસ્પેક્ટ/અપેક્ષા, કલ્પના ચિત્ર
prospective/પ્રોસ્પેક્ટિવ/થનાર, ભવિષ્યનું
prospectus/પ્રોસ્પેક્ટસ/માહિતી પુસ્તીકા
prosperity/પ્રોસ્પેરિટિ/સમૃદ્ધિ, ઉત્કર્ષ
prosperous/પ્રોસ્પરસ/સમૃદ્ધ
prostitute/પ્રોસ્ટિટ્યુટ/વેશ્યા
prostitution/પ્રોસ્ટિટ્યુશન/વેશ્યાગીરી
prostrate/પ્રોસ્ટ્રેટ/જમીન પર આડું પડેલું, પરાભુત થયેલું
protagonist/પ્રોસિક્યુટ/મુખ્યપાત્ર, નાયક
protean/પ્રોટીઅન/બહુમુખી, પરિવર્તશીલ
protect(ion) / /
protect/પ્રોટેક્ટ/રક્ષણ કરવું
protective / /
protégé/પ્રોટેજી/રક્ષિત વ્યક્તિ, આશ્રિત
protest / /
protest/પ્રોટેસ્ટ/વિરોધ કરવો
protocol/પ્રોટોકોલ/શિષ્ટાચાર, કરાર, દરખાસ્ત
prototype/પ્રોટોકોલ/નમુનો
protract/પ્રોટ્રેક્ટ/ઢીલમાં નાખવું
protruding/પ્રોટ્રુડિંગ/બહાર આવતું
protuberant/પ્રોટ્યુબરન્ટ/બહાર દેખાતું

proud / /
proud/પ્રાઉડ/અભિમાની, અહંકારી
prove / /
prove/પ્રૂવ/સાબિત કરવું
proven/પ્રૂવન/સાબિત થયેલું
proverbial/પ્રોવર્બીઅલ/નામચીન, કહેવતનું
provide(d) / /
provide/પ્રોવાઈડ/પૂરું પાડવું
provided/પ્રોવાઈડેડ/જો (શરત), પુરું પાડેલ
providence/પ્રોવિડન્સ/ભાગ્ય
providential/પ્રોવિડેન્શિઅલ/દેવયોગિક
provincial/પ્રોવિન્સિઅલ/પ્રાદેશીક, પ્રાંતીય
provision / /
provision/પ્રોવિઝન/પુરવઠો, જોગવાઈ, વ્યવસ્થા
provisional/પ્રોવિઝનલ/કામચલાઉ
proviso/પ્રોવિઝો/
provocative/પ્રોવોકેટિવ/ઉશ્કેરણી જનક
provoke/પ્રોવોક/ઉશ્કેરવું
prow
proWess/પ્રોવેસ/વીરતા, બહાદુરી
prowl / /
prowl/પ્રાઉલ/તરાપ મારવી
proximity/પ્રોક્ષિમિટિ/નિકટતા
proxy/પ્રોક્ષિ/અપરોક્ષ, ના વતી
prude/પ્રુડ/
prudence/પ્રુડન્સ/ડહાપણ
prudent/પ્રુડન્ટ/શાશું, ડહાપણ ભર્યું
pruient
prune/પ્રુન/કાપકૂપ થી સમારવું
prurient/પ્રુરીઅન્ટ/કામાતુર, કામલોલુપ
pry into/પ્રાય ઈન ટુ/માં ડોકિયું કરવું
pseudo/સ્યુડો/નકલી, દંભી, આભાસી
pseudonym/સ્યુડોનિમ/ઉપનામ
psyche/સાયકી/મન, ચિત, માનસિકતા
psychedelic/સાયકીડેલિક/ભ્રમણા પેદા કરતું
psychological/સાયકોલોજિકલ/મનોવેજાનિક
pub / /
pub/પબ/દારૂનું પીઠું
puberty/પ્યુબર્ટિ/કિશોરાવસ્થા
pubic/પ્યુબિક/કિશોરાવસ્થા
public / /
public/પબ્લીક/જનતા, જાહેર
publish / /
publish/પબ્લિશ/પ્રકાશિત કરવું, પ્રસિધ્ધ કરવું
pudgy/પુજી/જાડું, રૂપ્પુષ્ટ
puerile/પ્યુએરાઈલ/બાલિશ, નજીવું
puff/પફ/હાંફવું, કસ, પવન ની લહેર
puffins
pugilist/પયુજલિસ્ટ/ઘંઘાદારી મુક્કાબાજ
pugmark

pugnacious/પગ્નેશિઅસ/કજિયાખોર, માથાભારી
puissance સબળતા, શક્તિ
puke/પ્યુક/ઓકવું
pull away-વું
pull down-વું
pull in-વું
pull off-વું
pull out/પુલ આઉટ/પાછું ખેંચી લેવું
pull out-વું
pull over-વું
pull through / /
pull through-વું
pull together-વું
pull up / /
pull up/પુલ અપ/તતડાવવું
pull / /
pull/પુલ/ખેંચવું
pulp/પલ્પ/માવો, રગડો
pulsate/પલ્સેટ/ઘબકવું
pulse / /
pulse/પલ્સ/નાડ, હૃદયના ઘબકારા, રગ
pulses/પલ્સીજ/કઠોળ
pulverize/પલ્વરાઈઝ/ચૂરો-ભુકો કરવો
pump / /
pump/પમ્પ/હવા ભરવી, ઠાલવવું
pun/પન/શ્લેષ અલંકાર, દ્વિઅર્થી
punch / /
punch/પન્ય/મુકકો મારવો, કાણું પાડવું
punctilious/પન્કટિલિઅસ/અતિશિષ્ટાચાર આગ્રહી
punctual/પન્કચ્યુઅલ/સમયબધ્ધ
punctuate/પન્કચ્યુએટ/કટકે કટકે, વિરામ વિન હો મૂકવા
punctuation/પન્કચ્યુએશન/અલ્પવિરામ વગેરે, અટકવું
puncture/પન્કચર/કાણું
pungent/પન્જન્ટ/ચટાકેદાર, તમતમતું
punish(ment) / /
punish/પનિશ/સજા કરવી
punitive/પ્યુનિટિવ/સજારૂપ, દંડનિય
punk/પંક/બકવાસ, વંઢેલ વેજા
puny/પ્યુનિ/નબળું, નાજુક
pupil / /
pupil/પ્યુપિલ/વિદ્યાર્થી, કીકી
puppet/પપિટ/કઠપૂતળી
purchase / /
purchase/પર્ચેઝ/ખરીદવું
pure / /
pure/પ્યુઅર/શુધ્ધ, ચોખ્ખું
purgation/પરગેશન/વિરોચન, રેચ, જુલાબ
purify/પ્યૂરિફાય/શુધ્ધ કરવું
puritanical/પ્યૂરિટનિકલ/શુધ્ધતાવાદી
purloin/પર્લોઈન/ચોરી કરવી

purple / /
purple/પર્પલ/જામલી
purport/પર્પટ/અર્થ કે તાત્પર્ય કે હોવું
purpose / /
purpose/પર્પઝ/હેતુ, આશય, ઈરાદો
purse / /
purse/પર્સ/પાકિટ, પૈસાની કોથળી
purser/પર્સર/કોઠારી
pursue/પર્સ્યુ/અનુસરવું
pursuing/પર્સ્યુઈંગ/અનુસરવું
pursuit/પર્સ્યુટ/પીછો, અનુસરણ
purveyor
purview/પર્વ્યુ/કાર્યક્ષેત્ર, મર્યાદા
push ahead-વું
push along-વું
push around-વું
push for-વું
push off-વું
push on-વું
push through-વું
push up-વું
push / /
push/પુશ/ધક્કો મારવો
pusillanimous/પુસિલેનિમસ/બીકણ, ડરપોક, નામદ
pustule
put about-વું
put across / /
put across/પુટ અકોસ/ની સામે રજૂ કરવું
put across-વું
put away-વું
put by / /
put down દાબી દેવું, નોંધ કરવી
put down / /
put forward-વું
put in-વું
put off મુલતવી રાખવું, ટાળવું
put off / /
put off-વું
put on to-વું
put on / /
put on/પુટ ઓન/પહેરવું
put out / /
put out/પુટ આઉટ/હોલવી નાખવું
put through-વું
put up with સહન કરવું
put up with / /
put up / /
put up/પુટ અપ/રજૂ કરવું, ઊભું કરવું
put / /
put/પુટ/મુકવું
putrefied/પુટ્રીફાઈડ/સડેલું

putsch/પુચ્ચ/વિદ્રોહ, બળવો
putty/પુટિ/પાલીસ માટેની માટી
puzzle / /
puzzle/પઝલ/કોચડો
pyre/પાયર/ચિતા
Pyrrhic/પિરિક/અતિ કિંમતી
python / /
python/પાયથન/અજગર
quack/ક્વૉક/ઊંટવેદ, બતકનો અવાજ
quaff/ક્વૉફ/ઢીચવું
quagmire/ક્વૉગમાયર/કાદવ, કિચડ
quaint / /
quaint/ક્વૉઈન્ટ/જુનવાણી, વિલક્ષણ, વિચિત્ર
quake/ક્વૉઈક/ધ્રુજારી, કંપન, ઘરતીકંપ
qualify / /
qualify/ક્વૉલિફાય/લાયકાત મેળવવી
quality / /
quality/ક્વૉલિટિ/ગુણવત્તા
qualm/ક્વૉમ/ખટકો, રંજ
quandary/ક્વૉન્ડરી/મૂંઝવણ, દ્વિધા
quantity / /
quantity/ક્વૉન્ટિટિ/જથ્થો, માત્રા
quantum/ક્વૉન્ટમ/પરિમાણ, માત્રા
quarantine/ક્વૉરન્ટિન/જંતુ આશંકા થી જુદું રાખવું
quarrel / /
quarrel/ક્વૉરલ/ઝઘડો કરવો
quarry/ક્વૉરિ/પથ્થર-ખાણ, શિકાર
quarter / /
quarter/ક્વૉર્ટર/ચતુર્થાંશ
quash/ક્વૉશ/રદ્દ કરવું
quasi/ક્વેઝાઈ/અર્ધ, લગભગ
quay/કી/કૃત્રિમ ધક્કો
queasy/ક્વીઝિ/પાપભીરું
queen / /
queen/ક્વીન/રાણી
queer / /
queer/ક્વીઅર/વિચિત્ર
quell/ક્વેલ/શાંત પાડવું, કાબુમાં લેવું
quench/ક્વેન્ચ/છિપાવવું
query/ક્વેરિ/તપાસ
quest/ક્વેસ્ટ/શોધ, ખોજ
question / /
question/ક્વેશ્ચન/પ્રશ્ન-કરવો
questionnaire/ક્વેશ્ચનેર/પ્રશ્નોત્તરી
queue / /
queue/ક્યૂ/કતાર, લાઈન
quibble શબ્દછળ, ઊડાઉ જવાબ
quick / /
quick/ક્વિક/ઝડપી, ફટાફટ
quicken/ક્વિકન/ઝડપી થવું-કરવું

quickie/કવિકી/ઝડપી, ફટાફટ, હુંકુ, ઉતાવળે
quicksand/કવિકસંન્ડ/કળણ, દલદલ
quicksilver/કવિકસિલ્વર/પારો
quick-witted/કવિકવિટેડ/હાજર જવાબી
quid pro quo વળતર, બદલો
quienten down-વું
quiet /
quiet/કવાએટ/શાંત, ચૂપ શાંતી
quietus-end -exit
quill /
quill/કવીલ/પીછું
quilt /
quilt/કવીલ્ટ/રજાઈ, ગોદડું
quintessence/કવિન્ટસન્સ/સારતત્વ, અર્ક
quip/કવિપ/ટોણો મારવો
quirky/કર્વકી/બોલવામાં ચાલાક
quisling/કવિઝલિંગ/દુશ્મન સાથે ભળી જનાર
quit /
quit/કવિટ/છોડવું, ત્યાગ કરવો
quite /
quite/કવાઈટ/તદન
quittance/કવિટન્સ/છૂટકારો
quiver/કવીવર/ભાથો, ઘુજવું
quixotic/કવિક્સોટિક/તરંગી, ધુરિયલ
quiz /
quiz/કવિઝ/પશ્નકરવો, મૂંઝવવું
quorum/કવૉરમ/જરૂરી હાજરી
quota/કવોટા/નિયત હિસ્સો, ભાગ
quotable/કવોટેબલ/ટાંકવા યોગ્ય, અવતરણ
quotation /
quote /
quote/કવોઉટ/ટાંકવું, ઉતારો આપવો
quotes/કવોઉટસ/અવતરણો, સુવાક્યો
rabbit /
rabbit/રેબિટ/સસલું
rabble/રેબલ/ઘડાં, ટોળું
rabid/રેબિડ/હડકાયું, ગાંડું
rabies/રેબીઝ/હડકવા
race /
race/રેઈસ/હરિકાઈ જાત, વંશ, શરત, ઓલાદ
racial/રેસિઅલ/જાતિય, વંશીય, કોમી
racist/રેસિસ્ટ/જાતિવાદી, રંગભેદી
rack /
rack/રેક/જલમ કરવો
racket/રેકિટ/ખડ્ગયંત્ર, કોભાંડ
racketeer/રેકિટીઅર/કોભાંડિયું, ગોલમચાલિયું
rackish/રેકિશ/
radiant/રેડિઅન્ટ/તેજસ્વી, ચમકતું, પ્રકુલિત
radiate/રેડિએઈટ/કિરણો ફેંકવા
radiation/રેડિએશન/વિકિરણ, કિરણોત્સર્ગ

radical/રેડિકલ/આમૂલ, ઉગ્ર-સુધારાવાદી
radio /
radio/રેડિઓ/રેડિયો
radius/રેડિઅસ/ત્રિજ્યા
raffish/રેફિશ/વંદી ગયેલું, બેઆબરૂ
raft/રેફ્ટ/પાણીમાં તરતો તરાપો
rag /
rag/રેગ/ગાભો, પજવવું, મશકરી કરવી
ragamuffin/રેગામફિન/ચીથરેહાલ
rage v
rage /
rage/રેઈજ/કેર વર્તાવવો, ગાંડુતુર
raid /
raid/રેઈડ/હુમલો, દરોડો, ધાડ
rail /
rail/રેઈલ/ગાળો દેવી, ભાંડવું, પાટો
railway /
raiment/રેઈમન્ટ/પોષાક
rain off-વું
rain(y) /
rain/રેઈન/વરસવું, વરસાદ
raise /
raise/રેઈજ/ઉઠાવવું, ઉછેરવું, વધારવું, એકત્ર કરવું
raisonne સુવ્યવસ્થિત
rake /
rake/રેઈક/ઉસેડવું
rally ઠેકડી ઉડાવવી, દોટ મૂકવી, સરઘસ કાઢવું
ram into માં ઘસી જવું, અથડાવું
ram /
ram/રેમ/ઘેટો
ramble/રેમ્બલ/રખડવું, રખડપટ્ટી
ramification/રેમિફિકેશન/જટિલતા, પરિણામ
ramify/રેમિફાય/ શાખાઓ થવી
rammed/રેમ્ડ/ માં ઘસી ગયું, અથડાયું
ramp/રેમ્પ/ઠગાઈ, તરાપો નો માર્ગ
rampage/રેમ્પેઈજ/તોફાને ચડવું
rampant/રેમ્પન્ટ/બેફામ, બેસુમાર
rampart/રેમ્પાર્ટ/આરક્ષિત દિવાલ
ramrod/રેમરોડ/
ramshackle/રેમ્શૉકલ/હાલકડોલક, ખખડી ગયેલું
ran/રેન/દોડ્યા
ranch/રેન્ચ/ઢોરવાડો
rancid/રેન્સિડ/ખોરું
rancour/રેન્કર/હાડવેર, દ્વેષ, ખાર, અંટશ
random/રેન્ડમ/આડેઘડ, અવ્યવસ્થિત, ફાવે તેમ
randy/રેન્ડિ/કામાતૂર
rang/રેન્ગ/વગાડ્યું
range /
range/રેન્જ/મર્યાદા,
rank /

rank/ર/કતાર, વર્ગ, કક્ષા
ransack/રેન્સૅક/લૂંટફાટ-તોડફાડ કરવી
ransom/રેન્સમ/ભાન છોડવા ની રકમ
rant/રેન્ટ/શબ્દાડંબર, ભાષણભાજી
rant/રેન્ટ/આડંબરી ભાષણ
rap/રેપ/ટીકા કરવી, ટકોરો
rapacious/રેપેશિઅસ/ખાઉધરું, લોભી, લૂંટારુ
rape/રેપ/બળાત્કાર
raphers
rapid(ly) /
rapid/રેપિડ/ઝડપી
rappochement/રપ્રોશમાં/સુલેહ, સંધી
rapport/રપોર્ટ/એકરાગ, સમભાવ
rapsallion/રેસ્કલ/હરામખોર, બદમાશ
rapture/રેપચર/ઉન્માદ, અતિ આનંદ
rare /
rare/રેર/વિરલ, અલભ્ય, અદ્ભુત
rarefied/રેરિફાઈડ/પાતળી હવા વાળું
raring/રેરિંગ/ઝંખતું, આતુર
rascal/રાસ્કલ/હરામખોર, બદમાશ
rash /
rash/રેશ/ફોલ્લો, ઉતાવળીયું
rasp/રેસ્પ/છોલવું, ઘસવાનો અવાજ
rat /
rat/રેટ/ઉદર
rate /
rate/રેટ/દર, ભાવ, માત્રા
rather than/રાધર ઘેન/ના કરતાં
rather /
ratification
ratify/રેટિફાઈ/મંજૂર કરવું, બહાલી આપવી
rating/રેટિંગ/માપ, અંકન
ratio/રેશિઓ/પ્રમાણ, માત્રા
rational/રેશન/ખાઘસામગ્રી
rational/રેશનલ/તર્કસંગત, વિચારશીલ
rattle off/રેટલ ઓફ/સડસડાટ બોલી જવું
rattle through-વું
rattle/રેટલ/ખખડાવવું, ઘૂઘરો, ખખડાટ
raunchy/રૉન્ચી/
ravage/રેવેઈજ/પાયમાલ કરવું,
rave/રેઈવ/લવારો કરવો, ફૂંકાવું, જલસો, આલોચના
raven/રેઈવન/શિકાર-લૂંટ કરવી, ઓહિયા કરવું
ravine/રવાઈન/કોતર, ખીણ
raving/રેઈવિંગ/ફૂંકાવું, બકવાસ કરવો
ravish/રેઈવિશ/બળાત્કાર કરવો, મુગ્ધ કરવું
raw deal/રૉ/અન્યાય, દુર્લ્યવહાર
raw /
raw/રૉ/કાચું, અણઘડ,
ray /
ray/રેય/કિરણ

raze /
raze/રેઈઝ/જમીનદોસ્ત, ધ્વંશ કરવો
razze-dazzle/રેઝલ ડેઝલ/ઝાકમઝોળ, ધમાલ
razmatazz/રેઝમૅટ્ઝ/ઝાકમઝોળ, બકવાસ
reach /
reach /
reach/રીચ/પહોંચવું
react(ion) /
react/રિએક્ટ/પ્રત્યાઘાત આપવા
reactionary/રિએક્શનરિ/ઉગ પ્રત્યાઘાતી
read out-વું
read upon-વું
read /
read/રીડ/વાંચવું
ready/રેડી/તૈયાર
reaffirmed
real(ly) /
real/રીઅલ/અસલી, સાચું, મૂળ
realise /
realise/રીઅલાઈઝ/સમજવું, વસુલવું, પ્રાપ્ત કરવું
realistic/રીઅલિસ્ટીક/વાસ્તવિક, યથાર્થ
realms/રીઆલ્મ/પ્રદેશ, વિષય, રાજ્ય
reap /
reap/રીપ/પાક લણવો
re-appraisal/રિ અપ્રાઈઝલ/પુનઃમુલ્યાંકન
rear /
rear/રીઅર/ઉછેરવું, પાછળનું
reason(able) /
reason/રીઝન/દલીલ કરવી, તર્ક, કારણ,
reasonable/રીઝનબલ/વ્યાજબી, માફકસર
reassure/રિઅશ્યોર/હેયાધારણ આપવી
rebel/રેબલ/બળવો કરવો, બંડ પોકારવું
rebellion/રેબેલિઅન/બંડ, બળવો
rebellious/રિબેલિઅસ/બળવાખોર
rebuff/રિબફ/થુત્કારવું, હડધૂત કરવું
rebuke/રેબ્યુક/ઠપકો આપવો
rebut/રિબટ/ખંડન કરવું, રદિયો આપવો
rebuttal/રિબટ/ખંડન, રદિયો
recalcitrant/રિકેલ્સિટ્રાંટ/હઠીલું, જીદ્દી
re-call/રી કૉલ/પાછા બોલાવવું
recall/રિકૉલ/યાદ કરવું,
recapitulate(ીબચે) સંક્ષેપમાં કહેવું
recce/રેકી/**reconnaissance** જાસૂસી નિરીક્ષણ હવાઈ જહાજ
recede/રેસીડ/ઘટાડો થવો, ઓસરવું
receipt /
receipt/રેસીટ/રસીદ, પાવતી, પહોંચ
receive /
receive/રેસીવ/મેળવવું, સ્વીકારવું
recent(ly) /
recent/રેસન્ટ/તાજેતરનું

recently/રિસન્ટલિ/તાજેતરમાં
receptacle/રિસેપ્ટેકલ/દાનપેટી
reception / /
receptive/રિસેપ્ટિવ/ગ્રહણકરતું
recess / /
recess/રિસેસ/વિશ્રામ, મંદી, વિરામ
recession/રિસેશન/મંદી, પીછેહઠ
recidivism/રિસિડિવિઝમ/પાપ કે અપરાધ વૃત્તિ
recipient/રિસિપીઅન્ટ/મેળવનાર, ગ્રહણકરનાર
reciprocal/રિસિપ્રોકલ/પરસ્પર, આપસનું
recital/રિસાટલ/વાદન
recite/રિસાઈટ/કાવ્ય પઠન કરવું
reckless/રેકલેસ/બેદરકાર
reckon with ધ્યાનમાં લેવું
reckon/રેકન/ગણતરી કરવી, ધારવું
reclamation નવપ્રાપ્તિ
recline/રેક્લાઈન/પાછળ નમવું
recognise / /
recognition / /
recognize/રેકગનાઈઝ/ઓળખવું, કદર કરવી, સ્વીકારવું
recoil/રેકોઈલ/ગૂચળું વળવું, પાછું હટવું
recollect/રેકલેક્ટ/યાદ આવવું-કરવું
recommend(ation) / /
recommend/રેકમેન્ડ/ભલામણ-સૂચન કરવું
reconcile/રેકન્સાઈલ/સમાધાન-સમજૂતી કરવી
reconciliation સમાધાન
recondite ગૂઢ, ગહન, ગુપ્ત
reconnaissance(ભીભી)/રેકી/જાસૂસી નિરીક્ષણ હવાઈ જહાજ
reconstruct/રેકન્સ્ટ્રક્શન/પુનઃરચના
record / /
record/રેકોર્ડ/વિક્રમ, નોંધ, પત્રક **nondhvu**
recoup/રેકૂપ/ભરપાઈ કરવું
recourse/રેકોર્સ/ઉપાય
recover(ry) / /
recover/રેકવર/સાજા થવું, શોધી કાઢવું, વસૂલવું
recovery/રેવસુલાત, રોગમુક્તિ, સુધારો
recreant/રેક્રિઅન્ટ/
recrimination/રેક્રિમિનેશન/પ્રત્યારોપ
recrudesence/રે/
recruit/રેક્રૂટ/ભરતી કરવી (નોકરી)
rectangle/રેક્ટેન્ગલ/લંબચોરસ
rectify/રેક્ટિફાય/સુધારવું, શુદ્ધ કરવું
rectitude/રેક્ટિટ્યુડ/સચ્ચાઈ
rector/રેક્ટર/ગૃહપતિ
recuperate/રેક્યુપરેટ/સાજા થવું
recur/રેકર/વારંવાર બનવું
recurrence/રેકરન્સ/વારંવાર ની ઘટના
red / /
red/રેડ/લાલ
redact/રેડક્ટ/

red-alert/રેડઅલર્ટ/અતિ સર્તકતા, સાવધાની
reddish/રેડિશ/લાલાશ પડતું
redeem/રેડીમ/પરિપૂર્ણ કરવું, અદા કરવું
redemption/રેડેમ્પ્શન/ઉધાર, મુક્તિ, અદાપગી
red-handed/રેડહૅન્ડેડ/રંગેહાથ, સબૂત સાથે
redolent/રેડોલન્ટ/તીવ્રવાસ-ગંધવાળું
redound/રેડાઉન્ડ/
redress/રેડ્રેસ/વળતર ચુકવવું, નિવારણ કરવું
redressal/રેડ્રેસલ/નિવારણ
red-tapism/રેડટૅપિઝમ/તુમારશાહી
reduce / /
reduce/રેડ્યુસ/ઘટાડવું, ઓછું કરવું
reduction / /
redundant/રેડંડન્ટ/ફાજલ, બિનજરૂરી, નકામું
reef / /
reef/રીફ/
reek/રીક/ગંધાવું
reeling/રીલિંગ/
re-entry
refer(ence) / /
refer/રેફર/ઉલ્લેખકરવો, સંદર્ભ આપવો
referee/રેફરી/નિર્ણાયક, મધ્યસ્થ
referendum/રેફરન્ડમ/લોકમત
refine/રેફાઈન/શુદ્ધ કરવું
reflect/રેફલેક્ટ/વિચાર કરવો, પ્રતિબિંબ પાડવું
reflex
reflexive
reform/રેફોર્મ/સુધારા કરવો, ઘડવું (કાયદો)
ref- raff
refrain/રેફ્રેઈન/દૂર રહેવું
refresh(ment) / /
refresh/રેફ્રેશ/તાજું કરવું
refrigerator / /
refrigerator/રેફ્રિજરેટર/
refuel/રેફ્યુલ/ભળતણ ભરવું
refuge/રેફ્યુજ/આશ્રય, શરણ
refugee/રેફ્યુજી/નિરાશ્રિત
refund/રેફન્ડ/પાછું વાળવું
refurbish/રેફર્બિશ/પુનઃસજાવવું, ચમકાવવું
refusal / /
refuse / /
refuse/રેફ્યુઝ/ના પાડવી
refute/રેફ્યુટ/ખંડન કરવું
regain/રેગેઈન/પુનઃપ્રાપ્ત કરવું
regale/રેગેઈલ/
regard(s) / /
regard/રેગાર્ડ/ગણવું, માનવું, બાબત
regardless/રેગાર્ડલેસ/બેફિકર, ના વિના
regards/રેગાર્ડ્ઝ/
regatta/રેગાટા/નૌકાસ્પર્ધા

regime/રિજીમ/રાજ્યશાસન
regimen/રિજીમન/
regiment/રિજીમન્ટ/પલ્ટન, દળ
region/રિજીઅન/પ્રદેશ
regional/રિજીઅનલ/પ્રાદેશીક
regress/રિગ્રેસ/પીછેહઠ, પારોઠ ના પગલાં
regret/રિગ્રેટ/દિલગીરી, અફસોસ
regrettable/રિગ્રેટેબલ/અફસોસજનક
regular//
regular/રિગ્યલર/નિયમિત
regularize/રિગ્યુલરાઈઝ/નિયમિત કરવું
regulate/રિગ્યુલેઈટ/નિયંત્રિત કરવું
regulation//
rehabilitation/રિહૅબિલિટેશન/પુનઃવસવાટ
rehearsal/રિહૅર્સલ/પૂર્વાભ્યાસ
rehotric/રિટરિક/ભાષણબાજી, આડંબરી પ્રવચન
reign//
reign/રિઈન/શાસન, ની ઉપર કાબુ હોવો
reimburse/રિમ્બર્સ/ચુકવવું
rein in/રિઈન્સ/લગામ, કાબુ
rein//
reinforce/રીઈનફોર્સ/વધારે મજબૂત બનાવવું
reinforcements/રિઈન્ફોર્સ/વધુ-મદદ-મજબૂતી
reins/રિઈન્સ/લગામ, કાબુ, શાસન
reinstale/રિઈન્સ્ટેઈટ/ફરીથી સ્થાપવું-નિમવું
reiterated/રિઈટીરેઈટ/ભાર મૂક્યો
reiteration
reject//
reject/રિજેક્ટ/નકારવું, ફેંકી દેવું
rejoice/રિજોઈસ/મોજ કરવી
rejoin/રિજોઈન/પ્રત્યુત્તર વાળવો
rejuvenate/રિજુવિનેઈટ/ફરી યુવાન/ચેતનવંતુ કરવું
relapse/રિલેપ્સ/ઉથલો (રોગનો)
relate//
relate/રિલેટ/વર્ણવવું, લાગુ પડવું
relation(ship)//
relation/રિલેઈશન/સબંધ, સગું
relative//
relative/રિલેટિવ/સાપેક્ષ, સગું
relax//
relax/રિલેક્ષ/હળવું કરવું- થવું
relaxation/રિલેક્ષેશન/છુટછાટ, આરામ
release/રિલીઝ/છુટકારો, છુટું-મુક્ત કરવું
relegate લોપ કરવો, દેશવટો આપવો
relentless/રિલેન્ટલેસ/કઠોર, નિર્દય
relevance/રિલવન્સ/સબંધ
relevant/રિલવન્ટ/સબંધીત
reliable/રિલાયેબલ/ભરોસાપાત્ર, આધારભૂત
reliance/રિલાયન્સ/ભરોસો, આધાર
relics/રિલિક/

relief//
relief/રિલીફ/રાહત, છુટકારો
relieve/રિલીવ/થી છુટકારો મેળવવો
religion//
religion/રિલીજીઅન/ધર્મ
religious//
religious/રિલીજસ/ધાર્મિક
relinquish/રિલિન્કિશ/ત્યજવું
relish/રિલિશ/સ્વાદ માણવો
reluctance/રિલકટન્સ/નાખુશી, અનિચ્છુકતા
reluctant/રિલકટન્ટ/નાખુશ, અનિચ્છુક
rely//
rely/રિલાય/ની પર આધાર રાખવો
remain//
remain/રિમેઈન/બાકી રહેવું
remains/રિમેઈન્સ/રહ્યું સહ્યું, અવશેષો, અસ્થિ
remand/રિમાન્ડ/પોલીસને સોંપવું
remark(able)//
remark/રિમાર્ક/નોંધ, ટીકા, અવલોકન કરવું
remedial/રિમેડિઅલ/ઉપચારાત્મક
remedy/રિમેડિ/ઉપચાર
remember(ance)//
remember/રિમેમ્બર/યાદ કરવું-રાખવું
remind(of)/રિમાઈન્ડ/યાદ અપાવવું
remind//
reminiscences/રિમિનિસન્સિઝ/સંસ્મરણો
reminiscent/રિમિનિસન્ટ/સૂચક
remis/રિમીસ/બેપરવા
remission/રિમીશન/માફી, ઘટાડો
remit/રિમીટ/ઘટાડવું, મોકલવું
remonstrate/રિમોન્સ્ટ્રેટ/તકરાર કરવી
remorse/રિમોર્સ/પ્રશ્ચાતાપ
remote/રિમોટ/દૂરનું
remove//
remove/રિમૂવ/હટાવવું, દૂર કરવું
remunerate/રિમ્યુનરેટ/ વળતર આપવું
remuneration/રિમ્યુનરેશન/પગાર, મહેનતાણું
renaissance/રિનેસાં/પુનરુત્થાન
renal/રિનલ/મૂત્રપિંડનું
rend/રિન્ડ/ચીરવું, ફાડવું
render/રિન્ડર/બનાવી દેવું, રજૂ કરવું, ભાષાંતર કરવું
rendezvous/રોન્ડિવૂ/મિલન
rendition/રિન્ડિશન/અર્થઘટન
renegade/રિનિગેડ/ફાંટાબાજ, લફંગો, રખડું
renew/રિન્યુ/પુનઃસ્થાપના કરવી
renounce/રિનાઉન્સ/નકારવું, ત્યાગવું
renovate/રિનોવેટ/ફરીથી નવું બનાવવું
renowned/રિનાઉન્ડ/વિખ્યાત, પ્રતિષ્ઠિત
rent//
rent/રિન્ટ/ભાડું

repair / /
repair/રિપેર/સમું કરવું, વળતર
repatee/રિપાટી/હાજર જવાબ, સામું મેણું
repast/રિપાસ્ટ/ઉજવણી
repatriate/રિપાટ્રિએટ/સ્વદેશ પાછું મોકલી દેવું
repeal/રિપીલ/પાછું ખેંચવું, રદ કરવું
repeat / /
repeat/રિપીટ/પુનરાવર્તન કરવું
repel/રિપેલ/મારી હઠાવવું, અણગમો થવો
repellent/રિપેલન્ટ/અણગમો-સુગ પેદા કરતું
repent/રિપેન્ટ/પ્રશ્ચાતાપ કરવો
repercussion/રિપર્કશન/પ્રત્યાઘાત
repertoire/રિપટવાં/નાટ્ય સંગીત
replace / /
replace/રિપ્લેસ/બદલાવવું
replenish/રિપ્લેનિશ/પુનઃ ભરવું
replete/રિપ્લીટ/ભરપૂર
replica/રિપ્લીકા/ચિન્હ, પ્રતિકૃતી
reply / /
reply/રિપ્લાય/જવાબ આપવો
report / /
report/રિપોર્ટ/અહેવાલ
repose/રિપોઝ/વિશ્વાસ રાખવો
reprehend/રિપ્રીહેન્ડ/ઠપકો આપવો
reprehensible/રિપ્રીહેન્સિબલ/ઠપકાપાત્ર
represent(ative) / /
represent/રિપ્રીઝેન્ટ/પ્રતિનિધિત્વ કરવું
representation/રિપ્રીઝેન્ટેશન/રજૂઆત-પ્રતિનિધિત્વ
representative/રિપ્રઝન્ટેટિવ/પ્રતિનિધિ
repression/રિપ્રેશન/દબામણી, જુલમ, યાતના
reprieve/રિપ્રીવ/મૃત્યુ-દંડ માં થી છુટકારો
reprimand / /
reprimand/રિપ્રીમાન્ડ/ઠપકો આપવો
reprisal/રિપ્રાઇઝલ/વેર વાળવું
reproachment/રિપ્રોચમન્ટ/ઠપકો
reproductive/રિપ્રોડક્ટિવ/પ્રજનનનું
reprove/રિપ્રૂવ/ઠપકો આપવો
republic/રિપબ્લીક/પ્રજાસત્તાક રાજ્ય
repudiate/રિપ્યુડિએટ/ઈન્કાર કરવો, રદ કરવું
repudiation/રિપ્યુડિએશન/ઈન્કાર
repugnant/રિપગનન્ટ/અણગમતું, ચિતરી ચડે તેવું
repulse/રિપ્લઝ/મારી હઠાવવું
repulsive/રિપ્લઝીવ/ચિતરી-સૂગ ચડે તેવું
reputation/રિપ્યુટેશન/ પ્રખ્યાતી, પ્રતિષ્ઠા
reputed/રિપ્યુટેડ/પ્રખ્યાત
request / /
request/રિક્વેસ્ટ/વિનંતી-કરવી
require(ment) / /
require/રિક્વાયર/જરૂર હોવી
requisite/રિક્વીઝિટ/જરૂરી, અપેક્ષિત

rescind/રિસીન્ડ/રદ કરવું
rescue/રિસ્ક્યુ/બચાવ, બચાવી લેવું
resemble/રિઝેમ્બલ/સામ્ય હોવું, મળતા આવવું
resent(ful) / /
resent/રિસેન્ટ/કડવાસ-નારાજગી કે રંજ હોવો
reservation / /
reserve/રિઝર્વ/આરક્ષિત કરવું
reservoir/રિઝર્વોર/જળાશય, જલસંગ્રહ
reshuffle/રિશફલ/પુનઃરચના, ફેરબદલ
reside/રિઝાઇડ/રહેવું, વસવાટ કરવો
residence / /
residence/રિઝિડન્સ/નિવાસ, રહેઠાણ
residential/રિઝિડેન્શિયલ/રહેઠાણને લગતું
residual/રિઝિડ્યુઅલ/બાકી રહેતું, વધું ઘટ્યું
residue/રિઝિડ્યુઅલ/અવશેષ
resign / /
resign/રિઝાઇન/રાજીનામું આપવું
resilient/રિઝીલીન્ટ/ સ્વસ્થ
resilience/રિઝીલીઅન્સ/સ્વસ્થ પ્રતિક્રિયા
resist/રિઝિસ્ટ/પ્રતિકાર કરવો
resistance/રિઝિસ્ટન્સ/પ્રતિકાર, સામનો
resolve/રિઝોલ્વ/નિર્ણય, ઉકેલ આણવો
resonance
resonance/રિઝોનન્સ/
resonant/રિઝોનન્ટ/પડવા પાડતું
resort / /
resort/રિઝોર્ટ/આશરો, સ્થળ, ઉપાય, સાધન
resounding પડવા પાડતું
resource/રિસોર્સ/શંસાધન, સ્ત્રોત
resourceful/રિસોર્સફુલ/કોઠાસૂઝ-હેયાઉકલત વાળું
resources/રિસોર્સીઝ/સાધન-સંપત્તિ, સ્ત્રોતો
respect(ful) / /
respect/રિસ્પેક્ટ/માન આપવું, બાબત, અદબ
respective/રિસ્પેક્ટિવ/સંબંધિત, જે તે વ્યક્તિ
respite/રિસ્પાઇટ/રાહત, વિસામો
resplendent/રિસ્પ્લેન્ડન્ટ/ચમકતું
respond/રિસ્પોન્ડ/જવાબ-પ્રતિભાવ આપવો
respondent/રિસ્પોન્ડન્ટ/પ્રતિવાદી
responsible / /
responsible/રિસ્પોન્સિબલ/જવાબદાર
responsive/રિસ્પોન્સિવ/પ્રતિભાવ આપનારું
rest up-વું
rest / /
rest/રિસ્ટ/આરામ, બાકીનું
restaurant / /
restaurant/રિસ્ટોરાં/
restive/રિસ્ટિવ/અસ્થિર, રઘવાયું
restiveness
restoration/રિસ્ટોરેશન/પુનઃસ્થાપના
restore/રિસ્ટોર/પૂર્વવત કરવું, સ્થાપવું

restrain/રિસ્ટ્રેઈન/સંયમ-કાબુ રાખવો
restraint/રિસ્ટ્રેઈન્ટ/સંયમ-કાબુ, દાબ, નિયંત્રણ, લગામ
restrict / /
restrict/રિસ્ટ્રીક્ટ/મર્યાદિત-સીમીત રાખવું-કરવું
result / /
result/રિઝલ્ટ/પરિણામ
résumé/રેઝ્યુમે/સંક્ષેપ, સાર
resume/રિઝ્યુમ/શરૂ કરવું
resurgence/રિસર્જન્ટ/ફરી થી ઊભું થવું
resurgent/રિસર્જન્ટ/
resurrection/રિસરેક્શન/પુનરુત્થાન
retailer/રિટેઈલર/છુટક વેચનાર
retain/રિટેઈન/કામ માટે રોકવું, જાળવી રાખવું
retaliate/રિટાલીએઈટ/વળતો ધા મારવો
retaliation/રિટાલીએશન/વળતો ધા, પ્રત્યાઘાત
retard/રિટાર્ડ/નબળું-મંદપાડવું
retardation/રિટાર્ડેશન/મંદતા, સુસ્તી
retarded/રિટાર્ડેશન/મંદ, નબળું
retention/રિટેન્શન/પ્રતિધારણ
reticent/રિટિસન્ટ/મીઠો, ચૂપ, મૌન
retinue/રિટિન્યુ/નોકર-ચાકર, રસાલો
retire / /
retire/રિટાયર/નિવૃત્ત થવું
retort/રિટોર્ટ/મહેણું, ટોણો
retraction
retreat/રિટ્રીટ/પીછેહઠ, વિશ્રામ, આરામ
retrench/રિટ્રેન્ચ/કાપ મૂકવો, છટણી કરવી
retrenchment/રિટ્રેન્ચમેન્ટ/છટણી, કાપ
retribution/રિટ્રિબ્યુશન/યોગ્ય, બદલો, સજા
retrieve/રિટ્રીવ/ફરી થી મેળવવું
retrospect/રિટ્રોસ્પેક્ટ/પ્રશ્નાદ
retrospective
retrospective/રિટ્રોસ્પેક્ટિવ/પશ્ચાદભુમિકાનું
return / /
return/રિટર્ન/પરત થવું -કરવું
revamp/રિવેમ્પ/પુનઃરચના, આમૂલ ફેરફાર
reveal/રિવીલ/બહાર પાડવું, પોલ ખોલવી
veille/રણશીંગું, બ્યગલ
revelation/રિવીલેશન/ખુલ્લું, જાહેરાત
reveller/રેવલર/મોજમાણનાર
revenge/રિવેન્જ/બદલો લેવો
revenue/રેવન્યુ/સરકારી આવક
reverberate/રેવરબ્રેટ/પડઘાં-પ્રત્યાઘાત પડવાં
revere/રિવીયર/માન આપવું
reverend/રેવરન્ડ/આદરણીય
reverent/રેવરન્ટ/આદરયુક્ત
reverie/રેવરી/દિવા સ્વપ્ન
reverse/રેવર્સ/ઊંઘી દિશામાં, પીછેહઠ
review / /
review/રિવ્યુ/અવલોકન

revise/રિવાઈઝ/ફરીથી કરવું
revitalise/રિવાટલાઈઝ/ફરીથી ચેતનવંતુ કરવું
revival/રિવાઈવલ/પુનઃ જીવન
revive/રિવાઈવ/પુનઃ જીવિત કરવું
revoke/રિવોક/પાછું ખેંચવું
revolt/રિવોલ્ટ/બળવો-કરવો
revolutionary/રિવોલ્યુશનરિ/ક્રાંતિવાદી
revolve/રિવોલ્વ/ગોળ ફરવું
reward / /
reward/રિવોર્ડ/બદલો, શિરપાવ
rhetoric/રિટરિક/વક્તૃત્વ, વાકછટા
rhino/રાયનો/ગેંડો
rhyme / /
rhyme/રાઈમ/પ્રાસ
rhythm/રિધમ/તાલ, લય
rib / /
rib/રિબ/પાંસળી
rice / /
rice/રાઈસ/ચોખા
rich(ness) / /
rich/ર/સમૃદ્ધ, ધનવાન
riches/રિચીઝ/સંપત્તિ
ricochet/રિકશે/અથડાવું
rid(den) / /
rid/રિડ/છુટકારો, મુક્તિ
ridance/રિડાન્સ/થી છુટકારો, રાહત
ridden/રિડન/થી ગ્રસ્ત
riddle/રિડલ/રહસ્ય, કોયડો
riddled/રિડલ્ડ/ચાળણી, કાણા વાળું, મૂંઝાયેલું
ride out / /
ride / /
ride/રાઈડ/સવારી, આરોહણ કરવું
ridge / /
ridge/રિજ/પર્વતની ધાર
ridicule/રિડીક્યુલ/હાંસી ઉડાવવી
ridiculous/રિડીક્યુલસ/હાસ્યાસ્પદ
rife/રાઈફ/જોર હોવું, ભરમાર હોવી
riffle/રિફલ/ઝડપથી પાનાં ઉથલાવવા
riff-raff/રિફરૉફ/હલકા-લેભાગુ માણસો
rift/રિફ્ટ/તડાંતડ, તીરાડ, તડાં
rigging/રિગિંગ/ઘાલમેલ, ચેડાં
right(eous) / /
right/રાઈટ/સાચું, જમણું, હકક
righteous/રાઈટિઅસ/સદ્ગુણી
rigid/રિજિડ/સખત, અકકડ
rigmarole/રિગ્મરોલ/લવારો, બકવાસ
rigorous/રિગરસ/સખત
rile/રાઈલ/
rim/રિમ/ધાર, કોર
ring back / /

ring back -વું	robot / /
ring in -વું	robot /રોબોટ/યંત્રમાનવ
ring off / /	robust /રોબસ્ટ/ખડતલ
ring off -વું	rock / /
ring out -વું	rock /રૉક/ખડક, હથમચાવવું
ring up / /	rocky /રૉકિ/ખડકાળ
ring up -વું	rococo /રૉકો/અતિશણગાર થી કઢંગુ
ring / /	rod / /
ring /રિંગ/	rod /રૉડ/સળિયો
rinse /રીન્સ/પાણી નીતારી નાખવું	rode / /
riot / /	rode /રોડ/સવારી કરી (ride ભૂ.કા.)
riot /રાયટ/હુલ્લડ	rodomontade /રૉડોમોન્ટેડ/બડાઈખોર
rip off -વું	roger /રોજર/તમારો સંદેશો મળ્યો (વાયરલેસ)
rip / /	rogue / /
rip /રિપ/ચીરવું, વંઠેલ	rogue /રોગ/બદમાશ, હરામખોર
ripe / /	roguish /રૉગીશ/લુચ્ચું
ripe /રાઈપ/પાકેલું	role / /
ripen /રાઈપન/પાકવું (ફળ)	role /રોલ/પાત્ર,
riposte /રિપોસ્ટ/સામો-વળતો ઘા(કટાક્ષ)	roll / /
ripple /રિપલ/લહેર, મોજું	roll /રોલ/કમ, વિંટવું, વિંટો, ગોથું ખાવું
rise / /	romantic / /
rise /રાઈઝ/ઉદ્ભવવો, ચઢવું, ચડતી	romantic /રોમેન્ટિક/શુંગારરસ-પ્રેમાઆલાપમય
risible /રિઝબલ/હાસ્યાસ્પદ	romp
risk / /	romp /રોમ્પ/કુદાકુદ કરવું, ધમાચકડી મચાવવી
risk /રિસ્ક/જોખમ, હોડ	roof / /
risky /રિસ્કી/જોખમી	roof /રૉફ/છાપરું
risqué /રિસ્ક/અશ્લીલ	room(y) / /
rite / /	room /રૂમ/ઓરડો, જગ્યા, અવકાશ
rites /રાઈટ/ધાર્મિક વિધિ	roomy /રૂમી/વિશાળ
rituals /રિચ્યુઅલ્સ/ક્રિયાકાંડ, ઔપચારિકતા	root for -વું
ritzy /રિટ્ઝી/રજવાડી, વિલાસી	root out /રૂટ/નાબૂદ કરવું
rival / /	root / /
rival /રાઈવલ/હરીફ	root /રૂટ/માર્ગ, રસ્તો
rivalry /રાઈવલરી/હરીફાઈ	rope in /રોપ ઈન/મેળવવું, એકઠું કરવું
river / /	rope / /
river /રિવર/નદી	rope /રોપ/દોરડું
road / /	rosary /રોઝરિ/માળા
road /રોડ/રસ્તો, માર્ગ	rose / /
roam / /	rose /રોઝ/ગુલાબ
roam /રોમ/રખડવું	rosy /રૉઝી/ગુલાબી
roan /રોન/કાબરચીતરું	rot / /
roar / /	rot /રોટ/ગોખવું
roar /રોર/ગર્જના કરવી	rote /રોટ/ગોખણપટી
roast / /	rotten /રોટન/સડેલું
roast /રોસ્ટ/શેકવું, ભૂંજવું	rotter /રોટર/બ્રષ્ટ-નાલાયક, ગોળ ફરતું ચક
rob / /	rotting /રોટિંગ/સડતું
rob /રોબ/લુંટવું	rough out -વું
robber(y) / /	rough up /રફ/હુમલો કરવો, ફટકારવું
robber /રોબર/લુંટારો	rough / /
robbery /રોબરિ/લુંટ	rough /રફ/ખરબચડું, તોછડું

roughshod
round down-વું
round off-વું
round on-વું
round up/રાઉન્ડ અપ/ધરપકડ કરવી
round/ /
round/રાઉન્ડ/ગોળ
rouse/ /
rouse/રાઉઝ/જગાડવું, ઉશ્કેરવું
roust/ /
rout/ /
rout/રાઉટ/સફાયો-સજ્જડ હાર આપવી
route/ /
route/રૂટ/માર્ગ, દિશા
routine/રૂટ/ઘરેડ, રાબેતા મુજબનું, સામાન્ય
roving/રોવિંગ/રખડતું
row/ /
row/રોઉ/વિવાદ, હાર, કતાર
rowdy/રાઉડી/ધમાલિયું, ઘોંઘાટિયું
royal/ /
royal/રોયલ/રજવાડી, શાહી
rub down-વું
rub in-વું
rub off-વું
rub/ /
rub/રબ/ચોળવું
rub-a-dub/રબ-એ-ડબ/ઢોલક-તબલાં નો અવાજ
rubato/રબાટો/છુટછાટ
rubber/ /
rubber/રબર/
rubbish/રબિશ/કચરો, બકવાસ
rubble/રબ્લ/ભંગાર, કાટમાળ, રગડો
Rubicon/રૂબીકોન/પીછે ન હટી શકાય તેવું વચન
rubric/રૂબરિક/ધાર્મિક રીત-રસમ
ruction/રક્શન/દંગલ, તકરાર
rude/ /
rude/રયુડ/તોછડું, અવિવેકી
rudimentary/રુડિમેન્ટરિ/પાયાનું, પ્રાથમિક
rueful/રયુફુલ/અફસોસ કરતું
ruff/રફ/હુકમનું પત્તું ઉતરવું
ruffian/રફીઅન/બદમાશ, ટપોરી, મવાલી
rug/ /
rug/રગ/ગાલીચો
rugged/રગિડ/સખત, નક્કર
ruin/ /
ruin/રુઈન/વિનાશ
ruinous/રુઈનીઅસ/વિનાશક
rule out/ /
rule out/રુલ આઉટ/નકારી કાઢવું
rule the roost/કાબુ-નિયંત્રણ/બોલબાલા હોવી

rule(r)/ /
rule/રૂલ/આંકવું, શાસન, નિયમ
ruler/રૂલર/શાસક, આંકણી
ruling/રૂલિંગ/ઠરાવ, નિર્ણય
rumble/રમ્બલ/ઘણઘણાટ
ruminant/રૂમિનેન્ટ/વાગોળવું, મનન કરવું
rummage ફાંફા મારવા, શોધવું
rumour/ /
rumours/રૂમર/અફવા
rumpus/રમ્પસ/ઘીંગાણું, તોફાન, ગડબડ
run about-વું
run across-વું
run at-વું
run away with-વું
run back-વું
run down/ /
run down-વું
run in-વું
run into/ /
run into-વું
run off-વું
run out of/ /
run out off-વું
run out/ /
run out-વું
run out-વું
run over/ /
run over/રન ઓવર/પરથી પસાર થઈ જવું
run over-વું
run riot ઘીંગાણું-તોફાન મચાવવું
run through/ /
run through-વું
run up-વું
run/ /
run/રન/દોડ, દોડવું, ગતી
rung/રંગ/સીડીનું પગું
rural/ /
rural/રૂરલ/ગ્રામ્ય
ruse/રયુઝ/ચાલાકી
rush through-વું
rush/ /
rush/રશ/ધસારો
rust(y)/ /
rust/રસ્ટ/કાટ
rustic/ /
rustic/રસ્ટીક/ગામડિયું
rusticate કાઢી મુકવું
rustle up-વું
rusty/રસ્ટી/કટાયેલું
rut/રટ/ઘરેડ

ruthless/રૂથલેસ/નિર્દય
ryots ખેડૂતવર્ગ
sabotage ભાંગફોડ
saboteur/સેબોટર/ભાંગફોડકનાર
sabre rattling ખાંડા ખખડાવતું
sabreસેબર/તલવાર
sac કોથળી (પ્રાણી)
saccharine
sachetસેશે/નાની કોથળી
sack/ /
sack/સેક/પાણીયું, લૂંટકાટ, કોથળો રૂખસદ
sacred/સેક્રિડ/પવિત્ર
sacrifice/સેક્રિફાઈસ/બલિદાન
sacrilegious/સેક્રિલેજિઅસ/ધર્મદ્રોહી
sacrosanct/સેક્રાસેક્ટ/અતિપવિત્ર
sad(ness)/ /
sad/સેડ/ઉદાસ, ખિન્ન
saddle/સેડલ/જીન, સીટ
sadistic/સેડિસ્ટિક/પરપીડન કરનારું
safe(ity)/ /
safeસેઈફ/સલામત
safeguardસેઈફગાર્ડ/સંરક્ષણ વ્યવસ્થા
safetyસેઈફટિ/સલામતી
saffronસેફરન/કેસરિયો
saga/સેગા/ગાથા, યશોગાથા
sagacious/સેગેસિઅસ/હડાપણવાળું
sagacityસેગેસિટિ/હડાપણ
sageસેઈજ/હાથું
saggingસેગિંગ/નીચે આવતું-પડતું
saidસેડ/કહ્યું
sail/ /
sailસેઈલ/સઢ, સફર કરવી
saint(ly)/ /
saintસેઈન્ટ/સંત
sake/ /
sakeસેઈક/કાતર
salaciousસેલેસિઅસ/લંપટ
sale/ /
saleસેઈલ/વેચાણ
saleableસેલેબલ/વેચાણયોગ્ય
salientસેલિઅન્ટ/આગવું, વિશિષ્ટ
salineસલાઈન/ખારું
salivaસલાઈવા/થુંક, લાળ
salt/ /
saltસોલ્ટ/મીઠું
salubriousસેલ્યુબ્રિઅસ/આરોગ્યપ્રદ-વર્ધક
salutaryસેલ્યુટરિ/લાભદાયક
salutationસેલ્યુટેશન/અભિવાદન
saluteસેલ્યુટ/સલામ કરવી
salvageસેલ્વેજ/બચાવ, બચાવેલો માલ

salvationસેલ્વશન/
salvoસેલ્વો/તોપમારો, ટીકા,
same/ /
sameસેઈમ/તે જ, અમુક
sanctimoniousસેન્કટિમોનિઅસ/પવિત્ર
sanctionસેન્કશન/મંજૂર કરવું
sanctionsસેન્કશન્સ/નિયંત્રણો
sanctityસેન્કટિટિ/પવિત્રતા
sanctuary/ /
sanctuaryસેન્કચ્યુઅરિ/સલામત સ્થળ, અભિયારણ
sanctum sanctorumસેન્કટમ સેન્કટોરમ/ગર્ભદ્વાર-મંદિર
sand/ /
sandસેન્ડ/રેતી
sand-dunes રણમાં રેતીના ઢુવા
sandwich/ /
sandwichસેન્ડવિચ/
sane/ /
saneસેઈન/શાણું, હડાપણ વાળું
sangસેન્ગ/ગાયું
sanguineસેન્ગવીન/લાલ
sanitariumસેન્ટોરિઅમ/આરોગ્યભવન
sanitaryસેનિટરિ/સ્વચ્છતા, આરોગ્યલક્ષી
sansસાં/વિના
sarcasm
sarcasticસાર્કેસ્ટિક/વ્યંગાત્મક, કટાક્ષયુક્ત
sarcophagusસાર્કોફેગસ/આરસની શબપેટી
sardonicસાર્ડોનિક/ઉપહાસ, ઠકા-મશ્કરી
sartorialસાર્ટોરિઅલ/સિલાઈકામનું
sashસેશ/પટ્ટો
sassસેસ/અસભ્ય-તોછડું વર્તન
sassyસેસી/અસભ્ય-તોછડું
sat/ /
satસેટ/બેઠા
satanicસેટેનિક/શૈતાનિક, શૈતાનનું
sateસેઈટ/ધરાઈ-ઓચાઈ જવું
satelliteસેટેલાઈટ/ઉપગ્રહ
satiateસેશિએઈટ/સંતુષ્ટ થવું, ધરાઈ જવું
satiatedસેશિએઈટેડ/સંતુષ્ટ થયેલું
satiricalસેટાઈરિકલ/કટાક્ષમયું
satirizeસેટરાઈઝ/કટાક્ષ કરવો
satisfaction/ /
satisfactory/ /
satisfactoryસેટિસફેકરિ/સંતોષકારક
satisfy/ /
satisfyસેટિસફાઈ/સંતોષવું
satrapસેટ્રપ/સુબો
saturateસેચ્યુરેટ/તરબોળ થવું
Saturday/ /
satyromaniaસેટિરોમેનિઆ/હવસાખોરી
saucе/ /

sauce/સૉસ/ચટણી, ઝાટકો દેનાર, ઉધ્ધતાઈ

saucy/સૉસિ/ચાલાક, ઉધ્ધત, ફાટેલ

sauna/સોઉના/બાષ્પસ્નાન

saunter/સોઉન્ટર/લટાર

savage/સેવેજ/જંગલી, ક્રુર

savant/સાવન્ટ/વિદ્વાન

save up-વું

save/ /

save/સેઈવ/મચાવવું, સિવાય

saviour/સેવીયર/તારણહાર

savoir faire/સેવર ફેઅર/કુનેહ, ડહાપણ

savour/સેવર/સ્વાદ માણવો, સુચવવું

savoury/સેવરી/સ્વાદિષ્ટ

savvy/સેવી/જાણકારી, સમજણ

saw/ /

saw/સૉ/વેરવું, કરવત, જોયું

say/ /

say/સે/કહેવું, જણાવવું

scabbard/સ્કૉબાર્ડ/મ્યાન, ઘડું

scaffold/સ્કૉફોલ્ડ/પાલખ, માંચડો

scald(heat)verb

scale/ /

scale/સ્કેઈલ/માપ/કાંટા જેવા હાડકાં(માછલી) ચડવું

scallywag બદમાશ, હરામખોર

scam/સ્કેમ/કોભાંડ

scamster/સ્કેમસ્ટર/કોભાંડીયો

scan/સ્કેન/તાગવું, આંકવું

scandal/સ્કેન્ડલ/કોભાંડ

scandalous/સ્કેન્ડલસ/કોભાંડિયું

scansion/ /

scanty/સ્કેન્ટિ/છૂટ્ટવાયું, અપુરવું

scapegoat/સ્કેઈપગોટ/બલીનો બકરો

scar/ /

scar/સ્કાર/ઘા, ઈજાનું નિશાન

scarce/ /

scarce/સ્કેર્સ/અલભ્ય, અછતવાળું

scarcely/સ્કેર્સલિ/ભાગ્યેજ

scarcity/સ્કેરસિટિ/અછત

scare monger ભય ફેલાવનાર

scare/ /

scare/સ્કેઅર/ભયસંકેત, ડર ડરવું-ડરાવવું

scare/સ્કેઅર/ભયસંકેત, ડરાવવું

scaremonger/સ્કેઅરમોન્ગર/ભય ફેલાવનાર

scarf/ /

scarf/સ્કાર્ફ/માથાનો રૂમાલ

scarlet/સ્કાર્લેટ/લાલાશ પડવું

scarred/સ્કેર્ડ/ડરી ગયેલું

scathing/સ્કેથિંગ/સખત, આકરું ટીકા

scatter(ed)/ /

scatter/સ્કેટર/વિખરાવું

scavenger/સ્કેવેન્જર/સફાઈ કામદાર

scenario/સીનારિઓ/દૃશ્યાવલી

scene(ry)/ /

scene/સીન/દશ્ય

scenic/સીનિક/પ્રકૃતિ દશ્યનું

scent/ /

scent/સેન્ટ/સુગંધ, ગંધ

sceptic(જૈબ) સંશયવાદી

sceptre/સેપ્ટર/દંડ-લાકડી(સત્તાનું પ્રતિક)

schedule પરિશિષ્ટ, યાદી, સમયપત્રક

schematic

schism ફાટકુટ

schismatic ફાટકુટ કરાવનાર

schizophrenia/સ્કીઝોફ્રેનીઆ/મનોવિકાર

schmaltz/શમોલ્ટ્ઝ/લાગણી-વેવલાવેડાં

scholar(ship)/ /

scholar/સ્કૉલર/વિદ્વાન

scholarly/સ્કૉલરલિ/વિદ્વતાપૂર્ણ

school/ /

school/સ્કૂલ/નિશાળ, વિચારમંચ, શિક્ષણ આપવું

science/ /

science/સાયન્સ/વિજ્ઞાન

scientific/ /

scientific/સાયન્ટિફિક/વૈજ્ઞાનિક

scientist/ /

scintillating/સિન્ટિલેટિંગ/ચળકતું, તેજસ્વી

scion/cion/સાયન/

scissors/ /

scissors/સીઝર્સ/કાતર

scoff/ /

scoff/સ્કૉફ/

scold/ /

scold/સ્કૉલ્ડ/ઠપકો આપવો

scooge/સ્કૂજ/કંજૂસ

scoop

scoop/સ્કૂપ/સમાચારનો ઘડાકો

scooter/ /

scooter/સ્કૂટર/

scope/ /

scope/સ્કોઉપ/તક,

scorch/સ્કોઉપ/બાળવું, ડામદેવો, દઝાડવું

score off-વું

score out/ /

score out-વું

score/ /

score/સ્કોર/

scores/સ્કોર્સ/અનેક

scorn/ /

scorn/સ્કોર્ન/તિરસ્કાર કરવો

scotch

scot-free દોષમુક્ત, નિર્દોષ
scoundrel બદમાશ,
scour out / /
scourge/સ્કર્જ/શ્રાપ, થપાટ, ચાબખો
scout around //
scout / /
scouting
scowl/સ્કાઉલ/ડોળા કાઢવાં
scrambled/સ્ક્રમ્બલ/ઢગલો થવો, દોટ મુકવી
scrap / /
scrap/સ્ક્રૅપ/રદ કરવું, ઝઘડો, ભંગાર, કચરો
scrape along-વું
scrape by/through-વું
scrape together/up-વું
scrape / /
scrape/સ્ક્રૅપ/છોલવું
scratch / /
scratch/સ્ક્રૅચ/લીસોટા
scrawl/સ્ક્રૅલ/ઝડપથી લખવું, લીટાં કરવા
scrawny/સ્ક્રૅનિ/
scream out-વું
scream / /
scream/સ્ક્રીમ/ચીસ પાડવી
screaming/સ્ક્રીમિંગ/ચીસ પાડતું
screed/સ્ક્રીડ/લાંબુ કંટાળાજનક લખાણ
screen / /
screen/સ્ક્રીન/પરદો, જાળી
screw up છબરડો વાળવો, બગાડવું
screw / /
screw/સ્ક્રુ/સંભોગ કરવો (અશ્લીલ)બગાડવું
scribble/સ્ક્રિબલ/અર્થહીન લીટા દોરવા
scribe/સ્ક્રાઇબ/પત્રકાર
scrimmage/સ્ક્રિમેજ/ઝપાઝપી
scrimpy/સ્ક્રિમ્પી/
scrimshank/સ્ક્રિમશૅન્ક/ફરજ ચૂકવી
scrip/સ્ક્રિપ/મૂલ્યપત્ર
script/સ્ક્રિપ્ટ/હસ્તપ્રત
scriptures/સ્ક્રિપ્ચર્સ/ધર્મગ્રંથો
scrivener/સ્ક્રિવનર/દસ્તાવજે તૈયાર કરનાર
scrounge/સ્ક્રૅન્જ/
scrub/સ્ક્રબ/ઘસવું
scruples/સ્ક્રુપલ્સ/સદાચાર, કર્તવ્યનિષ્ઠા
scrupulous/સ્ક્રુપલ્સ/સદાચારી, ઈમાનદાર
scrutinize/સ્ક્રુટિનાઇઝ/ઝીણવટ થી તપાસવું
scrutiny/સ્ક્રુટિનિ/ઝીણવટ થી તપાસ-ચકાસણી
scuffle/સ્કફલ/ઝપાઝપી, ઘકકામુકકી
sculpted/સ્કલપ્ટેડ/ઘડી કાઢવું, કોતર્ણ
sculpture/સ્કલચર/સ્થાપત્ય
scupper
scurrilous/સ્કરિલસ/ભાંડણલીલા

scurry
scuttle/સ્કટલ/હડી કાઢવી, ભગાડી મૂકવું
sea / /
sea/સી/દરિયો, સમુદ્ર, સાગર
seal/સીલ/ચિન્હ, સિકકો, બંધ કરવું
seam/સીમ/સિલાઈ, ટાંકા
seamy
seamy/સીમી/**weak**
search for-
search / /
search/સર્ચ/શોધવું, તપાસ
season / /
season/સીઝન/ઋતુ, ઘડાવું
seasoned/સીઝન્ડ/ઘડાયેલું, રીઠું
seat / /
seat/સીટ/બેઠક, આસન
secede/સેસીડ/છુટા પડવું, ટુકડાં કરવા
second / /
second/સેકન્ડ/બીજું, ક્ષણ
secretary / /
secret / /
secret/સિક્રેટ/ખાનગી, ગુપ્ત
secretariat / /
secretariat/સેક્રેટરિયેટ/સચીવાલય
secretary / /
secretary/સેક્રેટરિ/સચીવ, મંત્રી
sectarian/સેક્ટેરિઅન/અલગતાવાદી
sectarianism/સેક્ટેરિઅનિઝમ/અલગતાવાદ
section / /
section/સેક્શન/વિભાગ, ભાગ, ટુકડો
sector / /
sector/સેક્ટર/ભાગ
secular/સેક્યુલર/ધર્મનિરપેક્ષ, બિનસાંપ્રદાયિક
secularism/સેક્યુલારિઝમ/ધર્મનિરપેક્ષતા
secure/સીક્યોર/સલામત બનાવવું
security/સેક્યોરિટિ/જામીનગીરી, સલામતી
sedantary/સિડેન્ટરી/બેઠાવું
sedate/સિડેટ/ગંભીર, સ્વસ્થ
sediments/સેડિમન્ટ/થર, પડ
sedition/સિડિશન/રાજદ્રોહ, બંડ
seduce/સિડ્યુસ/દુષ્કર્મ માટે પટાવવું-ભોળવવું
seduction/સિડક્શન/ફોસલાવી કરેલ ભ્રષ્ટ કૃત્ય
seductive/સિડક્ટિવ/પટાવતું, મોહક
see about-વું
see across-વું
see in-વું
see off / /
see off-વું
see out-વું
see over/round-વું

see through /
see through/ટકી રહેવું, સફળ થવું
see to /
see to-વું
see up-વું
see /
see/સી/જોવું
seed /
seed/સીડ/બીજ, બિયારણ
seek /
seek/સીક/માગણી કરવી, શોધવું
seekers/સીકર્સ/માગણી કરનારા
seem /
seem/સીમ/લાગવું, દેખાવું
seemingly
seen/સીન/
seepage/સી/ઝમવું, ટપકવું
seer/સીઅર/પયગંબર, દૃષ્ટા
see-saw/સીસૉ/ઉંચક-નીચક
seethe/સીધ/બડબડિયાં બોલવા
segment/સેગમેન્ટ/ભાગ, ટુકડો
segregate/સેગ્રેગેટ/અલગ પાડવું
seismologist
seize (up)on-વું
seize up-વું
seize /
seize/સીઝ/જપ્ત કરવું, પકડી પાડવું
seized/સિઝડ/જપ્ત કર્યું
seizure/સીઝર/જપ્તી, પકડ
seldom /
seldom/સેલ્ડમ/ભાગ્યેજ
select(ion) /
select/સિલેક્ટ/પસંદ કરવું, ચુનંદા
self /
self/સેલ્ફ/સ્વયં, જાતે
self-exile/સેલ્ફ એક્ઝાઇલ/દેશવટો
selfish/સેલ્ફિશ/સ્વાર્થી
self-reliant/સેલ્ફરીલાયન્ટ/આત્મનિર્ભર
self-styled/સેલ્ફસ્ટાઇલ્ડ/બની બેઠેલું, કહેવાતું
sell off-વું
sell out-વું
sell up-વું
sell /
sell/સેલ/વેચવું
sell-out
semantics/સિમેન્ટિક/શબ્દાર્થવિજ્ઞાન
semblance/સેમ્બલંસ/સામ્ય
seminal
send away for-વું
send away-વું
send down-વું

send for તેડાવવું
send for/સેન્ડ ફોર/તેડાવવું
send in-વું
send off-વું
send on-વું
send out for-વું
send out-વું
send up-વું
send /
send/સેન્ડ/મોકલવું
senescent
senile વડપણનું
senior most
senior/સિનિઅર/વરિષ્ઠ, પ્રવર, જૂથેષ્ઠ
sensation /
sensation/સેન્સેશન/રોમાંચ
sense(less) /
sense/સેન્સ/
sensex(જીહજીૌપી હગીટ)શૌરબજાર
sensible /
sensible/સેન્સિબલ/સમજદાર, ડાહ્યું
sensitising
sensitive /
sensitive/સેન્સિટિવ/સંવેદનશીલ
sensual/સેન્સ્યુઅલ/કામી, વિલાસી
sensuous/સેન્સ્યુઅસ/ઈન્દ્રિયજન્ય, ઈન્દ્રિયગામી
sent/સેન્ટ/મોકલ્યું
sentence /
sentence/સેન્ટેન્સ/સજા, વાક્ય
sentimental/સેન્ટિમેન્ટલ/લાગણીપ્રધાન
sentinel/સેન્ટિનલ/સંત્રી, ચોકીદાર
separable અલગ પાડી શકાયતેવું
separate /
separate/સેપરેટ/અલગ, જુદું
separatist/સેપરેટિસ્ટ/અલગતાવાદી
septic /
septic/સેપ્ટીક/દૂષિત, જંતુયુક્ત
septuagenarian
sepulture કબર
sequel અનુભાગ
sequence/સિક્વન્સ/ક્રમ, રોન **ghtna kram**
sequester
serenade પ્રેમી માટે ગાયેલું ગીત
serendipity આકસ્મિક શોધ
serene શાંત
serenity/સિરીનિટિ/શાંતિ
serf
serial /
serial/સીરીઅલ/ધારાવાહિક, ક્રમીક
sericulture/સેરિકલ્ચર/રેશમઉદ્યોગ
series /

series/સીરીઝ/શ્રેણી, કક્ષા, કતાર

serious/ /

serious/સિઅરિઅસ/ગંભીર

serpentine/સર્પેન્ટિન/સર્પાકાર

serrated/સેરેટેડ/કરવત જેવી ધાર વાળું

servant/ /

servant/સર્વન્ટ/નોકર, ગુલામ, સેવક

serve out-વું

serve/ /

serve/સર્વ/સેવા કરવી, પીરસવું

service/ /

service/સર્વિસ/નોકરી, સેવા, સાફસુફી કરવી

servile/સર્વાઈલ/નીચ, દુષ્ટ, અધમ

sesame/સેસેઈમ/તલનો છોડ

sesquipedalian લાંબુ-કંટાળાજનક

sessionસેશન/અધિવેશન, સત્ર

set about-વું

set against-વું

set apart-વું

set aside-વું

set back/ /

set back-વું

set down-વું

set forth-વું

set in/ /

set in/સેટ ઈન/બેસવું, શરૂ થવું

set off(out)/ /

set off/ /

set off/સેટ ઓફ/ઉપડવું

set on-વું

set out/ /

set out-વું

set to અણી પર, કરવાની તૈયારી માં

set up ઉભું કરવું

set up won/ /

set/ /

set/સેટ/ગોઠવવું, જોડી

set-back પીછેહઠ, પારોઠ ના પગલાં

settle down-વું

settle ગોઠવવું, ઠીકઠાક કરવું

settle in-વું

settle on-વું

settle the score વેર વાળવું

settle up-વું

settle/ /

settle/સેટલ/

seven/ /

seven/સેવન/

severસેવર/કાપી નાખવું

several/ /

severalસેવરલ/અનેક, થોડા ઘણા

severe/ /

severeસીવીઅર/સખ્ત

sew/ /

sew/સો/સીવવું, સીલાઈ કરવી

sewage

sewerage/ગટરવ્યવસ્થા

sex/ /

shabbyશૌભિ/ગંદુ

shacklesશૉકલ્સ/હાથકડી

shade/ /

shadeશેઈડ/છાંયો, રંગની છાંટ

shadow/ /

shadowશૉડો/પડછાયો

shady/ /

shadyશેઈડી/છાંયાવાળું

shake off

shake off-વું

shake up ઢંઢોળવું

shake up-વું

shake/ /

shakeશેઈક/હલાવવું

shall/ /

shallશૉલ/

shallowશૉલો/છીછરું

shamશૉમ/દંભ, ડોળ, આડંબર

shamblesશૉમ્બલ્સ/અસ્તવ્યસ્ત, વેરવિખેર

shame(ful)/ /

shameશૉઈમ/શરમ, લાંછન, કલંક

shananigans

Shanghaiશાંગહાઈ/અપહરણ કરવું

shape/ /

shapeશૉઈપ/આકાર, ઘડવું

share/ /

shareશૉઅર/ભાગ પાડવો

sharp/ /

sharpશાર્પ/તીક્ષ્ણ, આકરો

sharpenશાર્પન/ધાર કાઢવી

shatterશૉટર/ભુકકા બોલાવવા

shave/ /

shaveશૉઈવ/હજામત કરવી

she/ /

shearશીઅર/કાપવું, ચીરવું

shedશેડ/છૂટકારો મેળવલો, ત્યાગવું

sheep/ /

sheepશીપ/ઘેટાં

sheer/ /

sheer//તદ્દન, કેવળ, માત્ર

sheet/ /

sheetશીટ/

shelf/ /
shelf/શેલ્ફ/અભેરાઈ, છાજલી
shell out-વું
shell/ /
shell/શેલ/
shelling/શેલિંગ/તોપમારો
shelter/ /
shelter/શેલ્ટર/આશ્રય, રક્ષણ
shelve/સેલ્વડ/અભેરાઈએ ચડાવવું
shepherd/શેફર્ડ/ગોવાળ, ભરવાડ
shibboleth કાયમી સિધ્ધાંત
shield/ /
shield/શિલ્ડ/ઢાલ, રક્ષણ,
shift/ /
shift/શિફ્ટ/બદલાવવું, પાળી
shiftless
shiftly
shilly shally/શિલ્લિ શેલિ/ઢીલું પોચું, ઢચું પરું
shimmer/શિમર/ઉકળવું, ખદખદવું
shine/ /
shine/શાઈન/ચમકવું, ઝળકવું
shiny/ /
shiny/શાઈનિ/ચમકદાર
ship(ment)/ /
ship/શિપ/જહાજ
shipment/શિપમેન્ટ/માલ ની રવાનગી
shirk/શર્ક/જવાબદારીમાંથી છટકવું
shirt/ /
shirt/શર્ટ/પહેરણ, ખમીસ
shit/ /
shiver/શિવર/ધ્રુજવું, કાંપવું
shock at/by-
shock/ /
shock/શૉક/આંચકો, ઝટકો
shocked
shoe/શૂ/જોડું, પગરાખું
shoes/ /
shook/ /
shook/શૂક/હલાવ્યું
shoot down-વું
shoot out-ગોળીબાર
shoot up-વું
shoot/ /
shoot/શૂટ/ગોળી મારવી, ફોટો લેવો
shop around-વું
shop(keeper)/ /
shop/શૉપ/દુકાન, ખરીદી કરવી
shore/ /
shore/શૉર/દરિયા કાંઠો
shorn/શૉર્ન/સફાચટ

short/ /
short/શૉર્ટ/ટુંક, ઓછું
shortage/ /
shortage/શૉર્ટેજ/તંગી
short-list
shortly/ /
shortly/શૉર્ટલિ/થોડી જ વારમાં
shot/ /
shot/શૉટ/ભડાકો, ગોળી મારી
should/ /
should/શુડ/જોઈએ
shoulder/ /
shoulder/શૉલ્ડર/ખભો, જવાબદારી ઉપાડવી
shout at-
shout down-વું
shout to-
shout/ /
shout/શાઉટ/રાડો પાડવી, હાકલ મારવી
shove/શૉવ/ઠાંસી ને ભરવું
shovel
show off દેખાડો, પ્રદર્શન
show off/ /
show up/ /
show up/શૉ અપ/વું
show/ /
show/શૉ/દેખાડવું, પ્રદર્શન, ખેલ
showbiz =જર્નુ મેજીકીજીજ
show-down બળપ્રદર્શન, દેખાવો
shower zaptu
shower/શાવર/વરસાદનું ઝાપટું, વરસાવવું
shred/શ્રેડ/લીરા, ટુકડા
shrewd/ /
shrewd/શ્રૂડ/વિચક્ષણ, ચતુર
shriek/ /
shriek/શ્રીક/ચિસ પાડવી
shrift/શ્રીફ્ટ/એકરાર
shrill/શ્રીલ/તીણો અવાજ, ચીસ
shrine/શ્રાઈન/ધાર્મિક સ્થાન
shrink/ /
shrink/શ્રિંક/સંકોચાવું
shroud/શ્રાઉડ/કફન, છુપાવવું
shrug off/શ્રગ/ખંખેરી નાખવું (જવાબદારી)
shrug/ /
shrugs
shudder/શડર/ડરથી ધ્રુજવું-કાંપવું,
shuffle/શફલ/ચીપવું, ફેરબદલ
shuk/શક/ફોતફું, ફોલવું
shun/શન/ત્યાગવું, થી દુર રહેવું
shunt/શન્ટ આઈટ/કાઠી મૂકવું
shut away-વું
shut down-વું

shut in-વું
shut off-વું
shut/ /
shut/શટ/બંધ કરવું
shuttle/શટલ/આવ-જા, ફેરાં કરવા
shy away from-વું
shy awayશરમથી આધું રહેવું
shy/ /
shy/શાય/શરમાળ
Shylock
sibilant/સિબિલન્ટ/શ, સ, ષ ના અવાજ વાળું
sibling/સિબલિન્ગ/ભાઈ કે બહેન (બાળક)
sick/ /
sick/સિક/માંદું, બિમાર
sicken
sickening
side burns/સાઈડ બર્ન્સ/થોભિયાં, કલમ(વાળ)
side(ways)/ /
side/સાઈડ/પડખું, પક્ષ, તરફદારી કરવી
side-kick ગુંડાનો સાગરીત, મળતીયો
siege/ /
siege/સીજ/ધેરો ઘાલવો
siesta/સીએસ્ટા/વામકુશી
sieve/સીવ/ચાળવું, ચાળણી
sift out-વું
sift/સિફ્ટ/ચાળવું
sigh/ /
sigh/સાય/નિસાસા નાખવા
sight/ /
sight/સાઈટ/દૃષ્ટિ, જોવું, નજર
sign away-વું
sign for-વું
sign in-વું
sign off-વું
sign on-વું
sign up-વું
sign/ /
sign/સાઈન/સહી કરવી, નિશાની
signal/ /
signal/સિગ્નલ/ઈહારો, સંકેત
signatories/સિગ્નેટરિઝ/સહી કરનાર
signature/ /
significance/સિગ્નિફિકન્સ/મહત્ત્વ
significant/ /
significant/સિગ્નિફિકન્ટ/મહત્ત્વનું, અગત્યનું
silence/ /
silence/સાયલન્સ/શાંતિ,
silent/ /
silent/સાયલન્ટ/ચૂપ, શાંત, મૂક
silhouette/સિલ્યુએટ/છાયાચિત્ર

silk(y)/ /
silk/સિલ્ક/રેશમ
silky/સિલ્કિ/રેશમી
silly/ /
silly/સિલિ/મુર્ખ
silt/ /
silt/સિલ્ટ/કાદવ, કિચડ
silver/ /
silver/સિલ્વર/ચાંદી
similar/ /
similar/સિમિલર/સરખું, સમરૂપ
simmer down-વું
simmer/સિમર/ઉકળતું, બડબડિયા બોલવાં
simple/ /
simple/સિમ્પલ/સરળ, સાદું
simulation/સિમ્યુલેશન/નમુના રૂપ, મોડેલ
simultaneous/સિમલ્ટેનીઅસ/સાથે બનતું
sin(ful)/ /
sin/સિન/પાપ
since/ /
since/સિન્સ/થી
sincere/ /
sincere/સિન્સિઅર/સંનિષ્ઠ, પરાદિલનું
sine die/સાયનેડાઈ/અનિશ્ચિત સમય માટે
sine qua non/સિને ક્વો નન/અનિવાર્ય શરત
sinecure/સિનેક્યોર/ઓછું કામ વધારે પગાર
sinewy/સિન્યુઈ/સ્નાયુવાળું
sinful/સિનફુલ/પાપી, દુષ્ટ
sing/ /
sing/સિંગ/ગાવું
single out-જુદું તારવવું
single/ /
single/સિંગલ/એક, એકવડું
singular/ /
sinister/સિનિસ્ટર/ખતરનાક, અશુભ, દુષ્ટ, મલીન
sink in-વું
sink/ /
sink/સિંક/ડૂબવું
sip/ /
sip/સિપ/ઘૂંટડો
siphon off નળીથી બહાર કાઢવું
sir/ /
sir/સઃ/સાહેબ, હજુર
siren/સાયરન/મોહક સ્ત્રી, ભંગળું
sister/ /
sister/સિસ્ટર/બહેન, નર્સ
sit about/around-વું
sit back-વું
sit down-વું
sit in-વું

sit on-વું
sit out-વું
sit up-વું
sit/ /
sit/સિટ/બેસવું
sitcom/સિટકોમ/હાસ્ય નાટિકા
site/ /
site/સાઈટ/સ્થળ, જગ્યા
sitting duck
situated/ /
situated/સિચ્યુએટેડ/સ્થિત, આવેલું
situation/ /
sit-ups/સિટ અપસ/ઉઠ-બેસ
six/ /
sixth/ /
sixty/ /
sixty/સિક્સ્ટિ/સાઈઠ
size up-વું
size/ /
size/સાઈઝ/માપ, મોટું
sizeable
sizzling
skedaddle/સ્કેડડલ/નાસી જવું
skein/સ્કેઈન/ગૂંચળું, ફિંડલું
skeleton/ /
skeleton/સ્કેલિટન/હાડપિંજર
skeptic/(જર્મીબ)/સ્કેપ્ટીક/સંશયવાદી
sketch/ /
sketch/સ્કેચ/રૂપરેખા
skew/સ્ક્યુ/ત્રાંસુ, અસમાંતર
skilful/ /
skilful/સ્કિલફુલ/કુશળ
skill/ /
skill/સ્કિલ/કૌશલ્ય, કુશળતા
skim off-વું
skim over/through-વું
skin/ /
skin/સ્કીન/ચામડી
skip કુદી-ઠેકી જવું, છોડી જવું,
skipper/સ્કિપર/કપ્તાન
skirmish/સ્કર્મિશ/અથડામણ, મારામારી
skirt/ /
skirt/સ્કર્ટ/બાજુમાં, ની કોર પર
skit/સ્કિટ/નાની રમુજ નાટિકા
skivvy/સ્કિવી/પરચૂરણ કામો કરનાર નોકર
skull/ /
skull/સ્કલ/ખોપડી
sky/ /
sky/સ્કાય/આકાશ
slab/સ્લૅબ/પથ્થરનો મોટો ટુકડો

slack/ /
slack/સ્લૅક/ઢીલું, એદી, મંદી
slacks/સ્લૅક્સ/
slain/સ્લૅઈન/હત્યા થયેલ, મૃત
slake/સ્લૅઈક/બદલાની આગ સંતોષવી
slam/સ્લૅમ/સખત ટીકા-જોરથી બંધકરવું-દબાવવું
slammer/સ્લૅમર/જેલ, કારાવાસ
slander/સ્લૅન્ડર/યુગલી કરવી, બુરાઈ કરવી
slang/સ્લૅન્ગ/વાતચિતના ખાસ શબ્દો
slant/સ્લૅન્ટ/ત્રાંસું
slap on-વું
slap/ /
slap/સ્લૅપ/લાફો-મારવો
slapdash/સ્લૅપ/ઉતાવળિયું ને બેદરકાર
slash/સ્લૅશ/કાપ મૂકવો, ટીકા, ફટકો,
slashed
slate/ /
slate/સ્લેઈટ/ટીકા કરવી, પાટી
slated
slatern/સ્લૅટર્ન/ફૂવડ, લઘરવઘર સ્ત્રી
slaughter/સ્લૅટર/કતલ
slave/ /
slave/સ્લેઈવ/ગુલામ, બંદિવાન
slavery/સ્લેઈવરિ/ગુલામી
slavish/સ્લેઈવિશ/ગુલામીપૂર્ણ
slay/સ્લે/હત્યા કરવી, વધ કરવો
sleazy/સ્લીઝી/અતિ, ગંધાતુ, મલીન
sleek/સ્લીક/સુંવાળું, લીસું
sleep around-વું
sleep in-વું
sleep off-વું
sleep on-વું
sleep together-વું
sleep with-વું
sleep/ /
sleep/સ્લીપ/સુવું
sleeve/ /
sleeve/સ્લીવ/બાંય
sleigh/ /
sleigh/સ્લેઈ/વહાણ
sleight/સ્લેઈટ/તરકીબ, યુક્તિ, ચાલાકી
slept/ /
slept/સ્લેપ્ટ/સુતા
slenth/સ્લેનથ/છુપી પોલીસ
slice/ /
slice/સ્લાઈસ/પતરી, કાતરી
slide/ /
slide/સ્લાઈડ/સરકવું
slight/ /
slight/સ્લાઈટ/જરાક, થોડુંક

slim/સ્લિમ/પાતળું
slime/સ્લાઈમ/માટી
slimming
sling/
sling/સ્લિંગ/ટીંગાડવું, લટકાવવું
slink છુપાતા-લપાતા જવું
slip away-વું
slip by-વું
slip in-વું
slip off-વું
slip on-વું
slip out-વું
slip up-વું
slip/
slip/સ્લિપ/કાપલી, લપસવું, ભૂલ, હાથતાળી
slippery/
slit/
slit/સ્લિટ/કાપ,
slob/સ્લોબ/મૂર્ખ, જંગલી માણસ
slog/સ્લોગ/ઢંસરડા કરવા, આંખો મીચી મારવું
slogan/
slogan/સ્લોગન/નારો, સુત્ર
slope/
slope/સ્લોપ/ઢાળ
sloppy/સ્લોપિ/વેવવું, ઢંગઘડા વગરનું, રોતલ
slot/
slot/સ્લોટ/કાણું, ખાંચો
slothful/સ્લોથફુલ/આળસું, એટી
slouge
slough
slough/સ્લાફ/કળણ, સાંપની કાંચળી
sloven/સ્લવન/ઉછાંછળું, ઉપરછલ્લું
slow down-વું
slow/
slow/સ્લો/ધીમું
slug
slug/સ્લગ/ગોળી, ફટકારવું
sluggard/સ્લગર્ડ/આળસુનો પીર
sluggish/સ્લગિશ/જડ, મંદ, ધીમું
slum/સ્લમ/ગંદો વસવાટ, રુંપડપટી
slumberous/સ્લમ્બરસ/ઊંઘતું, ધોરતું, ઘેનમાં
slump/
slump/સ્લમ્પ/મંદી, ખાડો
slur/સ્લર/કલંક, ભૂલ
slurp/સ્લર્પ/સબડકા મારવા
slurry/સ્લરિ/રોગો, રગડો
slush/સ્લશ/કાદવ, રબડી
slut/સ્લટ/ફૂવડ સ્ત્રી, કુલ્ટા
sly/સ્લાઈ/કપટી, છાનું છાનું, કાવત્રાબાજ
smack/
smack/સ્મૅક/લાફો, ઝાપટ, ચરસ, ગાંજો

small/
small/સ્મૅલ/નાનું
smart aleck
smart/
smart/સ્માર્ટ/ચપળ, ચબરાક, તૈયાર, પીડા થવી
smash/
smash/સ્મૅશ/ભુકકા બોલાવવા,
smashing/સ્મૅશિંગ/ભુકકા બોલાવવું
smatter
smatter
smear/સ્મીઅર/ચોપડવું
smell/
smell/સ્મેલ/ગંધ-આવવી
smile at
smile/
smile/સ્માઈલ/
smirk/સ્મર્ક/અહહાસ્ય
smog/સ્મૅગ/ધૂમાડા+ધૂમ્મસ
smoke/
smoke/સ્મોઉક/ધુમ્રપાન કરવું, ધુમાડો
smooth down-વું
smooth out-વું
smooth over-વું
smooth(ly)/
smooth/સ્મૂથ/
smother/સ્મૅધર/હોલવી નાખવું
smoulder/સ્મૅલડર/ધૂંધવાવું
smug
smuggle/સ્મગલ/દાણચોરી કરવી
snack/
snack/સ્નેક/નાસ્તો
snafu/સ્નાફુ/અંધાધૂંધિ, અરાજકતા
snag/સ્નેગ/ખોટકો, યાંત્રિક ખામી
snail/
snail/સ્નેઈલ/ગોકળગાય, ધીમું
snake/
snake/સ્નેઈક/સાંપ
snap out off-વું
snap out-વું
snap up-વું
snap/
snap/સ્નેપ/તતડાવવું, ફોટો લેવો, તોડી નાખવું, ત્વરિત
snapped
snapshot
snarl ધૂરકવું, વિટંબણા
snarl up-વું
snatch/
snatch/સ્નેચ/લુંટ, ખુંચવી લેવું, પડાવી લેવું
sneak/સ્નીક/ચોરીછુપી, છાનું, ચાડી ખાવી
sneer/
smack/સ્મૅક/લાફો, ઝાપટ, ચરસ, ગાંજો

sneer/સ્નીઅર/
sneeze /
sneeze/સ્નીઝ/છીંક ખાવી
snickers//મૂર્ખાઈ પૂર્ણ હાસ્ય, પોચાં જોડાં
snide
sniff out સૂંઘવું, તાગવું
sniff /
sniff/સ્નિફ/સૂંઘવું, તાગવું
snipe at
snippet નાના ઉતારા, કાપલીઓ
snob/સ્નોબ/આડંબરી ઉચ્ચ વર્ગ
snooty/સ્નૂટી/ઘમંડી
snooze/સ્નૂઝ/ઝોકું ખાવું, ઉંઘવું
snore નસકોરાં બોલાવવા
snort /
snort//છીંકોટા નાખવા
snotty/સ્નોટી/ઘમંડી
snow
snow under-વું
snow /
snow//બરફ કુદરતી
snowball ઝડપથી વધવું
snub ઉતારી પાડવું, ઘુત્કારવું
so /
so/સો/તેથી, જેથી કરીને
soak /
soak/સોક/ભીનું કરવું, ભીંજવવું
soap /
soap/સોપ/સાબુ, લાંબી ટી.વી સીરીઅલ
soar /
soar/સોર/ઉપર ચઢવું
sob /
sob/સોબ/ડૂસકાં ભરવાં
sober /
sober/સોબર/સ્વસ્થ, નશામુક્ત
soberity/સોબ્રેઈટિ/ધીર ગંભીરતા
sobriquet/સોબ્રિકેટ/ઉપનામ
so-called/સો કૉલ્ડ/ કહેવાતું, નામ માત્રનું
soccer/સોકર/ફુટબૉલ ની રમત
social /
social/સોશલ/
society /
society/સોસાયટી/સમાજ
sock /
sock/સૉક/મોજું(પગ)
soft peddle/સૉફ્ટ પેડલ/ થાબડભાણાં કરવા
soft /
soft/સૉફ્ટ/નરમ
soften up/સૉફ્ટન અપ/નરમ પાડવું નકામં બનાવવું
softened/સૉફ્ટન્ડ/નરમ પાડવું

software/સૉફ્ટવૉર/કમ્પ્યુટર પ્રોગ્રામ
soggy/સૉગ્ગી/ પાણીથી ખુબ ભીનું
soigné/સ્વૉનેઈ/વ્યવસ્થિત ગોઠવાયેલું-ઘડાયેલું
soil /
soil/સોઈલ/જમીન
soiree/સ્વાયરે/સંગીત મહેફીલ
sojourn/સોજોર્ન/રખડવું, ભમવું
solace/સોલેસ/આશ્વાસન
solar /
solar/સોલર/સુર્યનું, સૌર
solastic/સૉલાસ્ટિક/
sold/સૉલ્ડ/વેચાયું
solder/સૉલ્ડર/ઘાતુઓને સાંઘવી
soldier on-વું
soldier /
soldier/સૉલ્જર/સૈનિક
sole /
sole/સોલ/સંપૂર્ણ, પગનું તથિયું
solecism/સોલસિઝમ/ભાષાની ભૂલ
solemn /
solemn/સોલેમ/ગંભીર
solemnised/સોલેમ્નાઈઝડ/
solicitor/સોલિસિટર/વકીલ
solicitous/સોલિસિટસ/વિનવણી કરતું
solid /
solid/સોલિડ/નકકર
solidarity/સોલિડૉરિટી/એકતા, સહાનુભૂતિ
soliloquy/સોલિલોકવી/સ્વગતોકિત
solitary/સોલિટરિ/એકલું, અટલું
soluble/સોલ્યુબલ/ઓગાળી શકાય તેવું
solution /
solve /
solve/સોલ્વ/ઉકેલવું
somber/સોમ્બર/ગંભીર, ગમગીન
sombre/સોમ્બર/ગમગીન, ઉદાસ
some /
some/સમ/થોડું, થોડાક
somebody /
somehow /
someone /
somersault/સમરસૉલ્ટ/ગોથું
something /
sometimes /
somewhat/સમવૉટ/થોડું ઘણું
somewhere /
somnambulism/સોમ્નામબ્યુલિઝમ/ ઊંઘમા ચાલવાનો રોગ
somnolent/સોમ્નોલન્ટ/ઊંઘતું
son /
son/સન/પુત્ર
sonar/સૉનાર/અવાજ થી ઊંડાણ માપક યંત્ર

song /
song/સોંગ/ગીત
sonorous/સોનોરસ/ પ્રચંડ અવાજ વાળું
soon /
soon/સૂન/તુરંતજ
soothing/સુધિંગ/ શામક
soothsayer ભવિષ્યવેતા
sop/સોપ/થોડી રાહત, નજીવો લાભ
sophisticated/સોફિસ્ટિકેટેડ/અતિ આધુનિક
sophistry/સોફિસ્ટ્રી/ સુઙ્ગિયાણી વાતો
sophomore/સોફોમોર/યુનિ. નો વિદ્યાર્થી
soporific/સોપોરિફિક/ધિનચડાવતું
sordid/સોર/ગંધાતું, અધમ, નીચ
sore /
sore/સોર/પીડિત, સોજેલું
sorrow /
sorrow/સોરો/દુઃખ
sorry about/for-
sorry /
sorry/સોરિ/દિલગીર
sort out પતાવટ કરવી, નિવેડો લાવવો
sort out /
sort /
sort/સોર્ટ/જાત, જુદું પાડવું, વર્ગીકરણ કરવું
sortie/સોર્ટી/હવાઈ હુમલો, ખેપ
SOS/એસ ઓ એસ/ સંકટ સંદેશ-પોકાર (વિમાન-જહાજ)
so-so/સો સો/ઠીક-ઠીક
sot/સોટ/દારૂની લતથી પતી ગયેલું
sought/સોટ/માગણી કરી
soul searching
soul /
soul/સોલ/આત્મા
sound off-વું
sound out-વું
sound /
sound/સાઉન્ડ/નકકર, અખંડ, તાગવું
soup /
soup/સૂપ/
soupcon સૂચન
sour /
sour/સાવર/ખાટું
source /
source/સોર્સ/
south /
south/સાઉથ/
southern /
souvenir/સુવનિઅર/સંભારણું
sovereign/સોવરેઈન/સાર્વભોમ
sow /
sow/સો/વાવવું

sozzled/સોઝલ્ડ/ખૂબ પીધેલું
space /
space/સ્પેસ/
spacecraft /
spacious/સ્પેશીઅસ/વિશાળ
spacum
spade /
spade/સ્પેઇડ/ખોદવાનું ઓજાર
spadework/સ્પેઇડ વર્ક/તેયારી રૂપે કરેલું કામ
span/સ્પેન/ગાળો, અવધિ
spangle/સ્પેન્ગલ/શણગારની ટીપકી-બીંદી
spank/સ્પેન્ક/ફડાકો, ઝાપટ
spanking/સ્પેન્કિંગ/ધમધોકાર, છટાદાર
spanner/સ્પેનર/
spar/સ્પાર/
spare baakaat
spare /
spare/સ્પેઅર/વધારાનું
spark /
spark/સ્પાર્ક/શરૂ કરવું
sparkle/સ્પાર્કલ/ચમકવું, તણખાં ઝરવા
sparrow /
sparrow/સ્પેરો/ચકલી
sparse/સ્પાર્સ/છટું છવાયું
Spartan/સ્પાર્ટન/ખડતલ, સાદગી વાળું
spasm/સ્પાઝમ/તાણ, આંચકી
spasmodic/સ્પેસ્મોડિક/અચાનક આંચકી રૂપ
spasmodically/સ્પેસ્મોડિકલિ/
spastic/સ્પેસ્ટિક/લકવા થી અપંગ
spate/સ્પેઇટ/ઉછાળો, પૂર
spatial
spawn/સ્પોન/બચ્ચાં, ઈંડા
speak to/with-
speak /
speak/સ્પીક/બોલવું
speakeasy/સ્પીકઝી/શરાબ નો અડો
spear /
spear/સ્પીઅર/
spearhead/સ્પીઅરહેડ/આગેવાની લેવી
special /
special/સ્પેશલ/ખાસ, વિશિષ્ટ
specialise /
specialist /
species/સ્પીસીઝ/જાત, વર્ગ
specific /
specific/સ્પેસીફિક/વિશિષ્ટ
specious/સ્પેસીઅસ/
speck/સ્પેક/કણું, દાંતમાં ભરાતો કચરો
spectacle/સ્પેટેકલ/પ્રદર્શન, દૃશ્ય, નજારો
spectacles /

spectacles/સ્પેટેકલ્સ/ચશ્મા
spectacular/સ્પ/દર્શનીય, જોવા જેવું
spectre/સ્પેક્ટર/ભૂત
spectrum/સ્પેક્ટ્રમ/
speculate/સ્પેક્યુલેટ/અંદાજ, ધારણા, સહો કરવો
speculation/સ્પેક્યુલેશન/ધારણા, સહો, અટકળ
speculative/સ્પેક્યુલેટિવ/સહાક્રીય, ધારણાગત
speculators sttakhoro
speech / /
speech/સ્પીચ/વાચા, ભાષણ
speed(y) / /
speed/સ્પીડ/ગતી
spell out-વું
spell(ing) / /
spell/સ્પેલ/મંત્ર, અવધિ
spellbound/સ્પેલબાઉન્ડ/મંત્રમુગ્ધ
spend / /
spend/સ્પેન્ડ/ખર્ચવું, વિતાવવું
spent/સ્પેન્ડ/
spices/સ્પાઈસિસ/મરી-મસાલા
spicy / /
spicy/સ્પાઈસિ/
spill / /
spill/સ્પિલ/ઢોળાવું
spillage/સ્પિલેજ/ઢોળફોળ
spin out-વું
spin / /
spin/સ્પિન/ફેરવવું, કાંતવું
spinach/સ્પિનાચ/રિસાવાળી શાકભાજી
spinal/સ્પાઈનલ/કરોડરજ્જુનું
spine
spinster/સ્પિનસ્ટર/કુમારિકા
spiralling/સ્પિરલિંગ/ઉપર ચડતું
spirit / /
spirit/સ્પિરિટ/જુસ્સો
spiritual/સ્પિરિચ્યુઅલ/આધ્યાત્મિક
spirituality/સ્પિરિચ્યુઆલિટી/આધ્યાત્મિકતા
spit / /
spit/સ્પિટ/થૂંકવું
spite / /
spite/સ્પાઈટ/
spiv/સ્પિવ/ગોરખધંધા કરીને મહાલતું
splash down-વું
splash out-વું
splash / /
splash/સ્પ/ખાબકવું, ભૂસકો મારવો
splendid / /
splendid//ભવ્ય, સરસ, મજાનું
splendour/સ્પલેન્ડર/ભવ્યતા
splice/સ્પલાઈસ/ગૂંથવું, લગન કરવા

splinter/સ્પલીન્ટર/કરચ, ટુકડા, છરા
split up-વું
split / /
split/સ્પ્લીટ/ભાગલા-ટુકડા થવાં
splutter/સ્પલટર/ઉશ્કેરાટમાં બબડવું
spoil / /
spoil/સ્પોઈલ/બગાડવું, બગાડો
spoilsport
spoke/સ્પોક/બોલ્યું
spoken/સ્પોકન/બોલાતું, મૌખિક
spokesman/સ્પોકસ્મેન/પ્રવક્તા
spokesperson/સ્પોકસ્પર્સન/પ્રવક્તા
sponge / /
sponge/સ્પોંજ/
spongy/સ્પોંજી/પોચું, ગાદી જેવું
sponsor/સ્પાસર/ટેકેદાર, પ્રેરનાર
spontaneous/સ્પોન્ટેનિઅસ/સ્વયંસ્ફુરિત
spoof/સ્પૂફ/છેતરપીડી, ઢગવિદ્યા
spook/સ્પૂક/ભૂત, પિશાચ
spoon / /
spoon/સ્પૂન/ચમચી, ચમચો
spoonerism/સ્પૂનરિઝમ/ઉલ્ટા સુલ્ટો ગોટો (શબ્દો)
sporadic/સ્પોરેડિક/આડેઘડ, છુટું છવાયું
sport/સ્પોર્ટ/રાખવું, રમત, મજાક
sportive/સ્પોર્ટિવ/ખેલદિલ
sports / /
sports/સ્પોર્ટ/રમત ગમત, ખેલકુદ
spot / /
spot/સ્પોટ/સ્થળ, નજરે ચડવું, ડાઘ
spotlight/સ્પોટ/પ્રકાશકેન્દ્ર
spotted
spotted/સ્પોટિડ/ટપકાંવાળું, દેખાણું, નજરે ચડયું
spouse/સ્પાઉઝ/જીવનસાથી
sprawl/સ્પ્રોલ/પથરાવું, લાંબા થઈને સુવું
spray/સ્પ્રે/છાંટવું, કુમળી ડાળી
spread / /
spread/સ્પ્રેડ/ફેલાવવું, ફેલાવો, પાથરવું
spree / /
spree/સ્પ્રી/ઉજાણી, ઉન્માદ, જોશ
spring up-વું
spring / /
spring/સ્પ્રિંગ/અચાનક ઉછળવું, છલાંગ, વસંતઋતુ
sprinkle/સ્પ્રિન્કલ/છાંટવું
sprint/સ્પ્રિન્ટ/ઢોટ, હડી
sprite/સ્પ્રાઈટ/પરી, ભૂત
sprout/સ્પ્રાઉટ/ફણગો-કોંટો ફૂટવાં
spruce/સ્પ્રૂસ/
sprun/સ્પ્ર્ન/ધુતકારવું
spry/સ્પ્રાઈ/તરવરાટ વાળું
spunk/સ્પંક/હિંમત, જુસ્સો

spur/સ્પર/એડી, ઉત્તેજન, કેડી
spurious/સ્પ્યુરિઅસ/બે નંબરી, નકલી
spurt /
spurt/સ્પર્ટ/ફૂવારો, તેજી, ઉછાળો
sputter/સ્પટર/તડતડ થવું,
sputum/સ્પ્યુટમ/કફ, થુંક
spy/સ્પાય/જાસૂસી કરવી, ગૂપ્તચર
squeamishness
squabble/સ્કૉબલ/બોલાચાલી, ઝગડો
squad/સ્કૉડ/દળ, ટુકડી
squalid/સ્કૉલિડ/ગંદુ
squalor/સ્કૉલર/ગંદગી, દારિદ્રતા
squander/સ્કૉન્ડર/વેડફવું
square up-વું
square /
square/સ્ક્વેઅર/ચોક, ચોરસ
squash/સ્ક્વૉશ/રદબાતલ, નિચોવવું, રમત
squat /
squat/સ્કૉટ/બેસવું
squeamish/સ્કીમિશ/માંદલું
squeeze /
squeeze/સ્ક્વીઝ/નિચોવવું
squiggle/લ/અર્થહીન લીટા દોરવા
squint/સ્ક્વીટ/ત્રાંસી આંખ
squirm/સ્ક્ર્મ/ કીડાની જેમ મરડાવું
squirmish/સ્ક્ર્મિશ/અથડામણ, ટકરાવ
squirt/સ્ક્વિર્ટ/પીચકારી, ફૂવારો
stab/સ્ટેબ/છૂરો ભોંકવો
stabbing/સ્ટેબિંગ/છૂરાભોંક, છૂરાબાજ
stabilize/સ્ટેબિલાઇઝ/સ્થિર બનાવવું
stacked
staff /
staff/સ્ટાફ/સ્તંભ, કર્મચારીગણ
stage /
stage/સ્ટેઇજ/યોજવું-રજુ કરવું, તબ્બકો, સ્થિતિ
stagger/સ્ટેગર/લથડીયાં, ચકકર ખાવા
stagnant/સ્ટેગનન્ટ/બંધિયાર, સ્થિર
stagnation/સ્ટેગનેશન/સ્થગિતતા
stain /
stain/સ્ટેઇન/ડાઘ
stair /
stair/સ્ટેઅર/દાદરો
stake/સ્ટેઇક/આર્થિક હિત, હોડ-જોખમમાં મૂકવું
stale /
stale/સ્ટેઇલ/સડેલું, પડતર
stalemate/સ્ટેઇલમેઇટ/મડાગાંઠ, ડ્રો
stalk/સ્ટૉક/દમામભેર ચાલવું, ધમરોળવું
stalker/સ્ટૉકર/છાનાપગે પીછો કરનાર
stall /
stall/સ્ટૉલ/બાજુમાં રાખવું, હાટ

stallion/સ્ટેલિઅન/વછેરો, ઘોડો
stalwart/સ્ટૉલવર્ટ/દિગ્ગજ, મહારથી, ખેરખાં
stammer/સ્ટેમર/તોતડાવું
stamp out/સ્ટેમ્પઆઉટ/નાબુદ કરવું
stamp out-વું
stamp /
stamp/સ્ટેમ્પ/છાપ, ટિકિટ, પગ પછાડવા
stampede/સ્ટેમ્પીડ/ધકકામુકી
stance/સ્ટેન્સ/વલણ, નિતી
stand by /
stand by-વું
stand down-વું
stand for /
stand for-વું
stand in-વું
stand out /
stand out-વું
stand up for /
stand up for-વું
stand up to-વું
stand up-વું
stand /
stand /
stand/સ્ટેન્ડ/વલણ, વિસામો
standard /
standard/સ્ટૉન્ડર્ડ/માપ, યોગ્યતા, સામાન્ય
stand-by તૈયાર, ની પડખે ઉભું રહેવું
stand-off રૂક્સદ, દૂર રહેવું મડાગાંઠ
stand-offish/સ્ટેન્ડઑફિશ/ધમંડી
standstill/સ્ટેન્ડસ્ટીલ/અશકત, સ્થિર
stanza/સ્ટેન્ઝા/કડી, શ્લોક
staple/સ્ટેપ્લ/મુખ્ય, સાથે જોડવું
star /
star/સ્ટાર/તારો, સિતારો
stardom/સ્ટારડમ/અભિનેતાનું વિશ્વ
stare /
stare/સ્ટેઅર/તાકી ને જોવું
stark/સ્ટાર્ક/નગ્ન, ઉજ્જડ
start off-વું
start up-વું
start /
start/સ્ટાર/શરૂઆત-કરવી
startle/સ્ટાર્ટલ/આઘાત, આશ્ચર્ય પામવું
starve /
starve/સ્ટાર્વ/ભુખે મરવું
state of the art અતિ આધુનિક
state /
state/સ્ટેટ/જણાવવું, રાજ્ય, હાલત
stately/સ્ટેઇટલી/ભવ્ય
statement /

statesman/સ્ટેટ્સમન/મુત્સદી
static/સ્ટેટિક/સ્થિર
station /
station/સ્ટેશન/મથક, રોકાણ સ્થળ
stationary/સ્ટેશનરી/સ્થિર, ઊભેલું
stationery/સ્ટેશનરી/લેખનસામગ્રી
statistics/સ્ટેટિસ્ટિક્સ/આંકડાશાસ્ત્ર
statue /
statue/સ્ટેચ્યુ/પૂતળું
status quo/સ્ટેટસકવો/યથાસ્થિતિ
status/સ્ટેટસ/સ્થિતિ, મોભો, પ્રતિષ્ઠા
statute /
statute/સ્ટેચ્યુટ/કાયદો
statutory/સ્ટેચ્યુટરી/કાયદાકીય-પ્રમાણે
staunch/સ્ટૉચ/કઠર, વફાદાર
stave off
stay off-વું
stay out-વું
stay /
stay/સ્ટે/રોકાવું, મનાઈ આદેશ
stead/સ્ટેડ/સ્થળ
steadfast/સ્ટેડફાસ્ટ/અચળ, અડગ
steady /
steady/સ્ટેડિ/સ્થિર
steal /
steal/સ્ટીલ/ચોરવું
stealth/સ્ટેલ્થ/ચોરી
steam /
steam/સ્ટીમ/વરાળ, ઉર્જા
steel /
steel/સ્ટીલ/પોલાદ, લોખંડ
steep /
steep/સ્ટીપ/આકર્ણ, અતિ ચઢાણ
steer /
steer/સ્ટીઅર/વળાંક વાળવો, દિશામાં વાળવું
stein/સ્ટેઈન/ગૂંચળું, કોકડું
stem /
stem/સ્ટેમ/થડ, ખાળવું, ઉદ્ભવવું
stemming/સ્ટેમિંગ/માંથી કૂટવું, ઉદ્ભવવું
stench/સ્ટેન્ચ/દુર્ગંધ
stentorian પડછંદ અવાજ
step in-વું
step up/સ્ટેઅપ/વધારી દેવું
step /
steps/સ્ટેપ્સ/પગલાં, પગથીયાં
sterile/સ્ટરાઈલ/જંતુરહિત, વાંઝિયું
stern /
stern/સ્ટર્ન/કડક, સખત
sternutation/સ્ટર્ન્યુટેશન/છીંકનો હુમલો
stevedore/સ્ટીવડૉર/જહાજ આડતિયો

stewardship/સ્ટિયુવર્ડશિપ/નેતાગીરી, વડપણું
stick to-વું
stick /
stick/સ્ટિક/ચોટાડવું, લાકડી
stiff /
stiff/સ્ટિફ/અકકડ, જકડી, જીદ્દી
stigma/સ્ટિગ્મા/કલંક, લાંછન, ડાઘ
stigmatise/સ્ટિગમૅટાઈઝ/
still /
still/સ્ટીલ/સ્થિર, હજુ
stimulant/સ્ટીમ્યુલન્ટ/ઉત્તેજક
stimulate/સ્ટિમ્યુલેઈટ/ઉત્તેજિત કરવું
stimulated
stimulus/સ્ટિમ્યુલસ/પ્રોત્સાહન, ઉત્તેજક, ઉદ્દીપન
sting /
sting/સ્ટિંગ/ડંખ, ડંશ, કરડવું
stingy/સ્ટિંગી/કંજુસ
stink /
stink/સ્પ/ગંધાવું, દુર્ગંધ
stint/સ્ટિન્ટ/કંજુસી કરવી, ઉપર છલ્લો અનુભવ
stipulate/સ્ટીપ્યુલેટ/કરાર કરવો, નિર્ધારિત કરવું
stipulation/સ્ટીપ્યુલેશન/કરાર, ઠરાવ ની શરતો
stir /
stir/સ્ટર/આંદોલનકરવું, હલાવવું
stir-up/સ્ટર અપ/હલચલ
stitch /
stitch/સ્ટિચ/ટાંકા લેવા, સીવવું
stock phrase
stock /
stock/સ્ટોક/શેર, જથ્થો
stoic/સ્ટોઈક/તપસ્વી, ધૈર્યવાન
stole /
stole/સ્ટોલ/ચોર્યું
stolid/સ્ટોલિડ/સુસ્ત, ભારેખમ
stomach /
stomach/સ્ટમક/પેટ, હોજરી
stone /
stone/સ્ટોન/પથ્થર, ફળના બી, પથ્થરી
stood/સ્ટૂડ/ઊભું રહ્યું
stooge/સ્ટૂજ/જંબૂરો, જોકર
stool /
stool/સ્ટૂલ/
stoop /
stoop/સ્ટૂપ/વાંકું વળવું(વર્તન)
stop by-વું
stop off-વું
stop over-વું
stop /
stop/સ્ટૉપ/અંત, બંધકરવું
store /

store/स्टोर/दुकान
storey/ /
storey/स्टोरी/भाण, मजलो
storm/ /
storm/स्टॉर्म/उल्ला करवो, वावाजोडुं
stormy peterel जंजावाती वकता
story/ /
story/स्टोरी/वाता
stout/ /
stout/स्टाउट/पडछंड, मजभूत
stove/ /
stove/स्टव/चूलो
stow/स्टोव/हांसीने भरवुं
strafing/स्ट्रेकिंग/
straight/ /
straight/स्ट्रेट/सीधुं
straighten out-वुं
strain/ /
strain/स्ट्रेन/ताण, श्रम, टूकी कविता
strait/ /
strait/स्ट्रेट/तंगी, संकट, सामुद्रधुनी
stranded/स्ट्रेंड/रजणी-रभडी पडया
strange/ /
strange/स्ट्रेंज/विचित्र
stranger/ /
stranger/स्ट्रेंजर/अजाण्युं, परायु
strangle/स्ट्रेंगल/गणुं दाभवुं
strangulation/स्ट्रेंग्युलेशन/गुंगणामण
strap/ /
strap/स्ट्रैप/पटो-बांधवो
strata/स्ट्रेटा/थर, पड (भ.व.)
stratagem/स्ट्रैटॅजॅम/छेतरवानी युक्ति
strategic/स्ट्रेटिजिक/व्युत्तान्मक
strategy/स्ट्रेटिजि/व्युत्त, दावपेच, युध्धनिती, कार्यकम
stratosphere/स्ट्रैटॉसफिअर/वायुआवरण
straw/ /
straw/स्ट्रॉ/तणभलुं, नणी
stray/स्ट्रे/रभडतुं-भटकतु, डरायुं डोर
streak/ /
streak/स्ट्रीक/लीसोटो
stream/ /
stream/स्ट्रीम/प्रवाह, जरणुं
streaming/स्ट्रीमिंग/
streamline/स्ट्रीमलाइन/डवानुं घषण निवारवुं
street/स्ट्रीट/शेरी, गली

strength/स्ट्रेन्थ/ताकात, शक्ति
strengthen/स्ट्रेंथन/मजभूत करवुं
strenuous/स्ट्रेन्युअस/श्रम पडे तेवुं
stress/स्ट्रेस/दबाण, श्रम, कष्ट, भार भूकवो

stretch/स्ट्रेच/लांबु करवुं, पटो
strew/स्ट/वेरवुं, पथरावुं
strewn
strict/ /
strict/स्ट्रिक्ट/कडक, सभत
stricture ढपकी, आरोपनामुं
stride/ /
stride/स्ट्राईड/चालवुं
strife/ /
strife/स्ट्राईफ/संघर्ष
strike back-वुं
strike chord
strike/ /
strike/स्ट्राईक/उडताल, फटकारवुं, टाटकवुं
strident/स्ट्रिडन्ट/कडक अवाजवाणुं
string along-वुं
string/ /
string/स्ट्रिंग/दोरी
stringent/ स्ट्रिजन्ट/कडक, चोककस
strip down-वुं
strip off भूंयवी लेवुं
strip/ /
strip/स्ट्रिप/पट्टी
stripe/ /
stripe/स्ट्राईप/पट्टा, लीसोटा
strive/ /
strive/स्ट्राईव/भूभ प्रयत्न करवो
stroke/ /
stroke/स्ट्रोक/फटको, टकोरो
stroll/स्ट्रोल/लटार मारवी
strong/ /
strong/स्ट्रॉंग/मजभूत
stronghold/स्ट्रॉंग डोल/डिल्लो, काभुनो प्रदेश
struck/ /
struck/स्ट्रक/टाटकवुं, फटकार्युं
structure/ /
structure/स्ट्रक्चर/रचना, बांधारण
struggle with-
struggle/ /
struggle/स्ट्रगल/संघर्ष
strum/स्ट्रम/तार जणजणवावा
strutter/स्ट्रटर/दमाम्बेर चालनार

stub/स्टब/
stubborn/स्टबर्न/जिद्दी, अकडक
stuck/स्टक/

student/ /
student/स्टयुडन्ट/विद्यार्थी
studies/ /
studious/स्टुडिअस/उद्यमी, पंतीलुं

study / /
study /સ્ટડી/અભ્યાસ કરવો
stuff / /
stuff /સ્ટફ/
stuffy /સ્ટ/ગીચ, ખીચોખીચ, બંધિયાર
stultify /સ્ટલ્ટીફાય/બગાડવું
stumble /સ્ટમ્બલ/ગોથુંખાવું, ઠેબું ખાવું
stumps / /
stumps /સ્ટમ્પ્સ/ડાંડી (ક્રિકેટ) ઢુંઠા
stun /સ્ટન/આંચકા દેવો, સ્તબ્ધ કરવું
stunned /સ્ટન્નડ/ભયભીત
stunning /સ્ટન્નિંગ/સ્તબ્ધ કરતું
stunt /સ્ટન્ટ/ખોટું પરાક્રમ-સાહસ
stupefied /સ્ટ્યુપિફાઈડ/જડ-બેવકૂફ બનાવવું
stupendous /સ્ટ્યુપેન્ડસ/પ્રચંડ અજબ, આશ્ચર્યજનક
stupid / /
stupid /સ્ટ્યુપિડ/મુર્ખ
stupour /સ્ટ્યુપર/
sturdy /સ્ટર્ડી/ખડતલ
sty /સ્ટાય/આંજણી
stygian નર્ક જેવું, અંધકારમય,
style / /
style /સ્ટાયલ/છટા, અદા, શૈલી
stylus /સ્ટાયલસ/હીરાકણી, લેખણ
stymie /સ્ટાઈમિ/નિષ્ફળ બનાવવું
suave /સ્વાવ/નમ્ર, વિવેકી
sub judice /સબ જ્યુડિસ/ન્યાયાધિન
sub rosa /સબ રોઝા/ગુપ્તરીતે
subcontinent /સબકોન્ટિનન્ટ/ઉપખંડ
subdue /સબડ્યુ/દબાવવું, ઘટારો થવો
subject to /સબ્જેક્ટ ટુ/ની શરતે, ને આધિન
subject / /
subject /સબ્જેક્ટ/પ્રજા, વિષય
subjective /સબ્જેક્ટિવ/વ્યક્તિલક્ષી, આત્મલક્ષી
subjugate /સબ્જુગેટ/જીતવું, દબાવવું
sublime /સબ્લાઈમ/ઉદાત, ઊંચું
submarine /સબમરીન/પનડુબી
submerge /સબમર્જ/ગરક થવું
submission /સબમિશન/શરણાગતી, રજૂઆત
submissive /સબમિસિવ/શરણાગતી સ્વીકારતું
submit /સબમિટ/રજૂ કરવું, શરણે થવું
subordinate
subordinate /સબઓર્ડિનેટ/નીચેના કર્મચારીઓ
subpoena /સબપોએના/કોર્ટ નું તેડું
subscribe /સબસ્ક્રાઈબ/સંમત થવું, લવાજમ ભરવું
subsequent /સબસીકવન્ટ/આનુસંગિક
subservient /સબસર્વિઅન્ટ/પુશામતિયું
subside /સબસાઈડ/ઘટવું, નરમ પડવું
subsidiary /સબસિડિઅરિ/ગોષ
subsidiise /સબસિડાઈઝ/રાહત આપવી

subsidy /સબસિડિ/આર્થિક રાહત
subsist /સબસિસ્ટ/ટકી રહેવું
substance / /
substance /સબસ્ટન્સ/
substantial /સબસ્ટેન્સિઅલ/
substantially
substitute /સબસ્ટિટ્યુટ/અવેજ, વિકલ્પ
subsume
subterfuge /સબટર ફ્યુજ/બહાનું
subtle /સફ્ટલ/સૂક્ષ્મ, નાજુક, ચાલાક
subtlety /સફ્ટલિટિ/સૂક્ષ્મતા, બારીકાઈ (અર્થ)
subtract / /
subtract /સબટ્રેક્ટ/બાદબાકી કરવી
suburb /સબઅર્બ/અર્ધશહેરી, પરું, ઉપનગર
subversion /સબવર્ઝન/રાષ્ટ્ર વિરોધી ભાંગફોડ
subversive /સબવર્સિવ/ભાંગફોડિયો
succeed / /
succeed /સકસીડ/સફળ થવું, અનુસરવું
success(ful) / /
success /સકસેસ/સફળતા
succession /સકસેઝન/વારસો, અનુક્રમ
successive /સકસેસિવ/આનુસંગિક, સતત
successor /સકસેઝર/વારસદાર, અનુક્રમ
succinct /સકસિન્ક્ટ/સચોટ, સંક્ષિપ્ત
succour /સકર/કુમક, મદદ, રાહત
succumb /સકમ/શરણે થવું
such / /
such /સચ/આવું,
suck / /
suck /સક/ચૂસવું
suckle /સકલ/ધવડાવવું
sudden(y) / /
sudden /સડન/એકાએક
sue /સ્યુ/કોર્ટ કેસ માંડવો
suffer from
suffer / /
suffer /સફર/ભોગવવું
suffered
suffice /સફાઈસ/પૂરતું હોવું
sufficient /સફિસન્ટ/પૂરતું, પર્યાપ્ત
suffocate /સફોકેઈટ/ગુંગળાવું
suffrage /સફરેજ/મતાધિકાર
sugar / /
sugar /સ્યુગર/ખાંડ
sugarcane / /
sugarcane /સ્યુગરકેન/શેરડી
suggest / /
suggest /સજેસ્ટ/સૂચવવું
suggestion /સજેસન્/સૂચન, સંકેત
suggestive /સજેસ્ટિવ/સૂચક

suicidal
suit(able)/ /
suit/સ્યુટ/બંધ બેસવું, અનુકૂળ હોવું
suitable/સ્યુટેબલ/યોગ્ય, લાયક
suite/ /
suite/સ્વીટ/શયન ખંડ+મુલાકાતી ખંડ
suitor/સ્યુટર/મુરતિયો, ઉમેદવાર
sulk/ /
sulk/સલ્ક/રીસાવું
sulking/સલ્કિંગ/રીસાતું
sullen/સલન/ઉદાસ, ગમગીન
sully/સલી/મલિન, ખરાબ કરવું
sultry/સલ્ટ્રી/સુકું-ગરમ (હવામાન)
sum up-વું
sum/ /
sum/સમ/દાખલો
summer/ /
summer/સમર/
summit/સમિટ/શિખર, ટોચ
summon up-વું
summon/સમન/તેડું-કહેણ મોકલવું
sumptuous/સમ્પ્યુઅસ/ભવકાદાર, ભવ્ય
sun(ny)/ /
sun/સન/સૂરજ
sundry/સન્ડ્રી/પરચૂરણ
sunny/સન્નિ/તેજસ્વી, પ્રકાશિત
suo moto/સ્યુઓ મોટો/સ્વયં, આપમેળે
superb/ /
superb/સુપર્બ/ઉત્તમ, શ્રેષ્ઠ
supercillious/સુપરસિલસ/મિજાજી, તિરસ્કાર કરતું
superficial/સુપરફિશિઅલ/ઉપરછલ્લું, છીછરું
superfluous/સુપરફલ્યુઅસ/વધારાનું, ફાજલ
superhuman/સુપરહુમન/મહામાનવ
superior/ /
superior/સુપીરિઅર/ચડિયાતું, ઉપરી
supersede/સુપરસીડ/ની ઉપરવટ જવું, રદ કરવું
superstition/સુપરસ્ટીશન/અંધશ્રદ્ધા
superstitious/સુપરસ્ટિશસ/અંધશ્રદ્ધાવાળું
supervise/સુપરવાઈઝ/નિરીક્ષણ કરવું
supine/સપાઈન/ચત્તું, વાંસાભેર
supper/ /
supper/સપ્પર/સાંજનું ભોજન
supplement/સપ્લિમેન્ટ/પૂર્તિ, પૂરવણી કરવી
supplicate/સપ્લિકેટ/અરજ-વિનવણી કરવી
supply/ /
supply/સપ્લાય/પુરવઠો, પૂરું પાડવું
support/ /
support/સપોર્ટ/ટિકો-સમર્થન, પાલન પોષણ
suppose/ /
suppose/સપોઝ/ધારવું, માની લેવું

suppress/સપ્રેસ/દબાવી-કચડી નાખવું, છુપાવવું
supremacy/સુપ્રીમસિ/સર્વોપરિતા
supreme/સુપ્રીમ/સર્વોચ્ચ
supremo/સુપ્રીમો/સર્વેસર્વા
sure/ /
sure/સ્યુઅર/ચોકકસ, અવશ્ય, નિશ્ચિત
surf/સર્ફ/સપાટી-મોજાં પર વિહાર કરવો
surface/ /
surface/સરફેસ/સપાટી, બહાર આવવું
surfeit/સરફીટ/અતિરેક(ખાવા પીવામાં)
surge/સર્જ/આગળ ધસી જવું, ઉછાળો
surly/સર્લી/તોછડું
surmise/સરમાઈઝ/અનુમાન, અટકળ
surmount/સરમાઉન્ટ/વટાવવું, પાર કરવું
surpass/સરપાસ/થી ચડીયાતા હોવું
surplus/સરપ્લસ/પુરાંત, ફાજલ, વધારાનું
surprise/ /
surprise/સરપ્રાઈઝ/આશ્ચર્ય
surrender શરણાગતિ, સર્મપણ, ત્યાગ
surreptitiously/સરિપ્ટિસ્યસલિ/છુપી રીતે
surrogate/સરોગેટ/ની બદલીમાં
surround/ /
surround/સરાઉન્ડ/ઘેરવું, આજુબાજુ
surveillance/સર્વેલન્સ/જાપતો, પહેરો, જાસૂસી
survey/સર્વે/અંદાજ-કાઢવો
survival/સર્વાઈવલ/બચાવ, જીવન સંઘર્ષ
survive/સર્વવાઈવ/ટકી, જીવી જવું
survivor/સર્વાઈવર/હયાત, જીવીત, બચી જનાર
susceptible/સસેપ્ટિબલ/સંવેદનશીલ
suspect/ /
suspect/સસ્પેક્ટ/શંકા કરવી, શંકમંદ
suspected/સસ્પેક્ટેડ/શંકાસ્પદ
suspend/સસ્પેન્ડ/વિલંબીત કરવું, લટકાવવું
suspense/સસ્પેન્સ/ઉત્સુકતા, દ્વિધા, કુતૂહલ
suspension/સસ્પેન્શન/વિલંબીત
suspicion/સસ્પિશન/શંકા, શક
suspicious/સસ્પિશસ/શંકાશીલ
sustain
sustain/સસ્ટેઈન/જાળવવું, સમર્થન આપવું, ટકી રહેવું, ભોગવવું
sustained/સસ્ટેઈન્ડ/એકધારું, સતત, ભોગ
svelte/સ્વેલ્ટ/ મનોહર, પાતળું, મોહક, લાવણ્યમય
swab/સ્વૉબ/ગાભો
swagger/સ્વૉગર/ગર્વભેર-દમમભેર ચાલવું
swallow up-વું
swallow/ /
swallow/સ્વૉલો/ગળી જવું, ચકલો
swamp/ /
swamp/સ્વૉમ્પ/નીચાણવાળી જમીન
swank/સ્વૉન્ક/છટાદાર, ડંફાસ મારવી
swankey/સ્વૉન્કિ/છટાદાર, બડાઈખોર

swap/સ્વૉપ/અદલાબદલી-કરવી
swashbuckling શેખીખોર, મવાલી
swath/સ્વૉથ/કાપેલો પુળો
sway તરફ ઝુકવું
sway / /
sway/સ્વેઈ/પ્રભાવ હોવો, સમજાવવું, ઝુલવું
swear in-/સ્વૉરિંગ ઈન્/વું
swear / /
swear/સ્વૉઅર/શપથ લેવા, ગાળો દેવી
sweat out-વું
sweat/સ્વેટ/પરસેવો થવો-પાડવો
sweep / /
sweep / /
sweep/સ્વીપ/સપાટો, વાળવું
sweet / /
sweet/સ્વીટ/મીઠું, ગળ્યું (સ્વાદ)
sweetheart/સ્વીટહાર્ટ/ચિત્તચોર
swell / /
swell/સ્વેલ/પૂર આવવું, ગર્વ, સોજો ચડવો
swerve back-સામો ઉતર વાળવો
swerve / /
swerve/સ્વર્વ/ગોળ ફરવું
swift / /
swift/સ્વીફ્ટ/ઝડપી
swim / /
swim/સ્વિમ/તરવું, ન્હાવું
swindle/સ્વિન્ડલ/છેતરવું, ઠગવું
swing / /
swing/સ્વીંગ/ઝુલવું, હિંચવું
swish/સ્વીશ/અવાજ (કપડાંનો)
switch back-વું
switch off/on-વું
switch over/સ્વીચ ઓવર/ફેરવવું, બદલાવવું
switch over-વું
switch round-વું
switch / /
switch/સ્વીચ/બદલાવવું, ચાંપ
switched/સ્વીચ્ડ/
swollen/સ્વોલન/સોજેલું, છલોછલ
swoon/સ્વૂન/મૂર્છાત-બેભાન થવું
swoop/સ્વૂપ/સપાટો, દરોડો-તરાપ મારવી
swop/સ્વૉપ/જોરદાર ફટકો-મારવો
sword / /
sword/સૉર્ડ/તલવાર
sybarite/સિબારાઈટ/વિલાસી, મોજશોખીલું
sycophant/સિક્ફન્ટ/પુશામતખોર, જહજુરિયા
syllabi
syllabus/સિલૅબસ/અભ્યાસક્રમ
sylvan (જૈનપચહ) ગ્રામીણ, વન્ય
symbol / /

symbol/સિમ્બલ/ચિન્હ, પ્રતિક
symbolic/સિમ્બૉલિક/ચિન્હરૂપ, પ્રતિકાત્મક
symmetrical/સિમેટ્રિકલ/સુડોળ, સુરેખ, ઘાટીલું
symmetry/સિમિટ્રી/સમરૂપતા, ઘાટ
sympathetic / /
sympathetic/સીમ્પથેટિક/સહાનુભુતિવાળું
sympathize/સિમ્પથાઈઝ/સહાનુભુતિ દર્શાવવી
sympathy / /
sympathy/સિમ્પથી/સહાનુભુતિ
symposium/સિમ્પૉઝિયમ/ચર્ચા, પરિસંવાદ
symptom/સિમ્પટમ/ચિન્હ, સંકેત, લક્ષણ
synchronise/સિન્ક્રનાઈઝ/સાથે બનવું
syndicate/સિન્ડિકેઈટ/મંડળી, સંઘ
syndrome/સિન્ડ્રમ/ચિન્હો, લક્ષણો
synonym/સિનનિમ/પર્યાય, સમાનાર્થી
synonymous/સિનોનિમસ/પર્યાય, સમાનાર્થી
synopsis/સિનોપ્સિસ/રૂપરેખા, ટૂંકસાર
syntax/સિન્ટૅક્સ/વાક્યરચના
synthetic/સિન્થેટિક/કૃત્રિમ રેસાનું
system / /
system/સિસ્ટમ/પદ્ધતી
systematic/સિસ્ટમેટિક/પદ્ધતિસર
table / /
table/ટ/પત્રક, મેજ
tableau/ટેબલૉ/ચિત્ર, મોડેલ
tabloid લઘુ અખબાર-વર્તમાનપત્ર
taboo નિષેધ, પ્રતિબંધ, મનાઈ
tabular કોઠાવાળું
tacit/ટેસિટ/મૂક, છાનું, ચૂપ
taciturn/ટેસિટર્ન/મૂક, અવ્યક્ત, મિતભાષી
tack/ટેક/જોડવું, સાઘવું
tackle/ટેકલ/સંભાળવું, કાબુમાં લેવું
tactical/ટેકટિકલ/વ્યૂહાત્મક
tactics/ટેકટિક્સ/દાવપેચ, વ્યૂહબાજી
tad/ટેડ/થોડુંક, અલ્પ
tail away/off-વું
tail / /
tail/ટ/પૂંછડી, પીછો કરવો
tailback/ટેઈલબૅક/ગીચોગીચ ટ્રાફિક જામ
taint/ટેઈન્ટ/ડાઘો, લાંછન
tainted
tainted/ટેઈન્ટેડ/કલંકિત, બદનામ
take aback-વું
take after / /
take after-વું
take apart-વું
take around-વું
take away-વું
take back-વું
take down / /

take down-વું
take home-વું
take in / /
take in/દિઈક ઈન/
take in-વું
take off / /
take off-વું
take on / /
take on/દિઈક ઓન/સામ સામે આવવું-ટકરાવું
take on-વું
take over / /
take over/દિઈક ઓવર/સંભાળી લેવું, હાથમાં લેવું
take / /
take/દિઈક/લેવું
tale / /
tale/દિઈલ/વાર્તા
talent / /
talent/ટેલેન્ટ/ભુદ્ધિ,
talisman/ટેલિઝમન/તાવીજ, માદળિયું
talk at talk-વું
talk away-વું
talk back-વું
talk down-વું
talk over-વું
talk round-વું
talk(ative) / /
talk/ટોક/વાત-કરવી
talks/ટોકસ/વાટાઘાટો
tall / /
tall/ટોલ/ઉંચું,
tallow/ટેલો/પ્રાણીની ચરબી
tally/ટેલિ/સરખાવવું, તાળો મેળવવો, પાટિયું
tame / /
tame/ટેઈમ/પાળેલું
tangle up-વું
tamper with-વું
tamper/ટેમ્પર/ચેડાં કરવા (લાખાણ)
tan / /
tan/ટેન/ચામડા જેવો રંગ
tandem/ટેન્ડેમ/એકની પાછળ બીજું
tangential
tangible/ટેન્જબલ/મૂર્ત, ઈદ્રિયગ્રાહ્ય
tangle/ટેન્ગલ/ગૂંચવાડો, સમસ્યા
tango/ટેન્ગો/dance
tank / /
tank/ટેન્ક/રણગાડી, તોપ, ટાંકી
tantalize/ટેન્ટલાઈઝ/ટટવાવું
tantamount/ટેન્ટેમાઉન્ટ/સમકક્ષ, સમાન, ના બરાબર હોવું
tantrum/ટેન્ટ્રમ/તરંગ, ધૂરી
tap / /

tap/ટેપ/ઉપયોગમાં લેવું, નળ, ટકોરા મારવા
tape / /
tape/ટેઈપ/પટ્ટી
tarantella ઈટાલિયન નૃત્ય
tardy
tare / /
tare/ટેઅર/
target નિશાન-બનાવવું, લક્ષ્યાંક, લક્ષ્ય
target / /
tariff/ટેરિફ/ભાવપત્રક
tarmac/ટારમૅક/ડામર
tarnish/ટાર્નિશ/લાંછન લગાડવું, કલંકિત કરવું
tarragon/ટેરાગોન/દવાઈ વનસ્પતિ
tart/ટાર્ટ/ખાટું, હલકટ સ્ત્રી
tartar/ટાર્ટર/છારી (દાંત)
task
task / /
task/ટાસ્ક/કાર્ય
taskmaster/ટાસ્કમાસ્ટર/કામ, શ્રમ કરાવનાર
tassel/ટેસલ/ફૂમડું
taste / /
taste/ટેઈસ્ટ/સ્વાદ
tasty/ટેઈસ્ટ/સ્વાદિષ્ટ
tatterdemalion ચિથરે હાલ
tattered/ટેટર્ડ/ચિથરેહાલ
tattle
tattoo ત્રાજવા-છૂદણાં ત્રોફાવવા, કવાયત
taunt/ટૉન્ટ/મેણા-ટોણાં મારવા
taut/ટાઉટ/ખેચીને તંગ-સખત કરવું
tautology/ટૉટૉલજી/પુનરુક્તિ
tavern/ટેવર્ન/ઘારૂં પીઠું
tawdry/ટૉડ્રી/ભપકાદાર દેખાવ
tax / /
tax/ટેક્સ/કર, બોજ-નાખવો
tax-evasion/ટેક્સ ઈવેઝન/કરચોરી
taxi / /
taxi/ટેક્સિ/ભાડાની મોટર
tea / /
tea/ટી/ચાય
teach / /
teach/ટીચ/શિખવવું, ભણાવવું
teacher/ટીચર/શિક્ષક
teak / /
teak/ટીક/સાગનું લાકડું
team / /
team/ટીમ/ટોળી, સંઘ, ટુકડી
tear apart-વું
tear away-વું
tear / /
tear/ટીઅર/આંસુ, ફાડવું, ચીરો

tease / /
tease/ટીઝ/ચીડવવું, પજવવું
technical / /
technical/ટિકનિકલ/તૈત્તિક
technique/ટિકનિક/યુક્તિ, કિમિયો
technocrat/ટિકનોક્રૉટ/તંત્રજ્ઞ
technology/ટિકનોલજી/તંત્રજ્ઞાન
techy ચિડીયું
tedious/ટિડીઅસ/કંટાળાજનક
tedium/ટિડીઅમ/કંટાળો
teem/ટીમ/ભરપૂર, છલોછલ હોવું
teeny/ટીનિ/નાનું
teeny-bopper/ટીનીબૉપર/ટાપટીપ કરતી છોકરી
teeny-weeny/ટીનિવીનિ/નાનું, ટચલી આંગળી
teeter/ટીધર/ડગુમગુ
teeth / /
teeth/ટીથ/દાંત, દાંતા
teetotaller/ટીટૉટલર/શરાબથી દૂર રહેતું
teetotum/ટીટૉટમ/નસીબ નું રમકડું
telegenic/ટેલિજીનીક/ટીવી માટે આકર્ષક ચહેરો
telepathy/ટેલિપથી/દૂરાનુભૂતિ, વિચાર-સંક્રમણ
telephone / /
televise/ટેલિવાઈઝ/ટીવી પ્રસારણ કરવું
television / /
tell off-વું
tell / /
tell/ટેલ/કોઈને કહેવું
temericious/ટિમેરિશિઅસ/ઉદ્ધત, ધૃષ્ટ
temerity/ટિમેરિટિ/ઉદ્ધતાઈ, ધૃષ્ટતા
temper / /
temper/ટિમ્પર/મિજાજ
temperament/ટિમ્પેરામેન્ટ/પ્રકૃતિ, સ્વભાવ
temperamental/ટિમ્પેરામેન્ટલ/પ્રકૃતિજન્ય
temperance/ટિમ્પરન્સ/સંયમ
temperate/ટિમ્પરેટ/સંયમી
temperature / /
temperature/ટિમ્પરેચર/તાપમાન
tempest/ટિમ્પેસ્ટ/ઝંઝાવાત, વાવાઝોડું
tempestuous/ટિમ્પેસ્ટ્યુઅસ/ઝંઝાવાતી, તોફાની
temple / /
temple/ટેમ્પલ/મંદિર
temporal/ટેમ્પૉરલ/દુન્યવી, પાર્થીવ
temporary / /
temporary/ટેમ્પરરિ/કામચલાઉ, હંગામી
tempt/ટેમ્પ્ટ/લલચાવવું
temptation/ટેમ્પ્ટેશન/લાલચ
tenable/ટેનૉબલ/સ્વીકાર્ય, સમર્થનિય
tenacious/ટેનૉશિઅસ/મકકમ, સ્થિર
tenament
tenancy/ટેનન્સિ/ભાડૂઆત

tend / /
tend/ટેન્ડ/મત-વલણ હોવું,
tendency / /
tendency/ટેન્ડન્સિ/વલણ, વૃત્તિ
tendentious/ટેન્ડેન્શિઅસ/પક્ષપાતી
tender / /
tender/ટેન્ડર/નાજુક, પ્રસ્તાવ, ચલણ, પાલન
tenebrous murky
tenets/ટેનેટસ/સિધ્ધાંતો, મત, માન્યતાઓ
tennis / /
tennis/ટેનિસ/રમત
tenor/ટેનર/હેતુ, મતલબ
tense / /
tense/ટેન્સ/કાળ, તંગ હોવું-કરવું-તાણવું
tension/ટેન્શન/તાણ, સંતાપ, સખત
ten-strike
tent / /
tent/ટેન્ટ/તંબુ, ડેરા
tentacles/ટેન્ટેકલ્સ/આંકડાઓ (વિંછી-કરોળિયો)
tentative/ટેન્ટેટિવ/અંદાજીત, કામચલાઉ
tenterhooks/ટેન્ટરહૂક્સ/અધ્ધરશ્વાસે, લટકતું
tenure/ટેન્યૉર/અવધિ, મુદત, ગાળો
tepid/ટેપિડ/નવશેકું
teraacotta/ટેરાકૉટા/પીળી માટીના વાસણ
termagant/ટરમૅગન્ટ/ઝગડાખોર સ્ત્રી
terminal/ટર્મિનલ/અંતનું, સત્રાંત
terminate/ટરમિનેટ/અંતઆણવો
terra firma/ટેરાફર્મા/નકકર જમીન
terrace / /
terrace/ટેરૅસ/છત, અગાસી
terrain/ટેરૅઈન/ભૂપ્રદેશ, જમીન
terrene પાર્થિવ, દુન્યવી
terrestrial/ટેરૅસ્ટ્રીઅલ/ધરતીનું, પાર્થિવ
terrible / /
terrible/ટેરિબલ/ભયાનક, બિહામણું
terrific/ટેરિફિક/ભયંકર, પ્રચંડ
terrified/ટેરિફાયડ/ભયભીત
terrify / /
terrify/ટેરિફાય/ભયભીત કરવું
territorial/ટેરિટૉરિઅલ/પ્રાદેશિક
territory/ટેરિટરિ/પ્રદેશ, મુલક
terror / /
terrorise/ટેરરાઈઝ/ભય ફેલાવવો
terrorist/ટેરરીસ્ટ/આતંકવાદી, ઉગ્રવાદી
terse/ટર્સ/સંક્ષિપ્ત, ટુંકું
tertiary/ટર્શરિ/ત્રીજી હરોળનું
test / /
test/ટ/કસોટી, પરીક્ષણ
testament/ટેસ્ટામન્ટ/ કરાર, દસ્તાવેજ
test-fire/ટેસ્ટફાયર/પ્રક્ષેપણ-પરીક્ષણ કરવું

testify/ટેસ્ટિફાય/સાક્ષી- પુરાવો દેવો
testimony/ટેસ્ટિમનિ/પુરાવો, સાબિતી
tether
tether
textile/ટેક્સટાઈલ/કાપડ
than/ /
than/થેન/ના કરતાં
thank(s)/ /
thank/થેન્ક/આભાર માનવો
that/ /
that/થેટ/તે(એ. વ.)
thatched/થેચ્ડ/
thaw out-વું
thaw/થો/પીગળવું, ઓગળવું
the/ /
theatre/ /
theatre/થીએટર/નાટ્યગૃહ
theft/થેફ્ટ/ચોરી, ઘરફોડી
their(s)/ /
their/ /
their/થેઅર/તેઓનું
theist/થીઈસ્ટ/શ્રદ્ધાળુ, ઈશ્વરમાં માનનાર
them(selves)/ /
them/થેમ/તેઓને
thematic/થીમેટિક/વિષયવસ્તુ નું
theme/ /
theme/થીમ/વિષય-કથા વસ્તુ
then/ /
then/થેન/પછી, ત્યારે
theoretical/થીઓરેટિકલ/શાસ્ત્રીય, સૈધાંતિક
theosophy/થીઓસોફી/ભકિતમાર્ગ, ઈશ્વરજ્ઞાન
therapy/થેરાપિ/
there/ /
there/થેર/ત્યાં
therefore/ /
therefore/થેરફર/તેથી
thesaurus/થીસોરસ/સમાનાર્થી/વિરુદ્ધાર્થી શબ્દકોષ
these/ /
these/ધીઝ/આ(બ. વ.)
thesis/થીસિસ/મહાનિબંધ,
Thespian/થેસ્પિઅન/નાટ્યકલાનું, નટ-નટી
thew સ્નાયુબળ
they/ /
they/થે/તેઓ
thick/ /
thick/થિક/ઘાટું, જાડું
thief/ /
thief/થીફ/ચોર
thieve/થીવ/ચોરી કરવી
thin out-વું

thin/ /
thin/થિન/પાતળું, આછું
thing/ /
thing/થિંગ/વસ્તુ, બાબત
thingummies/થિન્ગમીઝ/ફલાણું-ફલાણું, અમુક
think about-વું
think out/ /
think/ /
think/થિન્ક/વિચારવું, માનવું, મત હાવો
thinktank/થિન્કટૅન્ક/વિચારપ્રેરક બળ
third/ /
third/થર્ડ/ત્રીજું
thirst(y)/ /
thirst/થર્સ્ટ/તરસ, તૃષ્ણા
thirsty/થર્સ્ટિ/તરસ્યું
this/ /
this/થિસ/આ(એ. વ.)
thither
thong/થોંગ/વાઘરી, પટ્ટી
thorax/થોરેકસ/છાતીનો ભાગ
thorn/ /
thorn/થોર્ન/કાંટો
thorny/થોર્ની/કાંટાળું
thorough/ /
thorough/થરઃ/સંપૂર્ણ
thoroughfare/થરઃફેર/માર્ગ, રસ્તો
those/ /
those/થોઝ/તે-પેલા(બ. વ.)
though/ /
though/થોઊ/છતાં પણ
thought(ful)/ /
thousand/ /
thousand/થાઉઝન્ડ/એક હજાર
thrall/થ્રોલ/ગુલામ
thrash/ /
thrash/થ્રેશ/ફટકારવું
thread/ /
thread/થ્રેડ/દોરો, આંટા
threadbare/થ્રેડબેઅર/જીર્ણ, જર્જરિત
threat(en)/ /
threat/થ્રેટ/ધમકી, ભય
threaten/થ્રેટન/ધમકી આપવી, ભય ફેલાવવો
three/ /
three/થ્રી/ત્રણ
thresh/થ્રેશ/ફટકારી ને અનાજ છુટું પાડવું
threshold/થ્રેશોલ્ડ/ઉંબરો, ધાર
threw/ /
threw/થ્રીયુ/ફેંક્યું
thrice/ /
thrice/થ્રાઈસ/ત્રણવાર

thrifty/થ્રિફ્ટિ/કરકસરીયું

thrill/

thrill/શ્રીલ/ધ્રુજારી, કંપારી, ઝણઝણાટ

thrilling/થ્રિલિંગ/ધ્રુજારી, કંપારી, ઝણઝણાટ

thrive/

thrive/શ્રાઈવ/સમૃદ્ધથવું

throat/

throat/થ્રોટ/ગળું, ગરદન

throb/થ્રોબ/ઘબકવું

throes/થ્રોઝ/તીવ્રવેદના

throne/થ્રોન/સિંહાસન, રાજગાદી

throng/

throng/થ્રોંગ/ભીડ થવી, ઘસી જવું

throttle/થ્રોટલ/ગૂંગળાવવું

through/

through/થરઃ/સંપૂર્ણ

throw at-

throw away-વું

throw/

throw/થ્રો/ફેંકવું, ધા-કરવો

thrum/થ્રમ/આડેઘડ વગાડવું

thrush/થ્રશ/મોઢું આવી જવું

thrushes

thrust/થ્રસ્ટ/જોર, ધકકો

thud/

thud/થડ/ધ્રુજારી, ઘડ ઘડ અવાજ

thug/ઠગ/લૂંટારો,

thumb/

thumb/થમ/હાથનો અંગુઠો

thumbnail/થમ્સનેઈલ/ઢુંકુ, ખીલો

thumbs-up/થમ્સ અપ/મંજુર રાખવું

thumping/થમ્પિંગ/સખત ફટકો

thunder/

thunder/થંડર/મેઘગર્જના

thurable/થરિબ્લ/ધૂપદાની

thus/

thus/થસ/આ રીતે, આમ

thwart/થ્વાર્ટ/ઊંધું વાળવું, નમવું

thyroid/થાયરોડ/કંઠમાળ

tiaara/ટિએરા/માથાનો તાજ, મુકુટ

tick off-વું

tick over-વું

tick/

tick/ટિક/ટક અવાજ, ઠંનિશાની

ticket/

ticket/ટિકિટ/ટિકિટ

tickle/ટિકલ/ગલગલિયાં કરવા

tidal/ટાઈડલ/દરિયાની ભરતી-ઓટનું

tide over-વું

tide/

tide/ટાઈડ/દરિયાની ભરતી, ઓટ

tidings/ટાઈડિંગ/સમાચાર

tidy/

tidy/ટાઇડી/વ્યવસ્થિત

tie/

tie/ટાઈ/બાંધવું

tier/

tier/ટીઅર/સ્તર, શ્રેણી

ties/ટાઈઝ/સંબંધો, જોડાણ

tie-up/ટાઈ અપ/જોડાણ

tiff/

tiff/ટિફ/ઝગડો, વિવાદ

tiffin/ટિફિન/ભાતું

tiger/

tiger/ટાઈગર/વાઘ

tight/

tight/ટાઈટ/સખત, તંગ

tighten/ટાઈટન/સખત બનાવવું

tight-lipped ચૂપ, મોઢું બંધ રાખવું

tile/

tile/ટાઈલ/નળીયું, ઢાંકણું

till/

till/ટિલ/ત્યાં સુધી ખેડવું, દુકાનનો ગલ્લો

tilt/ટિલ્ટ/નમાવવું, ઝુકાવ

timber/ટિમ્બર/લાકડું

timbrel ઢોલકી, ખંજરી

time/

time/ટાઈમ/સમય

time-frame/ટાઈમ/સમયમર્યાદા

times/ટાઈમ્સ/સમય, વખત

timid/ટિમિડ/ભીરૂ, ડરપોક

timorous/ટિમરસ/ભીકણ

timpano/ટિમ્પાનો/નગારૂ

tin/

tin/ટિન/પતરૂ, ડબલું

tinge/ટિંગ/છાંટ, છાયા, આભાસ

tinged/ટિન્જડ/ છાંટવાળું

tinkle/ટિન્કલ/ખણખણાટ

tinsel/ટિન્સલ/ચમકતું, તકલાદી

tint/ટિન્ટ/છાંટ, છાયા

tiny/

tiny/ટાઇનિ/નાનું, નાજુક

tip off/ટિપઓફ/બાતમી આપવી

tip/

tip/ટિપ/બક્ષિસ, ટેરવું, ટોચ

tips/ટિપ્સ/સૂચના, માર્ગદર્શન

tipsy/ટિપ્સિ/પીથેલું, છાકટું

tirade/ટિરેડ/બકવાશ

tired/

tired/ટાઇર્ડ/થાકેલું

Titan**titanic**/ટાઇટનિક/વિરાટ**titbits**/ટિટબિટ્સ/રસિક સમાચાર**titillate**/ટિટિલેઇટ/ગલગલિયાં કરવાં**titivate**/ટિટિવેઇટ/ટાપટીપ કરવી, શણગારવું**title** / /**title**/ટાઇટલ/હોદ્દો, મથાળું, હક્ક**tits**/ટિટ/ડિટડી**titter**/ટિટર/મનમાં હસવું**tittle**/ટિટલ/ગપ્પા મારવા**tittle-tattle**/ટિટલ-ટૅટલ/ગપસપ**tizzy**/ટિઝી/ભોભ, ગભરામણ, ઉશ્કેરાટથી ચિતભ્રમ**tobacco** / /**tobacco**/ટબૅકો/તમાકુ**today** / /**toddler**/ટોડલર/પા-પા પગલી ચાલતું બાળક**toddy**/ટોડી/તાડી**toe** / /**toe**/ટૅ/પગનો પંજો**together** / /**together**/ટુગેઘર/સાથે, ભેગા, એકઠા**toil** / /**toil**/ટૅઇલ/શ્રમ કરવો, વૈતરું કરવું**toilet** / /**tolerable**/ટોલરબલ/સહન થઈ શકે તેવું**tolerance**/ટૅલરન્સ/સહનશક્તિ**tolerant**/ટૅલરન્ટ/સહનશીલ**tolerate**/ટોલરેઇટ/સહનકરવું**toll** / /**toll**/ટોલ/ખુવારી, ભોગ, નાકું, ઘંટ**tomato** / /**tomato**/ટમાટો/ટમેટાં**tomb**/ટૂમ/કબર**tombola**/ટમ્બોલા/ખાનાવાળી લોટરી**tomorrow** / /**tomorrow**/ટુમૅરૉ/આવતીકાલ**ton**/ટન/ઝડપ, હજાર કિલો**tone down**-વું**tone** / /**tone**/ટોન/**tongue-tied**/ટન્ગ ટાઇડ/મૂંઝુ, વાચાવિહીન**tongue** / /**tongue**/ટન્ગ/જીભ, ભાષા**tonight** / /**tonight**/ટુ નાઇટ/આજે રાત્રે**tonne** / /**tonne**/ટન/હજાર કિલો**tonsure**/ટૅન્શર/મૂંડન કરવું, ટકો કરવો**too** / /**too**/ટૂ/વળી, પણ**took** / /**tool** / /**tool**/ટૂલ/ઓજાર, સાધન**tooth** / /**tooth**/ટૂથ/દાંત, દાંતો**top most**/ટોપમૉસ્ટ/સર્વોચ્ચ**top** / /**top**/ટોપ/ઉચ્ચ, વધી જવું, ભમરડો**topbrass**/ટોપબ્રાસ/ઉચ્ચ પોલીસ-લશ્કરી અધિકારી**topography**/ટૅપોગ્રાફી/ભૌગોલિક લક્ષણો**topple**/ટૅપલ/ઉથલાવવું**topsy-turvy**/ટોપ્સીટર્વી/ઊંચુંચતું, મુંજાયેલું**torch** / /**torch**/ટોર્ચ/મશાલ, આગ ચાંપવી**tore** / /**torment**/ટોર્મેન્ટ/ત્રાસ-પીડા આપવી**torn** / /**torn**/ટોર્ન/ફાટેલું, ચીરાયેલું**tornado**/ટોર્નેડો/ઝંઝાવાત, વાવાઝોડું**torpedo**/ટોપિડો/સમુદ્ર ની તોપ, વ્યર્થ બનાવવું**torpid soosupt****torpor**/ટોરપાર/જડતા**torrent**/ટોરન્ટ/ઘોઘ**torrential**/ટોરેન્શલ/ઘોઘમાર**torrid**/ટોરન્સ/બળી ગયેલું**torso**/ટોર્સો/માનવઘડ-શરીર**torts**/ટોર્ટ્ઝ/અપકૃત્ય**torture**/ટોર્ચર/જુલમ-પીડા આપવી**torturous**/ટોર્ચરસ/જુલમી**tosh**/ટૅશ/બકવાસ**toss**/ટોસ/ઉછાળવું**total** / /**total**/ટોટલ/કુલ, સંપૂર્ણ**totalitarian**/ટૅટૅલિટૅરિઅન/એકહથ્થુ**totalitarian**/ટૅટૅલિટૅરિઅન/એકહથ્થુ શાસન**totems**/ટોટેમ/પ્રતિકાત્મક સ્તંભ**totter**/ટોટર/ડગમગ થવું**totting**/ટોટિંગ/હાથમા લઈનેફરતું**touch off** / /**touch** / /**touch**/ટચ/સ્પર્શ, સંપર્ક, ઠીકઠાક કરવું**touchable** સ્પર્શી શકાય તેવું**touchy**/ટચિ/અતિ લાગણીશીલ, વેવલું**tough** / /**tough**/ટક/મજબૂત, કઠણ, સખત**toughen up**-વું**tour** / /**tour**/ટૂઅર/પ્રવાસ, યાત્રા**tourist** / /**tourist**/ટુરિસ્ટ/પ્રવાસી, યાત્રાળું

tourney/ટર્ની/ટુર્નામેન્ટ
tousel/ટોસેલ/કેંદવુ
tout / /
tout/ટાઉટ/દલાલ(ગ્રાહક શોધી લાવનાર)
tow / /
toward
toward(s) / /
towards/ટુઅર્ડ્ઝ/ની બાબતે, તરફ
tower / /
tower/ટાવર/ઉંચો સ્તંભ
town / /
town/ટાઉન/કસબો
townee/ટાઉની/શહેરીજન
toxic/ટોક્સિક/ઝેરી
toy / /
toy/ટોય/રમકડું, રમત કરવી
trace/ટ્રેઇસ/નિશાની, ચિન્હ, શોધી કાઢવું
track down
track down/ટ્રેકડાઉન/શોધી કાઢવું
track / /
track/ટ્રેક/માર્ગ, રસ્તો
tractor / /
tractor/ટ્રેક્ટર/ટ્રેક્ટર
trade / /
trade/ટ્રેઇડ/વેપાર, લે વેચ
tradition(al) / /
tradition/ટ્રેડિશન/રૂઢિ, પ્રણાલી
traditional/ટ્રેડિશનલ/રૂઢીગત, પ્રણાલીકાગત
traduce/ટ્રેડ્યુસ/નિંદા કરવી
traffic / /
traffic/ટ્રાફિક/વાહન વ્યવહાર
trafficking/ટ્રાફિકિંગ/હેરાફેરી
tragedy/ટ્રેજેડિ/કરુણાતિકા, કરુણ ઘટના-બનાવ
tragic / /
tragic/ટ્રેજિક/કરુણ, કરુણાતિક
trail / /
trail/ટ્રેઇલ/લીસોટો, લીટા
train / /
train/ટ્રેઇન/તાલિમ, ગાડી, અનુક્રમ, રસાલો
traitor/ટ્રેઇટર/દગાબાજ
trajectory/ટ્રેજેક્ટરી/પડતા પદાર્થ ની માર્ગ રેખા
tramp / /
tramp/ટ્રેમ્પ/રખડું, ભટકવું
trample/ટ્રેમ્પલ/પગનીચે કચડવું
trance/ટ્રેન્સ/સંમોહન
tranquil/ટ્રેન્કવિલ/શાંત, સૌમ્ય
tranquelize/ટ્રેન્કવિલાયત/શાંત પાડવું
transaction/ટ્રાન્ઝેક્શન/લેવડ દેવડ
transcend/ટ્રાન્સેન્ડ/ઉપર ચડવું, પાર જવું-કરવું
transcendental/ટ્રાન્સેન્ડેન્ટલ/ઉર્ધ્વગામી

transfigure/ટ્રાન્સફિગર/સ્વરૂપ-પરિવર્તન થવું
transfix/ટ્રાન્સફિક્સ/ભાલા થી વિંધવું
transform/ટ્રાન્સફોર્મ/રૂપાંતર કરવું
transfusion/ટ્રાન્સફ્યુઝન/પ્રવાહી બદલો
transgress/ટ્રાન્સગ્રેસ/વિષયાંતર કરવું
transient/ટ્રાન્ઝિઅન્ટ/ક્ષણિક, ક્ષણભંગુર
transit/ટ્રાન્ઝિટ/માર્ગ, આગળ જવું
transition/ટ્રાન્ઝીશન/સંક્રમણકાળ
translate / /
translate/ટ્રાન્સલેટ/અનુવાદ કરવો
translucent/ટ્રાન્સલ્યુસન્ટ/અર્ધપારદર્શક
transmit/ટ્રાન્સમિટ/સંકેતો દ્વારા પાઠવવું
transmogrification/ટ્રાન્સમોર્ગીફિકેશન/રૂપાંતર
transparency/ટ્રાન્સપેરેન્સિ/પારદર્શકતા
transparent / /
transparent/ટ્રાન્સપેરન્ટ/પારદર્શક
transpire/ટ્રાન્સપાયર/છતું થવું, જાહેર થવું
transport/ટ્રાન્પોર્ટ/બીજે મોકલવું
trap / /
trap/ટ્રેપ/જાળ, છટકું, ફસાવવું
trapping
trash/ટ્રેશ/કચરો, હલકું, બકવાશ
trauma/ટ્રોમા/આઘાત
travail/ટ્રાવેઇલ/પીડા, સખત મહેનત
travel / /
travel/ટ્રાવેલ/પ્રવાસ, યાત્રા
travelogue/ટ્રાવેલોગ/પ્રવાસ-લેખ
traverse/ટ્રાવર્સ/આરપાર
travesty/ટ્રાવેસ્ટી/વિડંબના
tray / /
tray/ટ્રેયાળી
treacherous/ટ્રેચરસ/કપટી, દગાબાજ
treachery/ટ્રેચરિ/છળ, કપટ, દગો
treacle/ટ્રીકલ/ગોળ, મોલાસીસ
tread/ટ્રેડ/ધમધમ ચાલવું, કચડવું
treadmill/ટ્રેડમિલ/કંટાળાજનક કામ, ઘાણી
treason/ટ્રીઝન/રાજદ્રોહ
treasure/ટ્રેઝર/ખજાનો
treat(ment) / /
treat/ટ્રીટ/ગણવું, વર્તવું, માવજત કરવી
treatise/ટ્રીટાઇઝ/મિમાંસા, સંશોધન લેખ
treatment/ટ્રીટમેન્ટ/સારવાર, ઈલાજ, વર્તન
treaty/ટ્રીટી/કરાર, સમજૂતી
tree / /
tree/ટ્રી/ઝાડ
trek / /
trek/ટ્રેક/ચાલવાનો આકરો માર્ગ
tremble / /
tremble/ટ્રેમબલ/ઘુઘવું
tremendous/ટ્રિમેન્ડસ/જબરદસ્ત, ખૂબ વગારે

tremolo/ટ્રેમોલો/કંપન સ્વર
tremor/ટ્રિમર/ઘુંચારી, આંચકા
trench/ટ્રેન્ચ/ખાઈ
trend/ટ્રેન્ડ/વલણ, ઝોક
trend-setter/ટ્રેન્ડસેટર/ચીલો પાડનાર
trendy/ટ્રેન્ડિંગ/અદ્યતન ફેશન વાળું
trespass/ટ્રેસપાસ/પેશકદમી
triad/ટ્રાયડ/ત્રિખંડ, ત્રિપુટી
trial/ /
trial/ટ્રાયલ/ખટલો, અજમાયેશ
triangular/ટ્રાયંગ્યુલર/ત્રિકોણિયું
tribal/ /
tribal/ટ્રાયબલ/આદિવાસીઓનું
tribe/ /
tribe/ટ્રાયબ/આદિવાસી, જાતી
tribulations/ટ્રીબ્યુલેશનસ/વિટંબણાઓ
tribunal/ટ્રાયબ્યુનલ/ખાસ ન્યાયપંચ
tributary/ટ્રિબ્યુટરિ/ઉપનદી, ખંડણી ચૂકવનાર
tribute/ટ્રિબ્યુટ/ખંડણી, અંજલી, વખાણ
trick/ /
trick/ટ્રિક/યુક્તિ, ચાલાકી
trickle/ટ્રિકલ/પ્રવાહી વહેવું, ટપકવું
tricolour/ટ્રાયકલર/ત્રિરંગો
trident/ટ્રિડન્ટ/ત્રિશુળ
trifle/ટ્રાયફલ/નજીવી બાબત
trigger/ટ્રિગર/પ્રક્રિયા શરૂ કરવી, ઘોડો (બંદુક)
triggered/ટ્રિગર્ડ/પ્રક્રિયા શરૂ કરી, ઘોડો દબાવ્યો
trigger-happy ગોળી છોડવા ઉત્સુક
trim/ /
trim/ટ/કાપકૂપીને ઠીક કરવું
trio/ટ્રાયો/ત્રિપુટી, ત્રણ જણા
trip over- ગોઠું ખાવું
trip/ /
trip/ટ્રિપ/પ્રવાસ, ફેરો, ગોઠું ખાવું
tripartite/ટ્રિપાર્ટીટ/ત્રિપક્ષીય
trip/ટ્રાયપ/બકવાસ, કચરો,
trireme/ટ્રાયરીમ/યુધ્ધજહાજ
trisect/ટ્રાયસેક્ટ/ત્રણભાગ કરવા
trite/ટ્રાયટ/ચવાઈ-ઘસાયી ગયેલું
triumph/ટ્રાયમ્ફ/વિજય, જીત
triumphant/ટ્રાયમ્ફન્ટ/વિજેતા
triumphed/ટ્રાયમ્ફડ/જીત મેળવી
triumvirate/ટ્રાયમ્વિરેટ/ત્રિપુટી
trivet/ટ્રાયવેટ/ત્રણ પગવાળી ઘોડી
trivia/ટ્રિવિઆ/નજીવી બાબતો
trivial/ટ્રિવિઅલ/નજીવું, છલ્લક
trivialisation/ટ્રિવિઅલાઇઝેશન/
trolley/ /
trolley/ટ્રોલી/નજીવું, શુલ્લક
troop/ /

troops/ટ્રૂપસ/સેના, લશ્કર, દળ
tropical/ /
tropical/ટ્રોપિકલ/ગરમ પ્રદેશ નું
trot out-વું
trot/ટ્રોટ/
trotting/ટ્રોટિંગ/ઘોડાની ચાલ
trouble shooter
trouble/ /
trouble/ટ્રબલ/મુશ્કેલી, મુસિબત
trough/ટ્રાઉ/હવાડો, ચાટ
trounce/ટ્રાઉન્સ/સજૂજડહાર, કારમો પરાજય, ઠપકો
troupe/ /
troupe/ટ્રૂપ/કલાકાર મંડળી-વૃંદ
trousers/ /
trousseau/ટ્રૂસો/કરિયાવર
truant/ટ્રૂઆન્ટ/તોફાની-ભણવાથી ભાગતું બાળક
truce/ટ્રૂસ/સંધિ, યુધ્ધવિરામ
truck/ /
truck/ટ્રક/ખટારો, જોડાણ
trudge/ટ્રજ/ઢસડાવું
trudging/ટ્રજિંગ/ઢસડાતા ચાલવું
true/ /
true/ટ્રૂ/સાચું, અસલી
true-blue/ટ્રૂ બ્લુ/
trump/ટ્રમ્પ/હુકમનું પાનું, હંફાવવું
truncate/ટ્રન્કેટ/કાપકૂપ કરવી
truncheon/ટ્રન્ચન/દંડો, બડીકો
trundle/ટ્રંડલ/ઘડઘડ અવાજથી ચાલતું
trunk/ /
trunk/ટ્રંક/સુંઢ, થડ, ઘડ, મુખ્ય
trust(worthy)/ /
trust/ટ્રસ્ટ/વિશ્વાસ, ભરોસો
trustworthy/ટ્રસ્ટવર્થિ/વિશ્વાસપાત્ર
truth(ful)/ /
truth/ટ્રુથ/સત્ય
try for-વું
try on-વું
try out-વું
try/ /
try/ટ્રાય/કોશિષ, કામ ચલાવવું
tryst/ટ્રિસ્ટ/નિર્ધારીત મુલાકાત-મિલન
tsunami/સુનામિ/ભૂકંપસર્જીત મોજું
tub/ /
tub/ટબ/સ્નાનકુંડી
tube/ /
tube/ટ્યુબ/નળી, ભૂંગળું
tubectomy/ટ્યુબેક્ટોમિ/વંધ્યકરણ
tuck/ /
tuck/ટક/નાસ્તો, સંકેલીને મૂકવું
tuft/ટફ્ટ/વાળનું ઝુમખું, ગુચ્છો

tug of war/ટગ ઓવ વૉર/ખેચાખેચી, વેરઝેર

tug/ /

tug/ટગ/ખેચવું, બોટ

tuition/ /

tuition/ટયુશન/ઉપશિક્ષણ, અનુશિક્ષણ

tumble/ /

tumble/ટમ્બલ/ગોથું ખાવું

tumour/ટયુમર/ગાંઠ

tumultuous/ટયુમલ્ટસ/ખળભળાટવાળું, તોફાની

tune/ /

tunnel/ટનલ/ભુગર્હ,

turban/ટર્બન/પાઘડી

turbid/ /

turbid/ટર્બિડ/ડહોળું, રગડા જેવું

turbulence/ટર્બ્યુલન્સ/તોફાન

turbulent/ટર્બ્યુલન્ટ/તોફાની મચાવનારું

turgid/ /

turgid/ટર્જિડ/સોજેલું, આડંબરી

turmeric/ટર્મેરિક/હળદર

turmoil/ટર્મોઇલ/અંધાધૂંધી, અરાજકતા

turn against-વું

turn back-વું

turn down/ /

turn down/ટર્ન/ઇન્કાર કરવો

turn down-વું

turn in/ /

turn in-વું

turn off/ /

turn off-વું

turn on/ /

turn on-વું

turn out/ /

turn out/ટર્ન/બહાર આવવું, બનવું

turn over/ /

turn over/ટર્ન/ઊંઘ પડવું

turn round-વું

turn turtle/ટન ટર્ટલ/ઉથલી જવું, ગોથું ખાવું

turn up/ /

turn up-વું

turn/ /

turn/ટર્ન/ફિરો, વારો

turn-coat/ટર્ન/પક્ષ-પાટલી બદલુ

turnip/ટર્ન/સલગમ

turnkey/ટર્નકી/યંત્રસામગ્રી+સંચાલન કરાર

turnstile/ટર્નસ્ટાઇલ/ગોળ ફરતો દરવાજો

turpitude/ટર્પિટ્યુડ/બ્રષ્ટતા, અધમતા

turtle/ટર્ટલ/કાચબો

tusks/ /

tusks/ટસ્ક/હાથી ના દંતશૂળ

tutorial/ટ્યુટોરિઅલ/

tweak/ટવીક/

tweedle/ટવીડલ/

tweedledum/ટ/

twice/ /

twice/ટવાઇસ/બે વાર

twidled/ટવિડલ/

twilight/ટવાઇલાઇટ/સંધ્યા

twin/ /

twin/ટવિન/જોડકું, દ્વિ, જોડયું

twinkle/ટવિન્કલ/ઝબુકવું-ચમકવું

twist/ /

twist/ટવિસ્ટ/મરડવું

twit/ટવિટ/મહેણું

two/ /

two/ટૂ/બે(સંખ્યા)

two-fold/ટૂફોલ્ડ/બેવડું

tycoon/ટાયકૂન/ધૂરંધર વેપારી

type/ /

type/ટાઇપ/નમૂનો, અક્ષર

typical of

typical/ /

typical/ટિપિકલ/નમૂનેદાર, લાક્ષણિક

tyrannical/ટીરનિકલ/જુલમી

tyrannize/ટીયરનાયઝ/જુલમ કરવો

tyrant/ટાયરન્ટ/જુલમગાર

tyre/ /

tyre/ટાયર/રબ્બરનું પૈડું

tyro/ટાયરો/શિખાઉ, નવાણિયો

ubiquitous/યુબિકવિટસ/સર્વવ્યાપક, સાર્વત્રિક

ugly/અગ્લી/કદરૂપું, બિહામણું

ulcer/અલ્સર/ચાંદુ, ગુમડું

ulterior/અલ્ટીરીઅર/ગુપ્ત, અવ્યક્ત, સામે પારનું

ultimate/અલ્ટિમેઇટ/આખરી, અંતિમ

ultimatum/અલ્ટિમેટમ/આખરીનામું

ultra vire/અલ્ટ્રાવાયર/સતા-અધિકાર બહારનું

ultra/અલ્ટ્રા/આતંકવાદી, ઉગ્રવાદી

ultrasonic/અલ્ટ્રાસોનિક/અવાજથી વધુ ગતિ વાળું

umbra/અમ્બ્રા/સુર્યના ડાઘાનો મધ્યભાગ

umbrage/અમ્બ્રિજ/ગુનો, અનાદર, અપમાન

umbrella/ અમબ્રેલા/ છત્રી, રક્ષણ

umpteenth/અમપ્ટીન્થ/પુષ્કળ, મોટી સંખ્યામાં

umsy/કલમ્બી/કઢંગું

unambiguous/અનઅંબિગ્યુઅસ/સ્પષ્ટ, ચોખ્ખું

unanimity/યુનેનિમિટી/સર્વાનુમતી, એકમત

unanimous/યુનેનિમસ/સર્વાનુમત, સર્વસંમત

unassuming/અનઅંઝયુમિંગ/નમ્ર, નિરાભિમાની

unbearable/અનબૅરબલ/અસહ્ય

unbeatable/અનબિટૅબલ/અજેય

unbridled/અનબ્રિડલ્ડ/અમર્યાદ, બેફામ

uncalled for/અનકૉલ્ડફૉર/બિન જરૂરી

uncanny/અનકંનિ/વિચિત્ર, ગૂઢ, અગોચર
unceremonious/અનસેરિમોનિઅસ/અવિધિસર
uncle/અંકલ/કાકા, મામા વગેરે
unconfirmed/અનકન્ફર્મ્ડ/અનઆધારભુત
unconscious/અનકોન્સિઅસ/બેભાન
uncouth/અનકૂથ/અસંસ્કારી, તોછડું
unction/અન્કશન/આમ, મલમ
unctuous/અન્કટ્યુઅસ/પુશામતીયું, દંભી, ચીકણું
undaunted/અન્ડોન્ટેડ/બહાદુર, હિંમતવાળું
undemarcated/અનડિમાર્કેટેડ/
under/અંડર/નીચે
underestimate/અંડર એસ્ટિમેટ/ખોટો અંદાજ કાઢવો
undergo/અંડરગો/માં થી પસાર થવું
underlie/અંડરલાય/ગભિત, માં રહેવું
undermine/અંડરમાઈન/મૂલ્ય ઓછું કરવું
understand/અંડરસ્ટેન્ડ/સમજવું
undertake/અંડરટેઈક/હાથમાં લેવું
undertrial/અંડરટ્રાયલ/કાચા કામનો કેદી
underworld/અંડરવર્લ્ડ/અંધારી આલમ
underwriter/અંડરરાઈટર/વીમા-બાંહેધરી દલાલ
undesirable/અનડિઝાયરેબલ/અનિચ્છનીય
undettered/અનડિટર્ડ/વણથંભ્યા-અટકયુ
undo/અનડુ/પૂર્વવત કરવું
unearth/અનઅર્થ/શોધી કાઢવું
unequivocal/અનઈકવિવોકલ/સ્પષ્ટ
unexpected/અનઈકસ્પેક્ટેડ/અણધાર્યું
unfavourable/અનફૅવરબલ/વિપરિત
unfazed/અનફૅઈઝ્ડ/વિચલિત ન થયેલું
unforseen/અનફોરસીન/અણધાર્યું
unfortunate/અનફોર્ચ્યુનેટ/કમનસીબ
unfurl/અનફર્લ/ફરકાવવું
uniform/યુનિફોર્મ/ગણવેશ, એકરૂપ
unify/યુનિફાય/એક કરવું
unilateral/યુનિલૅટરલ/એકપક્ષી
uninhabited/અન ઈનહેબિટેડ/નિર્જન, ઉજ્જડ
union/યુનિઅન/એકતા, રાજ્ય, સંઘ
unique/યૂનિક/બેજોડ, અજોડ
unisex/યુનિસેક્સ/સર્વલીંગી
unison/યુનિઝન/એકસુર-રાગ, સંપ
unit/યુનિટ/માપ, નંગ, એકમ
unite/યુનાઈટ/એકત્રિત થવું
universal/યુનિવર્સલ/સર્વવ્યાપી, વિશ્વવ્યાપક
universe/યુનિવર્સ/બ્રહ્માંડ
university / /
unkempt/અનકેમ્પ્ટ/અસ્તવ્યસ્ત
unkind/અનકાઈન્ડ/ક્રૂર, નિદર્થ
unknowingly/અન્નોઈંગલિ/અજાણતા
unleash/અનલીશ/છુટ્ટુમુકવું
unless(if not) જો નહિં તો
unmanned/અનમૅન્ડ/માણસ વિનાનું

unmasked/અનમાસ્કડ/પર્દાફાસ કર્યો
unmistakably/અનમિસ્ટેકેબલ/અચૂકપણે
unmitigated/અનમિટિગેટેડ/ઓછું ન થયેલું
unnerve/અનનર્વ/હિમ્મત હારવી, ઢીલુ પડવું
unparalleled/અનપૅરેલેડ/બેજોડ
unpardonable/અનપાર્ડનેબલ/માફી નેઅયોગ્ય
unprecedented/અનપ્રિસિડેન્ટેડ/અભૂતપૂર્વ
unravel/અનરૅવલ/ગૂંચ ઉકેલવી
unrest/અનરેસ્ટ/અજંપો, અશાંતિ
unruly/અનરૂલિ/બેકાબૂ
unsavoury/અનસૅવરિ/બેસ્વાદ
unscrupulous/અનસક્રુપલસ/બેઈમાન
untenable/અનટેનેબલ/અસમર્થનીય, અસ્વિકાર્ય
until/અન્ટિલ/ત્યાં સુધી
unto death/અન ટુડેથ/આમરણાંત
untoward
unusual / /
unveil/અનવેઈલ/અનાવરણ કરવું, ખુલ્લુ મુકવું
unwarranted/અનવૅરન્ટેડ/અનધિકૃત, બીનજરૂરી
unwittingly/અનવિટિંગલિ/અજાણતા
upbeat/અપબિટ/આશાવાદી
upbraid/અપબ્રેડ/ઠપકો આપવો
upgraded/અપગ્રેડેડ/
upheal/અપહીલ/
upheaval/અપહીવલ/ઉથલપાથલ, વિપ્લવ
uphill/અપહિલ/કપરું ચઢાણ
uphold/અપહોલ્ડ/પુષ્ટિ-સમર્થન કરવું
upkeep
uplift/અપલિફ્ટ/ઉત્કર્ષ કરવો
upliftment/અપલિફ્ટમન્ટ/ઉત્કર્ષ, ઉદ્ધાર
upper / /
uppermost
uppish/અપિશ/ સ્વમતાગ્રહી
upright/અપરાઈટ/પ્રમાણિક
uprising/અપરાઈઝિંગ/બળવો, ઉથલપાથલ
uproar/અપરોઅર/ધાંધલ, ધમાલ
uproarious/અપરોરિઅસ/ધાંધલ, ધમાલ
uproot/અપરૂટ/નાબૂદ કરવું
upset/અપસેટ/બેચેન, ઊંધું વાળવું
upshot/અપશોટ/પરિણામ
upside down ઊંધુ, ઊલટું
upside / /
upstairs/અપરટેઅર્સ/ઉપરના મજલે
upstart/અપસ્ટાર્ટ/ તાજો ધનવાન, લેભાગુ
upsurge/અપસર્જ/ઉછાળો, ઉથલપાથલ
uptake/અપટેઈક/ સમજણ-બ્રહ્મણશક્તિ
urban/અર્બન/શહેરી
urbane/અર્બૅઈન/સુસંસ્કૃત
urge on-વું
urge/અર્જ/આવેગ, વિનંતિ કરવી

urged/અર્જડ/વિનંતિ કરવી
urgent / /
urgent/અર્જન્ટ/તાકીદનું, ત્વરિત
usage/યુસેજ/ઉપયોગ, રીત-રસમ
use up-વું
use/યુસ/ઉપયોગ
used to / /
used to/યુઝડ ટુ/ટિવાઈ જવું
useful / /
usher/અશર/આવકારવું
usual/યુઝઅલ/સામાન્ય
usurp/અઝર્પ/સત્તા ધીનવવી, પચાવી પાડવું
usury/અઝરિ/ખૂબ વ્યાજે પૈસા આપવા
utensil/યુટેન્સિલ/વાસણ
utilize/યુટિલાઈઝ/કામમાં લેવું, વાપરવું
utmost/અટમોસ્ટ/સૌથી વધુ
utopia/યુટોપિયા/કલ્પિત સુવર્ણભૂમિ
utter/અટર/તદ્દન, ઉચ્ચારવું
utterly/અટલિ/સંપૂર્ણરીતે
u-turn/યુ ટર્ન/આડું ફાટવું
uxorious/અકઝોરિઅસ/વહુથેલું
vacancy/વેઈકન્સી/ખાલી જગ્યા
vacant/વેઈકન્ટ/ખાલી
vacate/વકેઈટ/ખાલી કરવું
vaccinate/વેઈકિસનેટ/રોગ પ્રતિરોધક રસીમુકવી
vacillate/વેસિલેઈટ/અસ્થિર હોવું
vacuum/વેક્યુમ/શૂન્યાવકાશ
vade-macum/વેઈડમોકમ/નાનો ખીસ્સાકોષ
vagabond/વેંગાબોન્ડ/રખડું, આવારા
vagaries/વેઈગરિઝ/વિચિત્ર વર્તન, તરંગીપણું
vagrant/વેંગરન્ટ/રખડું, ધ્યેયહીન
vague/વેઈગ/અસ્પષ્ટ
vain/વેઈન/વ્યર્થ, મિથ્યા
vale/વેઈલ/ખીણ
valediction/વેલીડિક્શન/વિદાય, પૂર્ણહૃતિ
valiant/વેલિઅન્ટ/બહાદુર
valid/વેલિડ/યથાર્થ, માન્ય
validity/વેલિડિટિ/વેધકતા, માન્યતા
valley/વેલિ/ખીણ
valorous/વેલરસ/વીર, બહાદુર
valour/વેલર/બહાદુરી, વીરતા
valuable/વેલ્યુએબલ/કિંમતી
value/વેલ્યુ/કિંમત, મુલ્ય
valve/વાલ્વ/વાલ
vamoose/વામૂઝ/એકદમ ભાગી જવું
vampire/વેમ્પાયર/લોહી ચૂસનાર ભૂત
van/વૈન/માલવાહક મોટરગાડી
vandal/વૈન્ડલ/ભાંગફોડિયો
vandalism/વૈન્ડલિઝમ/ભાંગફોડ, વિધ્વંસવૃત્તી
vane/વેઈન/પંખો

vanish/વૈનિશ/લુપ્ત-અદૃશ્ય થવું
vanity/વૈનિટિ/મિથ્યાભિમાન
vanquish/વૈન્કવિશ/પરાસ્ત કરવું
vantage/વાન્ટેજ/લાભ
vapid/વૈપિડ/નીરસ, મોઠું
variant/વૈરિયન્ટ/ભિન્ન
varied/વૈરીડ/ભિન્ન, વિવિધ
variety/વરાઈટિ/વિવિધતા
various/વૈરિયસ/અનેક, વિવિધ
varsity/વર્સિટિ/યુનિવર્સિટિ
vary/વૈરિ/જુદું પડવું
vascular/વાઝક્યુલર/લોહી-રક્તનળીને લગતું
vase/વાઝ/ફૂલદાની
vasectomy/વાઝેક્ટોમિ/ નસબંધી
vast/વાસ્ટ/વિશાળ
vaudeville/વૉડવિલ/નાટ્ય, ગાયન કલાનું
vault/વૉલ્ટ/કૂદકો, છૂપું ખાનું
vaunt/વૉન્ટ/શોખી, બડાઈ
vector/વેક્ટર/જંતુવાહક
veer/વીઅર/દિશા બદલાવવી
vegetable/વેજટેબલ/શાકભાજી
vegetate/વેજિટેટ/નિરસ પડ્યા રહેવું
vehement/વેમન્ટ/જોશ-આવેશ વાળું
vehicle/વિકલ/વાહન
veil/વેઈલ/ભુરખો, આવરણ, છૂપું
velocity/વેલોસિટિ/ઝડપ, વેગ
venal/વિનલ/લાંબિયું
venality/વેનાલિટિ/
vendetta/વેન્ડેટા/ભાંગફોડ, ખૂની વેરઝેર
vendor/વેન્ડર/વિકેતા
venerable/વેનરેબલ/આદરણીય
venereal/વેનિરિઅલ/ગુપ્તરોગ
vengeance
venial/વિનીઅલ/નજીવું, ક્ષમ્ય
venom/વેનમ/ખુન્નસ, ઝેર (સાપનું)
vent/વેન્ટ/ઉભરો ઠાલવવો, નિકાલ, ચીરો
ventilation/વેન્ટિલેશન/હવાઉજાસ
ventriloquism/વેન્ટ્રિલોકિઝમ/ બીજાના અવાજમાં બોલવું
venture on-વું
venture/વેન્યર/સાહસ-કરવું
venue/વેન્યુ/સ્થળ
veracious/વેરૈસિઅસ/સારું
veracity/વેરૈસિટિ/ખરાપણું, સચ્ચાઈ
verb/વર્બ/ક્રિયાપદ
verbal/વર્બલ/શાબ્દીક, મૌખિક
verbatim/વર્બેટિમ/અક્ષરશઃ, શબ્દશઃ
verbiage/વર્બિએજ/શબ્દાડંબર
verdant/વર્ડન્ટ/લીલુંછમ
verdict/વર્ડિક્ટ/ચુકાદો
verge on-વું

verge/વર્જ/ધાર,કાંઠો,છેડો,આરે
verify/વેરિફાઇ/ચકાસવું,ખરાઈ કરવી
verily/વેરિલિ/ખરેખર,બેશક
veritable/વેરિટેબલ/સાક્ષાત,પ્રસ્થાપિત
vernacular/વર્નાક્યુલર/સ્થાનિક બોલી
versatile/વર્સાઇલ/બહુમુખી-કૌશલ્યવાળું
versed/વર્સ્ડ/કુશળ,પ્રાવિણ્ય ધરાવતું
verses/વર્સીઝ/કાવ્ય રચનાઓ, પંક્તિઓ
versimilitude/વર્સિમિલિટ્યુડ/બ્રાંતી
version/વર્ઝન/અર્થઘટન,આવૃત્તિ
versus/વર્સસ/ના વિરુદ્ધ
vertical/વર્ટિકલ/ઊભું
vertigo/વર્ટીજી/ચક્રર આવવાં
verve/વર્વ/ઉત્સાહ
very/વેરિ/બહુ,અતિ
vest/વેસ્ટ/બંડી
vested/વેસ્ટેડ/સ્થાપિત,હિત ધરાવતું
vestige/વેસ્ટિજ/નિશાની,ચિન્હ
vestigial/વેસ્ટિજીયલ/બંડી
veteran/વેટરન/અનુભવી,લબ્ધપ્રતિષ્ઠ
veterinary /
veterinary/વેટરિનરી/પશુચિકિત્સા
veto/વિટો/નિષેધાધિકાર
vex/વેક્સ/ચીડવવું
vexatious/વેક્સેશિઅસ/ત્રાસદાયક
viable/વાઇએબલ/વ્યવહારુ
viands/વિઅન્ડ્સ/
vibrant/વાઇબ્રન્ટ/ઘબકતું
vibrate/વાઇબ્રેટ/ઘબકવું,ઘુજવું,કંપવું
vicar/વિકર/પાદરી
vicarious/વાઇકેરિઅસ/આડકતરું
vice versa/વાઇસેવર્સા/એથી ઊલટું, ઉલટ-સુલટ
vice/વાઇસ/ઉપ,દુર્ગુણ,દૂષણ,વ્યસન
vicinity/વિસિનિટિ/સમીપતા
vicious/વિશિઅસ/દુષ્ટ
vicissitude/વિશિસીટ્યુડ/ચડતી પડતી, ઊથલ પાથલ
victim/વિક્ટિમ/ભોગ, બલી
victimize/વિક્ટિમાઇઝ/ભોગ બનાવવું
victims/વિક્ટિમ્સ/ભોગ બનાવવું
victorious/વિક્ટોરિઅસ/વિજેતા
victory /
victory/વિક્ટરિ/વિજય
victual
vide/વાઇડ/જુઓ
vie/વાઇ/હરીફાઈ કરવી
view/વ્યૂ/માન્યતા,દૃષ્ટિ,જોવું
view-point/વ્યૂપોઇન્ટ/દૃષ્ટિ બિંદુ
vigil/વિજિલ/સર્તકતા,સાવધાની
vigilant/વિજિલન્ટ/સતર્ક
vigilante/વિજિલાન્ટ/બની બેઠેલાકાયદા રક્ષક

vignette/વિન્નેટ/ટુંકુ ને ટચ
vigorous/વિગરસ/જુસ્સો-જોમ વાળું
vigour/વિગર/જુસ્સો-જોમ
vile/વાઇલ/નીચ,અધમ
vilify/વિલિફાઇ/બદનામ કરવું,નિંદા કરવી
villa/વિલા/
village/વિલેજ/ગામડું
villain/વિલન/ખલનાયક,ગુંડો,મવાલી
villification
villify/વિલિફાઇ/
vim/વિમ/જોમ,શક્તિ
vindicate/વિન્ડિકેટ/સમર્થન કરવું,સાબીત કરવું
vindictive કિન્નાખોર,વેરીલું
vintage/વિન્ટાજ/જુનવાણી,પુરાણું
violate/વાયોલેટ/ઉલ્લંઘન કરવું
violating/વાયોલન્ટ/ઉલ્લંઘન કરતું
violation/વાયોલેશન/ભંગ,ઉલ્લંઘન
violence/વાયોલન્સ/હિંસા
violent/વાયોલન્ટ/હિંસક,તોફાની
virgin/વર્જિન/કુમારિકા
virile/વિરાઇલ/પુરુષાતન વાળું
virtual/વર્ચ્યુઅલ/અવિધિસર,કલ્પિત,આભાસી
virtue/વર્ચ્યુ/સદ્ગુણ
virtuoso/વર્ચ્યુસો/ઉસ્તાદ,સંગિતજ્ઞ
virtuous/વર્ચ્યુઅસ/સદ્ગુણી
virulence/વર્ચ્યુઅન્સ/ઝેર,ડંખ
virulent/વર્ચ્યુઅન્સ/ઝેરી,ઘાતક
virus/વાયરસ/રોગના જંતુ
visa/વિઝા/દેશમાં પ્રવેશ ની રજા
visage/વિઝિજ/ચહેરો
vis-à-vis/વિઝાવિ/ની વિરુદ્ધ-સામે
viscous/વિસ્કોઅસ/ચીકણું
visible/વિઝિબલ/દૃશ્યમાન
visionary/વિઝનરિ/સ્વપ્નદૃષ્ટા
visit /
visit/વિઝિટ/મુલાકાત-લેવી
vista/વિસ્ટા/માનસપટ,દૂરથી દેખાતો માર્ગ
visualise/વિઝ્યુઅલાઇઝ/કલ્પના દૃષ્ટિ કરવી
vital /
vital/વાઇટલ/જરૂરી,અગત્યનું
vitiate/વિશીએઇટ/દૂષિત કરવું
vitreous/વિટ્રિઅસ/કાચ જેવું
vitriolic/વિટ્રિયોલિક/સખત ટીકા
vituperative
viva voce/વાઇવાવોસિ/મૌખિક પરીક્ષા
vivacious/વાઇવેશસ/ઉલ્લાસમય,જીવંત,જોમવાળું
vivid/વિવિડ/તાદૃશ્ય,જીવંત
viz/નેઇમલિ/**namely**
VJ/video jockey/કાર્યક્રમ રજૂ કરનાર
vocabulary/વકબ્યુલરિ/શબ્દો

vocal/વોકલ/કંઠ્ય, વાચાળ
vocational/વોકેશનલ/વ્યવસાયલક્ષી
vociferous/વોસિફરસ/દિકારો મચાવનારું
vogue/વોગ/ઢબ, ચલણ
voice vote/વોઈસવોટ/મૌખિક મતદાન
voice/વોઈસ/અવાજ, ઉભરો ઠાલવવો
void/વોઈડ/ખાલીપો, રદ
volatile/વોલેટાઈલ/પ્રવાહી, ચંચળ, આનંદી
volcano/વોલ્કેનો/જવાળામુખી
volition/વોલિશન/ઈચ્છા
volte face/વોલ્ટફેઈસ/પીછેહઠ
voluble/વોલ્યુબલ/અવિરત બોલ્યા કરવું
voluminous/વોલ્યુમિનસ/દળદાર, વિસ્તૃત, વિપુલ
voluntary/વોલિન્ટરી/સ્વૈચ્છિક
volunteer/વોલિન્ટીઅર/સ્વયંસેવક, સ્વૈચ્છિક કરનાર
voluptuous/વૉલ્યુપ્ટિઅસ/વિલાસી, લંપટ
vomit/વોમિટ/ઉલ્ટી કરવી
oodoo/વુડૂ/મંત્રતંત્ર, મેલી વિદ્યા
voracious/વોરૅશિઅસ/ખાઉધરું
vortex/વોર્ટેક્સ/વમળ, ચક્રવાત
votary/વોટરિ/ચાહક, પ્રેમી, ભક્ત
vote down-વું
vote in-વું
vote on-વું
vote/વોટ/મત-આપવો
vouch/વાઉચ/જામીન-ખાતરી આપવી
vouchsafe/વાઉચસેઈફ/ખાતરી આપવી
vow/વાઉ/કસમ, પ્રતિજ્ઞા, સોગંદ લેવા
vowel/વોઉલ/સ્વર
voyage/વોયેજ/સાહસયાત્રા-પ્રવાસ(સાગર)
vulgar/વલ્ગર/બિભક્સ, અશ્લીલ
vulnerable/વલ્નરેબલ/ભેદ, નમાલું, ઝુકી જાય તેવું
wad/વૉડ/કાગળ વગેરેનાં ઢૂયા
wade in-વું
wade into-વું
wade/ /
wade/વેઈડ/ખુંદીને ચાલવું
wag/ /
wag/વૉગ/પૂંછડી હલાવવી, ગરજ દેખાડવી
wage a war/વેઈજ અ વૉર/આક્રમણ કરવું
wage/વેઈજ/માડવું, લાદવું
wages/વેઈજસ/વેતન, કિંમત
waggish/વૉગિશ/ટીખળી, વિનોદી
wagon/વેગન/રિલ્વે-માલગાડી નો ડબ્બો
waif/વેઈફ/બિનવારસી, બેઘર, અનાથ
wail/વેઈલ/વિલાપ કરવો
waist/વેઈસ્ટ/કમર
wait behind-વું
wait in-વું
wait on-વું

wait up-વું
wait/ /
wait/વેઈટ/રાહ જોવી
waiter/ /
waive/ /
waive/વેઈવ/માંડી વાળવું-જતું કરવું
wake up-વું
wake/વેઈક/જાગવું, જગાડવું
walk into-વું
walk off with-વું
walk off-વું
walk out/વૉકઆઉટ/ગૃહત્યાગ
walk over-વું
walk through-વું
walk up-વું
walk/વૉક/ચાલવું, ચાલ
wall/ /
wall/વૉલ/દિવાલ
wallet/વૉલીટ/પાકિટ
wallow/વૉલો/આળોટવું, રાચવું
wallped
wan/વૉન/
wander/ /
wander/વૉન્ડર/ભટકવું, રખડવું
wanderlust/વૉન્ડરલસ્ટ/પ્રવાસભૂખ
wane/ /
wane/વેઈન/ફીકું, નિસ્તેજ, ક્ષીણ થવું
wanna = want to
want/વૉન્ટ/જરૂર હોવી, જરૂરિયાત
wanton/વૉન્ટન/નાદાન, તોફાની
war/વૉર/યુધ્ધ, લડાઈ
warble/વૉર્બલ/ગાવું, કૂજન કરવું
ward off/વૉર્ડ ઓફ/દૂર રાખવું, નિવારણ કરવું
ward/વૉર્ડ/ખાનું, વિભાગ
wardrobe/વૉર્ડરોબ/કપડાં નો કબાટ
wares/વેઅર્સ/સામગ્રી, સરંજામ
warfare/વૉરફેઅર/યુધ્ધકૌશલ્ય-કળા
warm up-વું
warm(th)/ /
warm/વૉર્મ/ગરમ, હુંફાળુ
warn off-વું
warn/ /
warn/વૉર્ન/ચેતવણી આપવી
warp & woofs તાણાવાણા(કાપડ)
warrant/વૉરન્ટ/સરકારી-કોર્ટનો હુકમ/પત્ર
warranty/વૉરન્ટિ/ભાંચધરી, ખાતરી
wart/વૉર્ટ/મસો(શરીર પરનો)
wary/વૉરિ/સાવચેત
wash down-વું
wash off-વું

wash out-વું
wash over-વું
wash up-વું
wash/વોશ/ધોવું, સાફ કરવું
wasp/વોસ્પ/ભમરી
waste/વેઈસ્ટ/બરબાદ કરવું, વેડફવું
watch out-વું
watch/વૉચ/ચોકી, ઘડિયાળ, તાકીને જોવું
water borne
water down-વું
water/વૉટર/પાણી, પાણી પાવું
Waterloo/વૉટરલુ/પતનસ્થાન
watershed/વૉટરશેડ/ક્રાંતિકારી ફેરફાર, ધોરિયો
wave down-વું
wave on-વું
wave / /
wave/વેઈવ/મોજું, હાથ હલાવવો
waver / /
waver/વેઈવર/જતું કરવું, છૂટ
wavering/વેઈવરિંગ/ડગુંમગું, અસ્થિર
wax / /
wax/વૉક્સ/મીણ, લીસું કરવું
way / /
way/વેઈ/રસ્તો, માર્ગ
waylay/વેઈલેઈ/આંતરી ને લુંટી લેવું
wayward/વેઈવર્ડ/ભટકતું, રેઢિયાળ
we / /
weak(en) / /
weak/વીક/નબળું, અશક્ત, નમાલું
weal/વીલ/ચાહું, ફોલ્લો
wealth(y) / /
wealth/વેલ્થ/સંપત્તિ
wealthy/વેલ્થી/સમૃદ્ધ, ધનવાન
wean/વીન/નબળું પડવું, સુકાવું
weapon / /
weapon/વેપન/હથિયાર, શસ્ત્ર
weaponary/વેપનરી/હથિયાર, શસ્ત્ર સામગ્રી
wear away-વું
wear down-વું
wear off-વું
wear out/વેઅર-આઉટ/ઘસારો લાગવો
wear/વ/પહેરવું, ઘસાવું
wearisome કંટાળાજનક
wearry/વીઅરિ/થાકેલું, કંટાળેલું
weasel word
weather/વેધર/હવામાન **weather v**
weave/વીવ/કાપડવણાટ કરવું
web/વેબ/જાળું, કાગળ નો વિંટો
wed/વેડ/પરણવું
wedded/વેડિડ/સમ્મિપિત

wee hours/વીઆવર્જ/વહેલી સવાર
weed out/વીડઆઉટ/નિંદવું, સાફસુફ કરવું
weed/વીડ/સાફસુફ કરવું, નિંદવું
weeds/વીડ્ઝ/શોકદર્શક કાળા વસ્ત્રો
weedy/વીડી/
week/વીક/અઠવાડિયું
week-end
weep /રડવું, રૂઢન કરવું
weepy/વીપિ/રોતલ
weevil/વીવિલ/
weigh in-વું
weigh up-વું
weigh/વેઈ/વજન કરવું, જોખવું, તોલવું, તાગવું
weight/વેઈટ/વજન, ભોજ, ભાર
weird/વીઅર્ડ/વિચિત્ર, ગૂઢ
welcome/વેલકમ/આવકારવું, પધારો
weld/વેલ્ડ/ધાતુઓ ને સાંધવી
welfare/વેલ્ફેર/સુખાકારી, કલ્યાણ
well of the house ગૃહનો મંચકક્ષ
well/વેલ/અચ્છા, ઠીક, કૂવો, સારી રીતે
well-being/વેલબિઈંગ/સુખાકારી
well-nigh/વેલનાય/લગભગ, અંદાજે
well-off/વેલ-ઓફ/સંપન્ન, સધ્ધર
welt/વેલ્ટર/ચાહું, ધાનું નિશાન
welter/વેલ્ટર/આળોટવું, રગદોળવું
west/વેસ્ટ/પશ્ચિમ
wet blanket/વેટબ્લેન્કેટ/નિરૂત્સાહ કરનારો માણસ
wet/વેટ/ભીનું, ભેજવાળું
whack/વૉક/ફડાકો-ઝાપટ મારવી
whale/વ્હેલ/એક માછલીની જાત
what/વૉટ/શું, કે જે
whatever / /
wheat/વ્હીટ/ઘઉં
wheel/વ્હીલ/ચક, પૈડું
whelp / /
when/વેન/ક્યારે, કે જ્યારે
whenever / /
where/વેર/ક્યાં, કે જ્યાં
whereabouts/વહેરેઆઉટ/કેકાણું, અતાપત્તા
whereas/વેરઅંઝ/જેથી કરીને, ને જોતાં
whereby/વેરબાય/જેથી કરીને
whether/વેધર/જો કે, કદાચ
whew/વે/છાસ
which/વિચ/કયું, કયા, કઈ, કયો
whichever / /
whiff/વિફ/લહેર, મોજું, ફૂંક મારવી
while away-વિતાવવું
while/વાઈલ/દરમ્યાન, સમય વિતાવવો
whim/વિમ/તરંગ, ઘૂરી, તોર
whimper/વિમ્પર/ઉંહકારા કરવા, ડુસકાં ભરવાં

whimsical/વિમઝિકલ/તરંગી, ધૂની, તોરી
whine/વાઈન/બબડાટ કરવો,
whip away-વું
whip down-વું
whip out-વું
whip up-વું
whip/વિપ/ચાબૂક, કોરડો, દંડક
whipping-boy હોળિનું નાળિયેર
whirl/વર્લ/ગોળગોળ ફરવું-ફંગોળાવું
whirlpool/વર્લપૂલ/વંટોળીયો
whisk away-વું
whiskers/વિસ્કર્સ/થોભિયાં, કલમ(વાળ)
whiskey/whisky
whisper/વિસ્પર/ગણગણવું
whistle/વિસલ/સીટી, સીટી મારવી
white/વાઈટ/સફેદ
white-lie/વાઈટ/સફેદજુઠ
whittle away-વું
whittle down-વું
whiz-kid/વિઝકિડ/પ્રખર બુધ્ધિશાળી યુવાન
who/હૂ/કોણ, કોને
whodunit/હૂડનઈટ/મુખ્યરહસ્ય, રહસ્યકથા
whoever /
whole/હોલ/સંપૂર્ણ, આખું, સમગ્ર
whom /
whom/હૂમ/કોને
whoop/વૂપ/ઉટાંટિયું
whopper/વોપર/મોટું જૂઠાણું, મોટો નમૂનો
whore/હોર/વેશ્યા
whose/હૂઝ/કોનું-કોના-કોની
why/વાય/શા માટે
wick/વિક/દિવાની વાટ-દિવેટ
wicked/વિકિડ/દુષ્ટ
wicket/વિકેટ/દાંડિ, નાનું બારણું
wide(spread) /
wide/વાઈડ/પહોળું, વિશાળ
widen/વાઈડન/પહોળું કરવું
wide-spread/વાઈડસ્પ્રેડ/સાર્વત્રિક
width/વિડ્થ/પહોળાઈ
wield/વીલ્ડ/સત્તા વાપરવી, વિંઝવું
wife/વાઈફ/પત્ની
wig/વિગ/નકલી-કૃતિમવાળ
wigwam/વિગવેમ/તંબુ
wild goose chase/વાઈલ ગૂઝ ચેઝ/વ્યર્થ પ્રયત્ન
wild/વાઈલ/જંગલી, વન્ય
wilderness/વિલ્ડરનેસ/વેરાનભૂમિ, અરણ્ય
wile/વાઈલ/લલચાવવું, દાવપેચ
wilful/વિલફુલ/ઈરાદાપૂર્વકનું
will/વિલ/ઈચ્છા, વસિયતનામું
willing

will-o'-the-wisp ભુતના ભડકા
willow/વિલો/કિકેટના બેટનું લાકડું
willow-artist/વિલો-આર્ટિસ્ટ/બેટસમંન
willowy
willy-nilly/વિલિનિલિ/મને કમને
willy-willy/વિલિવિલિ/વાવાઝેવું
wilt/વિલ્ટ/ક્ષીણ થવું, થાકી જવું
wily/વાઈલિ/લૂચ્યું
win back-વું
win out/through-વું
win over/round-વું
win/વિન/જીતવું, જીત
wince/વિન્સ/પાછા હઠવું, અચકાવું
wind down-વું
wind up/વાઈન્ડ અપ/સંકેલો કરવો, વિંટી લેવું
wind up-સંકેલી લેવું
wind/વાઈન્ડ/વિંટવું, ચાવી દેવી
wind/વિન્ડ/હવા, પવન
windfall/વિન્ડફોલ/ઓચિંતો લાભ
window/વિન્ડો/બારી
windy/વિન્ડિ/હવા-પવન વાળું
wine/વાઈન/એક હળવી દારૂની જાત
wing/વિંગ/પાંખ, કક્ષ
wink/વિન્ક/આંખ મિચકારવી,
winkle down-વું
winner/વિનર/વિજેતા
winnow/વિનો/ઉપણવું
winsome/વિન્સમ/મોહક, આકર્ષક
winter/વિન્ટર/શિયાળો
wipe off-વું
wipe out/વાઈપ આઉટ/સફાયો કરવો, લૂછવું
wipe/વાઈપ/લૂછવું
wire/વાયર/તાર
wired-now
wirily
wisdom/વિઝડમ/ડહાપણ, શાણપણ
wise/વાઈઝ/ડહાપણવાળું, શાણું, ડાહ્યું
wisacre/વાઈઝએકર/દોઢડાભો
wish/વિશ/ઈચ્છવું, ઈચ્છા
wishy-washy/વિશિવોશિ/ફીકડું, દમ વિનાનું
wistful/વિસ્ટફુલ/આતુર, ઉત્કંઠિત
wit/વિટ/હાસ્ય, વિનોદ, બુધ્ધિ ચાતુર્ય
witch/વિચ/ડાકણ
witchcraft/વિચક્રાફ્ટ/મેલીવિદ્યા, મંત્રતંત્ર
witch-doctor/વિચક્રાફ્ટ/ભૂવો
witch-hunt/વિચહન્ટ/રાજ.વિરોધીઓને ખતમ કરવા
with/વિથ/સાથે, દ્વારા, વડે
withdraw/વિથડ્રો/પાછું ખેંચવું
wither/વિથર/કરમાવું
withhold/વિથહોલ્ડ/અટકાવવું, રોકવું

within/વિધિન/અંદરનું, અંતરાત્મા
without /
witness/વિટનિસ/સાક્ષી થવું, પ્રમાણ આપવું
witticism/વિટિસિઝમ/હાસ્યવિનોદ
wittingly/વિટિંગિલ/જાણી જોઈને
witty/વિટિ/હાસ્ય, વિનોદી, રમુજી
wizard/વિઝર્ડ/જાદુગર, અદ્ભુત વ્યક્તિ
wizened/વિઝન્ડ/ચીમળાઈ ગયેલું
wobble/વોબલ/લથડિયાખાવાં, હાલક ડોલક થવું
woebegone/વૂબીગોન/દુઃખમય, વેદનાગ્રસ્ત
woeful/વૂફુલ/દુઃખમય, વેદનાગ્રસ્ત
woes/વૂઝ/દુઃખો, વેદનાઓ
woke/વોક/જાગ્યો, ઉઠ્યો
woman /
woman/વૂમન/સ્ત્રી
womanise/વૂમન/સ્ત્રીગમન કરવું
womanly/વૂમનલિ/સ્ત્રીસહજ, સ્ત્રૈણ
won/વન/જીત્યા win
won't/વોન્ટ/will not
wonder at /
wonder(ful) /
wonder/વન્ડર/આશ્ચર્ય, અદભુતતા, અજાયબી
wonky/વોન્કિ/અસ્થિર, અવિશ્વાસપાત્ર
wont/વોન્ટ/ટેવાયેલું, રિવાજ, રૂઢિ
woo/વૂ/પંપાળવું, રીઝવવું
wood/વૂડ/લાકડું
woods/વૂડ્ઝ/જંગલ
wool/વૂલ/ઊન
wool-gathering શુન્યમનસ્ક, દિવાસ્વપ્ન જોવું
word/વર્ડ/શબ્દ, વાત
work in-વું
work off /
work off-વું
work on-વું
work out /
work out/વર્કઆઉટ/ઘડીકાઢવું
work up to-વું
work up-વું
work/વર્ક/કામ, કાર્ય
workaholic/વર્કોલિક/કામગરું, કામદું
workforce
works/વર્ક્સ/કારખાનું, બાંધકામ, કૃતિઓ
world/વર્લ્ડ/દુનિયા, વિશ્વ
world-wide/વર્લ્ડવાઈડ/વિશ્વવ્યાપી
worm/વર્મ/કિડો
worrisome
worry/વરિ/ચિંતા
worse/વર્સ/વધારે ખરાબ
worsen/વર્સન/વણસવું, વધારે બગડવું
worship/વર્શિપ/સ્તુતિ કરવી

worst/વર્સ્ટ/સૌથી ખરાબ
worth/વર્થ/કિમત-ને યોગ્ય
worthy/વર્થિ/લાયક, યોગ્ય
would-be/વુડબી/થનાર, ભવિષ્યનું
wouldn't /
wound/વૂન્ડ/ઘાયલ થવું, ઘા, જખમ
wow/વાઉ/આશ્ચર્યનો ઉદ્ગાર
wraith/રાઈથ/ભુત જેવો આભાસ
wrangle/રેન્ગલ/ઝપાઝપી
wrap/રેપ/લપેટવું, વિંટાળવું
wrath/રોથ/પ્રક્રોધ, ગુસ્સો, રોષ, ક્રોધ
wreak/રીક/ગુસ્સો શાંત કરવો, વેર લેવું
wreath/રીથ/ફુલનો હાર (સમાધી પર)
wreck/રેક/ભાંગી જવું (વહાણ)
wreckage/રેકિજ/ભંગાર, કાટમાળ
wrench/રેચ/પાનું, ફેરવવું, આમળવું
wrest/રેસ્ટ/આમળવું, આંચકી-ખુંચવી લેવું,
wrestle/રેસલ/કુસ્તી
wretched/રેચિડ/દુઃખી, દરિદ્ર
wriggle out of-વું
wriggle/રિગલ/સાંપ જેમ સરકવું
wring/રિંગ/મરડવું, આમળવું
wrinkle/રિંકલ/સળ, કરચલીઓ, યુક્તિ
wrist/રિસ્ટ/કાંડું
writ/રિટ/કોર્ટ ને કરેલી અરજી
write away for-વું
write in-વું
write off-માંડવાળ કરવું
write out-લખી કાઢવું
write up-વું
write/રાઈટ/લખવું
write-off/રાઈટ ઓફ/માંડવાળ
writhe/રાઈથ/તરફડવું
wrong/રોંગ/ખોટું, અન્યાય
wrote/રોટ/લખ્યું
wry/રાય/વિકૃત, વ્યંગપૂર્ણ
xenodochy/ઝેનોડોકિ/મહેમાનગતિ
xenophobia/ઝેનોફોબિઆ/અજ્ઞાત સ્થળ-લોકોનો ભય
Xerox/ઝીરોક્ષ/ઝીરોક્ષ
X-ray/એક્સ-રે/ક્ષ-કિરણ
yacht/યૉટ/નૌકા
yahoo/યાહૂ/નરપશુ, હેવાન,
yammer/યેમર/વિલાપ, બબડાટ, ઉકારા
yank off/યેન્ક /
Yankee/યેન્કી/અમેરિકન પ્રજા
yard/યાર્ડ/વાર, માપદંડ
yardstick/યાર્ડસ્ટિક/માપદંડ, ગજ, વાર-પટી
yawn/યૉન/બગાસું ખાવું
yea/યા/હા, મૌખિક મત ઉદ્ગાર
year/યર/વર્ષ

yearn/યઃર્ન/ઝંખવું
yeast/યીસ્ટ/આથો, ખમીર, ફૂગ
yell/યેલ/રાડ પાડવી
yellow/યલો/પીળું
yes/યસ/
yesterday/યસ્ટરડે/ગઈકાલે
yet/યેટ/છતાં, હજુ સુધી
yield/યીલ્ડ/નીપજ, ઉતાર, ફળ, હાર માનવી
yoghurt/યોગર્ટ/રાયતુ-દંદી જેવી વાનગી
yoke/યોક/બળદની ઘોંસરી, બંધન
yokel/યોકલ/ગામડિયો, રોંગો
yolk/યોક/ઈડાનો પીળો ભાગ
yonder/યોન્ડર/ત્યાં, પેલેપાર
yore/યોર/પહેલાના સમયમાં
young/યંગ/યુવાન
your/યોર/તમારું
youth/યુથ/યુવાન, યુવાની
Yule/યૂલ/નાતાલ નો ઉત્સવ
Yuppie/યપી/શહેરી નવી ભણેલી પેઢી
zany/ઝેનિ/ગાંડો, પાગલ
zap up-વું
zap/ઝેપ/મારી નાખવું, હુમલો કરવો
zeal/ઝીલ/ઉમંગ, ઉત્સાહ
zealot/ઝીલોટ/ધર્મઝનૂની
zealous/ઝીલસ/ધર્મ ઝનૂનવાળું
zebu/ઝીબુ/આખલો, ગોધો
zeitgeist/ઝાઈટગાઈસ્ટ/સમકાલીન સ્થિતિ
zenith/ઝેનિથ/શિખર, પરાકાષ્ટા
zephyr/ઝેફીર/હવાની લહેર
zero in on -વું
zero/ઝીરો/શુન્ય
zest/ઝેસ્ટ/જુસ્સો, ઊંડોરસ
zestful/ઝેસ્ટફુલ/ઉત્સાહપૂર્ણ, તરવરિયું
Zeus/ઝીઅસ/ગ્રીક દેવતા
zigzag/ઝિગઝેગ/વાંકચુંકું
zilch/ઝિલ્ચ/શુન્ય, કશું નહિ
zinc/ઝિંક/જસત
Zion/ઝીઅન/સ્વર્ગ
zip up-વું
zip/ઝિપ/ચેઈન,
zombie/ઝોમ્બી/મંદબુદ્ધિ, જડ
zoo/ઝૂ/પ્રાણીઘર
zoom/ઝૂમ/ઉંચે ચડવું

Thank you for referring my dictionary,